



THE CEYLON GOVERNMENT GAZETTE

No. 10,348 — FRIDAY, FEBRUARY 1, 1952

Published by Authority

PART III—LANDS

(Separate paging is given to each Part in order that it may be filed separately)

Land Settlement Notices:—	PAGE	and Sales by the Settlement Officer:—	PAGE
Preliminary Notices	—	Western Province	—
Final Orders	—	Central Province	—
		Southern Province	—
		Northern Province	—
		Eastern Province	—
		North-Western Province	—
		North-Central Province	—
		Province of Uva	—
		Province of Sabaragamuwa	—
		Land Acquisition Notices	237
		Notices under the Land Development Ordinance	252
		Land Redemption Notices	253
		Land Resumption Notices	—
		Miscellaneous Land Notices	256
		Lands under Peasant Proprietor Scheme	—

PART V published with this Issue contains List of Applications for Public Carriers' Permits for use of Lorries, &c.

PART VI published with this Issue contains List of Jurors and Assessors.

Land Acquisition Notices

No. LD. 7341/J/AL/1262.

The Land Acquisition Act, No. 9 of 1950

Declaration under Section 5

I, Dudley Shelton Senanayake, Minister of Agriculture and Lands, hereby declare, under sub-section (1) of section 5 of the Land Acquisition Act, No. 9 of 1950, that the allotments of land described below are needed for a public purpose and will be required under the provisions of that Act:

(1) A portion in extent about 26 perches from the land called Kasangama, situated in the Village of Tissa South, F. V. P. 634, Magampattu, Hambantota District; and bounded as follows:—

North and West by property of C. L. M. Murath and Co-owners,
East by P. W. D. road and Lucasgoda Agricultural road,
South by property of W. D. A. Abeysuriya.

(2) A portion in extent about 26 perches from the land called Lucas Dapela, situated in the Village of Lucasgoda, F. V. P. 629, Magampattu, Hambantota District; and bounded as follows:—

North by Western Branch Channel off Tissa Low Level Channel,
East by Lucasgoda Agricultural road and property of T. K. Burah,
South and West by property of P. Andrade.

(3) A portion in extent about 10 perches from the land called Barwala, situated in the Village of Lucasgoda, F. V. P. 629, Magampattu, Hambantota District; and bounded as follows:—

South and East by property of T. K. Burah,
West by property of P. Andrade,
North by Lucasgoda Agricultural road.

(4) A portion in extent about 18 perches from the land called Barwala, situated in the Village of Lucasgoda, F. V. P. 629, Magampattu, Hambantota District; and bounded as follows:—

North and East by property of T. K. Burah,
South and West by Lucasgoda Agricultural road.

Colombo, January 17, 1952.

DUDLEY SENANAYAKE,
Minister of Agriculture and Lands.

LA/7452/J/E/1638.

The Land Acquisition Act, No. 9 of 1950

Declaration under Section 5

I, Dudley Shelton Senanayake, Minister of Agriculture and Lands, hereby declare, under sub-section (1) of section 5 of the Land Acquisition Act, No. 9 of 1950, that the land described below is needed for a public purpose and will be acquired under the provisions of that Act:

A portion in extent approximately 5 acres out of the land called Wewagama Estate, situated in Wewagama Village, Wewagama Palata of Dambadeni Hatpattu in Kurunegala District; and bounded as follows:—

North by remaining portion of Wewagama Estate,
East by Bihapola P. W. D. road,
South by school garden and Ambalampitiya Estate, and
West by remaining portion of Wewagama Estate.

Reference No. J/E/1638,
Colombo, January 9, 1952.

DUDLEY SENANAYAKE,
Minister of Agriculture and Lands.

237—J. N. B 18944-70541/52)

The Land Acquisition Act, No. 9 of 1950*Declaration under Section 5*

I, Dudley Shelton Senanayake, Minister of Agriculture and Lands, hereby declare, under sub-section (1) of section 5 of the Land Acquisition Act, No. 9 of 1950, that the land described below is needed for a public purpose and will be acquired under the provision of that Act:

A portion in extent 3 A 0 R 1.3 P, out of the land called Batalagoda Estate, situated in Paramulla, Nembirikumbura Palata, Thalawisedeke Korale West, Hiriyala Hatpattu in Kurunegala District, surveyed and described as lot No. 53 in Supplement No. 1 of final village plan 1196.

Ref. No. J/E/1473.
Colombo, January 9, 1952.

DUDLEY SENANAYAKE,
Minister of Agriculture and Lands.

LA./6625/J/HLG/1271.

The Land Acquisition Act, No. 9 of 1950*Declaration under Section 5*

I, Dudley Shelton Senanayake, Minister of Agriculture and Lands, hereby declare, under sub-section (1) of section 5 of the Land Acquisition Act, No. 9 of 1950, that the land described below is needed for a public purpose and will be acquired under the provision of this Act:

Two allotments of land called Monarawilawatte, in extent 0 A. 0 R. 7 9 P., situated in Manawala and Monarawila villages in Medapattu Korale, Katugampola Hatpattu in Kurunegala District, surveyed and more particularly described as lots No. 47 (F. V. P. 302) and 38 (F. V. P. 324) in combined supplement No. 1 to final village plans Nos. 302 and 324.

Ref. No. J/HLG/1271.
Colombo, January 9, 1952.

DUDLEY SENANAYAKE,
Minister of Agriculture and Lands.

The Land Acquisition Act, No. 9 of 1950*Declaration under Section 5*

I, Dudley Shelton Senanayake, Minister of Agriculture and Lands, hereby declare, under sub-section (1) of section 5 of the Land Acquisition Act, No. 9 of 1950, that the land described below is needed for a public purpose and will be acquired under the provisions of that Act:

A portion in extent about .056 acres out of the land called Casichettiyamulla Kumbura, situated at Pehyagoda Pattiya in Aluthkuru Korale South, Colombo District; and bounded as follows —

North by boutique,
East by Casichettiyamullakumbura,
South by Canal Casichettiyamulla Kumbura, and
West by P. W. D. road.

Ref. No. Q. 4052/J/TW/1553.
Colombo, January 16, 1952.

DUDLEY SENANAYAKE,
Minister of Agriculture and Lands.

The Land Acquisition Act, No. 9 of 1950*Declaration under Section 5*

I, Dudley Shelton Senanayake, Minister of Agriculture and Lands, hereby declare, under sub-section (1) of section 5 of the Land Acquisition Act, No. 9 of 1950, that the land described below is needed for a public purpose and will be acquired under the provisions of that Act:

A portion in extent approximately 1½ acres out of the land called Millagahawatta, situated at Galahitiyawa in Aluthkuru Korale South in Colombo District; and bounded as follows:—

North by paddy field claimed by R. A. D. Ranasinghe and others,
East by land claimed by W. Grigoris Appu and others,
South by Central School garden, and
West by land claimed by G. M. Martin Appuhamy and others.

Ref. No. Q. 4102/J/E/1719.
Colombo, January 16, 1952.

DUDLEY SENANAYAKE,
Minister of Agriculture and Lands.

The Land Acquisition Act, No. 9 of 1950*Declaration under Section 5*

I, Dudley Shelton Senanayake, Minister of Agriculture and Lands, hereby declare, under sub-section (1) of section 5 of the Land Acquisition Act, No. 9 of 1950, that the land described below is needed for a public purpose and will be acquired under the provisions of that Act:

An allotment of land called Wattedama Viharagama, in extent approximately 2 acres, situated at Wattedama Village in Buttala Wedirata Korale, Buttala Division, Badulla District; and bounded as follows:—

North by temple premises,
West by Alutgedera Banda's garden,
South by jungle, and
East by live fence of the land owned by Mr. W. M. M. Ukku Banda, Village Headman, Wattedama.

Ref. No. J/E/65.
Colombo, September 15, 1951.

DUDLEY SENANAYAKE,
Minister of Agriculture and Lands.

The Land Acquisition Act, No. 9 of 1950*Declaration under Section 5*

I, Dudley Shelton Senanayake, Minister of Agriculture and Lands, hereby declare, under sub-section (1) of section 5 of the Land Acquisition Act, No. 9 of 1950, that the land, described below is needed for a public purpose and will be acquired under the provisions of that Act:

An allotment of land called Galketiya Arawatta, in extent approximately 6 perches, situated at Erabedda Village in Palugama Wasama, Udapalatha Korale, Udukinda Division, Badulla District; and bounded as follows:—

North by at a point 15' away from end of retaining wall towards Palugama,
East by in line with jak tree from the south to the point as in north,
South by jak tree towards bank of stream, and
West by road.

Ref. No. J/TW/1130.
Colombo, September 26, 1951.

DUDLEY SENANAYAKE,
Minister of Agriculture and Lands.

The Land Acquisition Act, No. 9 of 1950*Declaration under Section 5*

I, Punchi Banda Bulankulame, Acting Minister of Agriculture and Lands, hereby declare, under sub-section (1) of section 5 of the Land Acquisition Act, No. 9 of 1950, that the land described below is needed for a public purpose and will be acquired under the provisions of that Act:

An allotment of land called Kingamapathana, in extent about 1 A 0 R. 11 P., situated at Kingama Village in Mahapalatha Korale, Udukinda Division, Badulla District; and bounded as follows:—

North by Kingamapathana (lots 8DF 3BG and 8DF 3BH in supplement No. 5 to F V P No. 19),
East by Kingampatane (lot 8DF 3BT in same plan),
South by reservation for path, and
West by Kingampatane (lot 8DF 3BV in same plan).

Ref. No. J/E/1259.
Colombo, October 12, 1951.

P. B. BULANKULAME,
Acting Minister of Agriculture and Lands.

The Land Acquisition Act, No. 9 of 1950*Declaration under Section 5*

I, Dudley Shelton Senanayake, Minister of Agriculture and Lands, hereby declare, under sub-section (1) of section 5 of the Land Acquisition Act, No. 9 of 1950, that the land described below is needed for a public purpose and will be acquired under the provisions of that Act:

An allotment of land called Galkadahena, in extent about 2½ acres, situated at Galbokka Village in Damagalla Korale of Wellasa Division, Badulla District; and bounded as follows:—

North by Magandana-Galbokka V. C. road,
East by Crown land,
South by Magandana-Galbokka V. C. road and land belonging to D. M. Ganethu, and
West by Dambagalla-Galbokka V. C. road.

Ref. No. J/E/1231.
Colombo, December 15, 1951.

DUDLEY SENANAYAKE,
Minister of Agriculture and Lands.

The Land Acquisition Act, No. 9 of 1950*Declaration under Section 5*

I, Dudley Shelton Senanayake, Minister of Agriculture and Lands, hereby declare, under sub-section (1) of section 5 of the Land Acquisition Act, No. 9 of 1950, that the land described below is needed for a public purpose and will be acquired under the provisions of that Act:

The land called Elamalketiya *alias* Tennepatana, and Angurubeddapattana, in extent approximately 5 A. 0 R. 24 P., forming parts of lots 400 and 401 in final village plan No. 387, situated in Elle-Alutwella, Udukinda Division, Badulla District; and bounded as follows:—

North by part of lot 400 in F. V. P. 387,
East by part of lot 400 in F. V. P. 387,
South by Kadurugamuwa village boundary, and
West by part of lot 401 in F. V. P. 387.

Ref. No. J/DEA/522.
Colombo, November 28, 1950

DUDLEY SENANAYAKE,
Minister of Agriculture and Lands.

The Land Acquisition Act, No. 9 of 1950*Declaration under Section 5*

I, Dudley Shelton Senanayake, Minister of Agriculture and Lands, hereby declare, under sub-section (1) of section 5 of the Land Acquisition Act, No. 9 of 1950, that the land described below is needed for a public purpose and will be acquired under the provisions of that Act:

A portion in extent about 4 A. 3 R. 0 P., out of the land called Angurubeddepatana, Elamalketiypatana *alias* Tennepatana, Elbeddegalaelpatana, situated at Ellealutwella in Udukinda, Badulla District, being a part of lot 401 in F. V. P. No. 387 and owned by Suduhewage Charles Fernando, 39, Chatham Street, Colombo.

Ref. No. J/DEA/696.
Colombo, June 14, 1951.

DUDLEY SENANAYAKE,
Minister of Agriculture and Lands.

The Land Acquisition Act, No. 9 of 1950*Declaration under Section 5*

I, Dudley Shelton Senanayake, Minister of Agriculture and Lands, hereby declare, under sub-section (1) of section 5 of the Land Acquisition Act, No. 9 of 1950, that the land described below is needed for a public purpose and will be acquired under the provisions of that Act:

A portion in extent approximately 0 A. 0 R. 13.44 P., out of the land called Agalarawabogahawatte, described as lot 95 in T. S. P. 43 (sheet No. 8), and situated at Jasingama within the U. C. limits of Badulla, Badulla District, and bounded as follows:—

North by A. V. G. Weerasekara's land,
East by Allugollehela path,
South by Punchinona Wijesooriya's land,
West by Walauwatte Kandura and said to owned by Punchinona Wijesooriya, 9, Alugollehela Path, Badulla.

Ref. No. J/HLG/800
Colombo, May 25, 1951.

DUDLEY SENANAYAKE,
Minister of Agriculture and Lands.

The Land Acquisition Act, No. 9 of 1950*Declaration under Section 5*

I, Dudley Shelton Senanayake, Minister of Agriculture and Lands, hereby declare, under sub-section (1) of section 5 of the Land Acquisition Act, No. 9 of 1950, that the land described below is needed for a public purpose and will be acquired under the provisions of that Act:

Five allotments of land aggregating an extent of about 35 perches out of the land called Ampitiyawatte Ulukadawatte and Totahubiliyagahagodawatte, situated in Pannalawela in Medapalatha and Dambewela in Dehiwinipalata, Udukinda D. R. O's Division, Badulla District and more particularly described as lots 64, 64½, 44 ½ and 45 ½ in Final Village Plan No. 430 and lot 124 in Final Village Plan No. 421

Ref. No. J/HLG/1053.
Colombo, August 30, 1951.

DUDLEY SENANAYAKE,
Minister of Agriculture and Lands.

The Land Acquisition Act No. 9 of 1950

Declaration under Section 5

I, Dudley Shelton Senanayake, Minister of Agriculture and Lands, hereby declare, under sub-section (1) of section 5 of the Land Acquisition Act, No. 9 of 1950, that the land described below is needed for a public purpose and will be acquired under the provisions of that Act:

Portions in extent approximately 0 A. 1 R. 0.9 P., out of the lands called Kotagahagedera, Pahalapollawatte, Elpitiyawatte, Illangamagerawatte, Morawatte, and Mediriyawatte bearing Assessment Nos. 519, 519A, 520, 520A, 520—A1 to 4A 520—B1 and B2, 520—C1 to C4, 522—A1 to A4, 524, 532, 532A, 523 (pt) 535, 533, 534, 536, 537, 538, 539, 540 and 540 A., Lower King Street, situated within the U. C. limits of Badulla, Badulla District and claimed by D. W. Jayasinghe, W. A. P. Jayatilake, heirs of O. D. Perera, Heirs of E. Hassen, Heirs of V. Somasundaram, Heirs of M. A. Pilorishamy, Mrs. Muthiah, W. A. P. Jayatilake, T. K. Burah, and the Church of England, respectively.

Ref. No. J/HLG/13.
Colombo, July 3, 1951.

DUDLEY SENANAYAKE,
Minister of Agriculture and Lands.

The Land Acquisition Act, No. 9 of 1950

Declaration under Section 5

I, Dudley Shelton Senanayake, Minister of Agriculture and Lands, hereby declare, under sub-section (1) of section 5 of the Land Acquisition Act, No. 9 of 1950, that the land described below is needed for a public purpose and will be acquired under the provisions of that Act:

An extent of approximately 0 A. 2 R. 0.9 P., out of lots 67, 66, 87, 83, 88, 83, 90, 82, 9, 10, 14 and 13 in T. S. P. P. 43 situated at Kendalagama in East Central Ward, within the U. C. limits of Badulla, province of Uva, within the following boundaries:—

North by private land,
East by Passara Road,
South by Private land,
West by Race Course Road.

Ref. No. J/HLG/27.
Colombo, June 1, 1951.

DUDLEY SENANAYAKE,
Minister of Agriculture and Lands.

The Land Acquisition Act, No. 9 of 1950

Declaration under Section 5

I, Dudley Shelton Senanayake, Minister of Agriculture and Lands, hereby declare, under sub-section (1) of section 5 of the Land Acquisition Act, No. 9 of 1950, that the land described below is needed for a public purpose and will be acquired under the provisions of that Act:

A portion in extent approximately 15 acres out of the land called El Teb Group, Passara, situated in Kanahella V. H.'s Division of Yatikinda Division, Badulla District and bounded as follows:—

North by stream,
East by Miriunduge Kandura,
South by the Estate boundary, and
West by the Estate boundary and stream

Ref. No. J/E/63.
Colombo, October 30, 1950.

DUDLEY SENANAYAKE,
Minister of Agriculture and Lands.

The Land Acquisition Act, No. 9 of 1950

Declaration under Section 5

I, Dudley Shelton Senanayake, Minister of Agriculture and Lands, hereby declare, under sub-section (1) of section 5 of the Land Acquisition Act, No. 9 of 1950, that the land described below is needed for a public purpose and will be acquired under the provisions of that Act:

An allotment of land called St. Andrew's Church premises in extent 36.086 perches situated within the Urban Council limits of Haputale, within the following boundaries:—

North—Public Market,
East—Cart road of Dambettenne Estate,
South—Cart road of Dambettenne Estate,
West—Boutiques and premises.

Ref. No. J/HLG/416.
Colombo, October 18, 1950.

DUDLEY SENANAYAKE,
Minister of Agriculture and Lands.

The Land Acquisition Act, No. 9 of 1950

Declaration under Section 5

I, Dudley Shelton Senanayake, Minister of Agriculture and Lands, hereby declare, under sub-section (1) of section 5 of the Land Acquisition Act, No. 9 of 1950; that the land described below is needed for a public purpose and will be acquired under the provisions of that Act:

An allotment of approximately 2 acres out of the land called Ampitihena situated in Canaverella Village in Badulla District and bounded on the—

North by V. C. Road,
East by parts of lots 49 and 102 in V. P. 550,
South by parts of lot 102 in V. P. 550, and
West by parts of lots 49 and 102 in V. P. 550.

Ref. No. J/E/305.
Colombo, September 20, 1950.

DUDLEY SENANAYAKE,
Minister of Agriculture and Lands.

The Land Acquisition Act, No. 9 of 1950

Declaration under Section 5

I, Dudley Shelton Senanayake, Minister of Agriculture and Lands, hereby declare, under sub-section (1) of section 5 of the Land Acquisition Act, No. 9 of 1950, that the land described below is needed for a public purpose and will be acquired under the provisions of that Act:

A portion in extent about 0A. 0R. 1.28P., out of the land called Bank House Garden situated within the Urban Council limits of Badulla, Badulla District, and bounded as follows:—

North by Bank of Uva (Bank of Ceylon, Badulla)
East by Lower Street,
South by Ela Terrace Road,
West by Ela Terrace Road.

Ref. No. J/HLG/17.
Colombo, May 10, 1951.

DUDLEY SENANAYAKE,
Minister of Agriculture and Lands.

The Land Acquisition Act, No. 9 of 1950*Declaration under Section 5*

I, Dudley Shelton Senanayake, Minister of Agriculture and Lands, hereby declare, under sub-section (1) of section 5 of the Land Acquisition Act, No. 9 of 1950, that the land described below is needed for a public purpose and will be acquired under the provisions of that Act:

A portion in extent approximately 0A 0R 8 0P, out of the land called Nildandu-arawa (lot 60 in T. S. P. P. 43) situated at Kailagoda within the U. C. limits of Badulla, Province of Uva and bounded as follows:—

North by paddy field,
East by paddy field,
South by existing paddy field ridge,
West by paddy field.

Ref. No. J/HLG/867.
Colombo, July 10, 1951.

DUDLEY SENANAYAKE,
Minister of Agriculture and Lands.

The Land Acquisition Act, No. 9 of 1950*Declaration under Section 5*

I, Dudley Shelton Senanayake, Minister of Agriculture and Lands, hereby declare, under sub-section (1) of section 5 of the Land Acquisition Act, No. 9 of 1950, that the land described below is needed for a public purpose and will be acquired under the provisions of that Act:

The land called Kahatagahakotuwa in extent 0A. 1R. 14 3P., situated at Pahalagedera in Puwakgodamulla Ward within the Urban Council limits of Badulla, Province of Uva, shown as lot 83 in T. S. P. 43 (sheet 6), bounded as follows and claimed by D. M. Ranmenika, D. M. Kirmenika, and D. M. Ukkumenika, all of Pahalagedera Medapatana, Badulla:—

North by private property,
East by crown land to be vested in the U. C., Badulla for trenching ground.
South by Badulla Oya,
West by Council's property.

Ref. No. J/HLG/995.
Colombo, May 29, 1951.

DUDLEY SENANAYAKE,
Minister of Agriculture and Lands.

The Land Acquisition Act, No. 9 of 1950*Declaration under Section 5*

I, Dudley Shelton Senanayake, Minister of Agriculture and Lands, hereby declare, under sub-section (1) of section 5 of the Land Acquisition Act, No. 9 of 1950, that the allotments of land described below are needed for a public purpose and will be acquired under the provisions of that Act:

A portion in extent about 15 perches of the land called Galbokka situated in Palugama Village, Udapalatha Korale, Udukinda Division, Badulla District and bounded as follows:—

North	} By land belonging to Mr. H. D. Daniel Appuhamy of Palugama
East	
South	
West	

A portion in extent about 18 perches of the land called Galbokka situated in Palugama Village, Udapalatha Korale, Udukinda Division, Badulla District and bounded as follows:—

North	} By land belonging to Mr. B. D. P. Peiris Appuhamy of Palugama.
East	
South	
West	

Ref. No. J/TW/1079.
Colombo, September 19, 1951.

DUDLEY SENANAYAKE,
Minister of Agriculture and Lands.

The Land Acquisition Act, No. 9 of 1950*Declaration under Section 5*

I, Dudley Shelton Senanayake, Minister of Agriculture and Lands, hereby declare, under sub-section (1) of section 5 of the Land Acquisition Act, No. 9 of 1950, that the land described below is needed for a public purpose and will be acquired under the provisions of that Act:

An extent of about one rood from the land called Malwatte situated in Ettalapitiya village, Mahapalatha Korale, Udukinda, Badulla District, and bounded as follows:—

North by L. D. O. allotments allotted to A. M. Siyatu and J. M. Muthu Banda,
East by L. D. O. allotments allotted to J. M. Muthu Banda,
South by L. D. O. allotments allotted to A. M. Siyatu,
West by private land.

and claimed by—

Mr. D. S. Gunasakera, Native Physician, Dik-Ulpotha, Bandarawela.

Ref. No. J/HLG/939.
Colombo, June 21, 1951.

DUDLEY SENANAYAKE,
Minister of Agriculture and Lands.

The Land Acquisition Act, No. 9 of 1950*Declaration under Section 5*

I, Dudley Shelton Senanayake, Minister of Agriculture and Lands, hereby declare, under sub-section (1) of section 5 of the Land Acquisition Act, No. 9 of 1950, that the land described below is needed for a public purpose and will be acquired under the provisions of that Act:

The land called Muttettuwehena, in extent about one rood, situated in Potawa village, Ridimaliadda Wasama, Aralupitiya Korale, Badulla District, and bounded as follows:—

North by Potawa-Yalwela V. C. road,
East by remaining portion of Muttettuwehena,
South by remaining portion of Muttettuwehena,
West by Bibile-Alutnuwara P. W. D. road,

Ref. No. J/HLG/789.
Colombo, May 29, 1951.

DUDLEY SENANAYAKE,
Minister of Agriculture and Lands.

The Land Acquisition Act, No. 9 of 1950

Declaration under Section 5

I, Punchi Banda Bulankulame, Acting Minister of Agriculture and Lands, hereby declare, under sub-section (1) of section 5 of the Land Acquisition Act, No. 9 of 1950, that the land described below is needed for a public purpose and will be acquired under the provisions of that Act:

A portion in extent approximately 6.4 perches of that land called *Lindawatte*, situated at Alutwelagama within the Urban Council limits of Badulla, and bounded as follows:—

North by private land belonging to W. M. Panchirala,
East by Allogollehela path,
South by private land belonging to W. M. Panchirala, and paddy land belonging to W. M. Panchirala and Kiri Banda,
West by private land belonging to W. M. Suduappu, W. M. Appuhamy and W. N. Appuhamy.

Ref. No. J/HLG/1461.
Colombo, October, 1951.

P. B. BULANKULAME,
Acting Minister of Agriculture and Lands.

The Land Acquisition Act, No. 9 of 1950

Declaration under Section 5

I, Dudley Shelton Senanayake, Minister of Agriculture and Lands, hereby declare, under sub-section (1) of section 5 of the Land Acquisition Act, No. 9 of 1950, that the land described below is needed for a public purpose and will be acquired under the provisions of that Act:

A portion in extent approximately 15 ft. by 15 ft. of the land called *Bogahawatte* (part of lot 95 in T. S. P. P. No. 43) situated at Alutwelagama in Hill Drive Ward within the Urban Council limits of Badulla, and bounded as follows:—

North by garden land belonging to W. A. Punchi Nona,
East by garden and fields belonging to W. A. Punchi Nona,
South by paddy fields belonging to W. A. Punchi Nona,
West by waste land belonging to W. A. Punchi Nona and by a *Kandura*.

[Ref. No. J/AL/1263.
Colombo, September 26, 1951.

DUDLEY SENANAYAKE,
Minister of Agriculture and Lands.

LA. 7462/J/HLG/1715.

The Land Acquisition Act, No. 9 of 1950

Declaration under Section 5

I, Dudley Shelton Senanayake, Minister of Agriculture and Lands, hereby declare, under sub-section (1) of section 5 of the Land Acquisition Act, No. 9 of 1950, that the land described below is needed for a public purpose and will be acquired under the provisions of that Act:

A portion in extent about 3 acres out of the land called *Kathakaduwayage*, situated in Madapola Village, Madapola Palata, Hiriyalahatpattu, Kurunegala District; and bounded as follows:—

North by lots 1bw 2c., 5, 1bw2, a bund and *Kathakaduwayawewa*,
East by lot 1bw2,
South by a road and T. Ps. 294027 to 294030, and
West by a road.

Ref. No. J/HLG/1715,
Colombo, January 13, 1952.

DUDLEY SENANAYAKE,
Minister of Agriculture and Lands.

LA. 7292/J/E/520.

The Land Acquisition Act, No. 9 of 1950

Declaration under Section 5

I, Dudley Shelton Senanayake, Minister of Agriculture and Lands, hereby declare, under sub-section (1) of section 5 of the Land Acquisition Act, No. 9 of 1950, that the land described below is needed for a public purpose and will be acquired under the provisions of that Act:

An allotment of land called *Innawatte* alias *Delgahamulahaena*, in extent about 1 acre, situated in the Village of Mutugala, Marawita Palata, Kurunegala District; bounded on the north and east by the land belonging to Mr. Wickremaratchi, Notary, Gampaha, south by the land belonging to H. M. Kiri Mudiyanse, and west by land belonging to N. G. Loku Singho and N. G. Punchi Banda.

Ref. No. J/E/520,
Colombo, August 10, 1951.

DUDLEY SENANAYAKE,
Minister of Agriculture and Lands.

LA. 7438/J/E/1534.

The Land Acquisition Act, No. 9 of 1950

Declaration under Section 5

I, Dudley Shelton Senanayake, Minister of Agriculture and Lands, hereby declare, under sub-section (1) of section 5 of the Land Acquisition Act, No. 9 of 1950, that the land described below is needed for a public purpose and will be acquired under the provisions of that Act:

A portion in extent 1 A. 1 R. 10 P., out of the lands called *Kosgahamulawatte* and *Kumbukgahamulawatte*, situated at *Talahitumulla* Village, Mahipiti Palata, Katugampola Hatpattu, Kurunegala District; and bounded as follows:—

North by *Weralugama-Welipennagahamula V. C. road*,
East by *Kumbukgahamulakumbura* and *Rattarangahakumbura*,
South by remaining portion of *Kumbukgahamulawatte*, and
West by *Kolongasyayawatte* (reservation for roads).

Ref. No. J/E/1534.
Colombo, January 10, 1952.

DUDLEY SENANAYAKE,
Minister of Agriculture and Lands.

LA/7452/J/E/1638.

The Land Acquisition Act, No. 9 of 1950

Declaration under Section 5

I, Dudley Shelton Senanayake, Minister of Agriculture and Lands, hereby declare, under sub-section (1) of section 5 of the Land Acquisition Act, No. 9 of 1950, that the land described below is needed for a public purpose and will be acquired under the provisions of that Act:

A portion in extent approximately 5 acres out of the land called *Wewagama Estate*, situated in *Wewagama* Village, *Wewagama* Palata of *Dambadeni Hatpattu* in Kurunegala District; and bounded as follows:—

North by remaining portion of *Wewagama Estate*,
East by *Bihapola P. W. D. Road*
South by school garden and *Ambalampitiya Estate*, and
West by remaining portion of *Wewagama Estate*.

Ref. No. J/E/1638,
Colombo, January 9, 1952.

DUDLEY SENANAYAKE,
Minister of Agriculture and Lands.

L.A. 7844/J/HLG/940.

The Land Acquisition Act, No. 9 of 1950*Declaration under Section 5*

I, Dudley Shelton Senanayake, Minister of Agriculture and Lands, hereby declare, under sub-section (1) of section 5 of the Land Acquisition Act, No. 9 of 1950, that the land described below is needed for a public purpose and will be acquired under the provisions of that Act:

An extent of about 2 acres out of the land called Daisy Valley Estate, situated in Ratmalgoda Village, Weligepola Palata, Weudawilli Hatpattu, Kurunegala District, and bounded as follows:—

North by V. C. building site and a part of Daisy Valley Estate;
East by paddy field and a part of Daisy Valley Estate;
South by land belonging to late M. Sainulabdeen and High Road; and
West by D. R. C. road from Paragahadeniya to Pussella.

Ref. No. J/HLG/940.
Colombo, September 8, 1951

DUDLEY SENANAYAKE,
Minister of Agriculture and Lands.

The Land Acquisition Act, No. 9 of 1950*Declaration under Section 5*

I, Dudley Shelton Senanayake, Minister of Agriculture and Lands, hereby declare, under sub-section (1) of section 5 of the Land Acquisition Act, No. 9 of 1950, that the allotments of land described below are needed for a public purpose and will be acquired under the provisions of that Act:

(1) A portion in extent about 2 roods out of the land called Dawatgahaowitagodabima situated at Batakettara, Salpiti Korale, Colombo District, and bounded as follows:—

North by Godabuma and Walarambe road;
East by Gulawattage kumbura and Digane kumbura;
South by Digane kumbura; and
West by Kapugekumbura and Owita.

(2) A portion in extent about 2 roods and 13 perches out of the land called Dawatagahakumbura, situated at Batakettara in Salpiti Korale, Colombo District, and bounded as follows:—

North by portion of Dawatagahaowita;
East and South by Digane Kumbura; and
West by a portion of the same land.

Ref. No. Q. 3520/J/HLG/346.
Colombo, January 17, 1952

DUDLEY SENANAYAKE,
Minister of Agriculture and Lands.

The Land Acquisition Act, No. 9 of 1950*Declaration under Section 5*

I, Dudley Shelton Senanayake, Minister of Agriculture and Lands, hereby declare, under sub-section (1) of section 5 of the Land Acquisition Act, No. 9 of 1950, that the land described below is needed for a public purpose and will be acquired under the provisions of that Act:

Two portions totalling in extent 0 A. 0 R. 04.4 P., perches out of the land called Tittawelakumbura-Kolainnakumbura and Delgahawatta situated in the village of Hokandara South, Hewagam Korale, Colombo District, surveyed and described as lots 1 and 3 in Preliminary Plan No. A 2,989.

Ref. No. Q. 3460/J/HLG/1410.
Colombo, January 17, 1952.

DUDLEY SENANAYAKE,
Minister of Agriculture and Lands.

The Land Acquisition Act, No. 9 of 1950*Declaration under Section 5*

I, Dudley Shelton Senanayake, Minister of Agriculture and Lands, hereby declare, under sub-section (1) of section 5 of the Land Acquisition Act, No. 9 of 1950, that the land described below is needed for a public purpose and will be acquired under the provisions of that Act:

A portion in extent approximately 5 acres, out of the land called Babaguruwatta, adjoining the land called White Plains situated at Liyanagemulla, Aluthkuru Korale North (A), Colombo District, and bounded as follows:—

North by White Plains (Crown Land);
East and South by Babaguruwatta;
West by Colombo-Negombo Main Road.

Ref. No. Q. 4039/J/LSS/1491.
Colombo, January 17, 1952.

DUDLEY SENANAYAKE,
Minister of Agriculture and Lands.

The Land Acquisition Act, No. 9 of 1950*Declaration under Section 5*

I, Dudley Shelton Senanayake, Minister of Agriculture and Lands, hereby declare, under sub-section (1) of section 5 of the Land Acquisition Act, No. 9 of 1950, that the land described below is needed for a public purpose and will be acquired under the provisions of that Act:

A portion in extent about 13 perches out of the land called Kahatagahawatta situated at Talgasmotte in Siyane Korale West Meda Pattuwa, Colombo District, and bounded as follows:—

North by Kahatagahawatta and road to Kaleliya;
East by old Irrigation Channel;
South by old Irrigation Channel and Veyangoda-Kaleliya Road;
West by Kahatagahawatta kumbura.

Ref. No. Q. 3907/J/AL/1030.
Colombo, January 17, 1952.

DUDLEY SENANAYAKE,
Minister of Agriculture and Lands.

The Land Acquisition Act, No. 9 of 1950

Declaration under Section 5

I, Dudley Shelton Senanayake, Minister of Agriculture and Lands, hereby declare, under sub-section (1) of section 5 of the Land Acquisition Act, No. 9 of 1950, that the allotments of land described below are needed for a public purpose and will be acquired under the provisions of that Act :

- (1) A portion in extent about 10.6 perches out of the land called Amunuthatha, situated at Asgiri Walpola in Aluthkuru Korale, North (B), Colombo District and bounded as follows :—
North and south by Amunuthatha,
East by Branch of Medella Ela,
West by Andimulla.
- (2) A portion in extent about 10.6 perches out of the land called Andimulla, situated at Asgiri Walpola in Aluthkuru Korale North (B), Colombo District and bounded as follows :—
North, east and south by Andimulla,
West by Thoduwa kumbura.
- (3) A portion in extent about 10.6 perches, out of the land called Andimulla, situated at Asgiri Walpola in Aluthkuru Korale North (B), Colombo District and bounded as follows :—
North, south and west by Andimulla,
East by Amunuthatha.
- (4) A portion in extent about 10.6 perches, out of the land called Thoduwa kumbura, situated at Asgiri Walpola in Aluthkuru Korale North (B), Colombo District and bounded as follows :—
North, south and west by Thoduwa kumbura,
East by Andimulla.
- (5) A portion in extent about 8.0 perches out of the land called Thoduwa kumbura, situated at Asgiri Walpola in Aluthkuru Korale North (B), Colombo District and bounded as follows :—
North, east, south and west by Thoduwa kumbura
- (6) A portion in extent 5.3 perches out of the land called Thoduwa kumbura, situated at Asgiri Walpola in Aluthkuru Korale North (B), Colombo District and bounded as follows :—
North, east and south by Thoduwa kumbura,
West by Thoduwa kumbura and coconut garden.
- (7) A portion in extent about 13.3 perches out of the land called Thoduwa kumbura, situated at Asgiri Walpola in Aluthkuru Korale North (B), Colombo District and bounded as follows :—
North, east and west by Thoduwa Kumbura,
South by Thoduwa kumbura and coconut garden.

Ref. No. Q. 4048/J/AL/1522.
Colombo, December 15, 1951.

DUDLEY SENANAYAKE,
Minister of Agriculture and Lands.

The Land Acquisition Act, No. 9 of 1950

Declaration under Section 5

I, Dudley Shelton Senanayake, Minister of Agriculture and Lands, hereby declare, under sub-section (1) of section 5 of the Land Acquisition Act, No. 9 of 1950, that the land described below is needed for a public purpose and will be acquired under the provisions of that Act :

An extent of about 57 acres of land, situated in the village of Puthukudiyiruppu in Maritime Pattus Division in Vavuniya District, and bounded as follows :—

North by Crown land,
East by Achchilankulam Tank bund,
South by Crown land,
West by Crown land.

Ref. No. J/AL/1787,
Colombo, January 10, 1952.

DUDLEY SENANAYAKE,
Minister of Agriculture and Lands.

The Land Acquisition Act, No. 9 of 1950

Declaration under Section 5

I, Dudley Shelton Senanayake, Minister of Agriculture and Lands, hereby declare, under sub-section (1) of section 5 of the Land Acquisition Act, No. 9 of 1950, that all those allotments of land described below are needed for a public purpose and will be acquired under the provisions of that Act :

All those allotments of land called Walauwewatta and Ratnarangahayatahena in extent aggregating 10A. 2R. 28.2P. situated at Nawangama, Tispane Korale and Hedunawa, Medapane Korale, Kotmale Division, Nuwara Eliya District, Central Province; and surveyed and described as Lots 1 to 9 in P. P. A 1,688.

Ref. No. J/E/1013.
Colombo, December 19, 1951.

DUDLEY SENANAYAKE,
Minister of Agriculture and Lands.

The Land Acquisition Act, No. 9 of 1950

Notice under Section 7

I hereby give notice, under sub-section (1) of section 7 of the Land Acquisition Act, No. 9 of 1950, that the Government intends to acquire the following land which is required for a public purpose :—

Lot	Name of Land	Description	Preliminary Plan No. A, 2,880.	Village—Kimbulapitiya	Name of Claimant	Extent
						A. R. P.
2	Jambugodella	Coconut garden			Agrabodhi Vihare (Chief Trustee M. B. Modhankara Thero of Negombo)	0 0 15.5

All persons interested in the aforesaid land are hereby required to appear personally, or by agents duly authorized in writing, before me at Colombo Kachcheri, on March 22, 1952, at 11.30 a.m., and are hereby requested to notify to me in writing (in duplicate), on or before March 8, 1952, the nature of their interests in the land, the particulars of their claims for compensation for the acquisition of the said land, the amount of compensation and the details of the computation of such amount.

The Kachcheri,
Colombo, January 28, 1952.

N. MANICKA IDAIKKADAR,
Additional Government Agent.

The Land Acquisition Act, No. 9 of 1950

Notice under Section 7

Reference No. Q. 3660/J/HLG/495.

I hereby give notice, under sub-section (1) of section 7 of the Land Acquisition Act, No. 9 of 1950, that the Government intends to acquire the following land which is required for a public purpose:

Description of the land to be acquired:—

Lot	Name of Land	Description	Preliminary Plan No. A. 3,130. Village—Owitagama	Extent
			Name of the Claimant	
1	Bangalawatta	Coconut garden and 3 permanent buildings	Siri T. P. Gunawardena of 57, Alwis Place, Kotahena	2 0 11 6

All persons interested in the aforesaid land are hereby required to appear personally, or by agents duly authorized in writing, before me at Colombo Kachcheri, on March 22, 1952, at 10 a.m., and are hereby requested to notify to me in writing (in duplicate), on or before March 7, 1952, the nature of their interests in the land, the particulars of their claims for compensation for the acquisition of the said land, the amount of compensation and the details of the computation of such amount.

The Kachcheri,
Colombo, January 25, 1952.

N. MANICKA IDAIKKADAR,
Additional Government Agent.

The Land Acquisition Act, No. 9 of 1950

Notice under Section 7

Please quote this number in all correspondence in this connection:

LD. 788 (J/E/324).

I hereby give notice, under sub-section (1) of section 7 of the Land Acquisition Act, No. 9 of 1950, that the Government intends to acquire the following land which is required for a public purpose:

Description of the land to be acquired:—

Name of Land: Wallaha Estate, shown as Lot 1 in Preliminary Plan No. A 1,750;

Extent: 1A. 2R. 05.5P.

Situation: In Tillicoultry Village, Dumbula Korale, Kotmale Division, Nuwara Eliya District, Central Province;

Description: Tea 50-60 years; contains about 25 plantain trees 1 year; 4 acacia trees and waste land;

Claimants: The Ceylon Tea Plantation Co., Ltd., Nuwara Eliya.

All persons interested in the aforesaid land are hereby required to appear personally, or by agents duly authorized in writing, before me at the Nuwara Eliya Kachcheri on March 12, 1952, at 11 30 a.m., and are hereby requested to notify to me in writing (in duplicate), on or before March 5, 1952, the nature of their interests in the land, the particulars of their claims for compensation for the acquisition of the said land, the amount of compensation and the details of the computation of such amount.

The Kachcheri,
Nuwara Eliya, January 28, 1952.

E. G. GOONEWARDENE,
Assistant Government Agent.

The Land Acquisition Act, No. 9 of 1950

Notice under Section 7

Please quote this number in all correspondence in this connection:

LD. 775 (J/HLG/232).

I hereby give notice, under sub-section (1) of section 7 of the Land Acquisition Act, No. 9 of 1950, that the Government intends to acquire the following land which is required for a public purpose:

Description of the land to be acquired:—

Name of Land: Rikillagaskada Estate, shown as Lots 1 and 2 in Preliminary Plan, No. A 1,714;

Extent: 0A. 0R. 1.82P.

Situation: In Rikillagaskada village, Diyatilake Korale, Uda Hewaheta Division, Nuwara Eliya District, Central Province;

Description: Tea 20 years;

Claimants: Kumara Estates Co., Ltd., Managing Director. D. S. Chandra Cumaru, Rikillagaskada.

All persons interested in the aforesaid land are hereby required to appear personally, or by agents duly authorized in writing, before me at the Nuwara Eliya Kachcheri on March 12, 1952, at 10 a.m., and are hereby requested to notify to me in writing (in duplicate), on or before March 5, 1952, the nature of their interests in the land, the particulars of their claims for compensation for the acquisition of the said land, the amount of compensation and the details of the computation of such amount.

The Kachcheri,
Nuwara Eliya, January 28, 1952.

E. G. GOONEWARDENE,
Assistant Government Agent.

The Land Acquisition Act, No. 9 of 1950

Notice under Section 7

Please quote this number in all correspondence in this connection:

LD. 621 (J/E/1013).

I hereby give notice, under sub-section (1) of section 7 of the Land Acquisition Act, No. 9 of 1950, that the Government intends to acquire the following land which is required for a public purpose:

Description of the land to be acquired:—

All those allotments of land called Walauwewatta and Ratnarangahayatahena, in extent aggregating 10A. 2R. 28.2P., situated at Nawangama, Tispane Korale and Hedunawa, Medapane Korale, Kotmale Division, Nuwara Eliya District, Central Province, and surveyed and described as Lots 1 to 9 in P. A. 1,688.

All persons interested in the aforesaid land are hereby required to appear personally, or by agents duly authorized in writing, before me at the Nuwara Eliya Kachcheri on March 12, 1952, at 10.45 a.m., and are hereby requested to notify to me in writing (in duplicate), on or before March 5, 1952, the nature of their interests in the land, the particulars of their claims for compensation for the acquisition of the said land, the amount of compensation and the details of the computation of such amount.

The Kachcheri,
Nuwara Eliya, January 28, 1952.

E. G. GOONEWARDENE,
Assistant Government Agent.

The Land Acquisition Act, No. 9 of 1950.

Notice under Section 7

I hereby give notice, under sub-section (1) of section 7 of the Land Acquisition Act, No. 9 of 1950, that the Government intends to acquire the following land which is required for a public purpose:—

Description of the land to be acquired:

Lot	Name of Land	Description	Name of Claimant	Extent		
				A.	R.	P.
1	Ambalangodella	Garden contains 1 coconut tree, 1 arecanut tree 10 years, and 1 bread fruit 20 years, and part of bund	Ranwall Pathinayaka of Yatalamatta, Nagoda	0	0	3 4
2	Maththemedilla	Paddy field contains parts of anicut and bund	U. W. Wickramasingha, Albert Sirimanna, Francis Wickramasingha, M. V. Cornelis, Charles Dias Pathinayaka and Baptist Dias Pathinayaka of Yatalamatta, Nagoda	0	0	22.8
3	Maththemedilla	Channels contains parts of anicut	U. W. Wickramasingha, Albert Sirimanna, Francis Wickramasingha, M. V. Cornelis, Charles Dias Pathinayaka of Yatalamatta, Nagoda	0	0	22.8
4	Do.	Paddy field contains parts of bund and anicut	do.	0	0	18.5
5	Paraliyadda	Paddy field contains part of bund	L. D. Pathinayaka, Udenis Wickramasingha, William Suriyaarachchi, U. W. Wickramasingha of Yatalamatta, Nagoda	0	0	7.1
6	Barigama	do.	U. W. Wickramasingha, Albert Sirimanna, M. V. Johanis, Francis Wickramasingha, Charles Dias Pathinayaka and C. W. Karunaratna of Yatalamatta, Nagoda	0	0	17.9
7	Hikkaduwegederawatta alias Millagahawatta	Part of garden (no cultivation), contains part of Irrigation Channel	U. W. Wickramasingha of Yatalamatta, Nagoda	0	0	1.4
8	Batadombagahawatta	Garden contains 1 rubber tree 20 years, 1 coconut tree 6 years, 1 arecanut tree 20 years and 13 tea bushes 15 years	Henry Dias Pathinayaka of Yatalamatta, Nagoda	0	0	2.7
9	Hikkaduwegederawatta alias Millagahawatta	Garden contains 1 kitul tree 20 years	U. W. Wickramasingha of Yatalamatta, Nagoda	0	0	1.2
11	Batadombagahawatta	Garden contains 2 arecanut trees, 1 kitul tree, 1 batadomba tree 3 to 10 years	L. D. Pathinayaka, P. H. Pathinayaka, A. D. Pathinayaka, G. D. Pathinayaka, C. D. Pathinayaka, Cornelis Dias Pathinayaka and Arnolia Dias Pathinayaka of Yatalamatta, Nagoda	0	0	2.6
13	Adeswatta alias Kahaduwa-watta	Garden contains 4 murunga trees, 2 godapora trees, 2 keena trees, 1 batadomba tree, 3 kitul trees, 1 coconut tree, 1 mango tree, 2 nadium trees and 2 arecanut trees 2-12 years, and 2 jak trees and 1 coconut tree 40-50 years	L. D. Pathinayaka, Yatalamatta, Nagoda	0	0	2.9
14	Galthotamulla	Paddy field contains a bund	W. A. Wijesena, W. A. Thilanasiri, W. A. Jina, dasa, Karalayin Dias Pathinayaka, all of Yatalamatta, Nagoda	0	0	3.8
16	Galthotamulla	Paddy field	do.	0	0	1.1

All persons interested in the aforesaid land are hereby required to appear personally, or by agents duly authorized in writing, before me at Yatalamatta Government School, on March 8, 1952, at 9.45 a.m., and are hereby requested to notify to me in writing (in duplicate), on or before February 23, 1952, the nature of their interests in the land, the particulars of their claims for compensation for the acquisition of the said land, the amount of compensation and the details of the computation of such amount.

The Kachcheri,
Galle, January 24, 1952.

RAINE WRIGHT,
Assistant Government Agent.

LP 6179.

HAVING been duly directed by the Minister of Agriculture and Lands, acting under the provisions of "The Land Acquisition Ordinance (Cap. 203)", section 5, to take order for the acquisition of the following land, required for a public purpose, namely, for the construction of Hikkaduwa Post Flood Drainage Scheme, to wit:—

Preliminary plan No. A 1,252. Village—Wawlagoda (part), Kirahandigoda (part), Duwegoda (part), Hikkaduwa-Dodanduwa, Kirayawadugoda, Egodagoda and Jomahandigoda

Lot	Name of Land	Description	Name of Claimant	Extent		
				A.	R.	P.
24	Acharigemahawatta	Coconut garden contains 1 breadfruit tree 4 years, 1 domba tree 1 year and 1 coconut tree 50 years	Weeramantri Acharige Don Diyashami, Mutuwana Acharige Sadirishami, ditto Sanchihami, ditto Sedorishami, ditto Carolishami, Dewanarayana Nonehami, Lokuwaduge Doehchina de Alwis, Dewasurendra Acharige Punchihami, ditto Carlinahami, Aturehiye Welandawaduge Podinona, Kalu Badalge Andiris Silva, Kaluappuhennadige William Silva, Meegama Acharige Babynona, all of Kirahandigoda, Hikkaduwa	0	0	1.6
25	Do.	Garden contains 4 arecanut trees 10 years	Weeramantri Acharige Don Diyashami, Mutuwana Acharige Sadirishami, ditto Sanchihami, ditto Sedorishami, ditto Carolishami, Dewanarayana Nonehami, Lokuwaduge Doehchina de Alwis, Dewasurendra Acharige Punchihami, ditto Carlinahami, Aturehiye Melandawaduge Podinona, Kalu Badalge Andiris Silva, Kalu Appuhennadige William Silva, Meegama Acharige Eramanishami and Mestri Acharige Babynona, all of Kirahandigoda, Hikkaduwa	0	0	0.9
26	Moonamalghawatta	Coconut garden contains 8 coconut plants 2-5 years, 11 arecanut trees 15 years, 2 breadfruit trees 2-5 years, 1 kapok and suriya tree 10 years, 1 mango plant 3 years and plantain bushes 1 year	Mutuwana Acharige Sadirishami and Kalu Badalge Andiris Silva, Both of Kirahandigoda, Hikkaduwa	0	0	3.2
27	Do.	Coconut garden contains 5 coconut and 2 breadfruit trees 75 years, 10 arecanut and 2 kottamba trees 15 years	Mutuwana Acharige Sadirishami, Pinnaduwege Gunadasa, Meegama Acharige Punchihami, Welandawaduge Tilakahami, Pitigala Acharige Adilinnona, Colombo, Mahamestrige Anohami, all of Kirahandigoda, Hikkaduwa, and P. H. William Silva of Batapola	0	0	3.9

Lot	Name of Land	Description	Name of Claimant	Extent A. R. P.
28	Aruma Acharigewatta	Coconut garden contains: (1) 12 coconut trees 75 years, 5 breadfruit trees 75 years, 5 arecanut trees 20 years, 5 kaju, 1 meda, 2 jambu, 1 bilu and nannan trees 5 years; (2) 7 coconut and 2 breadfruit trees 75 years, 7 coconut trees 10 years, 15 coconut trees 5 years, 57 arecanut trees 20 years, 1 jambu, 1 kitul and 11 mango plants 3-5 years, 1 breadfruit tree 1 year, part of a footpath and a budding (partly permanent and partly temporary)	Puwakdandawe Loku Acharige Danohami, ditto Menchohami, ditto Elarishami, Delpe Chitra Acharige Odiris Silva and Delpe Chitra Acharige Lilawathie, all of Kirahandigoda, Hikkaduwa, Delpe Chitra Acharige Lauris of Nalanda Vidyalaya, Colombo, Delpe Chitra Acharige Andries, Assistant Superintendent of Surveys, S. G. O., Colombo, and Delpe Chitra Acharige Wimalasona of Motor Garage, Main Street, Negombo	0 1 8.3
29	Dasanayakagewatta	Garden contains 2 breadfruit trees 30 years, 1 arecanut tree 10 years and part of a footpath	Abraham Seneviratna of Kurunduwatta, Hikkaduwa, Laura Goonawardena of Hikkaduwa, Alutwala Tantrige Endiris-Singho and Kaleho Jagodago Premasari, both of Kirahandigoda, Hikkaduwa	0 0 3.1
30	Tunhaulwatta	Coconut garden contains 19 coconut trees 75 years, 9 coconut trees 5-10 years, 11 coconut plants 3 years, 48 arecanut trees 15 years, 1 breadfruit tree 30 years, 3 breadfruit trees 3 years, 1 kaju and 1 jambu tree 5 years	Lekamwasam Liyanage John Silva of Tusayawadugoda, Hikkaduwa	0 1 7.0
31	Do.	Garden contains 1 mango tree and 8 arecanut trees 1-5 years	Wenaidawaduge Henry de Silva of Tusayawadugoda, Hikkaduwa	0 0 1.9
32	Do.	Coconut garden contains 30 coconut trees 50 years, 9 coconut trees 2-8 years, 8 breadfruit trees 20 years, 4 breadfruit trees 1-2 years, 3 mango trees 10 years, 14 mango trees 5 years, 5 kitul trees 8 years, 2 kitul trees 4 years, 136 arecanut trees 1-20 years, 5 citrus trees 2-5 years, 1 bilu tree 15 years, 1 cocoa tree 2 years, 3 plantain bushes 1 year, 1 temporary building and 2 old building foundations with about 2½ feet high walls partly broken down	Wenaidawaduge Danny de Silva of Tusayawadugoda, Hikkaduwa	0 1 0.9
33	Peepawela	Deniya contains, kohla 5 years	Wilfred Seneviratna, V. A., Hikkaduwa, disputed by Wenaidawaduge Henry de Silva of Tusayawadugoda, Hikkaduwa	0 0 4.1
34	Do.	do.	do.	0 0 0.6
35	Tunhaulwatta	Garden contains 1 kaju, 1 arecanut and 1 totilla trees 4 years	Goluwamarakkala Surasena and Wenaidawaduge Danny de Silva, both of Tusayawadugoda, Hikkaduwa	0 0 0.6
36	Peepawela	Paddy field	Wilfred Seneviratna, Vidana Arachchi, Hikkaduwa	0 1 29.4
37	Tunhaulwatta	Coconut garden contains 3 jak trees 50-70 years, 7 coconut trees 20 years, 3 coconut trees 8 years, 23 arecanut trees 10 years, 1 kitul tree 8 years and an earth well	Goluwamarakkalage Surasena of Tusayawadugoda, Hikkaduwa	0 0 16.7
38	Himidamarakkala Tunhaulwatta	Garden contains 2 coconut trees 20 years, 1 coconut tree 10 years and 2 rubber trees 20 years	Lekamwasam Liyanage John Silva and Mammela-wadu Ekmon, both of Tusayawadugoda, Hikkaduwa	0 0 2.0
39	Himidamarakkalawatta-addarakumbura	Paddy field	Samuel Warusavithana, Surveyor, Hikkaduwa	0 0 18.1
40	Do.	do.	do.	0 1 34.6
41	Do.	do.	do.	0 0 14.4

I hereby give public notice, as required by section 6, that the Government proposes to take possession of the land. All persons interested in the aforesaid land are hereby required to appear personally or by agent before me at Hikkaduwa Resthouse on March 25, 1952, at 9 a.m., and to state the nature of their respective interests in the land, and the amount and particulars of their claims to compensation for such interests.

The Kachcheri,
Galle, January 26, 1952.

RAINE WRIGHT,
Assistant Government Agent.

LP. 6179.

HAVING been duly directed by the Minister of Agriculture and Lands, acting under the provisions of "The Land Acquisition Ordinance (Cap. 203)", section 5, to take order for the acquisition of the following land, required for a public purpose, namely, for the construction of Hikkaduwa Post Flood Drainage Scheme, to wit:—

Preliminary plan No. A 1,252. Village—Wawlagoda (part), Kirihandigoda (part), Dewagoda (part); Hikkaduwa-Dodanduwa, Kiriyawadugoda, Egodagoda and Jomahandigoda

Lot	Name of Land	Description	Name of Claimant	Extent A. R. P.
1	Kuduwegoda Pela Bandarawatta, part of Assessment No. 365	Coconut garden contains 10 coconut trees 50 years	Gamage Kankanage Hendrick Appuhami of Wawlagoda, Hikkaduwa	0 0 10.0
2	Kuduwegoda Pela Bandarawatta, part of Assessment No. 630	Coconut garden contains 4 coconut trees 50 years and part of a ditch	David Seneviratna of Hikkaduwa	0 0 14.7
3	Kuduwegoda Pela Bandarawatta, part of Assessment No. 634	do.	Nagage Don Francis and ditto Alwis, both of Godagama, Telwatta	0 0 3.7
4	Kuduwegodawela, part of Assessment No. 367	Coconut garden contains 2 coconut trees 12 years and 6 coconut plants 3 years	Gonsalkoralage Clara, ditto Lilryan de Silva, and Emeris Dias Gunasingha, all of Wawlagoda, Hikkaduwa	0 0 5.5

Lot	Name of Land	Description	Name of Claimant	Extent
				A. B. P.
5	Kuduwigodawela, Assessment No. 367	Coconut garden contains 3 coconut trees 40 years, 8 coconut trees 12 years and 13 coconut plants 4 years	Gonsalkoralage Clara, ditto Lilyan de Silva and Eneris Dias Gunasinghe, all of Wawlagoda, Hikkaduwa	0 0 25.0
6	Kuduwigodawela, Assessment No. 368	Coconut garden contains 2 coconut trees 40 years, 1 breadfruit tree 2 years, plantain bushes, vegetables and an earth well	Gamage Kankanage Hendrick Appuhami and Eneris Dias Gunasingha, both of Wawlagoda, Hikkaduwa	0 0 14.8
9	Kirahandiyawatta, part of Assessment No. 327	Coconut garden contains 5 coconut trees 50 years, 3 coconut trees 10 years, 4 breadfruit and 1 arecanut tree 15 years	Thuyya Hennedige Appu Singho of Kirahandigoda, Hikkaduwa	0 0 9.8
10	Kirahandiyawatta, part of Assessment No. 329	Garden contains 3 arecanut trees 10 years	Sembbukuttige Jinadasa of Kirahandigoda, Hikkaduwa	0 0 0.3
12	Kuduwigodawela	Deniya	Jananandaramaya Temple Trustee: Ven. Hikkaduwe Wellawatte Sumanasara Nayaka Thero of Kirahandigoda, Hikkaduwa	0 1 3.1
13	Do.	Paddy field	Thuyyawattenedige Elyas Appu of Kirahandigoda, Hikkaduwa	0 0 9.2
14	Do.	do.	Jananandaramaya Temple Trustee: Ven. Hikkaduwe Wellawatte Sumanasara Nayaka Thero of Kirahandigoda, Hikkaduwa	0 0 39.1
15	Do.	do.	Kuruwage Nandoris Silva of Kirahandigoda, Hikkaduwa	0 0 12.1
16	Moonamalgahawatta alias Pansabawatta	Coconut garden contains 3 coconut trees 15 years	Jananandaramaya Temple Trustee: Ven. Hikkaduwe Wellawatte Sumanasara Nayaka Thero of Kirahandigoda, Hikkaduwa	0 0 2.4
17	Do.	Coconut garden contains 9 coconut trees 10 years, 3 coconut trees 5 years, 2 kottamba trees 10 years and 50 arecanut trees 3-10 years	do.	0 0 25.4
18	Kuduwigodawela	Paddy field and owita, contains 1 coconut tree 40 years and 9 coconut trees 15 years	Kuruwage Nandoris Silva of Kirahandigoda, Hikkaduwa	0 1 32.9
19	Kuduwigodawela	Paddy field and owita, contains 1 coconut tree 40 years and 2 coconut trees 15 years, and 2 coconut trees 5 years	Kuruwage Nandoris Silva of Kirahandigoda, Hikkaduwa	0 0 5.2
20	Moonamalgahawatta	Coconut garden contains 3 coconut trees 15 years and 3 coconut trees 1-5 years	Kelu Badalge Andiris Silva of Kirahandigoda, Hikkaduwa	0 0 2.7
21	Acharigamahawatta Addara kumbura	Paddy field and owita, contains a cadjan hut	Kalu Badalge Andiris Silva, Mutuwana Acharige Sadrishami, ditto Punchhami, ditto Sanchhami, ditto Theodorshami, ditto Carolishami, Ratuwaduge Tilakahami, Meegama Acharige Punchhami, Aturaliye Welanda Waduge Podinona, Lokuwaduge Dochchina de Alwis, Dewararyana Isarishami, ditto Nonehami, ditto Gabrielhami, all of Kirahandigoda, Hikkaduwa, and Dewanarayana Babanchinhami of Naotunna, Kottegoda	0 0 24.9
22	Do.	Paddy field	Kalu Badalge Andiris Silva, Mutuwana Acharige Sadrishami, ditto Punchhami, ditto Sanchhami, ditto Theodorshami, ditto Carolishami, Ratuwaduge Tilakahami, Meegama Acharige Punchhami, Aturaliye Welanda Waduge Podinona, Lokuwaduge Dochchina de Alwis, Dewanarayana Isarishami, ditto Nonehami, ditto Gabrielhami, all of Kirahandigoda, Hikkaduwa, and Dewanarayana Babanchinhami of Naotunna, Kottegoda	0 0 37.6
23	Do.	do.	do.	0 0 1.8

I hereby give public notice, as required by section 6, that the Government proposes to take possession of the land. All persons interested in the aforesaid land are hereby required to appear personally or by agent before me at the Hikkaduwa Rest House on March 26, 1952, at 9 a.m., and to state the nature of their respective interests in the land, and the amount and particulars of their claims to compensation for such interests.

The Kachcheri,
Galle, January 26, 1952.

RAINE WRIGHT,
Assistant Government Agent.

Reference No. L.B. 2038.

The Land Acquisition Act, No. 9 of 1950

Notice under Section 7

I, A. O. Wirasinghe, Assistant Government Agent, Matara District, hereby give notice, under sub-section (1) of section 7 of the Land Acquisition Act, No. 9 of 1950, that the Government intends to acquire the following land which is required for a public purpose:—

Description of the land to be acquired:

A strip of land about 230 ft. long and 16 ft. wide from the land called Dawanyagahahena, situated at Walana in Weligam Korale in Matara District; and bounded as follows:—

North by the existing V. C. road from Mudugamuwa;
East by the remaining portion of the same land;
South by the existing V. C. road from Walana;
West by the remaining portion of the same land.

All persons interested in the aforesaid land are hereby required to appear personally, or by agents duly authorized in writing, before me at Matara Kachcheri on March 21, 1952, at 11 a.m., and are hereby requested to notify to me in writing (in duplicate), on or before March 13, 1952, the nature of their interests in the land, the particulars of their claims for compensation for the acquisition of the said land, the amount of compensation and the details of the computation of such amount.

The Kachcheri,
Matara, January 26, 1952.

A. O. WIRASINGHE,
Assistant Government Agent.

Reference No. L.B. 2026.

The Land Acquisition Act, No. 9 of 1950

Notice under Section 7

I, A. O. Wirasinghe, Assistant Government Agent, Matara District, hereby give notice, under sub-section (1) of section 7 of the Land Acquisition Act, No. 9 of 1950, that the Government intends to acquire the following land which is required for a public purpose:—

Description of the land to be acquired:

A portion of about 20 ft. by 20 ft. from the land called Pelawatta in Tumbe village in Gangaboda Pattu, Matara District; and bounded as follows:—

North by Gonagahawatta;
East by Kamburupitiya-Kirinda P. W. D. road;
South by Pelawatta B.; and
West by Baduwatta *alias* Diragewatta.

All persons interested in the aforesaid land are hereby required to appear personally, or by agents duly authorized in writing, before me at Matara Kachcheri on March 12, 1952, at 11 a.m., and are hereby requested to notify to me in writing (in duplicate), on or before March 5, 1952, the nature of their interests in the land, the particulars of their claims for compensation for the acquisition of the said land, the amount of compensation and the details of the computation of such amount.

The Kachcheri,
Matara, January 21, 1952.

A. O. WIRASINGHE,
Assistant Government Agent.

Reference No. L. B. 2040.

The Land Acquisition Act, No. 9 of 1950

Notice under Section 7

I, A. St. V. Wijemanne, Additional Assistant Government Agent, Matara District, hereby give notice, under sub-section (1) of section 7 of the Land Acquisition Act, No. 9 of 1950, that the Government intends to acquire the following land which is required for a public purpose:—

Description of the land to be acquired:

A portion in extent about 20' x 20' from the land called Wellamadama Estate at Meddawatte East in Wellaboda Pattu and Four Gravets in Matara District; and bounded as follows:—

North by Wellamadama Estate;
East by P. W. D. road;
South and west by the Wellamada Estate.

All persons interested in the aforesaid land are hereby required to appear personally, or by agents duly authorized in writing, before me at the Matara Kachcheri on March 26, 1952, at 10 a.m., and are hereby requested to notify to me in writing (in duplicate), on or before March 19, 1952, the nature of their interests in the land, the particulars of their claims for compensation for the acquisition of the said land, the amount of compensation and the details of the computation of such amount.

The Kachcheri,
Matara, January 26, 1952.

A. ST. V. WIJEMANNE,
Additional Assistant Government Agent.

Reference No. L.B. 2033.

The Land Acquisition Act, No. 9 of 1950

Notice under Section 7

I, A. O. Wirasinghe, Assistant Government Agent, Matara District, hereby give notice, under sub-section (1) of section 7 of the Land Acquisition Act, No. 9 of 1950, that the Government intends to acquire the following land which is required for a public purpose:—

Description of the land to be acquired:

An extent of 0A. 3R. 12. 33P. of the central lot of partitioned lot E of the land called Ginnatigoda Are Dangahawatta, situated at Dodampahala village in Wellaboda Pattu, Matara District; and bounded as follows:—

North by Karagahawatta;
East by eastern half of the partitioned eastern lot E of Ginnatigoda Are Dangahawatta belonging to J. E. Weeratne;
South by Dissanayakewatta and V. C. road; and
West by partition lot E given to the Dodampahala Government School.

All persons interested in the aforesaid land are hereby required to appear personally, or by agents duly authorized in writing, before me at the Matara Kachcheri on March 20, 1952, at 11 a.m., and are hereby requested to notify to me in writing (in duplicate), on or before March 13, 1952, the nature of their interests in the land, the particulars of their claims for compensation for the acquisition of the said land, the amount of compensation and the details of the computation of such amount.

The Kachcheri,
Matara, January 26, 1952.

A. O. WIRASINGHE,
Assistant Government Agent.

Reference No. LD. 7324/LRO/APL 4662A/J/AL/1568.

The Land Acquisition Act, No. 9 of 1950

Notice under Section 7

I hereby give notice, under sub-section (1) of section 7 of the Land Acquisition Act, No. 9 of 1950, that the Government intends to acquire the following land which is required for a public purpose:—

Description of the land to be acquired:

Lot No.	Name of Land	Supplement No. 2 to final village plan No. 297.	Village—Mahahilla	Name of Claimant	Extent A. B. P.
355	Gorokgahawatta	Garden contains coconut, jak, arecanut and breadfruit trees 40 years		U. M. Salaman Appuhamy, Yodakandiya, Tissamaharama	1 3 6

All persons interested in the aforesaid land are hereby required to appear personally, or by agents duly authorized in writing, before me at Belkotta Town Council Office on April 2, 1952, at 9.30 a.m., and are hereby requested to notify to me in writing (in duplicate), on or before March 26, 1952, the nature of their interests in the land, the particulars of their claims for compensation for the acquisition of the said land, the amount of compensation and the details of the computation of such amount.

The Kachcheri,
Hambantota, January 23, 1952.

A. B. S. N. PULLENAYEGUM,
Assistant Government Agent.

The Land Acquisition Act, No. 9 of 1950

Notice under Section 7

I hereby give notice, under sub-section (1) of section 7 of the Land Acquisition Act, No. 9 of 1950, that the Government intends to acquire the following land which is required for a public purpose:—

Description of the land to be acquired:

Preliminary plan No. A 1,652. Village—Karaitivu East

Lot	Name of Land	Description	Name of Claimant	Extent		
				A.	R.	P.
1	Roddathalvu	Paddy field	Pakiam, wife of V. Subramaniam of Karainagar North	0	0	17.0
2	Kompayapulam	do.	Arumugam Subramaniam of Karainagar West	0	0	8.6
3	Do.	do.	Visuvanathar Kandiah and Visuvanathar Arunasalam, both presently in Malaya, and Kanapathipillai Kandappu of Karainagar West	0	0	12.1
4	Do.	do.	Muttiah Nadarajah presently in Malaya, and Sabapathipillai Muttiah of Karainagar West	0	0	12.7
5	Do.	do.	Kandiah Thilliyampalam presently in Malaya, Kandiah Ledchmanan, ditto Iswari, ditto Nallammah and Parameswari, wife of V. Somasunderam, all of Karainagar North	0	0	10.5
6	Do.	do.	Sunderam, widow of T. Kandiah of Karainagar East	0	0	6.5
7	Do.	do.	Paramu Velasi and Sivakaman, widow of P. Kumaravelu, both of Karainagar East	0	0	6.7
8	Do.	do.	Sithamparam, widow of A. Sanmugam of Karainagar East	0	0	27.0
9	Do.	do.	Paramanathar Sivasothy and Paramanathar Paramanandan, both of Karainagar East	0	0	20.5
10	Do.	do.	Parupathy, widow of K. Eliyathamby of Karainagar North	0	0	26.2
11	Do.	do.	Paramanathar Sivasothy and Paramanathar Paramanandan, both of Karainagar East	0	0	34.5
12	Uppukali	do.	Ambalavanar Velupillai of Karainagar East	0	0	28.0
				Total	1	1 10.3

All persons interested in the aforesaid land are hereby required to appear personally, or by agents duly authorized in writing, before me at the Jaffna Kachcheri on March 12, 1952, at 10 a.m., and are hereby requested to notify to me in writing (in duplicate), on or before March 4, 1952, the nature of their interests in the land, the particulars of their claims for compensation for the acquisition of the said land, the amount of compensation and the details of the computation of such amount.

The Kachcheri,
Jaffna, January 28, 1952.

P. J. HUDSON,
Government Agent.

Reference No. LF. 1447/J/HLG/1268.

(Please quote this reference in all letters)

The Land Acquisition Act, No. 9 of 1950

Notice under Section 7

I hereby give notice, under sub-section (1) of section 7 of the Land Acquisition Act, No. 9 of 1950, that the Government intends to acquire the following land which is required for a public purpose, viz., for opening a pathway, 6 feet wide to the land of A. M. Marakayar of Toppur:—

Description of the land to be acquired:

Preliminary plan No. A 972. Village—Toppur

Lot	Name of Land	Description	Name of Claimant	Extent		
				A.	R.	P.
1	Chenaivayal	Paddy field	Sathakulebbe Pathumma of Toppur	0	0	2.1

All persons interested in the aforesaid land are hereby required to appear personally, or by agents duly authorized in writing, before me at the Trincomalee Kachcheri on March 4, 1952, at 11 a.m., and are hereby requested to notify to me in writing (in duplicate), on or before February 19, 1952, the nature of their interests in the land, the particulars of their claims for compensation for the acquisition of the said land, the amount of compensation and the details of the computation of such amount.

The Kachcheri,
Trincomalee, January 22, 1952.

T. E. GOONERATNE,
Assistant Government Agent.

HAVING been duly directed by the Minister of Agriculture and Lands, acting under the provisions of "The Land Acquisition Ordinance (Cap. 203)", section 5, to take order for the acquisition of the following land, required for a public purpose, namely, for restoration of Huruluwewa Tank, to wit:—

Preliminary plan No. A 113. Village—Dambagahulpota

Lot	Name of Land	Description	Name of Claimant	Extent		
				A.	R.	P.
2	Keeriyagahaakkare	Chena	Appuralage Banda, Punchiappuge Kadiratte and Silamburalage Kirietani, all of Dambagahulpota	2	3	33
3	Dambagahakumbura	Paddy field	Punchiappuge Kadiratte of Dambagahulpota	0	2	33
4	Do.	do.	Appuralage Mudiyanse and Silamburalage Kirietani of Dambagahulpota	0	1	12
5	Do.	do.	Dewahamige Meniketani of Kukulawa	0	1	14
6	Do.	do.	Kirihamige Tikiriappu of Migahapattiya, and Malgahagamage Dharmasena of Yakalla	0	1	14
7	Do.	do.	Silamburalage Kirietani and Appuralage Banda, both of Dambagahulpota	0	2	12
10	Do.	do.	Kandatege Vallihamy, Kandatege Battietani, Kandatege Amaratta and Kandatege Appurala, all of Dambagahulpota	0	1	6
11	Do.	do.	Appuralage Mudiyanse and Kadiratege Ukku Banda, both of Dambagahulpota	0	0	36
12	Do.	do.	Punchirialage Kapurala, Kandatege Appurala, Kadiratege Ukkubanda, Dewahamige Meniketani, Silamburalage Kirietani, all of Dambagahulpota, and Kirihamige Tikiriappu of Migahapattiya	0	2	8

I hereby give public notice, as required by section 6, that the Government proposes to take possession of the land. All persons interested in the aforesaid land are hereby required to appear personally or by agent before me at the Yakalla Rural Court House on April 4, 1952, at 10 a.m., and to state the nature of their respective interests in the land, and the amount and particulars of their claims to compensation for such interests.

The Kachcheri,
Anuradhapura, January 26, 1952.

V. A. J. SENARATNA,
Assistant Government Agent.

Reference No. J/E/311/LM 4989:

The Land Acquisition Act, No. 9 of 1950

Notice under Section 7

I hereby give notice, under sub-section (1) of section 7 of the Land Acquisition Act, No. 9 of 1950, that the Government intends to acquire the following land which is required for a public purpose:—

Description of the land to be acquired:

Lot	Name of Land	Preliminary plan No. A 707. Village—Udumagama		Name of Claimant	Extent	
		Description			A.	R.
1	Ettie Estate (part)	Rubber (20 to 30 years), contains a small patch of garden cultivation including plantains, manioc, &c., one permanent building with tiled roof and masonry half walls and a temporary building with thatched roof and mud walls, both the latter used as the school		Heirs of the late B. A. Somneris Appuhami of Homagama	2	0 12.9
Total					2	0 12.9

All persons interested in the aforesaid land are hereby required to appear personally, or by agents duly authorised in writing, before me at the Kegalla Kachcheri on April 1, 1952, at 10 a.m., and are hereby requested to notify to me in writing (in duplicate), on or before March 25, 1952, the nature of their interests in the land, the particulars of their claims for compensation for the acquisition of the said land, the amount of compensation and the details of the computation of such amount.

The Kachcheri,
Kegalla, January 25, 1952.

D. G. DAYARATNE,
Assistant Government Agent.

Reference No. J/AL/1591/LRO/APL 3766/LM 5405.

The Land Acquisition Act, No. 9 of 1950

Notice under Section 7

I hereby give notice, under sub-section (1) of section 7 of the Land Acquisition Act, No. 9 of 1950, that the Government intends to acquire the following land which is required for the purposes of the Land Redemption Ordinance No. 61 of 1942:—

Description of the land to be acquired:

Lot	Name of Land	Preliminary plan No. A 686. Village—Edurapota		Name of Claimant	Extent	
		Description			A.	R.
1	Dematagollewatta	Coconut garden 30-50 years		W. W. J. P. R. Egithe Fernando of "Sylvanlot", Palledeniya, Kegalla	0	0 5
2	Do.	do.		do.	0	0 9
3	Do.	do.		do.	1	1 9
4	Do.	do.		do.	1	1 34
5	Do.	do.		do.	0	1 37
6	Kendagollewatta	do.		do.	0	0 27
7	Do.	do.		do.	2	1 36
Total					5	3 37

All persons interested in the aforesaid land are hereby required to appear personally, or by agents duly authorized in writing, before me at the Kachcheri, Kegalla, on March 26, 1952, at 10 a.m., and are hereby requested to notify to me in writing (in duplicate), on or before March 19, 1952, the nature of their interests in the lands, the particulars of their claims for compensation for the acquisition of the said lands, the amount of compensation and the details of the computation of such amount.

The Kachcheri,
Kegalla, January 25, 1952.

D. G. DAYARATNE,
Assistant Government Agent.

Reference No. J/HLG/1386/LM 4762.

The Land Acquisition Act, No. 9 of 1950

Notice under Section 7

I hereby give notice, under sub-section (1) of section 7 of the Land Acquisition Act, No. 9 of 1950, that the Government intends to acquire the following land which is required for a public purpose:—

Description of the land to be acquired:

Lot	Name of Land	Preliminary plan No. A 692. Village—Atulugama (part)		Name of Claimant	Extent	
		Description			A.	R.
1	Dehiowita Estate	Rubber estate 40 years, contains a rubber nursery 1 year		Dehiowita Rubber Co. Ltd., Agents: Carson Cumberbatch & Co. Ltd., Chartered Bank Buildings, Colombo	2	3 36.6
1	Dehiowita Estate	Rubber estate 40 years		Dehiowita Rubber Co. Ltd., Agents: Carson Cumberbatch & Co. Ltd., Chartered Bank Buildings, Colombo	6	3 30.3

All persons interested in the aforesaid lands are hereby required to appear personally, or by agents duly authorized in writing, before me at the D. R. O's Office, Dehiowita, on March 24, 1952, at 10 30 a.m., and are hereby requested to notify to me in writing (in duplicate), on or before March 17, 1952, the nature of their interests in the lands, the particulars of their claims for compensation for the acquisition of the said lands, the amount of compensation and the details of the computation of such amount.

The Kachcheri,
Kegalla, January 25, 1952.

D. G. DAYARATNE,
Assistant Government Agent.

Ref. No. MA/AC/927/51.

The Land Acquisition Act, No. 9 of 1950

Notice under Section 7

I hereby give notice, under sub-section (1) of section 7 of the Land Acquisition Act, No. 9 of 1950, that the Government intends to acquire the following lands which are required for a public purpose:—

Description of the lands or servitudes to be acquired:

Lot	Name of Land	Preliminary plan No. A 2,904. Village—Bambalapitiya, Ward No. 28, Havelock Town within the Municipal limits of Colombo, Colombo District, Western Province		Name of Claimant	Extent	
		Description			A.	R.
1	Part of premises bearing assessment No. 36, De Kretser Place, Bambalapitiya	Garden contains 4 coconut trees 40 years, 1 mango tree 25 years, 1 jak tree 20 years, 1 kitul tree 5 years, 1 kenda tree 30 years, 3 papaw trees 1 year, 14 plantain bushes		Mrs. L. J. David of 17, 19th Lane, Kollupitiya	0	0 22.96

Lot	Name of Land	Description	Name of Claimant	Extent		
				A.	R.	P.
2	Part of premises bearing assessment No. 22, De Kretser Place	Garden (no cultivation), part of a masonry wall	Mrs. A. S. Gunatileke of 22, Kretser Place, Bambalapitiya	0	0	0.09
3	Part of premises bearing assessment No. 36, De Kretser Place	Garden contains 3 coconut trees 40 years, 1 jak tree 15 years, 1 jak plant 3 years, 1 mango tree 8 years, 1 ka'ju tree 8 years, 2 anona trees 5 years, 5 plantain bushes	Mrs. L. J. David, 17, 19th Lane Kollupitiya	0	0	5.80
Total				0	0	28.85

All persons interested in the aforesaid lands are hereby required to appear personally, or by agents duly authorized in writing, before me at the Municipal Office, Colombo, on March 20, 1952, at 10 a.m., and are hereby requested to notify to me in writing (in duplicate), on or before March 12, 1952, the nature of their interests in the lands, the particulars of their claims for compensation for the acquisition of the said lands, the amount of compensation and the details of the computation of such amount.

Town Hall,
Colombo, January 23, 1952.

WILLIAM GOPALLAWA,
Municipal Commissioner.

Ref. No. MA/AC/1074/51.

The Land Acquisition Act, No. 9 of 1950

Notice under Section 7

I hereby give notice, under sub-section (1) of section 7 of the Land Acquisition Act, No. 9 of 1950, that the Government intends to acquire the following lands which are required for a public purpose —
Description of the lands or servitudes to be acquired:

Preliminary plan No. A 2,862. Hunupitiya and Kollupitiya, Ward Nos. 16 and 26 within the Municipal limits of Colombo, Colombo District, Western Province

Lot	Name of Land	Description	Name of Claimant	Extent		
				A.	R.	P.
1	Part of premises bearing assessment No. 131, Alston Place	Garden contains 1 coconut tree 40 years, 1 jak tree 15 years, 3 mango trees 50 years, 30 papaw trees 2 years, 20 plantain bushes and parts of masonry walls	W. A. D. Remanayaka of 131, Alston Place, Colombo	0	0	13.77
2	Parts of premises bearing assessment Nos. 191, 193, 201 and 203, Generals Lake Road	Garden contains 1 coconut tree 20 years, 1 bilin tree 5 years, 2 papaw trees 2 years, 1 pera tree 5 years, 2 jam trees 5 years, sugarcane 1 year, 6 wooden gates, 6 masonry gate pillars, masonry walls, parts of masonry walls, part of a retaining wall, part of masonry drain and part of concrete hood	W. H. Hendrick of 10, Cotta Road, Rajagiriya	0	0	18.17
3	Part of premises bearing assessment No. 79, Turret Road	Garden contains 1 mara tree 5 years, 1 mango plant 1 year, 10 papaw plants 2 months, 6 wooden gates, 6 masonry gate pillars, masonry walls and part of masonry wall	Mrs. D. G. Hettiarachchi of 79, Turret Road, Colombo	0	0	18.07
4	Part of premises bearing assessment No. 75, Turret Road	Garden contains flower hedges, 2 wooden gates with masonry gate pillars and parts of masonry walls	Sir Gerald Wijekoon of 75, Turret Road Colombo	0	0	4.37
Total				0	1	14.38

All persons interested in the aforesaid lands are hereby required to appear personally, or by agents duly authorized in writing, before me at the Municipal Office, Colombo, on March 18, 1952, at 10 a.m., and are hereby requested to notify to me in writing (in duplicate), on or before March 10, 1952, the nature of their interests in the lands, the particulars of their claims for compensation for the acquisition of the said lands, the amount of compensation and the details of the computation of such amount.

Town Hall,
Colombo, January 23, 1952.

WILLIAM GOPALLAWA,
Municipal Commissioner.

Notices under the Land Development Ordinance

Notification of Land Kacheheri to select Persons to receive Grants

NOTICE is hereby given that the Government Agent, Northern Province, Jaffna, will hold a Land Kacheheri under the Land Development Ordinance, at 9 a.m., on Monday, February 11, 1952, at the office of the Divisional Revenue Officer, Kopay, to select a person to receive a grant for the Crown Land, particulars of which are given below.

2. The grant will be subject to all the conditions contained in the first schedule to the aforesaid Ordinance as amended by section 5 (1) of the Land Redemption Ordinance, No. 61 of 1942, and by Regulation 3 of the Land Redemption Regulations, 1948.

3. Every applicant should attend the Land Kacheheri in person, or depute some one to represent him.

4. Inquiries with regard to the Land Kacheheri, should be addressed to the Government Agent.

Colombo, January 24, 1952.

A. C. L. ABAYESUNDERE,
Assistant Land Commissioner.

Particulars of Land referred to above

Preliminary plan No. A 1,538. Village—Nirveli

Lot No.	Name of Permit Holder or Applicant	Description	Extent		
			A.	R.	P.
1	M. Saravanamuttu, Chiruppidi, Puttur	Garden	0	3	32
		Waste land	0	1	17
Total			1	1	9

Notification of Land Kacheheri to select Persons to receive Grants

NOTICE is hereby given that the Government Agent, Northern Province, will hold a Land Kacheheri under the Land Development Ordinance (Cap. 320), at 10.30 a.m., on Wednesday, February 13, 1952, at the Community Hall, Old Colony, Kilmoochi, to select persons to receive grants for the Crown lands, particulars of which are given below.

2. Every applicant should attend the Land Kacheheri in person, or depute someone to represent him.

3. Inquiries with regard to this Land Kacheheri should be addressed to the Government Agent.

Deputy Land Commissioner.

Particulars of Land to be dealt with

I. S. P. P. 3—Periyaparanthan

Lot No.	Name of Permit-holder	Extent		
		A.	R.	P.
22v	Unnavan Panku	8	1	0
201	Paramu Nallathamby	5	0	5
133 (part)	Abraham Samuel Kanagaratnam	10	2	16
133 (part)	Arambu Vairamuttu Saravanamuttu	10	2	0
46	S. Chelliah	12	0	2
30 Western part	Karthigesu Murugesu	27	0	0
3A	Suppiah Ponnampalam	9	0	23
22c	Suppiah Ponnampalam	7	2	2
Supplement No. 2 to I. S. P. P. 3—Periyaparanthan				
19	D. M. Pedrick Appu	6	1	28
22 (part)	S. Rajaratnam	5	1	24
138	J. M. Sanders	14	0	25.2

Lot No.	Name of Permit-holder	Extent	
		A.	R. P.
74 (part)	Kandan Vinasi	9	2 3
Supplement No. 1 to I. S. P. P. 4—Paranthan			
57	S. A. Chrysostom	5	1 37
I. S. P. P. 5—Murasmoddai			
88L	K. Chinniah	17	2 5
52 (part)	Veluppillai Elaguppillai	2	2 0
123 (part)	Sinnakkudiyar Nagendram	2	0 0
I. S. P. P. 6—Iranamadu			
11	Waithiyalingam F. Rajagopal	64	3 29
I. S. P. P. 8—Periyaparanthan			
40	Anton Cathiravalo Ponnampalam	8	3 26
T. S. P. P. 34—Kilinochchi Town			
129	R. Nadetu	0	1 13
160	K. K. William Singho	0	1 31
152	Pumalai Muttusamy	0	1 11
119	Kandar Sinnathamby	0	1 36
153	Joseph Laurence	0	1 17
147	Kalimuttu Sinnathamby	0	1 3
150	Nagamma, wife of Kanapathippillai	0	1 16

Notification of Land Kachcheri to select Persons to receive Grants
NOTICE is hereby given that the Assistant Government Agent, Hambantota, will hold a Land Kachcheri under the Land Development Ordinance, at 10 a.m., on Wednesday, March 5, 1952, at the Tangalle Circuit Bungalow, to select a person to receive a grant for the Crown land particulars of which are given below.

2. The grant will be subject to all the conditions contained in the first schedule to the aforesaid Ordinance as amended by section 5 (1) of the Land Redemption Ordinance, No. 61 of 1942, and by Regulation 3 of the Land Redemption Regulations, 1948.

3. Every applicant should attend the Land Kachcheri in person, or depute someone to represent him.

4. Inquiries with regard to the Land Kachcheri should be addressed to the Assistant Government Agent, Hambantota.

January 29, 1952. A. C. L. ABEYESUNDERE,
Assistant Land Commissioner.

Particulars of the Land referred to above

Final Village plan No. 281. Village—Hangamuwa in West Giruwa Pattu

Lot No.	Name of Permit-holder or Applicant	Extent	
		A.	R. P.
94	James Sedara Dissanayake of Hangamuwa	2	1 1

Land Redemption Notices

LD 49/50.

My No. LRO/APL/5422/J/AL/1930.

Declaration under Section 5 of the Land Acquisition Act, No. 9 of 1950

WHEREAS the Land Commissioner has determined that the land described in the Schedule hereto, shall be acquired for the purposes of the Land Redemption Ordinance, No. 61 of 1942:

Now, therefore, I, Dudley Shelton Senanayake, Minister of Agriculture and Lands, do hereby declare under section 5 (1) of the Land Acquisition Act, No. 9 of 1950 (read with section 3 (5) of the said Ordinance as amended by section 62 of that Act), that the said land is needed for a purpose which is deemed to be a public purpose and will be acquired under that Act.

Colombo, January 15, 1952.

DUDLEY SENANAYAKE,
Minister of Agriculture and Lands.

SCHEDULE

Preliminary plan No. A 1,630. Village—Chankanai East

Lot	Name of Land	Description	Name of Claimant	Extent	
				A.	R. P.
1	Inchchilakkai	Paddy field, includes one half-share of the well lying in the western boundary	Cathirasar Sabapathy Ponniah, Pensioner, Chankanai East, Chankanai	0	2 12.9
Total				0	2 12.9

LD.—B. 49/50.

My No. LRO/APL 3299/J/AL/1865.

Declaration under Section 5 of the Land Acquisition Act, No. 9 of 1950

WHEREAS the Land Commissioner has determined that the land described in the Schedule hereto, shall be acquired for the purposes of the Land Redemption Ordinance, No. 61 of 1942:

Now, therefore, I, Dudley Shelton Senanayake, Minister of Agriculture and Lands, do hereby declare under section 5 (1) of the Land Acquisition Act, No. 9 of 1950 (read with section 3 (5) of the said Ordinance as amended by section 62 of that Act), that the said land is needed for a purpose which is deemed to be a public purpose and will be acquired under that Act.

Colombo, December 13, 1951.

DUDLEY SENANAYAKE,
Minister of Agriculture and Lands.

SCHEDULE

Preliminary plan No. A 1,629. Village—Achchuveli

Lot	Name of Land	Description	Name of Claimant	Extent	
				A.	R. P.
1	Paluppiddy	Garden contains 1 coconut tree and a well	Mallvaganam Suppiah of Thoppu, Achchuveli South. Achchuveli	0	1 2.2
2	Valuppiddy	Garden and waste land, contains coconut trees, palmyrah, poovarasu and ilandai trees, and includes share of the well lying in the south-western corner and a further share of water of the well lying on the north within lot 1 with right of way and water-course to and from the well	do.	0	1 3.7
Total				0	2 5.9

LD.—B 49/50.

My No. LRO/APL 5434/J/AL/1920.

Declaration under section 5 of the Land Acquisition Act, No. 9 of 1950

WHEREAS the Land Commissioner has determined that the land described in the Schedule hereto, shall be acquired for the purposes of the Land Redemption Ordinance, No. 61 of 1942:

Now, therefore, I, Dudley Shelton Senanayake, Minister of Agriculture and Lands, do hereby declare under section 5 (1) of the Land Acquisition Act, No. 9 of 1950 (read with section 3 (5) of the said Ordinance as amended by section 62 of that Act), that the said land is needed for a purpose which is deemed to be a public purpose and will be acquired under that Act.

Colombo, January 10, 1952.

DUDLEY SENANAYAKE,
Minister of Agriculture and Lands.

SCHEDULE

Lot	Name of Land	Description	Preliminary plan No. A 1,709. Village—Navali Name of Claimant	Extent		
				A.	R.	P.
1	Puthuvayal	Paddy field	Sinnathamby Kandiah of Ganesha Villa, Navali North, Manipay	0	2	21.1
Total				0	2	21.1

LD.—B. 49/50.

My No. LRO/APL 2737 & 2727A/J/AL/1924.

Declaration under Section 5 of the Land Acquisition Act, No. 9 of 1950

WHEREAS the Land Commissioner has determined that the land described in the Schedule hereto, shall be acquired for the purposes of the Land Redemption Ordinance, No. 61 of 1942 :

Now, therefore, I, Dudley Shelton Senanayake, Minister of Agriculture and Lands, do hereby declare under section 5 (1) of the Land Acquisition Act, No. 9 of 1950 (read with section 3 (b) of the said Ordinance as amended by section 62 of that Act) that the said land is needed for a purpose which is deemed to be a public purpose and will be acquired under that Act.

Colombo, January 10, 1952.

DUDLEY SENANAYAKE,
Minister of Agriculture and Lands.

SCHEDULE

Lot	Name of Land	Description	Preliminary plan No. A 1,625. Village—Pungudutivu West Name of Claimant	Extent		
				A.	R.	P.
1	Thanippanai	Palmyrah garden 25-30 years	Kandiah Sornalingam of Pungudutivu West, Pungudutivu	0	3	30.9
2	Sathurusinkanpakuthy	Paddy field	Annammah, wife of A. Sathasivam of Pungudutivu West, Pungudutivu	0	1	9.3
Total				1	1	0.2

No. LA. 3289/J/AL/1113.

Declaration under Section 5 of the Land Acquisition Act, No. 9 of 1950

WHEREAS the Land Commissioner has determined that the land described in the Schedule hereto, shall be acquired for the purposes of the Land Redemption Ordinance, No. 61 of 1942 :

Now, therefore, I, Dudley Shelton Senanayake, Minister of Agriculture and Lands, do hereby declare under section 5 (1) of the Land Acquisition Act, No. 9 of 1950 (read with section 3 (b) of the said Ordinance as amended by section 62 of that Act), that the said land is needed for a purpose which is deemed to be a public purpose and will be acquired under that Act.

Colombo, May 10, 1951.

DUDLEY SENANAYAKE,
Minister of Agriculture and Lands.

SCHEDULE

Lot	Name of Land	Description	Preliminary plan No. 1,095. Village—Kirimetiya West Name of Claimant	Extent		
				A.	R.	P.
1	Kohombagahawatta Pelawatta, Etambagahakumburegodabina and Amagahawatta	Coconut garden 20-30 years, contains a temporary house	Messrs. Muna Palaniandy, L. S. P. S. W. Karuppen Chettiar, 32, Bazaar Street, Kochchikade	8	1	0
2	Kohombagahawatta	Coconut garden contains 15 coconut and 1 jak trees 30 years	do.	0	0	25
Total				8	1	25

Q. 4068/LRO/APL 4860.

Notice under Section 7 of the Land Acquisition Act, No. 9 of 1950

I, N. Manicka Idaikkadar, Additional Government Agent of the Western Province, do hereby give notice under section 7 of the Land Acquisition Act, No. 9 of 1950, that—

- (1) it is intended to acquire under the said Act, for the purposes of the Land Redemption Ordinance, No. 61 of 1942, the lands described in the Schedule hereto,
- (2) claims for compensation for the acquisition of such lands may be made to me, and
- (3) every person interested in such lands shall—
 - (a) appear, personally or by agent duly authorized in writing, before me at Colombo Kachcheri on March 22, 1952, at 11 a.m., and
 - (b) notify to me in writing on or before March 8, 1952, the nature of his interests in the land, the particulars of his claim for compensation, the amount of compensation and the details of the computation of such amount.

January 28, 1952.

N. MANICKA IDAIKKADAR,
Additional Government Agent of the Western Province.

SCHEDULE

Lot	Name of Land	Description	Preliminary plan No. A. 3,002. Village—Ihalayagoda Name of Claimant	Extent		
				A.	R.	P.
1	Horagahalanda and Millagahawatta	Coconut garden	G. P. Dharmadasa of Kiribathgoda, G. P. James of Nedimale, Dehiwala, and G. P. Alwis of Buthgorauwa, Angoda	3	3	9
2	Do.	do.	do.	0	0	24
Total				3	3	33

LD. 4447/LRO/APL/1102.

Notice under Section 7 of the Land Acquisition Act, No. 9 of 1950

I, Edward Ellis Greiner, Assistant Government Agent of the Kandy District, do hereby give notice under section 7 of the Land Acquisition Act, No. 9 of 1950, that—

- (1) it is intended to be acquired under the said Act, for the purposes of the Land Redemption Ordinance, No. 61 of 1942, the land described in the Schedule hereto,
- (2) claims for compensation for the acquisition of such land may be made to me, and
- (3) every person interested in such land shall—
 - (a) appear, personally or by agent duly authorized in writing, before me at the Kandy Kachcheri on March 4, 1952, at 10 a.m.,
 - (b) notify to me in writing on or before February 26, 1952, the nature of his interests in the land, the particulars of his claim for compensation, the amount of compensation and the details of the computation of such amount.

The Kachcheri,
Kandy, January 24, 1952.

E. E. GREINER,
Assistant Government Agent.

SCHEDULE

Preliminary plan No. A 1,695. Village—Rambukkewela

Lot	Name of Land	Description	Name of Claimant	Extent	
				A.	R. P.
1.	Diyanawattehena <i>alias</i> Kalu-wadeniya	Tea, rubber, jak and mango trees (interplanted)	K. M. A. Soyadu Mohamadu Vidane Arachchi Bulugahatenno, Akurana	1	3 15
2.	Do.	Tea, rubber, jak, wild bread fruit trees and arcanut trees (interplanted)	do.	1	1 37
Total				3	1 12

Notice under Section 7 of the Land Acquisition Act, No. 9 of 1950

I, A. St. V. Wijemanne, Additional Assistant Government Agent of the Matara District, do hereby give notice under section 7 of the Land Acquisition Act, No. 9 of 1950, that—

- (1) it is intended to acquire under the said Act, for the purposes of the Land Redemption Ordinance, No. 61 of 1942, the land described in the Schedule hereto,
- (2) claims for compensation for the acquisition of such land may be made to me, and
- (3) every person interested in such land shall—
 - (a) appear, personally or by agent duly authorized in writing, before me at the Kachcheri, Matara, on March 26, 1952, at 2.30 p.m., and
 - (b) notify to me in writing (in duplicate) on or before March 19, 1952, the nature of his interests in the land, the particulars of his claims for compensation, the amount of compensation and the details of the computation of such amount.

The Kachcheri,
Matara, January 26, 1952.

A. ST. V. WIJEMANNE,
Additional Assistant Government Agent.

SCHEDULE

Supplement No. 1 to final village plan No. 44. Village—Rotumba

Lot	Name of Land	Description	Name of Claimant	Extent	
				A.	R. P.
408	Mahakumbura	Paddy field	C. W. S. Ratnayaka of Pasgoda, Mawarala	2	0 1
409	Do.	do.	do.	0	2 30
Total				2	2 31

L. D.—B. 49/50.

No. LA/7370/LRO/APL. 3854/J/AL/1572.

Notice under Section 7 of the Land Acquisition Act, No. 9 of 1950

I, Wijeyapala Tudor Jayasinghe, Assistant Government Agent of Kurunegala, do hereby give notice under section 7 of the Land Acquisition Act, No. 9 of 1950, that—

- (1) it is intended to acquire under the said Act, for the purposes of the Land Redemption Ordinance, No. 61 of 1942, the lands described in the Schedule hereto,
- (2) claims for compensation for the acquisition of such lands may be made to me, and
- (3) every person interested in such lands shall—
 - (a) appear, personally or by agent duly authorized in writing, before me at the Kurunegala Kachcheri, on March 18, 1952, at 9 a.m., and
 - (b) notify to me in writing on or before March 11, 1952, the nature of his interests in the land, the particulars of his claim for compensation, the amount of compensation and the details of the computation of such amount.

The Kachcheri,
Kurunegala, January 21, 1952.

W. T. JAYASINGHE,
Assistant Government Agent.

SCHEDULE

Supplement No. 1 to final village plan 325. Village—Paragammana

Lot	Name of Land	Description	Name of Claimant	Extent	
				A.	R. P.
55	Alutkuruwamaladeniya <i>alias</i> Thalakoladeniya and Habaralagahakumbura	Coconut garden 3-45 years and paddy field contains a temporary building	M. D. M. Sebastian Singho of Kithalahitiyawa, Yakwila	8	1 25
56	Kahatagahamulawatta	Coconut garden contains 17 coconut trees 45 years and 10 coconut trees 4 years	do.	0	0 30
56½	Habaralagahakumbura	Paddy field	do.	0	0 11
Total				8	2 26

Miscellaneous

Lease of the trees on the land acquired for a New Jail situated at Ragama—P.P. 17678

NOTICE is hereby given that the Government Agent, Western Province, will receive sealed tenders for the lease of the right to tap for rubber and to take the produce of the coconut trees standing on lots 1-28 in Preliminary Plan No. 17,678, for a period of one calendar year from February 1, 1952, subject to the conditions set out below.

2. Tenders which should be in sealed envelopes superscribed "Tender for lease of the right to tap rubber trees and to take the produce of coconut trees standing on lots 1 to 28 in P. P. 17,678, Ragama", will be received at the Colombo Kachcheri until 10 a.m. on February 13, 1952, when they will be opened. All tenderers will be required to be present in person or to satisfy the Government Agent by duly accredited agents that their tenders have been made in good faith.

Conditions

(1) The right of the lease of which is to be sold is the right to tap the rubber trees for rubber and to take the produce of the coconut trees standing on lots 1 to 28 in P.P. 17,678, Ragama, in extent 32 A. 0 R. 32-5 P., and the tenderer whose tender is accepted will be entitled, in addition, to receive rubber coupons if any such coupons are issued by the Rubber Controller in respect of the said rubber trees. The tenderer whose tender is accepted will not be entitled to make any use of the soil of the said lots.

(2) The tenderer whose tenders accepted (hereinafter referred to as the lessee) will be required to deposit, immediately after his tender is accepted, one-fourth of the amount tendered by him as cash security. This sum will be held in deposit and refunded to him on the expiry or the earlier termination of the lease. The Government Agent of the Western Province will have the right to confiscate the whole or any part of this security for breach of any condition of the lease.

(3) The lessee shall specify the monthly rent he is prepared to pay for the lease. The rent for a month or any part thereof shall be the same. Each monthly instalment will be payable in advance on or before the first day of each calendar month. If it were not paid on the due date each monthly instalment shall carry interest at the rate of nine per cent. per annum until it is paid in full.

(4) The lessee will be required to pay any rates and taxes which may be levied by the Village Committee in respect of the right to be leased.

(5) The lessee will be required to sign an indenture of the lease as soon as he is called upon to do so by the Government Agent.

(6) The lessee will not be allowed to transfer, assign or sub-let his rights under the lease to any other person without the permission of the Government Agent previously obtained in writing.

(7) No slaughter tapping of the rubber trees will be allowed in any circumstances.

(8) The lessee or his workmen will not be allowed to lop the branches of or to fell or otherwise damage, any trees standing on the said lots.

(9) The lessee or his workmen will not be allowed to pick any immature nuts.

(10) The lessee will not be allowed to erect structure of any sort in the said lots except with the permission of the Government Agent previously obtained in writing.

(11) The Government Agent reserves to himself the right to fell any trees, in respect of which the right above mentioned is to be leased, as may be found necessary, and a reasonable reduction of rent will be made in respect of any such felling. The decision of the Government Agent regarding the amount of any such reduction of rents will be final.

(12) The lease will be terminable on one month's notice without payment of any compensation to the lessee, if the use of the trees is required by the Government. In such a case a proportionate reduction of the rent will be made in respect of the unexpired period of the lease.

(13) The Government Agent will have the power, in the event of any breach of the foregoing conditions, to cancel the lease and to debar the lessee and his workmen from access to the trees without paying any compensation whatsoever to the lessee.

(14) The lessee will be required to pay inspection and assessment fees in respect of the rubber trees if and when he is called upon by the Rubber Controller to do so.

(15) The lessee will be required to keep the land clean and free from rank vegetation; but should not fell any trees.

(16) The Government Agent reserves the right to accept or reject any tender.

(17) Further particulars can be obtained from the Government Agent, Western Province, at the Kachcheri, Colombo. Particulars regarding the issue of the coupons in respect of the rubber trees should be obtained from the Rubber Controller, Colombo.

(18) Finally the lessee will be required to hand over the land at the termination of the lease without any damage to the existing plantations, to the Divisional Revenue Officer, Kandana, or any person deputed by him.

The Kachcheri,
Colombo, January 29, 1952.

C. MYLVAGANAM,
for Government Agent, W. P.

Tenders for the lease of the Rubber Plantation on lots, 1, 2, 3 and 4 in P. P. A 2,539—Kl/Matugama Central School Premises, Kalutara District

THE Assistant Government Agent, Kalutara, will receive tenders up to 12 noon on February 25, 1952, for the right to take the produce of the rubber plantation on lots 1, 2, 3 and 4, in P. P. A 2,539, Kl/Matugama Central School Premises, in extent ten acres and planted in budded rubber, about 14 years old, for the period March 1, 1952, to February 28, 1953, subject to the conditions *inter alia* hereinafter mentioned:

2. Tenders on the prescribed form should be sent in sealed envelopes superscribed "Tender for the lease of the Rubber Plantation on Kl/Matugama Central School Premises" addressed to the Assistant Government Agent, Kalutara. Tender forms could be obtained from the Kachcheri, Kalutara, up till 12 noon on February 18, 1952, on a deposit of Rs. 250. No tenders will be accepted unless they are on the prescribed form issued by the Kachcheri.

3. The successful tenderer will be informed in writing that his tender has been accepted. He should within a week of the receipt of the letter attend the Kachcheri and pay the full sum tendered for the lease and sign the lease. In failure thereof the deposit of Rs. 250 referred to in paragraph 2 above will be forfeited. He shall also deposit a sum of Rs. 500 as security for the due fulfilment of the conditions of the lease. This sum of Rs. 500 is inclusive of the Rs. 250 deposited with his tender.

4. The Assistant Government Agent reserves to himself the right to reject any or all the tenders.

5. Any further information required may be obtained on application in writing to the Assistant Government Agent, Kalutara.

January 19, 1952.

I. L. FERRINANDS,
for A. G. A., Kalutara.

Conditions

1. The tapping must be so done as not to damage the trees and the trees shall not be tapped on rainy days until they are dry. No tapping will be permissible during the month of February, the wintering season.

2. The lease may be terminated on one month's notice being given in writing by either party to the other. In either event the lessor shall not be liable to pay any compensation.

3. The purchaser shall not assign, transfer or sub-lease his rights without the written consent of the Assistant Government Agent, Kalutara.

4. The purchaser shall at all times allow the School authorities (staff and pupils) full and unhampered access to the property at all times.

5. If any portion of the land is required for building purposes, the successful tenderer shall, on two weeks notice being served on him surrender to the Assistant Government Agent, such portion of land required and a proportionate refund will be made.

LS. 2292.

Notification under Regulation 21 (2) of the Crown Lands Regulations, 1948

NOTICE is hereby given that Messrs. Hewainne Pedrick, Hewainne Seditri, Hewainne Lewis, Wahumpurage Surabiel and Wahumpurage Siyadoris of Hewainnekanda—trustees of the Vihara Sadaka Samitiya, Hewainnekanda—have applied for a lease of about two acres from lot 76 in F. V. P. 715, situated in Hewainnekanda, Ratnapura District, for the purpose of extending the Buddhist temple which stands on private lot 68 in the same plan.

2. The present premises are inadequate for the proposed extensions. The land applied for is available for the purpose. It is proposed to grant the application for lease subject to the following conditions, amongst others:—

(a) Rent: Rs. 3 per annum.

(b) The lessees shall, within five years from the commencement of the lease, erect a preaching-hall and dhanasalawa on the land to the satisfaction of the Government Agent, Sabaragamuwa.

(c) The lessees shall use the land as a site for a Buddhist temple and for no other purpose.

(d) The lessees shall, within six months of the completion of the buildings referred to at (b) above, dedicate them by deed approved by the Public Trustee. In that event the land will be leased to the Trustee or Controlling Viharadhipathi of the temple, as the case may be, for a term of 99 years.

3. The lease will be granted unless valid reasons to the contrary are adduced in writing to me within six weeks from the date hereof.

Colombo, February 1, 1952.

E. K. R. ASARAPPA,
for Land Commissioner.

No. LS. 2506.

Notification under Regulation 21 (2) of the Crown Lands Regulations, 1948

NOTICE is hereby given that the Co-operative Agricultural Products and Sales Society, Elahera, has applied for a lease of about 2 acres of Crown land, adjoining highland lots 1-5 in tract 19 within the Elahera Colonization Scheme, Matale District, for the purpose of constructing a godown, rice mill and quarters for staff thereon.

2. The land is available for the purpose. It is proposed to grant the application for lease subject to the following conditions, amongst others:—

(a) Term: 30 years.

(b) Rent: Rs. 2 per acre per annum.

(c) The lessee shall, within three years from the commencement of the lease, erect a godown, rice mill and quarters for staff thereon to the satisfaction of the Assistant Government Agent, Matale.

(d) The lessee shall use the land as a site for a godown, rice mill and quarters for staff, and for no other purpose.

3. The lease will be granted unless valid reasons to the contrary are adduced in writing to me within six weeks from the date hereof.

Colombo, February 1, 1952.

E. K. R. ASARAPPA,
for Land Commissioner.

ආණ්ඩුවට ඉඩම් ලබාගැනීම සම්බන්ධ දන්වීම්

1950^{න්} අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 5 වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය ආණ්ඩුවට ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950^{න්} අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කාපිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිවරයා වූ බිහිලි මැල්ටන් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි :

හපුතලේ නගර සීමාව තුළ පිහිටි පර්චස් 36.086 වපසරිය ඇති සෙන්ට් ඇන්ඩ්ස් වර්ච් නැමැති ඉඩම. ඊට මායිම් :—
උතුරට : ප්‍රසිඩ් මෙලුදපොල ;
නැගෙනහිරට : දඹෙතැන් නවත්තේ කරත්තපාර ;
දකුණට : එම
බස්නාහිරට : කඩවල්.

J/HLG/416.

මේ 1951^{ක්වූ} ජූනි මස 30 වැනි දින කොළඹදීය.

බිහිලි සේනානායක,
කාපිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිතුමා.

1950^{න්} අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 5 වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය ආණ්ඩුවට ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950^{න්} අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කාපිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිවරයා වූ බිහිලි මැල්ටන් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි :

උච්ච පළාතේ බදුල්ල නගර සීමාව තුළ ඊස්ට් සෙන්ට්‍රල් වර්ඩ්ස් කොදලගම පිහිටි 43 වෙනි නගර සීමයේ ලොට් 67, 66, 87, 86, 88, 83, 90, 82, 9, 10, 1 සහ 13 ක් පෙන්නන අ. 0, රු. 2, ප. 9 වපසරිය ඇති ඉඩම. ඊට මායිම් :—

උතුරට : පුද්ගලික ඉඩමක් ;
නැගෙනහිරට : පස්සර පාර ;
දකුණට : පුද්ගලික ඉඩමක් ;
බස්නාහිරට : රේස්කෝස් පාර.

J/HLG/27.

මේ 1951^{ක්වූ} ජූනි මස 1 වැනි දින කොළඹදීය.

බිහිලි සේනානායක,
කාපිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිතුමා.

1950^{න්} අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 5 වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය ආණ්ඩුවට ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950^{න්} අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කාපිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිවරයා වූ බිහිලි මැල්ටන් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි :

බදුලු දිඤ්ඤිකයේ ගරිකිද කොට්ඨාසයේ කනගාල්ල ගම් මූලාදානියාගේ කොටසේ පිහිටි අ. 15^{ක්} පමණ වපසරිය ඇති එල්ටෙට්ටි ගාප්, පස්සර නැමැති ඉඩම. ඊට මායිම් :—

උතුරට : දිය ඇල් ;
නැගෙනහිරට : ඕරිස්ට්‍රෝගේ කදුර ;
දකුණට : වතුයායෙහි සීමාව ;
බස්නාහිරට : වතුයායෙහි සීමාව සහ දිය ඇල්.

J/E/63.

මේ 1951^{ක්වූ} ඔක්තෝබර් මස 30 වැනි දින කොළඹදීය.

බිහිලි සේනානායක,
කාපිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිතුමා.

1950^{න්} අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 5 වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය ආණ්ඩුවට ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950^{න්} අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කාපිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිවරයා වූ බිහිලි මැල්ටන් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි :

බදුලු දිඤ්ඤිකයේ බදුලු නගර සීමාවෙහි ලෝමර් කින්සේ විවිදෙහි 519, 519A, 520, 520A, 520—A 1 සිට 4A, 520 B 1 සහ B 2, 520—C 1 සිට C 4, 522—A 1 සිට A 4, 524, 532, 532A, 523 (කොටසක්), 535, 533, 534, 536, 537, 538, 539, 540 සහ 540A වර්ජනම් අංක දරණ රු. 1, ප. 0.9 පමණ වපසරිය ඇත්තාවූ කොටගගගෙදර, පහල පොල්වත්ත, ආල්පිටියේ මත්ත, ඉලන්ගමානෙදරවත්ත, මොරවත්ත සහ මැදරියවත්ත යන ඉඩම්, අයිතියයි කියාසිටින්නන්ගේ නම් පිළිවෙලට : ඩී. බිහිලි. ජයවංශ සහ බිහිලි. ජී. පී. ජයතිලක යන ඩී. ඩී. පෙරේරා, ඊ. හසේන්, ඩී. සෝමසුන්දරම්, ආච්චි. ජී. පිලෝරිස්ගම, මුත්තසිංහ මහත්මයා, බිහිලි. ජී. පී. ජයතිලක, ඩී. කේ. මුරු යන අයගේ උරුමක්කාරයෝ සහ එන්ගලන්ත පල්ලියේ සභාව.

J/HLG/13.

මේ 1951^{ක්වූ} ජූනි මස 3 වැනි දින කොළඹදීය.

බිහිලි සේනානායක,
කාපිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිතුමා.

1950^{න්} අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 5 වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය ආණ්ඩුවට ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950^{න්} අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කාපිකම් හා ඉඩම් පිලිබඳ සහකාර ඇමතිවරයා වූ පුංචි බණ්ඩා මුලන්කුලමේ නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි :

බදුරි නගර සීමාව තුළ අලුත්මෙල ගමෙහි පිහිටා තිබෙන පර්චස් 6.4 පමණ වපසරිය ඇති ලීදවත්තේ නැමැති ඉඩමට මායිම් :—

උතුරට : බිහිලි. ඇම්. පුංචිහිරල මහතාට අයත් පුද්ගලික ඉඩම ;
නැගෙනහිරට : අලොහල්හෙල අනුපාර ;
දකුණට : බිහිලි. ඇම්. පුංචිහිරලට අයත් පුද්ගලික ඉඩම සහ බිහිලි. ඇම්. පුංචිහිරල සහ කිරිබණ්ඩාට අයත් ක්‍රමරක් ;
බස්නාහිරට : බිහිලි. ඇම්. සුදුඅපු, බිහිලි. ඇම්. අප්පුගාමි සහ බිහිලි. ඇන්. අප්පුගාමිට අයත් පුද්ගලික ඉඩම.

J/HLG/1461.

මේ 1951^{ක්වූ} ඔක්තෝබර් මස කොළඹදීය.

පී. ඩී. මුලන්කුලම,
කාපිකම් සහ ඉඩම් පිලිබඳ ඇමතිතුමාගේ සහකාර.

1950 අංක 9 දරන ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 5 වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම් පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය ආණ්ඩුවට ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950 අංක 9 දරන ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කෘෂිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිවරයා වූ බිහිලි ඡාලටත් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි:

බදුරු දිඤ්ඤිකයේ උඩුකිඳ කොච්චායගේ උඩපළාත කෝරළයේ පාර්ශම ගමෙහි පර්චස් 14ක් වපසරිය ඇති ගල්බොක්ක නමැති ඉඩමට, මායිම්:—

- උතුරට
 - නැගෙනහිරට
 - දකුණට
 - බස්නාහිරට
- පාර්ශම බිහිලිවි. ඩී. පී. පීරිස් අප්පුහාමිට අයත් ඉඩම්.

බදුරු දිඤ්ඤිකයේ උඩුකිඳ කොච්චායගේ උඩපළාත කෝරළේ පාර්ශම ගමෙහි පර්චස් 18ක් වපසරිය ඇති ගල්බොක්ක නමැති ඉඩමට, මායිම්:—

- උතුරට
 - නැගෙනහිරට
 - දකුණට
 - බස්නාහිරට
- පාර්ශම බිහිලිවි. ඩී. පී. පීරිස් අප්පුහාමිට අයත් ඉඩම්.

J/TW/1079.

මි 1951 ක්වූ සැප්තැම්බර් මස 17 වැනි දින කොළඹදීය.

බිහිලි සේනානායක,
කෘෂිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිතුමා.

1950 අංක 9 දරන ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 5 වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම් පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය ආණ්ඩුවට ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950 අංක 9 දරන ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කෘෂිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිවරයා වූ බිහිලි ඡාලටත් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි:

බදුරු දිඤ්ඤිකයේ උඩුකිඳ මහපළාත කෝරළයේ එත්තලපිටිය ගමෙහි පිහිටා තිබෙන රූඩ් 1 ක් වපසරිය ඇති මල්වත්ත නමැති ඉඩමට, මායිම්:—

- උතුරට: ඉඩම් සමුහ කිරීමේ අණපනත යටතේ ඒ. ආ. මී. සියාතුට සහ ජේ. ඇ. මී. මුතුබණ්ඩාට දී තිබෙන ඉඩම;
- නැගෙනහිරට: ඉඩම් සමුහ කිරීමේ අණපනත යටතේ ජේ. ඇ. මී. මුතුබණ්ඩාට දී තිබෙන ඉඩම;
- දකුණට: ඉඩම් සමුහ කිරීමේ යටතේ ඒ. ඇ. මී. සියාතුට දී තිබෙන ඉඩම;
- බස්නාහිරට: පුද්ගලික පාර.
- බණ්ඩාරවෙල, දික්වල් පහෙහි වෙදමහත්මියාමහ ඩී. ඇ. ජ. ගුනසේකර මහත්මියා අයිතිකම්යො සිටියි.

මි 1951 ක්වූ ජූනි මස 21 වැනි දින කොළඹදීය.

බිහිලි සේනානායක,
කෘෂිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිතුමා.

1950 අංක 9 දරන ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 5 වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම් පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය ආණ්ඩුවට ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950 අංක 9 දරන ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කෘෂිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිවරයා වූ බිහිලි ඡාලටත් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි:

බදුරු දිඤ්ඤිකයේ අරුර්පිටිය කෝරළේ රිදීමලියද්ද ව්‍යමේ පොතුව ගමෙහි පිහිටා තිබෙන රූඩ් 1 වපසරිය ඇති මුත්තේන්තුමේ අන්න නමැති ඉඩමට, මායිම්:—

- උතුරට: පොතුව-ගල්වෙල මී. සී. පාර;
- නැගෙනහිරට: මුත්තේන්තුමේ සේනේ ඉතිරි කොටස;
- දකුණට: එම
- බස්නාහිරට: බිහිලි-අරුත්තුමර් පී. බිහිලිවි. ඩී. පාර.

J/HIG/789.

මි 1951 ක්වූ මැයි මස 29 වැනි දින කොළඹදීය.

බිහිලි සේනානායක,
කෘෂිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිතුමා.

1950 අංක 9 දරන ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 5 වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම් පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය ආණ්ඩුවට ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950 අංක 9 දරන ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කෘෂිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිවරයා වූ බිහිලි ඡාලටත් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි:

බදුරු දිඤ්ඤිකයේ කනවැල්ල ගමෙහි පිහිටි අක්කර 2 ක් පමණ ඇති අංතිවෙනන නමැති ඉඩම, ඊට මායිම්:—

- උතුරට: මී. සී. පාර;
- නැගෙනහිරට: ලොව් 49 සහ 102, ගම් සිතියම 550;
- දකුණට: ගම් සිතියම 550 හි ලොව් 102;
- බස්නාහිරට: ගම් සිතියම 550 හි ලොව් 49 සහ 102 කේ කොටස.

J/E/305.

මි 1951 ක්වූ සැප්තැම්බර් මස 20 වැනි දින කොළඹදීය.

බිහිලි සේනානායක,
කෘෂිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිතුමා.

L A./7059/J/E 1473.

1950 අංක 9 දරන ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 5 වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම් පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය ආණ්ඩුවට ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950 අංක 9 දරන ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කෘෂිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිවරයා වූ බිහිලි ඡාලටත් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි:

කුරුණෑගල දිඤ්ඤිකයේ කිරියාල හත්පත්තුමේ බස්නාහිර ඉහල විසිදෙන කෝරළේ හෙරිබිරිකුඹුර පළාතේ පරුල්ලෙහි පිහිටි බහලගොඩවත්තේ අක්කර 3 සි, රූඩ් 0 පර්චස් 1.3 ක විසාලත්වයක් ඇති ඉඩම, ඔබා විස්තරව අන්තීම ගම් මැනීමේ ප්ලාන් හෝ 1,196 හේ හෝ. 1 දරන අතිරේකයේ හෝ. 53 දරන ඉඩම් කැඩැල්ලෙහි.

අභියාචනා J/E/1473.

මි 1952 ක්වූ ජනවාරි මස 9 වැනි දින කොළඹදීය.

බිහිලි සේනානායක,
කෘෂිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිතුමා.

1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 5 වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම් පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය ආණ්ඩුවට ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කෘෂිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිවරයා වූ බිහිලි පැල්වත් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි :

- බදුදු දිඤ්ඤකයේ බදුදු නගර සීමාව තුළ පිහිටා තිබෙන බැත්තකුණ මත්තෙන් නැමති ඉඩමෙන් අ. 0, රු. 0, ප. 1.28 ක් පමණ වපසරිය ඇති ඉඩම කැබැල්ලක්, ඊට මායිම:—
- උතුරට : උඹ බැත්තුව (ලංකා බැත්තුව බදුල්ල);
- නැගෙනහිරට : පල්ලේ විදිය;
- දකුණට : ඇලවැරස් පාර;
- බස්නාහිරට : එම

J/HLG/17.

වම් 1951 ක් වූ මැයි මස 10 වැනි දින කොළඹදීය.

බිහිලි සේනානායක,
කෘෂිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිතුමා.

1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 5 වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම් පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය ආණ්ඩුවට ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කෘෂිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිවරයා වූ බිහිලි පැල්වත් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි :

- උඹ පලාතේ, බදුල්ල නගර සීමාවේ කසිලගොඩ පිහිටා තිබෙන අ. 0, රු. 0, ප. 8 පමණ වපසරිය ඇති නිලදන්දුරුව (ලොව් 60, T. S. P. P. 43 නෙහි) නැමති ඉඩම, මායිම:—
- උතුරට : වි ගොවිතැන් කරන කුඹුරක්;
- නැගෙනහිරට : එම
- දකුණට : කුඹුරක ඉම නිසරක්.

J/HLG/867.

වම් 1951 ක් වූ ජූලි මස 10 වැනි දින කොළඹදීය.

බිහිලි සේනානායක,
කෘෂිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිතුමා.

1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 5 වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම් පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය ආණ්ඩුවට ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කෘෂිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිවරයා වූ බිහිලි පැල්වත් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි :

- උඹ පලාතේ බදුල්ල නගර සීමාව තුළ පුම්කොඩබදුල්ල මර්සිනි පහලගෙදර 43 වෙනි නගර සිතියමේ ලොව් 83 නෙහි පත්වන අ. 0, රු. 1, ප. 14.3 වපසරිය ඇති කහටහෙකොටුව නැමති ඉඩම, මායිම:—
- උතුරට : පුද්ගලික ඉඩම;
- නැගෙනහිරට : බදුදු නගරයේ කුණු වැලලීම සඳහා නගර සභාවට දී තිබෙන ඉඩම;
- දකුණට : බදුල්ලගම;
- බස්නාහිරට : සභාපිය අගස් දේපොල.

J/HLG/995.

වම් 1951 ක් වූ මැයි මස 29 වැනි දින කොළඹදීය.

බිහිලි සේනානායක,
කෘෂිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිතුමා.

No. L. D. 7341/J/AL/1262.

1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 5 වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම් පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය ආණ්ඩුවට ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කෘෂිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිවරයා වූ බිහිලි පැල්වත් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි :

- (1) හම්බන්තොට දිඤ්ඤකයේ මාගම් පත්තුවේ දකුණු නිසව අවසාන ගම්බද සිතියමේ නො. 624 පිහිටි කාසින්ගම යන ඉඩමෙන් පර්චස් 26 යේ බිම් ප්‍රමාණයට මායිම:—
උතුර සහ බටහිරට : සී. ඇල්. ඇම්. මුරුගේ සහ තවත් අයගේ ඉඩම්වලින්ද;
නැගෙනහිරට : පී. බිහිලිම්. ඩී. පාර සහ ලුකස්ගොඩ ගොවිකම්භානා දෙපාර්තමේන්තුවේ පාරෙන්ද;
දකුණට : බිහිලිම්. ඩී. ඒ. අබේසූරිය.
- (2) හම්බන්තොට දිඤ්ඤකයේ මාගම්පත්තුවේ ලුකස්ගොඩ අවසාන ගම්බද සිතියමේ නො. 629 පිහිටි ලුකස්දෙපොල යන ඉඩමෙන් පර්චස් 26 යේ බිම් ප්‍රමාණයට මායිම:—
උතුරම : නිස්සම්බගොරෙම් ඇලට යාම් තිබෙන බස්නාහිර කාඩා ඇල;
නැගෙනහිරට : ලුකස්ගොඩ ගොවිකම්භානා දෙපාර්තමේන්තුවේ පාර සහ ටී. කේ. මුරුගේ ඉඩම්වලින්;
දකුණට සහ බටහිරට : පී. අණ්ඩාමුගේ ඉඩම්වලින්ද.
- (3) හම්බන්තොට දිඤ්ඤකයේ මාගම්පත්තුවේ ලුකස්ගොඩ අවසාන ගම්බද සිතියමේ නො. 629 පිහිටි බාර්මල යන ඉඩමෙන් පර්චස් 10 බිම් ප්‍රමාණයට මායිම:—
දකුණට සහ නැගෙනහිරට : ටී. කේ. මුරුගේ ඉඩම්වලින්ද;
බටහිරට : පී. අණ්ඩාමුගේ ඉඩම්වලින්ද;
උතුරට : ලුකස්ගොඩ ගොවිකම්භානා දෙපාර්තමේන්තුවේ පාරද.
- (4) හම්බන්තොට දිඤ්ඤකයේ මාගම්පත්තුවේ ලුකස්ගොඩ අවසාන ගම්බද සිතියමේ නො. 629 පිහිටි බාර්මල යන ඉඩමෙන් පර්චස් 18 බිම් ප්‍රමාණයට මායිම:—
උතුරට සහ නැගෙනහිරට : ටී. කේ. මුරුගේ ඉඩම්වලින්ද;
දකුණට සහ බටහිරට : ලුකස්ගොඩ ගොවිකම්භානා දෙපාර්තමේන්තුවේ පාරෙන්ද.

වම් 1952 ක් වූ ජනවාරි මස 17 වැනි දින කොළඹදීය.

බිහිලි සේනානායක,
කෘෂිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිතුමා.

LA 7452/J/E/1638.

1950න් අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 5වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම් පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය ආණ්ඩුවට ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950න් අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කාමිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිවරයා වූ ඩබ්ලිව් ජැල්ටන් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශකරමි :

සුරැකුණු දිස්ත්‍රික්කයේ දඹදෙනි ගත්පත්තුවේ වැවේගම පළාතේ වැවේගම නම් ගමෙහි පිහිටි වැවේගම නම් වත්තෙන් ආස්කර හතක් පමණ ඕනෑම ආකාරයේ ඇති ඉඩමට මායිම් :—

- උතුරෙන් : වැවේගමේ ඉතිරි ඉඩම් කැබලි 0.4 ;
- නැගෙනහිරින් : බ්‍රිතාන්‍ය P. W. D. පාරද ;
- දකුණින් : අම්බලමුවියේ පාසැල් වත්තද ;
- බස්නාහිරින් : වැවේගමවත්තේ ඉතිරි ඉඩමද මේ.

අඛණ්ඩ : J/E/1638.

මේ 1952න් වූ ජනවාරි මස 9 වැනි දින කොළඹදීය.

ඩබ්ලිව් සේනානායක,
කාමිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිතුමා.

Q. 4102/J/E/ 1719.

1950න් අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 5වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම් පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය ආණ්ඩුවට ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950න් අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කාමිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිවරයා වූ ඩබ්ලිව් ජැල්ටන් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි :

කොළඹ දිස්ත්‍රික්කයේ දකුණු අර්ධකුරු කෝරළේ ගලහිටියාවේ පිහිටි මල්ලගහවත්ත ගන්දමුවේ අක්කර 1 1/2 ක පමණ ප්‍රමාණය ඊට මායිම් :—

- උතුරට : ආර්. ඒ. ඩී. රණසිංහ සහ නව අය අයිතිකම්කරු කුමාර ;
- නැගෙනහිරට : ඩබ්ලිව්. ගිරිසෝරිස් අප්පු සහ නව අය අයිතිකම්කරු ඉඩම ;
- දකුණට : මධ්‍යම පාඨනාලය ඉඩම ;
- බස්නාහිරට : ඒ. ඇම්. මාවන් අප්පුහාමි සහ නව අය අයිතිකම්කරු ඉඩම.

මේ 1952න් වූ ජනවාරි මස 16 වැනි දින කොළඹදීය.

ඩබ්ලිව් සේනානායක,
කාමිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිතුමා.

Q. 4052/J/TW/1553.

1950න් අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 5වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම් පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය ආණ්ඩුවට ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950න් අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කාමිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිවරයා වූ ඩබ්ලිව් ජැල්ටන් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි :

කොළඹ දිස්ත්‍රික්කයේ දකුණු අර්ධකුරු කෝරළේ පැලියගොඩ පව්වියේ පිහිටි කාසිවෙට්ටියකුලුල්ලකුමාර ගත ඉඩමෙන් කොටසක් වූ අක්කර : 056 ක ප්‍රමාණය ඊට මායිම් :—

- උතුරට : කඩය ;
- නැගෙනහිරට : කාසිවෙට්ටියකුලුල්ල කුමාර ;
- දකුණට : එම ඇල ;
- බස්නාහිරට : පී. ඩබ්ලිව්. ඩී. පාර.

මේ 1952න් වූ ජනවාරි මස 16 වැනි දින කොළඹදීය.

ඩබ්ලිව් සේනානායක,
කාමිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිතුමා.

LA 6620/J/HLG/1271.

1950න් අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 5වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම් පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය ආණ්ඩුවට ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950න් අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කාමිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිවරයා වූ ඩබ්ලිව් ජැල්ටන් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි :

සුරැකුණු දිස්ත්‍රික්කයේ කටුගමපොල ගත්පත්තුවේ මදපත්තු කෝරළේ මොනරවිල නැමැති ගමෙහි මහවලහි පිහිටි පර්ච්ස් 7.9 ක පමණ ඕනෑම ආකාරයේ ඇති මොනරවිලවත්ත නැමැති බිම්කැබලි දෙක—අවසාන ගම් මැනීමේ ප්ලාන් නො. 302 කේ නො. 47ද, අවසාන ගම් මැනීමේ ප්ලාන් නො. 324 කේ නො. 38ද, අවසාන ගම් මැනීමේ ප්ලාන් නො. 302 කේද, 324 කේද, නො. 1 දරණ අතිරේකය යයි විස්තර වී තිබේ.

අඛණ්ඩ : J/HLG/1271.

මේ 1952න් වූ ජනවාරි මස 9 වැනි දින කොළඹදීය.

ඩබ්ලිව් සේනානායක,
කාමිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිතුමා.

1950න් අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 5වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම් පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය ආණ්ඩුවට ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950න් අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කාමිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිවරයා වූ ඩබ්ලිව් ජැල්ටන් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි :

බදුදු දිස්ත්‍රික්කයේ උඩුතිද ඩී. ආර්. ඩී. කොඩාකයේ දෙහිවිටි පළාතෙහි මැද පළාත සහ දඹවෙලෙහි පත්තුවෙල පිහිටි අම්පිටිය වත්ත, උලුකඩ වත්ත, කොටඹිලියගහදෙරවත්ත නොහොත් විස්තර මගින් කිවහොත් 430 වෙනි අන්තිම ගම් සිතියමෙහි ලොට් 64, 64 1/2, 44 1/2, 45 1/2 සහ අංක 421 වෙනි අන්තිම ගම් සිතියමෙහි ලොට් 124 දරණ පර්ච්ස් 35 ක් වපසරිය ඇති ඉඩම් කැබලි පහ

J/HLG/1053.

මේ 1951න් වූ අගෝස්තු මස 30 වැනි දින කොළඹදීය.

ඩබ්ලිව් සේනානායක,
කාමිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිතුමා.

1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 5 වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි.

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය ආණ්ඩුවට ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උපවගන්තිය යටතේ කායිකම හා ඉඩම් පිළිබඳ ඇමතිවරයා වූ බිහිලි ෂැල්ටන් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි:

බදුදු දිනින් කාලයේ උඩුකිඳ ඇල්ලේ අලුත්වෙල පිහිටි 387 අන්තම ගම් සිතියමේ ලොට් 401 වූ නො. 39, වැනම් චිදිය, කොළඹ, සුදුසේවගේ වාර්ල්ස් ප්‍රනායුට අයත් ඉඩමේ කොටසක් වූ අ. 4, රූ. 3, ප. 0 වපසරිය ඇති එලමල්කොට්ටපහ නොහොත් කැන්තේ පහත, එල්බද්දේගලේපහ නමැති ඉඩම.

J/DEA/696.

මේ 1951 ක් වූ ජන මස 14 වැනි දින කොළඹදීය.

බිහිලි සේනානායක,
කායිකම හා ඉඩම් පිළිබඳ ඇමතිතුමා.

1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 5 වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි.

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය ආණ්ඩුවට ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කායිකම හා ඉඩම් පිළිබඳ ඇමතිවරයා වූ බිහිලි ෂැල්ටන් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි:

බදුදු දිනින් කාලයේ උඩුකිඳ කොඹාසයේ ඇල්ලේ අළුත්වෙල පිහිටා තිබෙන එලමල්කැපිය නොහොත් කැන්තේපහත සහ අතුරුබැද්දේ පහත හෙවත් නො. 387 දරණ අන්තම ගම් සිතියමේ නො. 400 සහ 401 දරණ සීමිතවිචලිත් කොටසක් වූ අ. 5, රූ. 0, ප. 24 පමණ වපසරිය ඇති ඉඩමට මායිම්:—

- උතුරට: නො. 387 දරණ අන්තම ගම් සිතියමේ නො. 400 දරණ ඉඩමෙන් කොටසක්;
- නැගෙනහිරට: එම;
- දකුණට: කදුරුගමුවේ ගම් මායිම;
- බස්නාහිරට: නො. 387 දරණ අන්තම ගම් සිතියමේ නො. 401 දරණ ඉඩමෙන් කොටසක්.

නො. J/DEA/5221.

මේ 1950 ක් වූ නොවැම්බර් මස 28 වැනි දින කොළඹදීය.

බිහිලි සේනානායක,
කායිකම හා ඉඩම් පිළිබඳ ඇමතිතුමා.

1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 5 වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි.

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය ආණ්ඩුවට ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කායිකම හා ඉඩම් පිළිබඳ ඇමතිවරයා වූ බිහිලි ෂැල්ටන් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි:

බදුදු දිනින් කාලයේ බදුදුල නගර සීමාව තුළ ජයින්ගම් පිහිටි 43 වෙනි නගර සිතියමේ ලොට් 95 පෙන්වන අගලැව්බෝගහ වත්ත නමැති ප. 13.44 පමණ වපසරිය ඇති ඉඩම, මායිම්:—

- උතුරට: ඒ. ඩී. ජී. මිරිසේකරගේ වත්ත;
- නැගෙනහිරට: අලුගොල්ලගෙල්ල මාවත;
- දකුණට: පුංචිනෝනා මිජේසුරියගේ වත්ත;
- බස්නාහිරට: වලවත්තේ කදුර.
- අයිතියයි කියනු ලබන්නේ බදුදුලේ අලුගොල්ලගෙල්ල පාරේ නො. 9 සෙහි පුංචිනෝනා මිජේසුරියගේ

J/HLG/800.

මේ 1951 ක් වූ මැයි මස 25 වැනි දින කොළඹදීය.

බිහිලි සේනානායක,
කායිකම හා ඉඩම් පිළිබඳ ඇමතිතුමා.

Q. 3907/J/AL/1030.

1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 5 වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි.

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය ආණ්ඩුවට ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කායිකම හා ඉඩම් පිළිබඳ ඇමතිවරයා වූ බිහිලි ෂැල්ටන් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි:

කොළඹ දිනින් කාලයේ බටහිර සියනැකෝරලේ මැදපත්තුවේ තල්ගස්මොටේ පිහිටි කහටගහවත්ත නමැති ඉඩමෙන් පාර්චස් 13ක පමණ ප්‍රමාණය, ඊට මායිම්:—

- උතුරට: කහටගහවත්ත සහ කල්එලියට යන පාර;
- නැගෙනහිරට: පරණ ඉරිගේගේ ආලු;
- දකුණට: එම සහ ගේගන්ගොඩ-කල්එලිය පාර;
- බස්නාහිරට: කහටගහවත්තකුඹුර.

මේ 1952 ක් වූ ජනවාරි මස 17 වැනි දින කොළඹදීය.

බිහිලි සේනානායක,
කායිකම හා ඉඩම් පිළිබඳ ඇමතිතුමා.

Q. 4039/J/LSS/1491.

1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 5 වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි.

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය ආණ්ඩුවට ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කායිකම හා ඉඩම් පිළිබඳ ඇමතිවරයා වූ බිහිලි ෂැල්ටන් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි:

කොළඹ දිනින් කාලයේ උතුරු අර්ත්තුරු කෝරලේ (A) කොට්ඨාසයේ ලියනගොඩුල්ලේ මිඳවිප්ලේන්ස් නමැති ඉඩමට යාම් පිහිටි බමාතුරුවත්ත යන ඉඩමෙන් අක්කර 5ක පමණ ප්‍රමාණය, ඊට මායිම්:—

- උතුරට: මිඳවිප්ලේන්ස් (රජය සතු ඉඩම);
- නැගෙනහිරට සහ දකුණට: සිබාතුරුවත්ත සහ
- බස්නාහිරට: කොළඹ-මිගමු මහපාර.

මේ 1952 ක් වූ ජනවාරි මස 17 වැනි දින කොළඹදීය.

බිහිලි සේනානායක,
කායිකම හා ඉඩම් පිළිබඳ ඇමතිතුමා.

1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 5 වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම් පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය ආණ්ඩුවට ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කාපිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිවරයා වූ බිහිලි පැල්වත් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි:

විවිධාන දිනෙකදී මැරීම් පත්‍රවලට අයිති පුතුකුණ්දර්පු නමැති ගම පිහිටා තිබෙන පහත සඳහන් මායිම් ඇති ආකාර 57 ක් විශාල ඇති ඉඩම.

- උතුරෙන්: ආණ්ඩුවේ ඉඩම;
- නැගෙනහිරෙන්: අවිච්චන්කුලම් වැවේ ඉඩම;
- දකුණෙන්: ආණ්ඩුවේ ඉඩම;
- බස්නාහිරෙන්: ආණ්ඩුවේ ඉඩම.

Ref. No. J/AL/1787.

මේ 1952 ක් වූ ජනවාරි මස 10 වැනි දින කොළඹදීය.

බිහිලි සේනානායක,
කාපිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිතුමා.

1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 5 වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම් පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය ආණ්ඩුවට ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කාපිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිවරයා වූ බිහිලි පැල්වත් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි:

බදුල්ලේ බදු පහර සීමාවෙහි හිල් වුඩ්ස් මර්සි අර්න්ගම පිහිටා තිබෙන අභි 15x15 පමණ වපසරිය ඇති බෝගන වත්ත නමැති ඉඩම. මායිම්:—

- උතුරට: බිහිලි. ඒ. පුංචිනෝනාට අයත් ගෙවත්ත;
- නැගෙනහිරට: බිහිලි. ඒ. පුංචිනෝනාට අයත් ගෙවත්ත සහ කුඹුරු;
- දකුණට: බිහිලි. ඒ. පුංචිනෝනාට අයත් වී කුඹුරු;
- බස්නාහිරට: බිහිලි. ඒ. පුංචිනෝනාට අයත් වූ බිහිලි සහ කඳුරයක්.

අභිකර J/AL/1263.

මේ 1951 ක් වූ සැප්තැම්බර් මස 26 වැනි දින කොළඹදීය.

බිහිලි සේනානායක,
කාපිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිතුමා.

Q. 3460/J/HLG/1410.

1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 5 වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම් පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය ආණ්ඩුවට ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කාපිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිවරයා වූ බිහිලි පැල්වත් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි:

කොළඹ දිනෙකදී සේවායම් කෝරළේ දකුණු සෝනන්දර පිහිටි ඒලෑන් නොමිචර A 2,989 හේ 1 වෙනි සහ 3 වෙනි කැබලිමල විස්තර කරනලද තිත්තමෙල කුඹුර, කොලඹ නමැති ගම දෙල්ගඟවත්ත ගන ඉඩමට දින: පාර්වස් 04.4 ක ප්‍රමාණය

මේ 1952 ක් වූ ජනවාරි මස 17 වැනි දින කොළඹදීය.

බිහිලි සේනානායක,
කාපිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිතුමා.

Q. 3520/J/HLG/346.

1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 5 වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම් පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය ආණ්ඩුවට ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කාපිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිවරයා වූ බිහිලි පැල්වත් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි:

(1) කොළඹ දිනෙකදී සේවායම් කෝරළේ බටකැත්තර පිහිටි දඹටගඟමල දිනෙකදී සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි:—

- උතුරට: ගොඩබිම් සහ මිරිසම පාර;
- නැගෙනහිරට: ගුලුමත්තගෙ කුඹුර සහ දිනෙක කුඹුර;
- දකුණට: දිනෙක කුඹුර, සහ
- බස්නාහිරට: කපුගෙ කුඹුර සහ මලිම.

(2) කොළඹ දිනෙකදී සේවායම් කෝරළේ බටකැත්තර පිහිටි දඹටගඟ කුඹුරෙන්: රූමි 2 සි පාර්වස් 13 ක පමණ ප්‍රමාණය, ඊට මායිම්:—

- උතුරට: දඹටගඟමලටත් කොටසක්;
- නැගෙනහිරට සහ දකුණට: දිනෙක කුඹුර, සහ
- බස්නාහිරට: මෙම ඉඩමේ කොටසක්.

මේ 1952 ක් වූ ජනවාරි මස 17 වැනි දින කොළඹදීය.

බිහිලි සේනානායක,
කාපිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිතුමා.

L. A. 7292/J/E/520.

1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 5 වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම් පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය ආණ්ඩුවට ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කාපිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිවරයා වූ බිහිලි පැල්වත් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි:

කුරුණෑගල දිනෙකදී මාරවිට පළාතේ වූ කුලු පහ මෙහි ඉතාමත් භෞමික දෙල්ගඟමලටත් නව මායිම්: උතුරෙන් සහ නැගෙනහිරින්: ගම්පහ නොනාරිස් නැනවු විකුම්භර මලිමට අයිති ඉඩමද, දකුණෙන්: එම්. ඇම්. කිරිඳිගත්සේට අයිති ඉඩමද, බස්නාහිරින්: ඇන්. ඒ. ලොකු සිසෙසුට සහ ඇන්. ඒ. පුංචි බණ්ඩාට අයිති ඉඩමද මායිම්වන බිම් කැබැල්ල වේ.

අංකය J/E/520.

මේ 1951 ක් වූ අගෝස්තු මස 10 වැනි දින කොළඹදීය.

බිහිලි සේනානායක,
කාපිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිතුමා.

1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ අඥපනත. 5 වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම් පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය අණුවට ඉඩම් ලබාගැනීමේ අඥපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ අඥපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කෘෂිකම් හා ඉඩම් පිලිබද ඇමතිවරයා වූ බිහිලි ජෙල්ටන් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි:

බදුල්ල දිස්ත්‍රික්කයේ බුත්තල දිසාවේ බුත්තල වැද්දට කෝරළේ වත්තේගම ගමෙහි පිහිටා තිබෙන අක්කර 2ක් (දෙකක්) පමණ වපසරිය ඇති වත්තේගම විහාරගම නැමති ඉඩමට, මායිම්:—

- උතුරට: පත්සලේ මායිම්;
- බස්නාහිරට: අලුත්ගෙදර බණ්ඩාගේවත්ත;
- දකුණට: කැලය සහ නැගෙනහිරට: වත්තේගම ගම් මුලාදුනි තැන්පත් බිහිලි. ඇම්. ඇම්. උක්කුබස්වා ගිහනාගේ ඉඩම් වැට.

J/E/65.

මි 1951 ක්වූ සැප්තැම්බර් මස 15 වන දින කොළඹදීය.

බිහිලි සේනානායක, කෘෂිකම් හා ඉඩම් පිලිබද ඇමතිතුමා.

1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ අඥපනත. 5 වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම් පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය අණුවට ඉඩම් ලබාගැනීමේ අඥපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ අඥපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කෘෂිකම් හා ඉඩම් පිලිබද ඇමතිවරයා වූ බිහිලි ජෙල්ටන් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි:

බදුල්ල දිස්ත්‍රික්කයේ උඩු දිසාවේ ආච්චලාන කෝරළේ පාලුගම වසමේ එරබැද්ද ගමෙහි පර්වත් ගඟක් (6) පමණ වපසරිය ඇති ගල්කැටිය-අරවත්ත නැමති ඉඩමට මායිම්:—

- උතුරට: පාලුගම නිමිත්තා වූ තාප්පයෙන් අඩි 15ක් පමණ අූතින්;
- නැගෙනහිරට: උතුරට මෙන්ම කොස්තස් පෙල්ලක්;
- දකුණට: දියඇල්ල පැත්තට ඇති කොස්ගෙ;
- බස්නාහිරට: පාර.

මි 1951 ක්වූ සැප්තැම්බර් මස 26 වැනි දින කොළඹදීය.

බිහිලි සේනානායක, කෘෂිකම් හා ඉඩම් පිලිබද ඇමතිතුමා.

1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ අඥපනත. 5 වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම් පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය අණුවට ඉඩම් ලබාගැනීමේ අඥපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ අඥපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කෘෂිකම් හා ඉඩම් පිලිබද ඇමතිවරයා වූ බිහිලි ජෙල්ටන් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි:

බදුල්ල දිස්ත්‍රික්කයේ උඩු දිසාවේ කොට්ඨාසයේ මහපලාන කෝරළේ කිහිගම ගමෙහි පිහිටා තිබෙන අ. 1, රූ. 0, ප. 11 වපසරිය ඇති කිහිගමපහන නැමති ඉඩමට මායිම්:—

- උතුරට: කිහිගමපහන (ලොච් 8 DF, 3 BG, 8 DF, 3 BH)
- නැගෙනහිරට: කිහිගමපහන (ලොච් 8 DF 3 BT එකම පැලෑටියේ)
- දකුණට: පාරකට වෙන්කළ ඉඩමක්;
- බස්නාහිරට: (ලොච් 8 DF, 3 BV එම පැලෑටියේ.)

J/E/1259.

මි 1951 ක්වූ ඔක්තෝබර් මස 12 වැනි දින කොළඹදීය.

බිහිලි සේනානායක, කෘෂිකම් හා ඉඩම් පිලිබද ඇමතිතුමා.

1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ අඥපනත. 5 වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම් පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය අණුවට ඉඩම් ලබාගැනීමේ අඥපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ අඥපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කෘෂිකම් හා ඉඩම් පිලිබද ඇමතිවරයා වූ බිහිලි ජෙල්ටන් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි:

බදුල්ල දිස්ත්‍රික්කයේ, බවල්ලස්ස කොට්ඨාසයේ දඹගල්ල කෝරළේ ගල්බොක්ක ගමේ පිහිටා තිබෙන අ. 2½ වපසරිය ඇති ගල්කන්දගේන නැමති ඉඩමට මායිම්:—

- උතුරට: මාගන්දන-ගල්බොක්ක වි. සී. පාර;
- නැගෙනහිරට: අණුවේ ඉඩම;
- දකුණට: මාගන්දන ගල්බොක්ක වි. සී. පාර සහ ඩී. ඇම්. ගංආතිට අගස් ඉඩම;
- බස්නාහිරට: දඹගල්ල-ගල්බොක්ක වි. සී. පාර.

J/E/1231.

මි 1951 ක්වූ දෙසැම්බර් මස 15 වැනි දින කොළඹදීය.

බිහිලි සේනානායක, කෘෂිකම් හා ඉඩම් පිලිබද ඇමතිතුමා. L. A. 7438/J/E/1534.

1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ අඥපනත. 5 වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම් පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය අණුවට ඉඩම් ලබාගැනීමේ අඥපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ අඥපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කෘෂිකම් හා ඉඩම් පිලිබද ඇමතිවරයා වූ බිහිලි ජෙල්ටන් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි:

සුරැකුණල දිස්ත්‍රික්කයේ කටුගමපොල හත්පත්තුම් මහියි පලාතේ නල්තිවිලුල්ල නම් ගමේ කුඹුක්ගහමුලවත්ත සහ කොස්ගහමුලවත්ත ගඟ වතු වලින් අක්කර 1, රූ. 1, පර්වත් 10 ක විශාලතියක් ඇති බිම් කැබැල්ලට, මායිම් —

- උතුරෙන්: මේර්ටගම වෙලීපෙත්තෙගහමුල ගම්සභා පාරද;
- නැගෙනහිරින්: කුඹුක්ගහමුල කුඹුරද, රත්තරන්ගහ කුඹුරද;
- දකුණෙන්: කුඹුක්ගහමුලවත්තේ ඉතිරි කොටස සහ
- බස්නාහිරින්: කොලොන්නස්සය වත්තද, (පාරට වෙන්කරනලද ඉඩම) මායිම් වේ.

අභිකය J/E/1534.

මි 1952 ක්වූ ජනවාරි මස 10 වැනි දින කොළඹදීය.

බිහිලි සේනානායක, කෘෂිකම් හා ඉඩම් පිලිබද ඇමතිතුමා.

L. A. 7452 J/E/1638.

1950න් අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. විවේචි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම් පොදු කටයුත්තකට උමමනාකර තිබෙන බවත්, එය ආණ්ඩුවට ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950න් අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කායිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිවරයා වූ බිඳිලි ඇල්ටන් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි:

කුරුණෑගල දිස්ත්‍රික්කයේ දඹදෙණියත් පත්තුවේ වෑවේගම් පළාතේ වෑවේගම් නමැති ගමේ පිහිටි වෑවේගම් වත්තෙන් අක්කර 5 හත පමණ ඵලාලයක් ඇති බිම් කැබැල්ලට, මායිම්:—

- උතුරෙන්: වෑවේගම ඉතිරි කොටසද;
- නැගෙනහිරින්: P. W. D. හිසපොල පාරද;
- දකුණෙන්: ආසැල් වත්තද, අම්බලම් පිටියවත්ත සහ බස්නාහිරින්: වෑවේගම වත්තේ ඉතිරි කොටසද වේ.

අංකය J/E/1638.

වම් 1952ක් වූ ජනවාරි මස 9 වැනි දින කොළඹදීය.

බිඳිලි සේනානායක,
කායිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිතුමා.

L. A. 7462/J. H. L. G/1715.

1950න් අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. විවේචි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම් පොදු කටයුත්තකට උමමනාකර තිබෙන බවත්, එය ආණ්ඩුවට ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950න් අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කායිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිවරයා වූ බිඳිලි ඇල්ටන් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි.

කුරුණෑගල දිස්ත්‍රික්කයේ කීරියාලහත් පත්තුවේ මැදපොල පළාතේ මැදපොල ගමේ පිහිටි කතකඩවේගම නමැති ඉඩමෙන් අක්කර 3 හත් පමණක් බිම් කැබැල්ලට, මායිම්:—

- උතුරෙන්: IBW 2C, 5, IBW 2 යන බිම් කැබැල්ලද, ඕම්මක් සහ කතකඩවේගම වැවද;
- නැගෙනහිරින්: IBW 2 යන බිම් කැබැල්ලද;
- දකුණෙන්: පාරකිත්තද, ටයිටල් පලාත් නො. 294027 නේ සිට 294030 දක්වා සහ බස්නාහිරින්: පාරකිත්ත වේ.

අංකය J/HLG/1715.

1952ක් වූ ජනවාරි මස 13 වැනි දින කොළඹදීය.

බිඳිලි සේනානායක,
කායිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිතුමා.

Q. 4048/J/AL/1522.

1950න් අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. විවේචි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම් පොදු කටයුත්තකට උමමනාකර තිබෙන බවත්, එය ආණ්ඩුවට ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950න් අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කායිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිවරයා වූ බිඳිලි ඇල්ටන් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි:

කොළඹ දිස්ත්‍රික්කයේ උතුරු අර්ථකුරු කෝරළේ (B) කොඨාශයේ අස්තිරිවල්පොල පිහිටි අමුණත්තක යන ඉඩමෙන් පාර්ච්ස් 10.6 ක පමණ ප්‍රමාණය, ඊට මායිම්:—

- උතුරට සහ දකුණට: අමුණත්තක;
- නැගෙනහිරට: මිදෙල්ල ඇළේ අත්තක්;
- බස්නාහිරට: ඇත්භිමුල්ල.

(2) කොළඹ දිස්ත්‍රික්කයේ උතුරු අර්ථකුරු කෝරළේ (B) කොඨාශයේ අස්තිරිවල්පොල පිහිටි ඇත්භිමුල්ල යන ඉඩමෙන් පාර්ච්ස් 10.6 ක පමණ ප්‍රමාණය, ඊට මායිම්:—

- උතුරට, නැගෙනහිරට සහ දකුණට: ඇත්භිමුල්ල;
- බස්නාහිරට: නොවූවෙකුමුර.

(3) කොළඹ දිස්ත්‍රික්කයේ උතුරු අර්ථකුරු කෝරළේ (B) කොඨාශයේ අස්තිරිවල්පොල පිහිටි ඇත්භිමුල්ල යන ඉඩමෙන් පාර්ච්ස් 10.6 ක පමණ ප්‍රමාණය, ඊට මායිම්:—

- උතුරට, දකුණට සහ බස්නාහිරට: ඇත්භිමුල්ල;
- නැගෙනහිරට: අමුණත්තක.

(4) කොළඹ දිස්ත්‍රික්කයේ උතුරු අර්ථකුරු කෝරළේ (B) කොඨාශයේ අස්තිරිවල්පොල පිහිටි නොවූවෙකුමුරෙන් පාර්ච්ස් 10.6 ක පමණ ප්‍රමාණය, ඊට මායිම්:—

- උතුරට, දකුණට සහ බස්නාහිරට: නොවූවෙකුමුර;
- නැගෙනහිරට: ඇත්භිමුල්ල.

(5) කොළඹ දිස්ත්‍රික්කයේ උතුරු අර්ථකුරු කෝරළේ (B) කොඨාශයේ අස්තිරිවල්පොල පිහිටි නොවූවෙකුමුරෙන් පාර්ච්ස් 8 ක පමණ ප්‍රමාණය, ඊට මායිම්:—

- උතුරට, නැගෙනහිරට, දකුණට සහ බස්නාහිරට: නොවූවෙකුමුර.

(6) කොළඹ දිස්ත්‍රික්කයේ උතුරු අර්ථකුරු කෝරළේ (B) කොඨාශයේ අස්තිරිවල්පොල පිහිටි නොවූවෙකුමුරෙන් පාර්ච්ස් 5.3 ක පමණ ප්‍රමාණය, ඊට මායිම්:—

- උතුරට, නැගෙනහිරට සහ දකුණට: නොවූවෙකුමුර;
- බස්නාහිරට: නොවූවෙකුමුර සහ පොල් ඉඩම.

(7) කොළඹ දිස්ත්‍රික්කයේ උතුරු අර්ථකුරු කෝරළේ (B) කොඨාශයේ අස්තිරිවල්පොල පිහිටි නොවූවෙකුමුරෙන් පාර්ච්ස් 13.3 ක පමණ ප්‍රමාණය, ඊට මායිම්:—

- උතුරට, නැගෙනහිරට සහ බස්නාහිරට: නොවූවෙකුමුර;
- දකුණට: නොවූවෙකුමුර සහ පොල් ඉඩම.

වම් 1951ක් වූ දෙසැම්බර් මස 15 වැනි දින කොළඹදීය.

බිඳිලි සේනානායක,
කායිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිතුමා.

L. A. 7344/J/HLG/940.

1950 අංක 9 දරන ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 5 වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම් පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය ආර්ථිකව ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950 අංක 9 දරන ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තියේ 1 වැනි උප වගන්තිය යටතේ කායිකම හා ඉඩම් පිළිබඳ ඇමතිවරයා විසින් මැලිටත් සේනානායක නමැති මෙහෙයුම් ප්‍රකාශකරම්

ඇතුළත්ව දැක්වීමට වූ - බිහිවූ ගත්පත්තුවේ වෙළුම්පොල පළාතේ රත්මලේගොඩ ගමේ පිහිටි බිහිවූ ඉඩමක් අත්කර 2 ක් පමණ විකාලනයක් ඇති ඉඩමට මායිම් :-

- උතුරෙන් : කේසරා කොඩිගැනිල්ලේ ඉඩම් කොටසද ;
- නැගෙනහිරින් : අඹුරුද, බිහිවූ ඉඩමක් කොටසක්ද ;
- දකුණෙන් : සෙත්තුවාසිදීන්ට අයිති ඉඩම සහ මහපාරද ;
- බස්නාහිරින් : පරගගදෙකිය සිට පුස්තැල්ලට ගත හි. අර්. සී. පාර මේ.

අංකය J/HLG/940.
මේ 1952 ක් වූ පැළපුවත් මස 18 වැනි දින කොළඹදීය.

බිහිවූ සේනානායක,
කායිකම හා ඉඩම් පිළිබඳ ඇමතිතුමා.
අංක MA/AC/1074/51.

1950 ඉඩම් ගැනීමේ ආඥාපනත අංක 9. 7 වන වගන්තිය යටතේ දැන්වීමයි

මෙහි පහත දැක්වෙන ඉඩම් ප්‍රසිද්ධ කටයුත්තක් සඳහා ආර්ථිකව වුවමනා කරන බැවින් 1950 අංක 9 දරන ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 7 වන වගන්තියේ 1 වන උප කොටස අනුව එම ලබාගැනීමට වුවමනා කරන බව මෙයින් දැනුම් දෙමි.

ලබාගැනීමට වුවමනා කරන ඉඩම්වල විස්තර :-

ප්‍රාදේශීය පලාත A 2,862. ගම - නුනුපිටිය සහ කොල්ලුපිටිය, කොට්ඨාශ 16 සහ 26, කොළඹ නාගරික සීමාව තුළ කොළඹ දිස්ත්‍රික්කයේ බස්නාහිර පළාත

නො.	ඉඩමේ නම	විස්තර	අයිතිකම්කීයන්ගේ අයිතිකම්කීයන්ගේ	ප්‍රමාණය, අ. රූ. ප.
1	ඇලුණටත් පෙදෙසේ අංක 131 දරණ ඉඩමේ කොටස	අවුරුදු 40 පොල්ගසක්, අවුරුදු 15 කොස්ගසක්, අම් ගස 3ක්, අවුරුදු 2 පැපොල්ගස 30ක්, කෙසෙල් පඳුරු 20 සහ ගලෙන් බැඳි තාප්පවල කොටස ඇති බව	කොළඹ ඇලුණ : න් පෙදෙසේ අංක 131 කේ බිහිවූ. එ. හි. රමනායක	0 0 13-77
2	ජනරල් ලේන් පාරේ අංක 191, 193, 201 සහ 203 දරණ ඉඩම්වල කොටස	අවුරුදු 20 පොල්ගස 5ක්, බිලින්ගසක්, අවුරුදු 2 ක පැපොල්ගස දෙකක්, අවුරුදු 5 පෙරෙසක්, අවුරුදු 5 ජැම්ගස 2ක්, අවුරුදු 1 උක්ගසක්, ලී ගෙවිලි 6ක්, ගලෙන් බැඳි ගෙවිලි කුටුණ 6ක්, ගලෙන් බැඳි තාප්ප සහ ජමායේ කොටස, බිත්තියක කොටස, ගලෙන් බැඳි කාණු 2 ක කොටසක් සහ කොන්ක්‍රීට් වැස්මක කොටසක් ඇති ඉඩම	රජකිරිගේ කොටා රෝසි හි අංක 10 ගේ පදිංචි බිහිවූ. ජ. හි. හෙන්රිස්	0 0 18-17
3	වරවි පාරේ අංක 97 දරණ ඉඩමේ කොටසක්	අවුරුදු 5 ක මාර්ගගත, අවුරුදු 1 ක අම්ගසක්, මාස 2 ක පැපොල්ගස 10 ක් ලී ගෙවිලි 6 ක්, ගලෙන් බැඳි තාප්ප සහ තාප්පයක කොටසක් ඇති ඉඩම	කොළඹ වරවි පාරේ අංක 97 ගේ පදිංචි හි. ජී. හෙවිට් අරච්චි මහත්මිය	0 0 18-07
4	වරවි පාරේ අංක 75 දරණ ඉඩමේ කොටසක්	මෙල්ගොඹ, ගලෙන් කළ ගෙවිලි, කුරුක්ක සහිත ලී ගෙවිලි 2 ක් සහ ගලෙන් බැඳි තාප්පවල කොටසක්	කොළඹ වරවි පාරේ අංක 75 ගේ පදිංචි හර්. ජරඩ් විජේකෝන්	0 0 4-37
එකතුව ..				0 1 14-38

ඒ නිසා ඉහත සඳහන් ඉඩම් ගැන අයිතිකම් කිසිදින අය හෝ ඒ වෙනුවට පෙනී සිටින අය හෝ 1952 ක් වූ මාර්තු මස 18 වැනි දින පොරවරු 10 ට කොළඹ නාගරික සභා කාර්යාලයේදී මා ඉදිරිපත් පැමිණිය යුතුය. නොඑසේ නම් අයිතිකම් ගැන විස්තර සහිතව ලිපි දෙකක් ලැබිය යුතු මුදල් සහාය සඳහන් කොට පිළි 1952 ක් වූ මාර්තු මස 10 වැනි දිනට ප්‍රථම ලියුම් මගින් දැන්විය යුතුයි.

මේ 1952 ක් වූ ජනවාරි මස 23 වැනි දින කොළඹ නාගරික සභා කාර්යාලයේදීය.

පිලියම් ගොපල්ලා,
නාගරික කොමසාරිස්තුමා.
අංකය MA/AC/927/51.

1950 අංක 9 දරන ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත අංක 9. 7 වන වගන්තිය යටතේ දැන්වීමයි

මෙහි පහත දැක්වෙන ඉඩම් ප්‍රසිද්ධ කටයුත්තක් සඳහා ආර්ථිකව වුවමනා කරන බැවින් 1950 අංක 9 දරන ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 7 වන වගන්තියේ (1) වන උප කොටස අනුව එම ඉඩම් ලබාගැනීමට වුවමනාකරන බව මෙයින් දැනුම් දෙමි.

ලබාගැනීමට වුවමනාකරන ඉඩම්වල විස්තර :-

ප්‍රාදේශීය පලාතේ නො. A 2,904. ගම - බිලිපිටිය කොට්ඨාශය නො. 28, කොළඹ නාගරික සීමාව තුළ පිහිටි හැරිලොක්වවුම, කොළඹ දිස්ත්‍රික්කය, බස්නාහිර පළාත

නො.	ඉඩමේ නම	විස්තර	අයිතිකම්කීයන්ගේ	ප්‍රමාණය, අ. රූ. ප.
1	බිලිපිටියේ හි ක්ෂේත්‍රයේ ප්ලාන්හි අංක 36 දරන ඉඩමේ කොටසක්	අවුරුදු 40 ක පොල්ගස සහරක්, අවුරුදු 25 ක් අම්ගසක්, අවුරුදු 20 ක කොස් ගසක්, අවුරුදු 5 ක කිටුල්ගසක්, අවුරුදු 3 ක කැන්දගසක්, අවුරුදු 1 ක පැපොල්ගස 3 ක්, කෙසෙල් පඳුරු 14 ක් ඇති ඉඩම	කොල්ලුපිටියේ 19 වන මාවතේ අංක 17 පදිංචි ඇල්. ජේ. බිහිවූ මහත්මී	0 0 22-96
2	හි ක්ෂේත්‍රයේ ප්ලාන්හි අංක 22 දරන ඉඩමේ කොටසක්	ගලෙන් බැඳි තාප්පයක කොටසක් ඇති (විශාලත් නැති) ඉඩම	බිලිපිටියේ හි ක්ෂේත්‍රයේ ප්ලාන්හි අංක 22 පදිංචි ජ. ඇස්. ගුණතිලක මහත්මී	0 0 0-09
3	හි ක්ෂේත්‍රයේ ප්ලාන්හි අංක 36 දරන ඉඩමේ කොටසක්	අවුරුදු 40 ක පොල්ගස 3 ක්, අවුරුදු 15 ක කොස්ගසක්, අවුරුදු 3 ක කොසපැල ගසක්, අවුරුදු 8 ක අම්ගසක්, අවුරුදු 8 ක කුස්සුගසක්, අවුරුදු 5 ක අනෙත්තා ගස දෙකක් සහ කෙසෙල් පඳුරු 5 ක් සහිත ඉඩම	කොල්ලුපිටියේ 19 වන මාවතේ අංක 17 පදිංචි ඇල්. ජේ. බිහිවූ මහත්මී	0 0 5-80
එකතුව ..				0 0 28-85

ඒ නිසා ඉහත සඳහන් ඉඩම් ගැන අයිතිකම් කිසිදින අය හෝ ඒ වෙනුවට පෙනී සිටින අය හෝ 1952 මාර්තු මස 20 වන දින පොරවරු 10 ට කොළඹ නාගරික සභා කාර්යාලයේදී මා ඉදිරිපත් පැමිණිය යුතුය. නොඑසේ නම් අයිතිකම් ගැන විස්තර සහිතව ලිපි දෙකක් ලැබිය යුතු මුදල් සහාය සඳහන් කොට 1952 මාර්තු මස 12 වන දිනට ප්‍රථම ලියුම් මගින් දැන්විය යුතුයි.

මේ 1952 ක් වූ ජනවාරි මස 23 වැනි දින කොළඹ නාගරික සභා කාර්යාලයේදීය.

පිලියම් ගොපල්ලා,
නාගරික කොමසාරිස්තුමා.

Q. 3660/J/HLG/495.

1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 7 වැනි වගන්තිය යටතේ වූ දැන්වීමයි

පොදු කටයුත්තක් සඳහා අවශ්‍ය පහත දැක්වෙන ඉඩම් ලබාගැනීමට ආණ්ඩුව අදහස් කරන බැව් 1950 අංක 9 දරන ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 7 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ මෙයින් දැනුම් දී සිටිමි.

ලබාගැනීමට බලාපොරොත්තුවන ඉඩමේ විස්තර:—

නො. ඉඩමේ නම	විස්තර	අයිතිවාසිකම් හෝ අයිතිවාසිකම්කරු	ප්‍රමාණය, අ.ර. ප.
1	බත්ගලාවත්ත	පොල් ඉඩම, ගොඩනැගිලි 3 කුත් සමග ..	සිරි වි. පී. ගුණවර්ධන, නො. 57, අල්ලිස් පෙදෙස; 2 0 11.6 කොට්ඨාස

ඉහත සඳහන් ඉඩමට හිමිකම්, අයිතිවාසිකම් හෝ වෙනත් සම්බන්ධතා කිසිවක් සිටින සියලුදෙනාම තම නමින් හෝ ඔවුන්ගෙන් ලියවිලිවලින් බලය ලත් අයවලුන් හෝ වම් 1952 ක්වූ මාර්තු මස 22 වෙනි දින පෙරවරු 10 වේ වේලාවට කොළඹ කවිචේරියේදී මා සම්මුඛ විය යුතුයි.

තවද වම් 1952 මාර්තු මස 7 වෙනි දිනට මත්තෙන් ඒ ඉඩම සම්බන්ධයෙන් ඔවුන්ගේ අයිතිවාසිකම්වල ස්ථිරත්වය, එකී ඉඩම ලබාගැනීම ගැන වත්දී ඉල්ලීමට ඇති කරුණු පිළිබඳ විස්තරත්, වත්දී මුදල හා ඒ මුදල ගණන් බැලූ හැටිත් මා වෙත (පිටපත් දෙකක් සහිතවූ) ලියවිලිවලින් දැනුම් දිය යුතුයි.

වම් 1952 ක්වූ ජනවාරි මස 25 වෙනි දින කොළඹ කවිචේරියේදීය. ඇත්. මානික්‍ය ඉඩම් සිකඩාර්, ආණ්ඩුවේ අතිරේක ඒජන්තතුමා.

Q. 2346/J/E/901.

1950 ක්වූ අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 7 වැනි වගන්තිය යටතේ වූ දැන්වීමයි

පොදු කටයුත්තක් සඳහා අවශ්‍ය පහත දැක්වෙන ඉඩම් ලබාගැනීමට ආණ්ඩුව අදහස් කරන බැව් 1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 7 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ මෙයින් දැනුම් දී සිටිමි.

ලබාගැනීමට බලාපොරොත්තුවන ඉඩමේ විස්තර:—

නො. ඉඩමේ නම	විස්තර	අයිතිවාසිකම් හෝ අයිතිවාසිකම්කරු	ප්‍රමාණය, අ.ර. ප.
2	ජම්බුගොඩැල්ල පොල් ඉඩම	අගුබෝධිවිහාරයේ භාරකරු: ගරු ඇම්. ඩී. මේධාන්කාර ස්වීරතුමා, මිගමු 0 0 15.5	

ඉහත සඳහන් ඉඩමට හිමිකම්, අයිතිවාසිකම් හෝ වෙනත් සම්බන්ධතා කිසිවක් සිටින සියලු දෙනාම තම නමින් හෝ ඔවුන්ගෙන් ලියවිලිවලින් බලය ලත් අයවලුන් හෝ වම් 1952 ක්වූ මාර්තු මස 22 වෙනි දින පෙරවරු 11.30 වේලාවට කොළඹ කවිචේරියේදී මා සම්මුඛ විය යුතුයි.

තවද වම් 1952 ක්වූ මාර්තු මස 8 වෙනි දිනට මත්තෙන් ඒ ඉඩම සම්බන්ධයෙන් ඔවුන්ගේ අයිතිවාසිකම්වල ස්ථිරත්වය, එකී ඉඩම ලබාගැනීම ගැන වත්දී ඉල්ලීමට ඇති කරුණු පිළිබඳ විස්තරත්, වත්දී මුදල හා ඒ මුදල ගණන් බැලූ හැටිත් මා වෙත (පිටපත් දෙකක් සහිතවූ) ලියවිලිවලින් දැනුම් දිය යුතුයි.

වම් 1952 ක්වූ ජනවාරි මස 23 වෙනි දින කොළඹ කවිචේරියේදීය. ඇත්. මානික්‍ය ඉඩම් සිකඩාර්, ආණ්ඩුවේ අතිරේක ඒජන්තතුමා.

අංකය L. D. 775 (J/HLG/232).

මේ සම්බන්ධ සියලුම ලියුම්වල මේ අංකය දැක්විය යුතුයි.

1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 7 වැනි වගන්තිය යටතේ වූ දැන්වීමයි

පොදු කටයුත්තක් සඳහා අවශ්‍ය පහත දැක්වෙන ඉඩම/බුක්කි විශාලය ලබාගැනීමට ආණ්ඩුව අදහස් කරන බැව් 1950 අංක 9 දරන ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 7 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ මෙයින් දැනුම් දී සිටිමි.

ලබාගැනීමට බලාපොරොත්තුවන ඉඩමේ නොහොත් බුක්කි විශාලයේ විස්තර:—

ඉඩමේ නම: ඩී. පී. ඒ. 1,714 දරණ ජලානේ අංක එක සහ දෙක දරණ කැබලි පෙත්තුවකර තිබෙන ඊකිල්ලගස්කඩවත්ත.
 ප්‍රමාණය: පර්චස් 1.82 (අ. 0, ර. 0, ප. 1.82).
 පිහිටීම: මධ්‍යම පළාතේ නුවරඑළිය දිස්ත්‍රික්කයේ උඩගේ මාහැට කොට්ඨාසයේ දියතිලක කෝරළයේ ඊකිල්ලගස්කඩ ගමේ.
 විස්තර: හේ අඩුරුදු 20 යි.
 ඉල්ලුම්කරුවෝ: සීමාසහිත කුමාරගේ චන්ද්‍ර සමාගම, කළමනාකාර අධ්‍යක්ෂ ඩී. ඇස්. චන්ද්‍රකුමාර, ඊකිල්ලගස්කඩ.

ඉහත සඳහන් ඉඩමට/බුක්කි විශාලයට හිමිකම්, අයිතිවාසිකම් හෝ වෙනත් සම්බන්ධතා කිසිවක් සිටින සියලුදෙනාම තම නමින් හෝ ඔවුන්ගෙන් ලියවිලිවලින් බලය ලත් අයවලුන් හෝ වම් 1952 ක්වූ මාර්තු මස 12 වෙනි දින පුළුබාග 10 වේලාවට නුවරඑළිය කවිචේරියේදී මා සම්මුඛ විය යුතුයි.

තවද වම් 1952 ක්වූ මාර්තු මස 5 දිනට මත්තෙන් ඒ ඉඩම සම්බන්ධයෙන් ඔවුන්ගේ අයිතිවාසිකම්වල ස්ථිරත්වය, එකී ඉඩම හෝ බුක්කි විශාලය ලබාගැනීම ගැන වත්දී ඉල්ලීමට ඇති කරුණු පිළිබඳ විස්තරත්, වත්දී මුදල හා ඒ මුදල ගණන් බැලූ හැටිත් මා වෙත (පිටපත් දෙකක් සහිතවූ) ලියවිලිවලින් දැනුම් දිය යුතුයි.

වම් 1952 ක්වූ ජනවාරි මස 28 වෙනි දින නුවරඑළිය කවිචේරියේදීය. ඊ. පී. ගුණවර්ධන, ආණ්ඩුවේ උප ඒජන්තතුමා.

අංකය. L. D. 621(J/E/1013).

මේ සම්බන්ධ සියලුම ලියුම්වල මේ අංකය දැක්විය යුතුයි.

වම් 1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 7 වැනි වගන්තිය යටතේ වූ දැන්වීමයි

පොදු කටයුත්තක් සඳහා අවශ්‍ය පහත දැක්වෙන ඉඩම් ලබාගැනීමට ආණ්ඩුව අදහස් කරන බැව් 1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 7 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ මෙයින් දැනුම් දී සිටිමි.

ලබාගැනීමට බලාපොරොත්තුවන ඉඩමේ විස්තර:—

ඩී. පී. ඒ 1,688 දරණ ජලානේ අංක 1 සිට 9 දක්වා මැන සහ විස්තරකර තිබෙන මධ්‍යම පළාතේ නුවරඑළිය දිස්ත්‍රික්කයේ කොත්මලේ කොට්ඨාසයේ තිස්පනේ හැදුනාව මැදපිටතේ කෝරළේ නවත්ගම පිහිටි අ. 10, ර. 2, ප. 28.2 පමණ ඇති වලව්වේ වත්ත සහ රත්නාරාමගමයේ න නමැති ඉඩම වේ.
 ඉහත සඳහන් ඉඩමට හිමිකම්, අයිතිවාසිකම් හෝ වෙනත් සම්බන්ධතා කිසිවක් සිටින සියලුදෙනාම තම නමින් හෝ ඔවුන්ගෙන් ලියවිලිවලින් බලය ලත් අයවලුන් හෝ වම් 1952 ක්වූ මාර්තු මස 12 වෙනි දින පුළුබාග 10.45 වේලාවට නුවරඑළිය කවිචේරියේදී මා සම්මුඛ විය යුතුයි.

තවද වම් 1952 ක්වූ මාර්තු මස 5 වෙනි දිනට මත්තෙන් ඒ ඉඩම සම්බන්ධයෙන් ඔවුන්ගේ අයිතිවාසිකම්වල ස්ථිරත්වය, එකී ඉඩම ලබාගැනීම ගැන වත්දී ඉල්ලීමට ඇති කරුණු පිළිබඳ විස්තරත්, වත්දී මුදල හා ඒ මුදල ගණන් බැලූ හැටිත් මා වෙත (පිටපත් දෙකක් සහිතවූ) ලියවිලිවලින් දැනුම් දිය යුතුයි.

වම් 1952 ක්වූ ජනවාරි මස 28 වැනි දින නුවරඑළිය කවිචේරියේදීය. ඊ. පී. ගුණවර්ධන, ආණ්ඩුවේ උප ඒජන්තතුමා.

අංකය. L. D. 621(J/E/1013).

මේ සම්බන්ධ සියලුම ලියුම්වල මේ අංකය දැක්විය යුතුයි.

අංකය. L. D. 788 (J/E/324).

මේ සම්බන්ධ සියළුම ලියුම්වල මේ අංකය දැක්විය යුතුයි.

1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 7 වෙනි වගන්තිය යටතේ දැන්වීමයි

පොදු කටයුත්තක් සඳහා අවශ්‍ය පහත දැක්වෙන ඉඩම් ලබාගැනීමට ආණ්ඩුව අදහස්කරන බැවින් 1950 අංක 9 දරන ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 7 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ මෙයින් දැනුම් දී සිටිමි.

ලබාගැනීමට බලාපොරොත්තුවන ඉඩමේ විස්තර :—

ඉඩමේ නම: ඩී. ඩී. ඒ 1,750 දරණ ජලාශේ අංක 1 දරන කැබලි පෙන්නුම්කර තිබෙන වල්ලගමත්ත; ප්‍රමාණය: අ. 1 රූ. 2, ප. 5.5. පිහිටීම: මධ්‍යම පළාතේ නුවරඑළිය දිස්ත්‍රික්කයේ කොත්මලේ කොළඹයේ දිවුලකෝරළේ මිලිකල්ලියමේ, විස්තරය: හේ, අවුරුදු 50-60 දක්වාද, අවුරුද්දක් පමණක් කෙරෙහි 25 ක්ද, ඇතැම්විට 4 ක් හා මුඩුබිමද; ඉල්ලුම්කරුවාගේ: සීමාසහිත ලංකා හේ වැවිලිකරු සමාගම.

ඉහත සඳහන් ඉඩමට හිමිකම්, අයිතිවාසිකම් හෝ වෙනත් සම්බන්ධතා කිසියම් සියලුදෙනාම තම තමන් හෝ ඔවුන්ගෙන් ලියවිලිවලින් බලය ලත් අයවලුන් හෝ වම් 1952 ක්වූ මාර්තු මස 12 වෙනි දින පූර්වහා 11.30 වේලාවට නුවරඑළිය කවිචේරියේදී මා සම්මුඛ විභාගයකට සහභාගී විය යුතුයි.

තවද වම් 1952 ක්වූ මාර්තු මස 5 වෙනි දිනට මත්තෙන් ඒ ඉඩම් සම්බන්ධයෙන් ඔවුන්ගේ අයිතිවාසිකම්වල සහායකයන්, එකී ඉඩම් ලබාගැනීම ගැන වන්දි ඉල්ලීමට ඇති කරුණු පිළිබඳ විස්තරයන්, වන්දි මුදල හා ඒ මුදල ගණන් බැලූ හැටිත් මා වෙත (පිටපත් දෙකක් සහිතව) ලියවිලිවලින් දැනුම් දිය යුතුයි.

වම් 1952 ක්වූ ජනවාරි මස 28 වෙනි දින නුවරඑළිය කවිචේරියේදීය.

ඒ. ඒ. ගුණවර්ධන,
ආණ්ඩුමේ උප ජ්‍යෙෂ්ඨ නිලධාරී.

1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 7 වැනි වගන්තිය යටතේ දැන්වීමයි

පොදු කටයුත්තක් සඳහා අවශ්‍ය පහත දැක්වෙන ඉඩම් ලබාගැනීමට ආණ්ඩුව අදහස්කරන බැවින් 1950 අංක 9 දරන ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 7 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ මෙයින් දැනුම් දී සිටිමි.

ලබාගැනීමට බලාපොරොත්තුවන ඉඩම්වල විස්තර :—

නො.	ඉඩමේ නම	විස්තර	මුල් සිතියමේ ඉඩකය. A 1,251. ගම්—යටලමත්ත	අයිතිකම්කරන්නා	ප්‍රමාණය, අ. රූ ප.
1	ඉම්බලන්තොඩැල්ල	අවුරුදු 10 ක් වයස්වූ පොල්ගසක් සහ පුවත්තසක් සහ අවුරුදු 20 ක් වයස්වූ දෙල්ගසක් සහ බැමිමක කොටසක් ඇති ඉඩම		නාගොඩ යටලමත්ත පදිංචි රත්මිල්ලි පතිනායක	0 0 3.4
2	මත්තේමැතිල්ල	බැමිමක සහ අමුණක කොටස සහිත කුඹුර		නාගොඩ යටලමත්ත පදිංචි යු. බිහිලිච්චි, වික්‍රමසිංහ, ඇල්බට් සිරිමත්ත, පුත්තේස් වික්‍රමසිංහ, එම්. ඩී. කොරනේලිස්, වාල්ස් දිසස් පතිනායක සහ බැප්ටිස් දිසස් පතිනායක	0 0 22.8
3	එම	අමුණක් සහිත විහාර ඇලක්		එම	0 0 18.5
4	එම	අමුණක් සහ බැමිමක් සහිත කුඹුර		එම	0 0 17.2
5	සරෙයිලියාද්ද	බැමිමක කොටසක් සහිත කුඹුර		නාගොඩ යටලමත්ත පදිංචි එල්. ඩී. පතිනායක, උදේතිස් වික්‍රමසිංහ, විලියම් සුරියආරච්චි, යු. බිහිලිච්චි, වික්‍රමසිංහ	0 0 7.1
6	බාර්ගම	එම		නාගොඩ යටලමත්ත පදිංචි යු. බිහිලිච්චි, වික්‍රමසිංහ, ඇල්බට් සිරිමත්ත, එෆ්. ඩී. ජේෂ්වරත්න, පුත්තේස් වික්‍රමසිංහ, වාල්ස් දිසස් පතිනායක සහ ඩී. බිහිලිච්චි, කරුණරත්න	0 0 17.9
7	කික්කඩුවේ ගෙදර වත්ත නොහොත් මිල්ලගමත්ත	වාට්මාට් ඇලක කොටසක් සහිත මුඩුබිමක කොටසක්		නාගොඩ, යටලමත්ත පදිංචි යු. බිහිලිච්චි, වික්‍රමසිංහ	0 0 1.4
8	බටදෙමගමත්ත	අවුරුදු 20 ක් වයස්වූ රබර්ගසක්ද, අවුරුදු 6 ක් වයස්වූ පොල්ගසක්ද, අවුරුදු 20 ක් වයස්වූ පුවත්තසක් සහ අවුරුදු 15 ක් වයස්වූ හේ පඳුරු 13 ක් ඇති ඉඩම		නාගොඩ යටලමත්ත පදිංචි හැන්දි දිසස් පතිනායක	0 0 2.7
9	කික්කඩුවේ ගෙදර වත්ත නොහොත් මිල්ලගමත්ත	අවුරුදු 20 ක් වයස්වූ කිතුල්ගසක් ඇති ඉඩම		නාගොඩ යටලමත්ත පදිංචි යු. බිහිලිච්චි, වික්‍රමසිංහ	0 0 1.2
11	බටදෙමගමත්ත	අවුරුදු 3-10 ක් වයස්වූ පුවත්තසක් 2 ක්ද, කිතුල්ගසක්ද, අවුරුදු 3-10 ක් වයස්වූ බටදෙමගසක් ඇති ඉඩම		නාගොඩ යටලමත්ත පදිංචි එල්. ඩී. පතිනායක, පී. එම්. පතිනායක, ඒ. ඩී. පතිනායක, ඒ. ඩී. පතිනායක සහ කොරනේලියා දිසස් පතිනායක සහ අර්නෝලියා දිසස් පතිනායක	0 0 2.6
13	අදෙස්වත්ත	අවුරුදු 2-12 ක් වයස්වූ මුරුංගාගස් 4 ක්ද, ගොඩපරගස් 2 ක්ද, කිනගස් 2 ක්ද, බටදෙමගසක්ද, කිතුල් ගස් 3 ක්ද, පොල්ගසක්ද, අම්බගසක්ද, නැඳුන්ගස් 2 ක් සහ පුවත්තසක් 2 ක්, අවුරුදු 40-50 ක් වයස්වූ කොස්ගස් 2 ක් සහ පොල්ගස් 2 ක් සහ පොල් ගසක් ඇති ඉඩම		නාගොඩ යටලමත්ත පදිංචි එල්. ඩී. පතිනායක	0 0 2.9
14	ගල්කොටමුල්ල	බැමිමක් සහිත කුඹුර		නාගොඩ, යටලමත්ත පදිංචි බිහිලිච්චි, ඒ. ඩී. ජේෂ්වරත්න, බිහිලිච්චි, ඒ. තිලකසිරි, බිහිලිච්චි, ඒ. ජ්‍යෙෂ්ඨ, කරුණරත්න දිසස් පතිනායක සහ පතිනායක	0 0 3.8
16	එම	කුඹුර		එම	0 0 1.1

ඉහත සඳහන් ඉඩම්වලට හිමිකම් අයිතිවාසිකම් හෝ වෙනත් සම්බන්ධතා කිසියම් සියලුදෙනාම තම තමන් හෝ ඔවුන්ගෙන් ලියවිලිවලින් බලය ලත් අයවලුන් හෝ වම් 1952 ක්වූ මාර්තු මස 8 වැනි දින පෙරවරු 9.45 ට යටලමත්තේ ආණ්ඩුමේ පාඨශාලාවේදී මා සම්මුඛ විභාගයකට සහභාගී විය යුතුයි.

තවද වම් 1952 ක්වූ පෙබරවාරි මස 23 වැනි දිනට මත්තෙන් ඒ ඉඩම් සම්බන්ධයෙන් ඔවුන්ගේ අයිතිවාසිකම්වල සහායකයන්, එකී ඉඩම් ලබාගැනීම ගැන වන්දි ඉල්ලීමට ඇති කරුණු පිළිබඳ විස්තරයන්, වන්දි මුදල හා ඒ මුදල ගණන් බැලූ හැටිත් මා වෙත (පිටපත් දෙකක් සහිතව) ලියවිලිවලින් දැනුම් දිය යුතුයි.

වම් 1952 ක්වූ ජනවාරි මස 22 වැනි දින ගාල්ලේ කවිචේරියේදීය.

ඒ. ඒ. ගුණවර්ධන,
ආණ්ඩුමේ උප ජ්‍යෙෂ්ඨ නිලධාරී.

නො. ඉඩමේ නම	විස්තර	අයිතිකරුවන්ගේ නම	ප්‍රමාණය, අ.ර.ප.
33 පිපාංවෙල	අවුරුදු 5ක් වයස් වූ කොහිල ඇති දෙකක	සීක්කවුම් මිහිඳුගේ ආරච්චි මල්පුඩු සෙනෙවිරත්න, සීක්කවුම් තුසාරාච්චුගොඩ පදිත්ති මිනුම්, මිනුමේ හැන්දේ ද සිල්වා ද අයිතිකරුවන්	0 0 4.1
34 එම	එම	එම	0 0 0.6
35 තුන්වැට්ටිවත්ත	අවුරුදු 4ක් වයස් වූ කාච්චුගොඩ, පුම්බගස්ස හා තොට්ටිලගස් ඇති ඉඩම	සීක්කවුම් තුසාරාච්චුගොඩ පදිත්ති ගොලුවා මරක්කල සුරසේන හා මිනුම්, මිනුමේ හැන්දේ සිල්වා	0 0 0.6
36 පිපාංවෙල	කුඹුර	සීක්කවුම් මිහිඳුගේ ආරච්චි මල්පුඩු සෙනෙවිරත්න	0 1 29.4
37 තුන්වැට්ටිවත්ත	අවුරුදු 50-70ක් වයස් වූ කොහිල 3ක්ද, අවුරුදු 20ක් වයස් වූ පොල්ගස් 7ක්ද, අවුරුදු 8ක් වයස් වූ පොල්ගස් 3ක්ද, අවුරුදු 10ක් වයස් වූ පුම්බගස් 23ක්ද, අවුරුදු 8ක් වයස් කිතුල්ගස් හා ලීදක් ඇති පොල් ඉඩම	සීක්කවුම්, තුසාරාච්චුගොඩ පදිත්ති ගොලුවා මරක්කලගේ සුරසේන	0 0 16.7
38 හිමිදුමරක්කල තුන් වැට්ටිවත්ත	අවුරුදු 20ක් වයස් වූ පොල්ගස් 2ක්ද, අවුරුදු 10ක් වයස් වූ පොල්ගස් හා අවුරුදු 20ක් වයස් වූ රබර්ගස් 2ක් ඇති ඉඩම	තුසාරාච්චුගොඩ සීක්කවුම් පදිත්ති මල්කම් මහේ ලියනගේ පේන් සිල්වා හා මහිමිවෙල වඩු එක්කම	0 0 2
39 හිමිදුමරක්කල වත්ත අද්දර කුඹුර	කුඹුර	සීක්කවුම් මිනිස් පෙරු තැන සැමු මෙල් මරුගමිනාන	0 0 18.1
40 එම	එම	එම	0 1 34.6
41 එම	එම	එම	0 0 14.4

එවැනි ඉඩම් අයිතිකරුවන්ගේ මට අණුවේ කලාපාරි නිබන්ධ බව පොදු ජනතාව දනගැනීම සඳහා හමුවෙහි වගන්තියේ ඕනෑකර නිබන්ධ ගැටීමට මෙයින් දැනුම් දෙමි.

ඉහත සඳහන් ඉඩම්වලට අයිතිවාසිකම් ඇත්තාවූ සෑමදෙනම තමුන්ම නොහොත් තමුන් වෙනුවට ක්‍රියාකරන අතර මිසි 1952ක් ඔබ්බේ මාර්තු මස 25 වැනි දින පෙරවර 9 කාණ්ඩයට සීක්කවුම් තානාප්පේදී මා ඉදිරිපිටට පැමිණ ඒ කොට්ඨාස අයිතිවාසිකම් ද කියා කිය සිටින්නට ඕනෑවා සහ මෙම ඉඩම් වෙනුවට ඉල්ලා සිටින මුදල් ගන්නන්, ඒම ඇත්තාවූ තමුන්ගේ අයිතිකරු නොවනුයේ, කියා සිටින්නට ඕනෑ බව මෙයින් දැනගනු යුතුයි.

මිසි 1952ක් වූ ජනවාරි මස 26 වැනි දින
 ගාල්ලේ කම්මලේදිය.
 ජේන් රයිඩ්,
 අණුවේ උප ජ්‍යෙෂ්ඨ මිනි.

අණුවේ කටයුත්තකට, එනම්:—සීක්කවුම් ජලාලේ මිලාක්කම් සඳහා කාණ්ඩ තැනීම පිණිස මෙහි පහත සඳහන් වෙහි ඉඩම් ලබාගැනීම සඳහා ක්‍රියාකරන පිණිස “203 පරිච්ඡේදයේ ඉඩම් ලබාගැනීමේ අභ්‍යන්තරය” පස්වැනි කාණ්ඩයේ කර නිබන්ධ පොතේ වැට්ටි ප්‍රකාරයට කැඩී කඩා ඉඩම් පිලිබද ඇමතිතුමාගෙන් කිසිදු කාර මට අණ ලැබී තිබේ. ඒ ඉඩමේ නම:—

නො. ඉඩමේ නම	විස්තර	අයිතිකරුවන්ගේ නම	ප්‍රමාණය, අ.ර.ප.
1 කුදුවෙහෙර පැල බණ්ඩර වත්ත, වර්ජනම් අඹක දරණ 365 ක් කොටසක්	අවුරුදු 50ක් වයස් වූ පොල්ගස් 10ක් ඇති පොල් ඉඩම	සීක්කවුම් මිහිඳුගොඩ පදිත්ති ගමගේ කන්කා නන්ගේ හෙණික් අප්පුහාමි	0 0 10
2 කුදුවෙහෙර පැල බණ්ඩර වත්ත, වර්ජනම් අඹක දරණ 630 ක් කොටසක්	අවුරුදු 50ක් වයස් වූ පොල්ගස් 4ක් සහ අගලක කොටසක් ඇති පොල් ඉඩම	සීක්කවුම් පදිත්ති හිමිසි සෙනෙවිරත්න	0 0 14.7
3 කුදුවෙහෙර පැල බණ්ඩර වත්ත, වර්ජනම් අඹක දරණ 634 ක් කොටසක්	එම	නෙල්වත්ත ගොඩගම පදිත්ති නගගේ දෙත් ජයවර්ධන සහ එම අල්විස්	0 0 3 7
4 කුදු විගොඩවෙල බණ්ඩර වත්ත, වර්ජනම් අඹක දරණ 367 ක් කොටසක්	අවුරුදු 12ක් වයස් වූ පොල්ගස් 2ක් සහ අවුරුදු 3ක් වයස් වූ පොල්පැල 6ක් ඇති පොල් ඉඩම	සීක්කවුම් මිහිඳුගොඩ පදිත්ති ගොවිල් කෝරලයේ ක්ලාර් එම් ලීලියන් ද සිල්වා සහ එනේරිස් දිසානායක	0 0 5.5
5 කුදුවාගොඩවෙල, වර්ජනම් අඹක දරණ 367	අවුරුදු 40ක් වයස් වූ පොල්ගස් 3ක්ද, අවුරුදු 12ක් වයස් වූ පොල්ගස් 8ක් සහ අවුරුදු 4ක් වයස් වූ පොල්පැල 14ක් ඇති පොල් ඉඩම	එම	0 0 25
6 කුදුවාගොඩවෙල, වර්ජනම් අඹක දරණ 365	අවුරුදු 40ක් වයස් වූ පොල්ගස් 2ක්ද, අවුරුදු 2ක් වූ දෙල්ගස් කද කොසෙල් පුරු එලවල සහ ලීදක් ඇති පොල් ඉඩම	සීක්කවුම් මිහිඳුගොඩ පදිත්ති ගමගේ කන්කා නන්ගේ හෙණික් අප්පුහාමි සහ එනේරිස් දිසානායක	0 0 14.8
9 කිරිගන්දියවත්ත, වර්ජනම් අඹක දරණ 367 කොටසක්	අවුරුදු 50ක් වයස් වූ පොල්ගස් 5ක්ද, අවුරුදු 10ක් වයස් වූ පොල්ගස් 3ක්ද, අවුරුදු 15ක් වයස් වූ දෙල්ගස් 4ක් සහ පුම්බගස් හා ඇති පොල් ඉඩම	සීක්කවුම් කිරිගන්දියගොඩ පදිත්ති කුසියා හැන්තැදිගේ අප්පු සිසෙසා	0 0 9.8
10 කිරිගන්දියවත්ත, වර්ජනම් අඹක දරණ 329 ක් කොටසක්	අවුරුදු 10ක් වයස් වූ පුම්බගස් 3ක් ඇති ඉඩම	සීක්කවුම් කිරිගන්දියගොඩ පදිත්ති හෙමිඳුකුමාරිගේ ජිනාදාස	0 0 0.3
12 කුදුවාගොඩවෙල	දෙකක	සීක්කවුම් කිරිගන්දියගොඩ පදිත්ති ගරුකටයුතු සීක්කවුම් මිහිඳුගොඩ පදිත්ති සුමනසාර නායක සමීර, ජනානාදන මහ පක්සලේ භාරකාර තැන එලියේ අප්පු	0 1 3.1
13 එම	කුඹුර	සීක්කවුම් කිරිගන්දියගොඩ තුදුගැන්තැන්ගේ එලියේ අප්පු	0 0 9.2
14 එම	එම	සීක්කවුම් කිරිගන්දියගොඩ පදිත්ති ගරුකටයුතු සීක්කවුම් මිහිඳුගොඩ පදිත්ති සුමනසාර නායක සමීර, ජනානාදන මහ පක්සලේ භාරකාර තැන	0 0 39.1
15 එම	එම	සීක්කවුම් කිරිගන්දියගොඩ පදිත්ති කුරුවගේ නන්පෙරිස් සිල්වා	0 0 12.1

නො. ඉඩමේ නම	විස්තර	අයිතිකම්කරුන්ගේ නම	ප්‍රමාණය, අ. රූ. ප.
16 මුනලේගමවත්ත නොහොත් පත්සලේවත්ත	අවුරුදු 15ක් වයස්වූ පොල්ගස් 3ක් ඇති පොල් ඉඩම	කිත්තවූවේ, කිරිගන්දියොඩ පදිංචි ගරුකවසුතු කිත්තවූවේ වැල්ලවත්තේ සුමනසාරනායක සමීර, ජනානන්දරාමයපත්සලේ භාරකාරතුමා	0 0 2.4
17 එම	අවුරුදු 10ක් වයස්වූ පොල්ගස් 9ක්ද, අවුරුදු 5ක් වයස්වූ පොල්ගස් 3ක්ද, අවුරුදු 10ක් වයස්වූ කොට්ටිබාගස් 2ක් සහ අවුරුදු 3-10ක් වයස්වූ පුවක් ගස් 59ක් ඇති පොල් ඉඩම	එම	0 0 25.4
18 කුඳවාගොඩවෙල	අවුරුදු 40ක් වයස්වූ පොල්ගස් සහ අවුරුදු 15ක් වයස්වූ පොල් ගස් 9ක් ඇති කුඹුර සහ මිටිව	කිත්තවූව, කිරිගන්දියොඩ පදිංචි කුරුවගේ නන්දේර්ස් සිල්වා	0 1 32.9
19 කුඳවාගොඩවෙල	අවුරුදු 40ක් වයස්වූ පොල්ගස්ද අවුරුදු 15ක් වයස්වූ පොල්ගස් 2ක් සහ අවුරුදු 5ක් වයස්වූ පොල්ගස් 2ක් ඇති මිටිව සහ කුඹුර	කිත්තවූව, කිරිගන්දියොඩ පදිංචි කුරුවගේ නන්දේර්ස් සිල්වා	0 0 5.2
20 මුනලේගමවත්ත	අවුරුදු 15ක් වයස්වූ පොල්ගස් 3ක් සහ අවුරුදු 1-5ක් වයස්වූ පොල් ඉඩම	කිත්තවූව, කිරිගන්දියොඩ පදිංචි කලබඩල්ගේ අන්දේර්ස් සිල්වා	0 0 2.7
21 අචාර්යගේගමවත්ත අද්දර කුඹුර	පොල්අතු මඩුවක් ඇති මිටිව සහ කුඹුර	කිත්තවූව, කිරිගන්දියොඩ පදිංචි කලබඩල්ගේ අන්දේර්ස් සිල්වා, මුතුමාන අචාර්යගේ පුංචිගාමි සාදේර්ස්ගාමි, මුතුමාන අචාර්යගේ පුංචිගාමි, මුතුමාන අචාර්යගේ සාන්තිගාමි, මුතුමාන අචාර්යගේ නෙළුරේර්ස්ගාමි, මුතුමාන අචාර්යගේ කරෝලීස් ගාමි, රතුමුගේ කීර්තියාමි, මීගම අචාර්යගේ පුංචිගාමි, අතුරුලේ චෙලදම්මුගේ පොම් නෝනා, ලොකුමුගේ ලොකුමුගේ ද අල්මිස්, දේවනාරායන ඉසාර්ස්ගාමි, එම නොනේගාමි, එම ගබිරියෙල්ගාමි සහ කෝට්ටේගොඩ, නාමදුන්න පදිංචි දේවනාරායන බඩන්තිගාමි	0 0 24.9
22 එම	කුඹුර	කිත්තවූව, කිරිගන්දියොඩ පදිංචි කලබඩල්ගේ අන්දේර්ස් සිල්වා, මුතුමාන අචාර්යගේ සාදේර්ස්ගාමි, මුතුමාන අචාර්යගේ පුංචිගාමි, මුතුමාන අචාර්යගේ සාන්තිගාමි, මුතුමාන අචාර්යගේ නෙළුරේර්ස්ගාමි මුතුමාන අචාර්යගේ කරෝලීස්ගාමි, රතුමුගේ කීර්තියාමි, මීගම අචාර්යගේ පුංචිගාමි, අතුරුලේ චෙලදම්මුගේ ලොකුමුගේ ද අල්මිස්, දේවනාරායන ඉසාර්ස්ගාමි, එම නොනේගාමි, එම ගබිරියෙල්ගාමි සහ කෝට්ටේගොඩ, නාමදුන්න පදිංචි දේවනාරායන බඩන්තිගාමි	0 0 37.6
23 අචාර්යගේගමවත්ත අද්දර කුඹුර	කුඹුර	එම	0 0 1.8

එබැවින් ඉඩම් අයිතිකරගැනීමට අණවූවේ කල්පනාව නිබන්ධන බව පොදු ජනශාධ දනනැත්ම සඳහා හසලවන වගන්තියේ මනාකර නිබන්ධන ගැටියට මෙයින් දුනු දෙමි.

ඉහත කී ඉඩම්වලට අයිතිවාසිකම් ඇත්තාවූ සෑමදෙනම කමුත් නොහොත් කමුත් වෙනුවට ක්‍රියාකරන අය, වසි 1952ක්වූ මාර්තු මස 26වෙනි දින පෙරවරු 9 කානිසමට කිත්තවූවේ නානායක දී මා ඉදිරිපිටට පැමිණ එ කොඩි අඟුණේ අයිතිවාසිකම්ද කියා කියාපිරිසට මනාවා සහ මෙම ඉඩම් වෙනුවට ඉල්ලා සිටින මුදල් ගණනක් ඊට ඇත්තාවූ කමුත්ගේ අයිතිකමේ නොරතුරුත් කියා සිටින්නට මනා බව මෙයින් දනගත යුතුයි.

වසි 1952ක්වූ ජනවාරි මස 26වෙනි දින
 ආලේ කවිචේරියේදීය.
 රේජර්ජි,
 ආණ්ඩුවේ උප ජ්ජන්ත විමසා.
 L. B. 2026.

1950න් අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 7 වැනි වගන්තිය යටතේ වූ දැන්වීමයි

පොදු කටයුත්තක් සඳහා අවශ්‍ය පහත දැක්වෙන ඉඩම ලබාගැනීමට අණවූ අදහස්කරන බැව් 1950න් අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 7 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ මාතර දිස්ත්‍රික්කයේ ආණ්ඩුවේ උප ජ්ජන්ත කැන්පස් ජී. ඩී. මිරසංග වන මම මෙයින් දුනුමිදි සිටිමි.

- ලබාගැනීමට ලබාපොරොත්තුවන ඉඩමේ විස්තර—
- මාතර / ක්‍රික්කයේ ගඟබඩ පත්තුවේ තුමේ ගත මෙ පිහිටි පැලවත්ත ගත ඉඩමක් දිගින් අඩි 20ක් සහ පළලින් අඩි 20ක් පමණ වන බිමක්, දඹට මායිම් :—
 - උතුරට : ගෝනගමවත්ත ;
 - නැගෙනහිරට : කඹුරුපිටිය-කිරිද පි. බිහිලිවි. ඩී. පාර ;
 - දකුණට : පැලවත්ත බි. සහ
 - බස්නාහිරට : ඕදුවත්ත නොහොත් දිරගෙවත්ත.

ඉහත සඳහන් ඉඩමට හිමිකම් අයිතිවාසිකම් හෝ වෙනත් සබඳතාවක් කියා සිටින සියලුදෙනාම තම තමන් හෝ බවුත්ගෙන් ලියවිලිවලින් බලය ලත් අයවලුන් හෝ වසි 1952ක්වූ මාර්තු මස 12වෙනි දින පෙරවරු 11න් වේලාවට මාතර කවිචේරියේදී මා සමීච්ච විය යුතුයි.

කවද වසි 1952ක්වූ මාර්තු මස 5වෙනි දිනට මත්තෙන් ඒ ඉඩම සබඳතාවෙන් බවුත්ගේ අයිතිවාසිකම්වලට සහායවන්න, එකී ඉඩම් ලබාගැනීම සඳහා වන්දි ඉල්ලීමට ඇති කරුණ පිළිබඳ විස්තරයක්, වන්දි මුදල හා ඒ මුදල ගණන් බැඳු ගැටිය මා වෙත (පිටපත් දෙකක් සහිතවූ) ලියවිලිවලින් දුනුමිදි යුතුයි.

වසි 1952ක්වූ ජනවාරි මස 21වෙනි දින
 මාතර කවිචේරියේදීය.
 ජී. ඩී. මිරසංග,
 ආණ්ඩුවේ උප ජ්ජන්තකුමා.

L. B. 2033.

1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ අඥපනත. 7 වැනි වගන්තිය යටතේ වූ දැන්වීමයි

පොදු කටයුත්තක් සඳහා අවශ්‍ය පහත දැක්වෙන ඉඩම් ලබාගැනීමට අණවූවු අදහස්කරන බැව් 1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ අඥපනතේ 7 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ මාතර දිස්ත්‍රික්කයේ අණුවේ උප ඒජන්තතුමා වන ඒ. ඩී. විරසිංහ වන මම මෙයින් දැනුම් දී සිටිමි.

ලබාගැනීමට බලාපොරොත්තුවන ඉඩමේ විස්තර:—

මාතර දිස්ත්‍රික්කයේ වැල්ලබඩ පන්තුවේ දෙබම්පහල යන ගම පිහිටි හින්තවිගොඩඅරේ දන්ගහවත්ත නැමති ඉඩමේ පාවිච්චි කරනලද ඒ. කැබලේලා මැද කැබලේලා, ප්‍රමාණය අක්කර 0, රූඩ් 3, පර්චස් 12.33. එම ඉඩමට මායිම්:—

උතුරට: කරගහවත්ත;

නැගෙනහිරට: ඒ. ඒ. විරන්තට අයිති හින්තවිගොඩ අරේ දන්ගහවත්ත නැමති පාවිච්චි කරනලද නැගෙනහිර ඒ. කැබලේලා නැගෙනහිර කොටස;

දකුණට: දිසානායකවත්ත සහ ගම්සභා පාර;

බස්නාහිරට: දෙබම්පහල අණුවේ පාඨශාලාවට දෙනලද පාවිච්චි කරනලද ඒ. කැබලේලා.

ඉහත සඳහන් ඉඩමට හිමිකම්, අයිතිවාසිකම් හෝ වෙනත් සංකීර්ණ කී පිරිසිඳු සියලුදෙනාම තම තමන් හෝ ඔවුන්ගෙන් ලියවිලිවලින් බලය ලත් අයවලුන් හෝ වසී 1952 ක්වූ මාර්තු මස 20 වැනි දින පෙරවරු 11 ට මාතර කවිචේරියේදී මා සම්මුඛ විඥානුයි.

තවද වසී 1952 ක්වූ මාර්තු මස 13 වැනි දිනට මත්තෙන් ඒ ඉඩම් සංකීර්ණයෙන් ඔවුන්ගේ අයිතිවාසිකම්වල ස්වභාවයත්, එකී ඉඩම් ලබාගැනීම ගැන වන්දි ඉල්ලීමට ඇති කරුණු පිළිබඳ විස්තරත්, වන්දි මුදල හා ඒ මුදල ගණන් බැලූ ගැටිත් මා වෙත (පිටපත් දෙකක් සහිතවූ) ලියවිලිලකින් දැනුම් දිය යුතුයි.

වසී 1952 ක්වූ ජනවාරි මස 26 වැනි දින මාතර කවිචේරියේදීය.

ඒ. ඩී. විරසිංහ,
අණුවේ උප ඒජන්තතුමා.
L. B. 2033.

1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ අඥපනත. 7 වැනි වගන්තිය යටතේ වූ දැන්වීමයි

පොදු කටයුත්තක් සඳහා අවශ්‍ය පහත දැක්වෙන ඉඩම් ලබාගැනීමට අණවූවු අදහස්කරන බැව් 1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ අඥපනතේ 7 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ මාතර දිස්ත්‍රික්කයේ අණුවේ උප ඒජන්තතුමා වන ඒ. ඩී. විරසිංහ වන මම මෙයින් දැනුම් දී සිටිමි.

ලබාගැනීමට බලාපොරොත්තුවන ඉඩමේ විස්තර:—

මාතර දිස්ත්‍රික්කයේ වැල්ලබඩ කෝරළේ වලාන යන ගම පිහිටි දවතිගහගහෙන යන ඉඩමින් දිගින් අඩි 230 ක් සහ පළලින් අඩි 16 ක් බිම් පටිපත්, ඉඩමට මායිම්:—

උතුරට: මුදුගමුවේ සිට දුනට නිබන ගම්සභා පාර;

නැගෙනහිරට: එම ඉඩමේ ඉතුරු කොටස;

දකුණට: වලානේ සිට දුනට නිබන ගම්සභා පාර;

බස්නාහිරට: එම ඉඩමේ ඉතුරු කොටස.

ඉහත සඳහන් ඉඩමට හිමිකම්, අයිතිවාසිකම් හෝ වෙනත් සංකීර්ණ කී පිරිසිඳු සියලුදෙනාම තම තමන් හෝ ඔවුන්ගෙන් ලියවිලිවලින් බලය ලත් අයවලුන් හෝ වසී 1952 ක්වූ මාර්තු මස 21 වැනි දින පෙරවරු 11 ට මාතර කවිචේරියේදී මා සම්මුඛ විඥානුයි.

තවද වසී 1952 ක්වූ මාර්තු මස 13 වැනි දිනට මත්තෙන් ඒ ඉඩම් සංකීර්ණයෙන් ඔවුන්ගේ අයිතිවාසිකම්වල ස්වභාවයත්, එකී ඉඩම් ලබාගැනීම ගැන වන්දි ඉල්ලීමට ඇති කරුණු පිළිබඳ විස්තරත්, වන්දි මුදල හා ඒ මුදල ගණන් බැලූ ගැටිත් මා වෙත (පිටපත් දෙකක් සහිතවූ) ලියවිලිලකින් දැනුම් දිය යුතුයි.

වසී 1952 ක්වූ ජනවාරි මස 26 වැනි දින මාතර කවිචේරියේදීය.

ඒ. ඩී. විරසිංහ,
අණුවේ උප ඒජන්තතුමා.
L. B. 2040.

1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ අඥපනත. 7 වැනි වගන්තිය යටතේ වූ දැන්වීමයි

පොදු කටයුත්තක් සඳහා අවශ්‍ය පහත දැක්වෙන ඉඩම් ලබාගැනීමට අණවූවු අදහස්කරන බැව් 1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ අඥපනතේ 7 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ මාතර දිස්ත්‍රික්කයේ අණුවේ අතිරේක උප ඒජන්තතුමාවන ඒ. සැන්චි වි. විජේමත්ත වන මම මෙයින් දැනුම් දී සිටිමි.

ලබාගැනීමට බලාපොරොත්තුවන ඉඩමේ විස්තර:—

මාතර දිස්ත්‍රික්කයේ කඩවත්තනාර් සහ වැල්ලබඩ පන්තුවේ මැද්දවත්ත නැගෙනහිර යන ගම පිහිටි වැල්ලබඩවිත්ත යන ඉඩමෙන් දිගින් අඩි 20 ක් සහ පළලින් අඩි 20 ක්, එම ඉඩමට, මායිම්:—

උතුරට: වැල්ලබඩවත්ත;

නැගෙනහිරට: පී. බිලිලි. සී. පාර;

දකුණට සහ බස්නාහිරට: වැල්ලබඩවත්ත.

ඉහත සඳහන් ඉඩමට හිමිකම්, අයිතිවාසිකම් හෝ වෙනත් සංකීර්ණ කී පිරිසිඳු සියලුදෙනාම තම තමන් හෝ ඔවුන්ගෙන් ලියවිලිවලින් බලය ලත් අයවලුන් හෝ වසී 1952 ක්වූ මාර්තු මස 26 වැනි දින පෙරවරු 10 ට මාතර කවිචේරියේදී මා සම්මුඛ විඥානුයි.

තවද වසී 1952 ක්වූ මාර්තු මස 19 වැනි දිනට මත්තෙන් ඒ ඉඩම් සංකීර්ණයෙන් ඔවුන්ගේ අයිතිවාසිකම්වල ස්වභාවයත්, එකී ඉඩම් ලබාගැනීම ගැන වන්දි ඉල්ලීමට ඇති කරුණු පිළිබඳ විස්තරත්, වන්දි මුදල හා ඒ මුදල ගණන් බැලූ ගැටිත් මා වෙත (පිටපත් දෙකක් සහිතවූ) ලියවිලිලකින් දැනුම් දිය යුතුයි.

වසී 1952 ක්වූ ජනවාරි මස 26 වැනි දින මාතර කවිචේරියේදීය.

ඒ. සැන්චි වි. විජේමත්ත,
අණුවේ අතිරේක උප ඒජන්තතුමා.

1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ අඥපනත. 5 වැනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම් පොදු කටයුත්තකට උමහනාකර තිබෙන බවත්, එය අණුවේ ඉඩම් ලබාගැනීමේ අඥපනතේ විධිවිධාන යටතේ ලබාගත්තා බවත්, 1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ අඥපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කාමිකම් හා ඉඩම් පිළිබඳ ඇමතිවරයා වූ බිලිලි පැල්ලන් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි:

පී. ඩී. ඒ 1,688 දරණ ප්ලාන් අඩක 1 සිට 9 දක්වා තිබෙන කැබලි මැන සහ විස්තර කර තිබෙන මධ්‍යම පළාතේ නුවරඑළිය දිස්ත්‍රික්කයේ කොත්මලේ කොමිසාරිස්වරයාගේ නිස්පන්තියට අනුව මැදපහේ කෝරළේ නවත්ගම පිහිටි අ. 10, රූ. 2, ප. 28.2 ක් පමණ ඇති වලවිචේවත්ත සහ රත්නාරාගහසමයෙන් නමැති ඉඩම් වේ.

නො. J/E/1013.

වසී 1951 ක්වූ දෙසැම්බර් මස 19 වැනි දින කොළඹදීය.

බිලිලි සේනානායක,
කාමිකම් හා ඉඩම් පිළිබඳ ඇමතිතුමා.

L D/7324/LRO APL 4662 AJ/AL/1568.

1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 7 වැනි වගන්තිය යටතේ දැන්වීමයි

පොදු කටයුත්තක් සඳහා ඉවසා පහත දැක්වෙන ඉඩම් ලබාගැනීමට ආණ්ඩුව අදහස්කරන බැවින් 1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 7 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ මෙයින් දැනුම් දී සිටිමි.

ලබාගැනීමට බලාපොරොත්තුවන ඉඩමේ විස්තර:—

නො. අඩංගු නම	විස්තර	අයිතිකම්කරුන්ගේ අයිතිකම්කරුන්ගේ නො. 297. ගම්—මහනිල්ල	ප්‍රමාණය අ. රූ. ප.
355	ගොරකනහවත්ත අවුරුදු (40) හතලිහක් වගා වැනි පොල්, කොස්, යු. ඇම්. සලමන් අපසුනම්, යෝධකන්ඩිය, පුවක් සහ දෙල්ගස්වලින් යුක්ත වේ	සම—මහනිල්ල අයිතිකම්කරුන්ගේ	අ. රූ. ප. 1 3 6

ඉහත සඳහන් ඉඩමට හිමිකම් අයිතිවාසිකම් හෝ වෙනත් සම්බන්ධකම් කීයා සිටින සියලුදෙනාම තම තමන් හෝ ඔවුන්ගෙන් ලියවිලිවලින් බලය ලත් අයවලුන් හෝ වසී 1952 ක්‍රි.ව. 2 වැනි දින පෙරවර 9.30ට බෙලිෆන්ත නගර සභාසාලයේදී මා සම්මුඛව විභාග කළෙමි.

තවද වසී 1952 ක්‍රි.ව. 2 වැනි දිනට මත්තෙන් ඒ ඉඩම සම්බන්ධයෙන් ඔවුන්ගේ අයිතිවාසිකම්වල සම්භාවයන්, එකී ඉඩම් ලබාගැනීම ගැන වන්දි ඉල්ලීමට ඇති කරුණු පිළිබඳ විස්තරයන්, වන්දි මුදල හා ඒ මුදල ගණන් බැඳු හැරින් මොවුන්ට (පිටපත් දෙකක් සහිතව) ලියවිලිවලින් දැනුම් දිය යුතුයි.

වසී 1952 ක්‍රි.ව. 2 වැනි දින හමබන්තොට කවිචේරියේදීය.

ඒ. ඩී. ඇස්. ඇන්. පුල්ලෙනාගම ආණ්ඩුවේ උප ඒජන්තතුමා.

L. A./448.

1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 7 වැනි වගන්තිය යටතේ දැන්වීමයි

පොදු කටයුත්තක් සඳහා ඉවසා පහත දැක්වෙන ඉඩම් ලබාගැනීමට ආණ්ඩුව අදහස්කරන බැවින් 1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 7 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ මෙයින් දැනුම් දී සිටිමි.

ලබාගැනීමට බලාපොරොත්තුවන ඉඩම්වල විස්තර:—

නො. අඩංගු නම	විස්තර	මම—කරෙයිතිවු නැගෙනහිර අයිතිකම්කරුන්ගේ	ප්‍රමාණය, අ. රූ. ප.
1	රෙයිබන්ද්‍ර	පාක්කිපම නොහොත් ඩී. සුමුමතිරමගේ භාග්‍යාව, කාරසිනගර, උතුර	0 0 17
2	කොළිපහලුම්	ආරුමුගම් සුමුමතිරම, කාරසිනගර, බස්නාහිර	0 0 8.6
3	එම	දුනට මලයාගේ සිටින විසුවනාදර කන්දසියා සහ විසුවනාදර ආරුගාලම්	0 0 12.1
4	එම	සහ කනානිපිල්ලෙයි කන්දපසු, කාරසිනගර, බස්නාහිර	0 0 12.7
5	එම	දුනට මලයාගේ සිටින මුත්තසියා හබ්බන් සහ සබාපති පිල්ලෙයි	0 0 10.5
6	එම	දුනට මලයාගේ සිටින කන්දසියා නිල්ලියම්පලම් සහ කන්දසියා ලෙලිපහන්, කන්දසියා අයිසම්, කන්දසියා නල්ලම්, පරවේසම් නොහොත් ඩී. සෝමසුඤ්ජයේ භාග්‍යාව, සියල්ලම්, කාරසිනගර උතුර	0 0 6.5
7	එම	සුඤ්ජයේ නොහොත් නැයිසියා ඩී. කන්දසියාගේ භාග්‍යාව, කාරසිනගර, නැගෙනහිර	0 0 6.7
8	එම	පරමනානාද් සිටියෝනි සහ පරමනානාද් පරමනානාද්, කාරසිනගර නැගෙනහිර	0 0 27
9	එම	සිහම්පරම් නොහොත් නැයිසියා ඒ. සන්දුගමගේ භාග්‍යාව, කාරසිනගර, නැගෙනහිර	0 0 20.5
10	එම	පරමනානාද් සිටියෝනි සහ පරමනානාද් පරමනානාද්, කාරසිනගර නැගෙනහිර	0 0 26.2
11	එම	පරමනානාද් සිටියෝනි සහ පරමනානාද් පරමනානාද්, කාරසිනගර නැගෙනහිර	0 0 34.5
12	උපසුකාලි	අම්බලවනාර් මේඋපිල්ලෙයි, කාරසිනගර නැගෙනහිර	0 0 28
			එකතුව .. 1 1 10.3

ඉහත සඳහන් ඉඩම්වලට හිමිකම් අයිතිවාසිකම් හෝ වෙනත් සම්බන්ධකම් කීයා සිටින සියලුදෙනාම තම තමන් හෝ ඔවුන්ගෙන් ලියවිලිවලින් බලය ලත් අයවලුන් හෝ වසී 1952 ක්‍රි.ව. 2 වැනි දින පූර්වහා 10 වන වේලාවට සාපයේ කවිචේරියේදී මා සම්මුඛව විභාග කළෙමි.

තවද වසී 1952 ක්‍රි.ව. 2 වැනි දිනට මත්තෙන් ඒ ඉඩම් සම්බන්ධයෙන් ඔවුන්ගේ අයිතිවාසිකම්වල සම්භාවයන්, එකී ඉඩම් ලබාගැනීම ගැන වන්දි ඉල්ලීමට ඇති කරුණු පිළිබඳ විස්තරයන්, වන්දි මුදල හා ඒ මුදල ගණන් බැඳු හැරින් මොවුන්ට (පිටපත් දෙකක් සහිතව) ලියවිලිවලින් දැනුම් දිය යුතුයි.

වසී 1952 ක්‍රි.ව. 2 වැනි දින සාපයේ කවිචේරියේදීය.

ඩී. ඒ. හඩ්සන්, ආණ්ඩුවේ උප ඒජන්තතුමා.

අංකය L F. 1447/J/HLG/1268.

(මේ සම්බන්ධ සියලු ලියවිලිවල මේ අංකය දැන්විය යුතුයි.)

1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 7 වැනි වගන්තිය යටතේ දැන්වීමයි

පොදු කටයුත්තක් සඳහා ඉවසා පහත දැක්වෙන ඉඩම් ලබාගැනීමට ආණ්ඩුව අදහස්කරන බැවින් 1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 7 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ මෙයින් දැනුම් දී සිටිමි.

ලබාගැනීමට බලාපොරොත්තුවන ඉඩමේ විස්තර:—

නො. අඩංගු නම	විස්තර	උරුම නොමිමරය A 972. ගම්—කෝප්පුර් අයිතිකම්කරුන්ගේ	ප්‍රමාණය, අ. රූ. ප.
1	වෙනසිවොල්	ආභාභුආලබ්බේ පානුම්මා, කෝප්පුර්	0 0 2.1

ඉහත සඳහන් ඉඩමට හිමිකම් අයිතිවාසිකම් හෝ වෙනත් සම්බන්ධකම් කීයා සිටින සියලුදෙනාම තම තමන් හෝ ඔවුන්ගෙන් ලියවිලිවලින් බලය ලත් අයවලුන් හෝ වසී 1952 ක්‍රි.ව. 2 වැනි දින පූර්වහා 11 වන වේලාවට ත්‍රිඤ්ඤමලේ කවිචේරියේදී මා සම්මුඛව විභාග කළෙමි.

තවද වසී 1952 ක්‍රි.ව. 2 වැනි දිනට මත්තෙන් ඒ ඉඩම් සම්බන්ධයෙන් ඔවුන්ගේ අයිතිවාසිකම්වල සම්භාවයන්, එකී ඉඩම් ලබාගැනීම ගැන වන්දි ඉල්ලීමට ඇති කරුණු පිළිබඳ විස්තරයන්, වන්දි මුදල හා ඒ මුදල ගණන් බැඳු හැරින් මොවුන්ට (පිටපත් දෙකක් සහිතව) ලියවිලිවලින් දැනුම් දිය යුතුයි.

වසී 1952 ක්‍රි.ව. 2 වැනි දින ත්‍රිඤ්ඤමලේ කවිචේරියේදීය.

ඩී. ඒ. ඉරේරත්න, ආණ්ඩුවේ උප ඒජන්තතුමා.

ආණ්ඩුවේ කටයුත්තකට ඒනම:—හුරුලුවා ව අර්භයන් සෑදීම පිණිස මෙහි පහත සඳහන්වන ඉඩම් ලබාගැනීම සඳහා ක්‍රියා කරන පිණිස “203 පරිච්ඡේදයේ ඉඩම් ලබාගැනීමේ ආඥාපත්‍රයේ,, පස්වෙනි කාණ්ඩයේ කරනිමෙන පත්තාර්තුවල ප්‍රකාරයට භාවිත වී සහ ඉඩම් පිළිබඳ ඇමැතිතුමාගෙන් නිසිආකාර මට අත් ලැබී තිබේ. ඒ ඉඩමනම්:—

නො. අඩංගු නම	විස්තර	අයිතිකම්කරුන්ගේ	ප්‍රමාණය, අ. රූ. ප.
2	කිරිගහඅක්කරේ .. භේන	දම්හතලුපොත පදිංචි අප්පුරුලේ බණ්ඩා, පුංචිඅප්පු හදිරනේ සහ සිලුමුරුලේ කිරිඑනනි	2 3 33
3	දම්හතලුමුරු	දම්හතලුපොත පදිංචි පුංචි අප්පුගේ කදිරනේ	0 2 33
4	එම	දම්හතලුපොත පදිංචි අප්පුරුලේ මුදියන්සේ සහ සිලුමුරුලේ කිරිඑනනි	0 1 12
5	එම	කුකුටාම පදිංචි දේවිගාමගේ මැතිකප්පනනි	0 1 14
6	එම	මීගහපරිවෙස් පදිංචි කිරිගාමගේ විකිරිඅප්පු සහ සකල්ලේ පදිංචි මල්ගහ	0 1 14
7	එම	දම්හතලුපොත පදිංචි සිලුමුරුලේ කිරිඑනනි සහ අප්පුරුලේ බණ්ඩා	0 2 12
10	එම	දම්හතලුපොත පදිංචි කන්දකගේ චල්ලිගාමි, කන්දකගේ බව්විඑනනි, කන්දකගේ අමරන්තා සහ කන්දකගේ අප්පුරුලු	0 1 6
11	එම	දම්හතලුපොත පදිංචි අප්පුරුලේ මුදියන්සේ සහ කදිරනගේ ලක්කුබණ්ඩා	0 0 36
12	එම	දම්හතලුපොත පදිංචි පුංචිපුරුලේ කපුරුලු, කන්දකගේ අප්පුරුලු, කදිරනගේ ලක්කුබණ්ඩා, දෙවගාමගේ මැතිකප්පනනි සහ සිලුමුරුලේ කිරිඑනනි, මීගහපරිවෙස් පදිංචි කිරිගාමගේ විකිරිඅප්පු	0 2 8

එබැවින් ඉඩම් අයිතිකරගැනීමට ආණ්ඩුවේ කලානාම තිබෙන බව පොදුපනසාට දනගැන්ම සඳහා සහවෙනි මගන්තියේ මහාකර තිබෙන හැටියට මෙයින් දැනුම්දෙයි.

ඉහතකී ඉඩම්වලට අයිතිවාසිකම් ඇත්තාවූ සෑමදෙනෙකුටම නමුත්ම නොහොත් නමුත් වෙනුවට ක්‍රියාකරණ අග වම්-1952ක්වූ අප්‍රේල් මස 4වෙනි දින උදේ 10ට ගකල්ලේ සම්ප්‍රදායිකව මා ඉදිරිපිටට පැමිණ ඒ කොසි අන්දමේ අයිතිවාසිකම්ද කියා කියා සිටින්නට මනාමා සහ මෙම ඉඩම් වෙනුවට ඉල්ලාසිටින මුදල් ගණනක්, ඊට ඇත්තාවූ නමුත්ගේ අයිතිකමේ තොරතුරුත් කියා සිටින්නට මනා බව මෙයින් දනගනු යුතුයි.

වම් 1952ක්වූ ජනවාරි මස 26වෙනි දින අනුරාධපුරේ කවිචේරියේදීය. ඩී. ඒ. දයාරත්න,
ආණ්ඩුවේ උප ඒජන්ත විභව.
අංක J/HLG/1386/LM 4762.

1950ගේ අගස්ත 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 7 වැනි වගන්තිය යටතේවූ දුන්විමසි පොදු කටයුත්තක් සඳහා අවශ්‍ය පහත දැක්වෙන ඉඩම් ලබාගැනීමට ආණ්ඩුව අදහස්කරන බැව් 1950ගේ අගස්ත 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 7 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ මෙයින් දැනුම්දී සිටිමි.

ලබාගැනීමට බලාපොරොත්තුවන ඉඩම්වල විස්තර:—

නො. අඩංගු නම	විස්තරය	අයිතිකම්කරුන්ගේ	ප්‍රමාණය, අ. රූ. ප.
1	දෙතිම්විටවත්ත .. අවුරුදු 40ක්වූ රබර්වත්ත, අවුරුදු 1ක් වයස්වූ රබර් කමානාත්ත තිබේ	සීමාසහිත දෙතිම්විට රබර් සමාගම, ඒජන්තවරු: කොළඹ සීමාසහිත කාසන් කම්බර් බැච් සහ සමාගම, වාර්ටර්ඩ් බැංකු ගොඩනැගිල්ල, කොළඹ	2 3 36.6
1	දෙතිම්විටවත්ත .. අවුරුදු 40ක්වූ රබර්වත්ත	අංක A 693 දරණ මුල් සැලැස්ම. ගම—රුදුපලුවිම සීමාසහිත දෙතිම්විට රබර් සමාගම, ඒජන්තවරු: කොළඹ සීමාසහිත කාසන් කම්බර් බැච් සහ සමාගම, වාර්ටර්ඩ් බැංකු ගොඩනැගිල්ල, කොළඹ	6 3 30.8

ඉහත සඳහන් ඉඩම්වල හිමිකම් අයිතිවාසිකම් හෝ වෙනත් සම්බන්ධතා කියා සිටින සියලුදෙනාම තම තමන් හෝ බඩුන්ගෙන් ලියවිලිවලින් බලය ලත් අගමලුන් හෝ වම් 1952ක්වූ මාර්තු මස 24වෙනි දින පු. ගා. 10.30ට දෙතිම්විට අදාළ පාලකතුමාගේ කාර්යාලයේදී මා සම්මුඛව සිටිය යුතුයි.

තවද වම් 1952ක්වූ මාර්තු මස 17වෙනි දිනට මත්තෙන් ඒ ඉඩම් සම්බන්ධයෙන් බඩුන්ගේ අයිතිවාසිකම්වල ස්ථාවරයන්, එකී ඉඩම් ලබාගැනීම ගැන වත්දී ඉල්ලීමට ඇති කරුණු පිළිබඳ විස්තරත්, වත්දී මුදල හා ඒ මුදල ගණන් බැඳු හැටිත් මා වෙත (විටපත් දෙනකක් සහිතවූ) ලියවිලිලිකින් දැනුම්දිය යුතුයි.

වම් 1952ක්වූ ජනවාරි මස 25වෙනි දින කැලණේ කවිචේරියේදීය. ඩී. ඒ. දයාරත්න,
ආණ්ඩුවේ උප ඒජන්තතුමා.
අංක J/AL/1591/LRO/APL 3766/LM 5405.

1950ගේ අගස්ත 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 7 වැනි වගන්තිය යටතේවූ දුන්විමසි පොදු කටයුත්තක් සඳහා අවශ්‍ය පහත දැක්වෙන ඉඩම් ලබාගැනීමට ආණ්ඩුව අදහස්කරන බැව් 1950ගේ අගස්ත 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 7 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ මෙයින් දැනුම්දී සිටිමි.

ලබාගැනීමට බලාපොරොත්තුවන ඉඩම්වල විස්තර:—

නො. අඩංගු නම	විස්තර	අයිතිකම්කරුන්ගේ	ප්‍රමාණය, අ. රූ. ප.
1	දෙමටතොල්ලේවත්ත .. අවුරුදු 30-5 දක්වා වයස්වූ පොල් ඉඩම	කැගල්ලේ පල්ලේදෙණියේ සිල්වන්ලොවිහි පදිංචි බඩ්ලිම්. බඩ්ලිම්. ජේ. පී. අර්. අහිඳු ප්‍රනායු	0 0 5
2	එම	එම	0 0 9
3	එම	එම	1 1 9
4	එම	එම	1 1 34
5	එම	එම	0 1 37
6	කැගුණොල්ලේවත්ත	එම	0 0 27
7	එම	එම	2 1 36
එකතුව			5 3 37

ඉහත සඳහන් ඉඩම්වල හිමිකම් අයිතිවාසිකම් හෝ වෙනත් සම්බන්ධතා කියා සිටින සියලුදෙනාම තම තමන් හෝ බඩුන්ගෙන් ලියවිලිවලින් බලය ලත් අගමලුන් හෝ වම් 1952ක්වූ මාර්තු මස 26වෙනි දින පුළුබාග 10ට කැගල්ලේ කවිචේරියේදී මා සම්මුඛව සිටිය යුතුයි.

තවද වම් 1952ක්වූ මාර්තු මස 19වෙනි දිනට මත්තෙන් ඒ ඉඩම් සම්බන්ධයෙන් බඩුන්ගේ අයිතිවාසිකම්වල ස්ථාවරයන්, එකී ඉඩම් ලබාගැනීම ගැන වත්දී ඉල්ලීමට ඇති කරුණු පිළිබඳ විස්තරත්, වත්දී මුදල හා ඒ මුදල ගණන් බැඳු හැටිත් මා වෙත (විටපත් දෙනකක් සහිතවූ) ලියවිලිලිකින් දැනුම්දිය යුතුයි.

වම් 1952ක්වූ ජනවාරි මස 25 වැනි දින කැලණේ කවිචේරියේදීය. ඩී. ඒ. දයාරත්න,
ආණ්ඩුවේ උප ඒජන්තතුමා.

අංක J/E/311/LM 4989.

1950න් අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 7 වැනි වගන්තිය යටතේ වූ දැන්වීමේ පොදු කටයුත්තක් සඳහා අමතර පහත දැක්වෙන ඉඩම් ලබාගැනීමට අණවූ අදහස්කරන බැවින් 1950න් අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 7 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ මෙයින් දැනුම් දී සිටී.

ලබාගැනීමට බලපොරොත්තුවන ඉඩමේ විහාර :-

අංක A 707 දරණ මුල් සැලැස්ම. ගම—උඩුමාගම

නො. ඉඩමේ නම	විහාර	අයිතිකම්කරන්නා	ප්‍රමාණය, අ.ර.ප.
1 ඇවිවත්ත (කොටසක්)	රබර් (අවුරුදු 20 සිට 30 දක්වා) කොසෙල්, මණ්ඩලයක්කා ආදිය වඩනලද කුඩා වෙහෙර කැබැල්ලක්ද, උදු සෙවිලිකොට කොට බිත්ති බඳිනලද සිර ගොඩනැගිල්ලක්ද, අතු සෙවිලිකළ මැරී ගැසු කාටකාලික ගොඩනැගිල්ලක්ද තිබේ, මේ ගොඩ නැගිලි දෙකම පෘෂ්ඨ වශයෙන් පෘථිවි කෙරේ	ගෝමාගම සිට නැගිනිය ඩී. ඒ. සෙනෙරත්න අප්පහාරිගේ උරුමක්කාරයෝ	2 0 12.9
		එකතුව	2 0 12.9

ඉහත සඳහන් ඉඩමට හිමිකම් අයිතිවාසිකම් ගෝමාගම වෙහෙර සමබන්ධ කිරීමේ කටයුතු සිදුකරන බවට අවධානය යොමු කරනු ලබන බවට අදහස් කරන බැවින් මේ 1952න් අංක 1 වෙනි දින උදේ 10ට කැඳවනු ලැබූ කවිචේරියේදී මා සම්මුඛ විභවයකි.

තවද මේ 1952න් මාර්තු මස 25 වෙනි දිනට මත්තේ ඒ ඉඩම සමබන්ධයෙන් බවුත්ගේ අයිතිවාසිකම්වල ස්වභාවයන්, එකී ඉඩම් ලබාගැනීම හැන මත්දී ඉල්ලීමට ඇති කරුණු පිළිබඳ විචාරයන්, මත්දී මුදල හා ඒ මුදල ගණන් බැලූ හැරීන් මා වෙත (පිටපත් දෙකක් සහිතව) ලියවිල්ලකින් දැනුම් දිය යුතුයි.

මේ 1952න් ජනවාරි මස 25 වෙනි දින කැඳවනු ලැබූ කවිචේරියේදීය.

ඩී. ඒ. දයාරත්න,
කැඳවනු ලැබූ කවිචේරියේ අණවූ මේ උප ඒජන්තතුමා.

L. D.—B 49/50. LRO/APL/5434/J/AL/1920.

1950න් අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මීට යාකොට ඇති උප ලේඛනයේ විහාර කර තිබෙන ඉඩම, 1942න් අංක 61 දරණ ඉඩම් නිදහස් කිරීමේ ආඥාපනතේ කටයුතු සඳහා ලබාගත යුතුයයි ඉඩම් කොමසාරිස්තුමා විසින් නිවැරදි කර තිබෙන බැවින් (ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 62 වැනි වගන්තියෙන් සංශෝධනය වූ ඉඩම් නිදහස් කිරීමේ ආඥාපනතේ 3 (5) වැනි වගන්තිය සමග සාධා තේරුම් ගත යුතු වූ) 1950න් අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 (1) යටතේ එකී ඉඩම් පොදු කටයුත්තක් වශයෙන් සැලකෙන කටයුත්තක් සඳහා අවශ්‍ය වී තිබෙන බවත්, එකී ආඥාපනත යටතේ අත්පත් කරගනු ලබන බවත්, කායිකම් හා ඉඩම් පිළිබඳ ඇමතිවරයා වූ බිඞ්ලි මැල්වන් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි.

1952න් ජනවාරි මස 10 වැනි දින කොළඹදීය.

බිඞ්ලි සේනානායක,
කායිකම් හා ඉඩම් පිළිබඳ ඇමතිතුමා.

උප ලේඛනය

මුල් පලයෙන් නොමිලය A 1,709. ගම—නාවල

නො. ඉඩමේ නම	විහාර	අයිතිකම්කරන්නා	ප්‍රමාණය, අ.ර.ප.
1 පුතුමාදල්	.. වි කුමුර	.. සින්නකම්බි කන්දසියා, "ගනෙමපිල්ල" නාවල උතුර, මැතිපේ	0 2 21.1
		එකතුව	0 2 21.1

L. D.—B 49/50 LRO/APL/2737&2737A/J/AL/1924.

1950න් අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මීට යාකොට ඇති උප ලේඛනයේ විහාර කර තිබෙන ඉඩම, 1942න් අංක 61 දරණ ඉඩම් නිදහස් කිරීමේ ආඥාපනතේ කටයුතු සඳහා ලබාගත යුතුයයි ඉඩම් කොමසාරිස්තුමා විසින් නිවැරදි කර තිබෙන බැවින් (ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 62 වැනි වගන්තියෙන් සංශෝධනය වූ ඉඩම් නිදහස් කිරීමේ ආඥාපනතේ 3 (5) වැනි වගන්තිය සමග සාධා තේරුම් ගත යුතු වූ) 1950න් අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 (1) යටතේ එකී ඉඩම් පොදු කටයුත්තක් වශයෙන් සැලකෙන කටයුත්තක් සඳහා අවශ්‍ය වී තිබෙන බවත්, එකී ආඥාපනත යටතේ අත්පත් කරගනු ලබන බවත්, කායිකම් හා ඉඩම් පිළිබඳ ඇමතිවරයා වූ බිඞ්ලි මැල්වන් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි.

මේ 1952න් ජනවාරි මස 10 වැනි දින කොළඹදීය.

බිඞ්ලි සේනානායක,
කායිකම් හා ඉඩම් පිළිබඳ ඇමතිතුමා.

උප ලේඛනය

මුල් පලයෙන් නොමිලය A 1,625. ගම—පුත්තලම

නො. ඉඩමේ නම	විහාර	අයිතිකම්කරන්නා	ප්‍රමාණය, අ.ර.ප.
1 කනිප්පනෙයි	.. අවුරුදු 25-30 අතර වූ නල්ගස්වත්ත	කන්දසියා සොර්නලිංගම්, පුත්තලම බස්නාහිර, පුත්තලම	0 3 30.9
2 සතුරුසිංහන් පතුනි	.. වි කුමුර	.. අත්තම්මා ගොතොත් ඒ. සනාසිම්මේගේ හා සොර්නලිංගම්, පුත්තලම බස්නාහිර, පුත්තලම	0 1 9.3
		එකතුව	1 1 0.2

L. D.—B 49/50. LRO/APL/5422/J/AL/1930.

1950න් අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මීට යාකොට ඇති උප ලේඛනයේ විහාර කර තිබෙන ඉඩම, 1942න් අංක 61 දරණ ඉඩම් නිදහස් කිරීමේ ආඥාපනතේ කටයුතු සඳහා ලබාගත යුතුයයි ඉඩම් කොමසාරිස්තුමා විසින් නිවැරදි කර තිබෙන බැවින් (ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 62 වැනි වගන්තියෙන් සංශෝධනය වූ ඉඩම් නිදහස් කිරීමේ ආඥාපනතේ 3 (5) වැනි වගන්තිය සමග සාධා තේරුම් ගත යුතු වූ) 1950න් අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 (1) යටතේ එකී ඉඩම් පොදු කටයුත්තක් වශයෙන් සැලකෙන කටයුත්තක් සඳහා අවශ්‍ය වී තිබෙන බවත්, එකී ආඥාපනත යටතේ අත්පත් කරගනු ලබන බවත්, කායිකම් හා ඉඩම් පිළිබඳ ඇමතිවරයා වූ බිඞ්ලි මැල්වන් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි.

මේ 1952න් ජනවාරි මස 15 වැනි දින කොළඹදීය.

බිඞ්ලි සේනානායක,
කායිකම් හා ඉඩම් පිළිබඳ ඇමතිතුමා.

උප ලේඛනය

මුල් පලයෙන් නො. 1,630. ගම—වත්තනෙයි නැගෙනහිර

නො. ඉඩමේ නම	විහාර	අයිතිකම්කරන්නා	ප්‍රමාණය, අ.ර.ප.
1 ඉන්විලිලක්කොයි	බස්නාහිර මායිමේ පිහිටි මුදුන්	කදිරසාසබාපති පොත්තසියා, මුලුම මැදුල් ලබන්නා, වත්තනෙයි නැගෙනහිර, වත්තනෙයි	0 2 12.6
		එකතුව	0 2 12.9

L. D.—B 49/50.

LRO/APL/3299/J/AL/1865.

1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මට යාකොට ඇති උප ලේඛනයේ විස්තර කර තිබෙන ඉඩම්, 1942 අංක 61 දරණ ඉඩම් නිදහස්කිරීමේ ආඥාපනතේ කටයුතු සඳහා ලබාගත යුතුයයි ඉඩම් කොමසාරිස්තුමා විසින් නිශ්චය කර තිබෙන බැවින් (ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 62 වැනි වගන්තියෙන් සංශෝධනය වූ ඉඩම් නිදහස්කිරීමේ ආඥාපනතේ 3 (5) වැනි වගන්තිය සමග නියමා තෝරා ගත යුතු වූ) 1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 (1) යටතේ එකී ඉඩම් පොදු කටයුත්තක් වශයෙන් සැලකෙන කටයුත්තක් සඳහා අවශ්‍යව තිබෙන බවත්, එකී ආඥාපනත යටතේ අත්පත්කරගනු ලබන බවත්, කායිකමාන්ත හා ඉඩම් පිළිබඳ ඇමතිවරයා වූ බිහිලි ශ්‍රේෂ්ඨ ජනරාල්වරයාට සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි.

නො. ඉඩමේ නම	විස්තර	ඉඩම් ලේඛන අංකය	බිහිලි සේනානායක, කායිකමාන්ත හා ඉඩම් පිළිබඳ ඇමතිතුමා.	ප්‍රමාණය, අ. රූ. ප.
1 පලුපිහි	ශ්‍රීදක් සහ පොල්ගසක් පිහිටි වත්ත	29	මයිල්වාහනම් සුප්පයියා, තෝපසු, ආච්චුමේලි දඹුණු, ආච්චුමේලි ඵම	0 1 2.2
2 වලුපිහි	1 වෙනි කොටස ඇතුළුව නොහොත් උතුරෙන් පිහිටි ශ්‍රීදේ වතුරෙන් කොටස් සහ ශ්‍රීදේ යන පාරද, දිග ඇලද, නිරිතෙන් පිහිටි ශ්‍රීදේ නොටසක්ද අයිති පොල්, තල්, පුවරසු, අයිලන්දෙයි යනාදී ගස් පිහිටි පාරිභිම සහ වත්ත	1,629	මයිල්වාහනම් සුප්පයියා, තෝපසු, ආච්චුමේලි දඹුණු, ආච්චුමේලි ඵම	0 1 3.7 එකතුව .. 0 2 5.9

No. LA 3289/J/AL/1113.

1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මට යාකොට ඇති උප ලේඛනයේ විස්තර කර තිබෙන ඉඩම්, 1942 අංක 61 දරණ ඉඩම් නිදහස්කිරීමේ ආඥාපනතේ කටයුතු සඳහා ලබාගත යුතුයයි ඉඩම් කොමසාරිස්තුමා විසින් නිශ්චය කර තිබෙන බැවින් (ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 62 වැනි වගන්තියෙන් සංශෝධනය වූ ඉඩම් නිදහස් කිරීමේ ආඥාපනතේ 3 (5) වැනි වගන්තිය සමග නියමා තෝරා ගත යුතු වූ) 1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 (1) යටතේ එකී ඉඩම් පොදු කටයුත්තක් වශයෙන් සැලකෙන කටයුත්තක් සඳහා අවශ්‍යව තිබෙන බවත්, එකී ආඥාපනත යටතේ අත්පත්කරගනු ලබන බවත්, කායිකමාන්ත හා ඉඩම් පිළිබඳ ඇමතිවරයා වූ බිහිලි ශ්‍රේෂ්ඨ ජනරාල්වරයාට සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි.

නො. ඉඩමේ නම	විස්තර	ඉඩම් ලේඛන අංකය	බිහිලි සේනානායක, කායිකමාන්ත හා ඉඩම් පිළිබඳ ඇමතිතුමා.	ප්‍රමාණය, අ. රූ. ප.
1 කොහොඹගවත්ත, පෙලාවත්ත, ඇටඹගහකුඹුර ගොඩබිම සහ අඹගවත්ත	පොල් ඉඩම, අවුරුදු 20-30 දක්වා ඇති නාවකාලික ගෙයක් තිබේ	A 1,095	කොමිස්නර් නො. 32, බයාර්විදේ පදිංචි මුහා පලනිආක් සහ ඇල්. ඇස්. පී. ඇස්. බිහිලි. කරුන්පස් වෙවිටියාර්	8 1 0
2 කොහොඹගවත්ත	පොල් වත්ත, අවුරුදු 30ක් ඇති පොල්ගස් 15ක් හා 1 කොස්ගසක්ද ඇත	A 1,095	එම	0 0 25 එකතුව .. 8 1 25

Q. 4068/LRO/APL 4860/J/AL/1567.

1950 අංක 9 දරණ ආණ්ඩුවට ඉඩම් ගැනීමේ පනතේ 7 වෙනි වගන්තිය යටතේ දැන්වීමයි

බස්නාහිර පළාතේ ආණ්ඩුවේ අතිරේක ඒජන්ත නැන්පත් ඇන්. මානික්ක ඉබෙයිකඩාර් වන මම, 1950 අංක 9 දරණ ඉඩම් ආණ්ඩුවට ගැනීමේ පනතේ 7 වෙනි වගන්තිය යටතේ පහත සඳහන් කරුණු ගැන මෙයින් කල්දෙමි.

- (1) මෙහි සඳහන් උප ලේඛනයේ විස්තර කර තිබෙන ඉඩම් ඉහතකී පනත යටතේ, 1942 අංක 61 දරණ ඉඩම් නිදහස්කිරීමේ ආඥාපනතේ අවශ්‍යතාවයන් සඳහා ආණ්ඩුවට ගැනීමට අදහස්කරනු ලැබේ.
- (2) එසේ ගැනීමට අදහස්කරන ඉඩම් වෙනුවෙන් වන්දි ලබාගැනීම සඳහා මා වෙත අයිතිවාසිකම් ඉදිරිපත් කළ යුතුය.
- (3) එසේ ගත් පසු ඉඩම් ගැන අයිතිවාසිකම් ඇති සෑම කෙනෙක්ම—
 - (අ) වම් 1952 ක්‍රි. මාර්තු මස 22 වෙනි දින පූර්වදා 11 වන කොළඹ කවුච්චරිය පැමිණ මා ඉදිරියේ පුද්ගලිකව පෙනී සිටිය යුතුය. නැතහොත් ලියවිල්ලකින් බලය දෙන ලද කමිත්තේ ඒජන්ත කෙනෙක් එසේ මා ඉදිරියට එවිය යුතුයි;
 - (ආ) තවද එසේ පෙනී සිටින නැතහොත් මිසින් 1952 ක්‍රි. මාර්තු මස 8 වෙනි දින හෝ ඊට ප්‍රථම හෝ ඉඩම් පිළිබඳ නමාගේ අයිතිවාසිකම්වල ස්වභාව, වන්දි ඉල්ලා සිටීම පිළිබඳ විස්තර, ඉල්ලන වන්දියේ ප්‍රමාණය සහ එම ප්‍රමාණය ගණන් බැලූ පිළිවෙලෙහි විස්තර ගත මේවා මා වෙත ලියවිල්ලකින් දැනුම්දී සිටිය යුතුයි.

මිමි 1952 ක්‍රි. ජනවාරි මස 28 වෙනි දින කොළඹ කවුච්චරියේදීය. ඇන්. මානික්ක ඉබෙයිකඩාර්, ආණ්ඩුවේ අතිරේක ඒජන්තතුමා.

නො. ඉඩමේ නම	විස්තර	ඉඩම් ලේඛන අංකය	බිහිලි සේනානායක, කායිකමාන්ත හා ඉඩම් පිළිබඳ ඇමතිතුමා.	ප්‍රමාණය, අ. රූ. ප.
1 පොරගහලන්ද සහ මිල්ලගහවත්ත	පොල් ඉඩම	A 3,002	ඒ. පී. බමිදුස, නිර්බන්ගොඩ, ඒ. පී. ජේමිස්, හැදිමාලෙ, ඒ. පී. අල්මිස්, බුත්ගමුම්	3 3 9
2 එම	එම	එම	එම	0 0 24 එකතුව .. 3 3 33

1950 අංක 9 දරණ ආණ්ඩුවට ඉඩම් ගැනීමේ පනතේ 7 වෙනි වගන්තිය යටතේ දැන්වීමයි

මහනුවර දිස්ත්‍රික්කයේ ආණ්ඩුවේ උප ඒජන්ත නැන්පත් එඩ්වඩ් එලිස් ග්‍රෙහිනර් වන මම, 1950 අංක 9 දරණ ඉඩම් ආණ්ඩුවට ගැනීමේ පනතේ 7 වෙනි වගන්තිය යටතේ පහත සඳහන් කරුණු ගැන මෙයින් කල්දෙමි.

- (1) මෙහි සඳහන් උප ලේඛනයේ විස්තර කර තිබෙන ඉඩම් ඉහතකී පනත යටතේ, 1942 අංක 61 දරණ ඉඩම් නිදහස්කිරීමේ ආඥාපනතේ අවශ්‍යතාවයන් සඳහා ආණ්ඩුවට ගැනීමට අදහස්කරනු ලැබේ.
- (2) එසේ ගැනීමට අදහස්කරන ඉඩම් වෙනුවෙන් වන්දි ලබාගැනීම සඳහා මා වෙත අයිතිවාසිකම් ඉදිරිපත් කළ යුතුය.
- (3) එසේ ගත් පසු ඉඩම් ගැන අයිතිවාසිකම් ඇති සෑම කෙනෙක්ම—
 - (අ) වම් 1952 ක්‍රි. මාර්තු මස 4 වෙනි දින උදේ 10 වන කවුච්චරිය පැමිණ මා ඉදිරියේ පුද්ගලිකව පෙනී සිටිය යුතුයි. නැතහොත් ලියවිල්ලකින් බලය දෙන ලද කමිත්තේ ඒජන්ත කෙනෙක් එසේ මා ඉදිරියට එවිය යුතුයි;
 - (ආ) තවද එසේ පෙනී සිටින නැතහොත් මිසින් වම් 1952 ක්‍රි. පෙබරවාරි මස 26 වෙනි දින හෝ ඊට ප්‍රථම හෝ ඉඩම් පිළිබඳ නමාගේ අයිතිවාසිකම්වල ස්වභාව, වන්දි ඉල්ලා සිටීම පිළිබඳ විස්තර, ඉල්ලන වන්දියේ ප්‍රමාණය සහ එම ප්‍රමාණය ගණන් බැලූ පිළිවෙලෙහි විස්තර ගත මේවා මා වෙත ලියවිල්ලකින් දැනුම්දී සිටිය යුතුයි.

මිමි 1952 ක්‍රි. ජනවාරි මස 24 වෙනි දින මහනුවර කවුච්චරියේදීය. ඒ. ජී. ග්‍රෙහිනර්, ආණ්ඩුවේ උප ඒජන්තතුමා.

උප ලේඛනය
මුල් පලයෙන් නොමිලය A.1,695. ගම්—රඹුක්වෙල

නො.	ඉඩමේ නම	විස්තර	අයිතිකම්කීයත්තා	ප්‍රමාණය, අ. ර. ප.
1	දිගහවත්තේන නොහොත් කඵලාදෙහිය	ත්, රබර්, කොස් සහ අම් වගාව ආදී ඉඩම	අකුරන් මුට්ඨගනුන්තේ තේ. ඇම්. ඒ. සෙසියදු මහමදු විදුනේආරච්චි	1 3 15
2	එම	ත්, රබර්, කොස්, වල්දෙල් සහ පුළුස් වගාව ආදී ඉඩම	එම	1 1 37
එකතුව				3 1 12

1950 අංක 9 දරණ ආණ්ඩුවට ඉඩම් ගැනීමේ පනතේ 7 වෙනි වගන්තිය යටතේ දැන්වීමයි
දකුණු පළාතේ මාතර දිස්ත්‍රික්කයේ ආණ්ඩුවේ අතිරේක උප ඒජන්ත තැන්පත් ඒ. සැන්ට්ටි. විජේමාන්ත වන මම, 1950 අංක 9 දරණ ඉඩම් ආණ්ඩුවට ගැනීමේ පනතේ 7 වෙනි වගන්තිය යටතේ පහත සඳහන් කරුණු ගැන මෙයින් කල්දෙමි.

- (1) මෙහි සඳහන් උප ලේඛනයේ විස්තර කර තිබෙන ඉඩම්, ඉහත කී පහත යටතේ 1942 අංක 61 දරණ ඉඩම් නිදහස්කිරීමේ ආඥාපනතේ අවශ්‍යතාවයන් සඳහා ආණ්ඩුවට ගැනීමට අදහස්කරනු ලැබේ.
- (2) එසේ ගැනීමට අදහස්කරන ඉඩම් වෙනුවෙන් වන්දි ලබාගැනීම සඳහා මා වෙත අයිතිවාසිකම් ඉදිරිපත් කළ යුතුය.
- (3) එසේ ගත්ව යන ඉඩම් ගැන අයිතිවාසිකම් ඇති සෑම කෙනෙක්ම—
(අ) මිනි 1952 ක්‍රි මාර්තු මස 26 වෙනි දින අපරහාය 2.30ට මාතර කවිවේරියට පැමිණ මා ඉදිරියේ පුද්ගලිකව පෙනීසිටිය යුතුයි. නැතහොත් ලියවිල්ලකින් බලය දෙන ලද තමන්ගේ ඒජන්ත කෙනෙක් එසේ මා ඉදිරියට එවිය යුතුයි;
(ආ) කවද එසේ පෙනී සිටින නැතහොත් මිසින් 1952 ක්‍රි මාර්තු මස 19 වෙනි දින හෝ ඊට ප්‍රථම හෝ ඉඩම් පිලිබද කඩාගස් අයිතිවාසිකම්වල ස්වභාව, වන්දි ඉල්ලා සිටීම පිලිබද විස්තර, ඉල්ලන වන්දියේ ප්‍රමාණය සහ එම ප්‍රමාණය ගණන් බැලූ පිලිවෙලෙහි විස්තර යන මේවා මා වෙත ලියවිල්ලකින් දැනුම්දී සිටිය යුතුයි.

මි 1952 ක්‍රි ජනවාරි මස 23 වෙනි දින
මාතර දිස.
ඒ. සැන්ට්ටි. විජේමාන්ත,
ආණ්ඩුවේ අතිරේක උප ඒජන්තතුමා.

උප ලේඛනය
පලයෙන් නොමිලය 1 දරන අතිරේක සිතියමේ නො. 44 දරන අවශ්‍යතා ගම් සිතියම. ගම්—රෙදුමු.

නො.	ඉඩමේ නම	විස්තර	අයිතිකම්කීයත්තා	ප්‍රමාණය, අ. ර. ප.
408	මහකුඹුර	කුඹුර	සී. බිබිලිච්චි. ඇස්. රත්නායක, පස්ගොඩ, මාවරල.	2 0 1
409	එම	එම	එම	0 2 30

L. D.—B. 49/50. අංකය LA 7370/LRO/APL 3854/J/AL 1572.

1950 අංක 9 දරණ ආණ්ඩුවට ඉඩම් ගැනීමේ පනතේ 7 වෙනි වගන්තිය යටතේ දැන්වීමයි
කුරුණෑගල දිස්ත්‍රික්කයේ ආණ්ඩුවේ උප ඒජන්ත තැන්පත් විජයසාල විසුබර් ජයසිංහ වන මම, 1950 අංක 9 දරණ ඉඩම් ආණ්ඩුවට ගැනීමේ පනතේ 7 වෙනි වගන්තිය යටතේ පහත සඳහන් කරුණු ගැන මෙයින් කල්දෙමි.

- (1) මෙහි සඳහන් උප ලේඛනයේ විස්තර කර තිබෙන ඉඩම්, ඉහත කී පහත යටතේ 1942 අංක 61 දරණ ඉඩම් නිදහස්කිරීමේ ආඥාපනතේ අවශ්‍යතාවයන් සඳහා ආණ්ඩුවට ගැනීමට අදහස්කරනු ලැබේ.
- (2) එසේ ගැනීමට අදහස්කරන ඉඩම් වෙනුවෙන් වන්දි ලබාගැනීම සඳහා මා වෙත අයිතිවාසිකම් ඉදිරිපත් කළ යුතුය.
- (3) එසේ ගත්ව යන ඉඩම් ගැන අයිතිවාසිකම් ඇති සෑම කෙනෙක්ම—
(අ) 1952 ක්‍රි මාර්තු මස 18 වෙනි දින පුළුබහ 9ට කුරුණෑගල කවිවේරියට පැමිණ මා ඉදිරියේ පුද්ගලිකව පෙනී සිටිය යුතුයි. නැතහොත් ලියවිල්ලකින් බලය දෙන ලද තමන්ගේ ඒජන්ත කෙනෙක් එසේ මා ඉදිරියට එවිය යුතුයි;
(ආ) කවද එසේ පෙනී සිටින නැතහොත් මිසින් 1952 ක්‍රි මාර්තු මස 11 වෙනි දින හෝ ඊට ප්‍රථම හෝ ඉඩම් පිලිබද කඩාගස් අයිතිවාසිකම්වල ස්වභාව, වන්දි ඉල්ලා සිටීම පිලිබද විස්තර, ඉල්ලන වන්දියේ ප්‍රමාණය සහ එම ප්‍රමාණය ගණන් බැලූ පිලිවෙලෙහි විස්තර යන මේවා මා වෙත ලියවිල්ලකින් දැනුම්දී සිටිය යුතුයි.

මි 1952 ක්‍රි ජනවාරි මස 21 වෙනි දින
කුරුණෑගල කවිවේරියේදිස.
බිබිලිච්චි. වි. ජයසිංහ,
ආණ්ඩුවේ උප ඒජන්තතුමා.

උප ලේඛනය
මුල් පලයෙන් නොමිලය 325. ගම්—පරගම්මත

නො.	ඉඩමේ නම	විස්තර	අයිතිකම්කීයත්තා	ප්‍රමාණය, අ. ර. ප.
55	අලුත්කුරුම මලාදෙහිය නොහොත් නලකොල දෙහිය සහ හබරලගහ කුඹුර	අවුරුදු 3 ක් සිට 45 කක් පොල් වත් ක ද, මඩබිම සහ නාවකාලික ගොඩනැගිල්ලක්	යක්වල, කිකලභිටියාවේ ඇම්. ඩී. ඇම්. සැබැස්තියන්සිසෙනෙ	8 1 25
56	කහවගහමුලවත්ත	අවුරුදු 45 ක පොල්ගස් 17 ක් ඇති පොල් මත්ත, අවුරුදු 4 ක පොල්ගස් 10 ක්	එම	0 0 30
56½	හබරලගහකුඹුර	මඩබිම	එම	0 0 11
එකතුව				8 2 26

ඉඩම් සලකුණකිරීමේ දැන්වීමයි
දිමනා පත්‍ර ලැබීමට සුදුස්සන් තේරීම පිලිබද
ඉඩම් කවිවේරියේ දැන්වීමයි

1. මෙහි පහත විස්තර දැක්වෙන ආණ්ඩුවේ ඉඩම් කැබැල්ල සඳහා දිමනා පත්‍ර ලැබීමට සුදුස්සන් තේරීමකට පිණිස නංගල්ලේ සංචාරක නිවාසයේදී (සර්කිට් බංගලාව) 1952 මාර්තු මස 5 වැනි බද්ද පුළුබහ 10ට ඉඩම් සලකුණකිරීමේ ආඥාපනත යටතේ ඉඩම් කවිවේරියක් හමුවන්නොට ආණ්ඩුවේ උප ඒජන්තතුමා මිසින් පවත්වන බැව් මෙයින් දැනුම්දෙනු ලැබේ.

2. මි 1942 අංක 61 දරණ ඉඩම් නිදහස්කිරීමේ ආඥාපනතේ 5 (1) වගන්තියෙන් හා 1948 එම ආඥාපනතේ නො. 3 නේ ව්‍යවස්ථාවෙන් හා සංශෝධනය කරන ලද පරිදි මෙම දිමනා පත්‍රය ඉඩම් සලකුණකිරීමේ ආඥාපනතේ පළමුවැනි උප ලේඛනයේ ඇතුළත් සියළුම කොන්දේසිවලට යටත්වෙනවා ඇත.

3. ඉඩම් කවිවේරියට පැමිණිය යුතුයි. නැතහොත් කඩා වෙනුවෙන් පෙනීසිටීමට නියෝජිතයකු එවිය යුතුයි.

4. මේ ඉඩම් කවිවේරිය පිලිබදව දහනගසුනු යමක් ඇත නොහොත් එම ආණ්ඩුවේ උප ඒජන්තතුමාගෙන් විභාග කළ යුතුයි.

ඒ. සී. ඇල්. අහගසුන්දර,
උප ඉඩම් කොමසාරිස්තුමා.

දීමට යන ඉඩමේ විස්තර

අවශ්‍යතා ගම් සිතියමේ අංකය 281. ගම්—හංගමුව (බටහිර හිරුවාපත්තුවේ)

කැබැල්ලේ අංකය	අවසරපත්‍ර දරන්නාගේ හෝ ඉල්ලුම්කරුගේ නම	ප්‍රමාණය, අ. ර. ප.
94	ලේඛ්ස් සේදර දිසානායක	2 1 1

அரசாட்சியாரின் தேள்வைக்காயி கானி விளம்பரங்கள்

1950 ம் ஆண்டின் 9 ம் இலக்க கானி எடுத்த சட்டம் 5 ம் பிரிவின்படியான பிரகடனம்.

மேற்காணும் கானி ஒரு பரிசுக் தேள்வைக்கு வேண்டியதாயிருக்கின்றதென்றும் 1950 ம் ஆண்டின் 9 ம் இலக்க கானி எடுத்த சட்டத்தின் ஏற்பாடுகளின் பிரகாரம் அது எடுத்துக்கொள்ளப்படும் என்றும் அச்சட்டத்தின் 5 ம் பிரிவின (1) ம் உட்பிரிவின பிரகாரம் கானி, விவசாய மந்திரி டட்லி ஷெலரன் சேனனாயக்க ஆகிய நான இத்தால் பிரகடனம் செய்கின்றேன்.

கொழும்பு,
1951 ம் ௨௫ (டிசெம்பர்) மார்ச்சு 15 ந் உ.
மாகாண அதிபர் இலக்கம் : Q 4048/J/AL/1522

டட்லி சேனனாயக்க,
கானி, விவசாய மந்திரி.

கானியின் விபரம்.

(1) கொழும்பு டிஸ்திரிக் அலுத்தரு கோறனை வடக்கு (B) ல் அல்கிரியா வல்பொல என்னும் கிராமத்திலிருக்கும் 10.6 பேர்ச்சல் விசாலமுள்ள அமுனுதாத என்னும் கானியின் ஒரு பகுதி. எல்லைகள் பின்வருமாறு :—

வடக்கு : அமுனுதாதா ;
தெற்கு : அமுனுதாதா ;
கிழக்கு : மிடிலை அரிவியின் கிளை ;
மேற்கு : அனடிமுள்ள.

(2) கொழும்பு டிஸ்திரிக், அலுத்தரு கோறனை வடக்கு (B) ல் அல்கிரியா வல்பொல என்னும் கிராமத்திலிருக்கும் 10.6 பேர்ச்சல் விசாலமுள்ள அனடிமுள்ள என்னும் கானியின் ஒரு பகுதி. எல்லைகள் பின்வருமாறு :—

வடக்கு : அனடிமுள்ளை ;
கிழக்கு : அனடிமுள்ளை ;
தெற்கு : அனடிமுள்ளை ;
மேற்கு : தொடுவகுமபுற.

(3) கொழும்பு டிஸ்திரிக், அலுத்தரு கோறனை வடக்கு (B) ல் அல்கிரியாவல்பொல என்னும் கிராமத்திலிருக்கும் 10.6 பேர்ச்சல் விசாலமுள்ள அனடிமுள்ள என்னும் கானியின் ஒரு பகுதி. எல்லைகள் பின்வருமாறு :—

வடக்கு : அனடிமுள்ளை ;
தெற்கு : அனடிமுள்ளை ;
மேற்கு : அனடிமுள்ளை ;
கிழக்கு : அமுனுதாத.

(4) கொழும்பு டிஸ்திரிக் அலுத்தரு கோறனை வடக்கு (B) ல் அல்கிரியா வல்பொல என்னும் கிராமத்திலிருக்கும் 10.6 பேர்ச்சல் விசாலமுள்ள தொடுவகுமபுற என்னும் கானியின் ஒரு பகுதி. எல்லைகள் பின்வருமாறு :—

வடக்கு : தொடுவகுமபுற ;
தெற்கு : தொடுவகுமபுற ;
மேற்கு : தொடுவகுமபுற ;
கிழக்கு : அனடிமுள்ளை.

(5) கொழும்பு டிஸ்திரிக், அலுத்தரு கோறனை வடக்கு (B) ல் அல்கிரியாவல்பொல என்னும் கிராமத்திலிருக்கும் 8.0 பேர்ச்சல் விசாலமுள்ள தொடுவகுமபுற என்னும் கானியின் ஒரு பகுதி. எல்லைகள் பின்வருமாறு :—

வடக்கு : தொடுவகுமபுற ;
கிழக்கு : தொடுவகுமபுற ;
தெற்கு : தொடுவகுமபுற ;
மேற்கு : தொடுவகுமபுற.

(6) கொழும்பு டிஸ்திரிக், அலுத்தரு கோறனை வடக்கு (B) ல் அல்கிரியாவல்பொல என்னும் கிராமத்திலிருக்கும் 5.3 பேர்ச்சல் விசாலமுள்ள தொடுவகுமபுற என்னும் கானியின் ஒரு பகுதி. எல்லைகள் பின்வருமாறு :—

வடக்கு : தொடுவகுமபுற ;
கிழக்கு : தொடுவகுமபுற ;
தெற்கு : தொடுவகுமபுற ;
மேற்கு : தொடுவகுமபுறவும், தென்னந் தோட்டமும்.

(7) கொழும்பு டிஸ்திரிக், அலுத்தரு கோறனை வடக்கு (B) ல் அல்கிரியாவல்பொல என்னும் கிராமத்திலிருக்கும் 13.3 பேர்ச்சல் விசாலமுள்ள தொடுவகுமபுற என்னும் கானியின் ஒரு பகுதி. எல்லைகள் பின்வருமாறு :—

வடக்கு : தொடுவகுமபுற ;
கிழக்கு : தொடுவகுமபுற ;
மேற்கு : தொடுவகுமபுற ;
தெற்கு : தொடுவகுமபுறவும், தென்னந் தோட்டமும்.

1950 ம் ஆண்டின் 9 ம் இலக்க கானி எடுத்த சட்டம் 5 ம் பிரிவின்படியான பிரகடனம்.

மேற்காணும் கானி ஒரு பரிசுக் தேள்வைக்கு வேண்டியதாயிருக்கின்றதென்றும் 1950 ம் ஆண்டின் 9 ம் இலக்க கானி எடுத்த சட்டத்தின் ஏற்பாடுகளின் பிரகாரம் அது எடுத்துக்கொள்ளப்படும் என்றும் அச்சட்டத்தின் 5 ம் பிரிவின (1) ம் உட்பிரிவின பிரகாரம் கானி, விவசாய மந்திரி டட்லி ஷெலரன் சேனனாயக்க ஆகிய நான இத்தால் பிரகடனம் செய்கின்றேன்.

கொழும்பு,
1952 ம் ௨௫ (ஜனவரி) தை 17 ந் உ.
மாகாண அதிபர் இலக்கம் :

டட்லி சேனனாயக்க,
கானி, விவசாய மந்திரி.

கானியின் விபரம்.

(1) கொழும்பு டிஸ்திரிக் சலபிறி கோறனை பற்றகெதறயிலிருக்கும் 2 ரூட விசாலமுள்ள டவத்தகஹுஹிறகொடலீம் என்னும் கானியின் ஒரு பகுதி எல்லைகள் பின்வருமாறு :—

வடக்கு : கொடலீம், வற்றம்யி ரோட ;
கிழக்கு : குளவத்தகே குமபுறவும், டிக்கண்குமபுறவும் ;
தெற்கு : டிக்கண்குமபுற ;
மேற்கு : கப்புக்கேகுமபுறவும் ஓவிறறவும்.

(2) கொழும்பு டிஸ்திரிக் சலபிறி கோறனை, பற்றகெதறையிலிருக்கும் 2 ரூட 13 பேர்ச்சல் விசாலமுள்ள டவத்தகஹுஹிறகொடலீம் என்னும் கானியின் ஒரு பகுதி. எல்லைகள் பின்வருமாறு :—

வடக்கு : டவத்தகஹு ஓவிறறவின பகுதி ;
கிழக்கு : டிக்கண்குமபுற ;
தெற்கு : டிக்கண்குமபுற ;
மேற்கு : அதேகானியின் பகுதி.

1950 ம் ஆண்டின் 9 ம் இலக்க காணி எடுத்தற் சட்டம் 5 ம் பிரிவின்படியான பிரகடனம்.

கீழ்க்காணும் காணி ஒரு பரிசுக் தேவைக்கு வேண்டியதாயிருக்கின்றதென்றும் 1950 ம் ஆண்டின் 9 ம் இலக்க காணி எடுத்தற் சட்டத்தின் ஏற்பாடுகளின் பிரகாரம் அது எடுத்துக்கொள்ளப்படுமென்றும் அச்சட்டத்தின் 5 ம் பிரிவின (1) ம் உட்பிரிவின பிரகாரம் காணி, விவசாய மந்திரி டடலி ஷேனனாய்க்க ஆகிய நான இத்தால பிரகடனம் செய்கின்றேன்.

கொழும்பு,
1952 ம் ஆண்டு (ஜனவரி) தைமீ 17 ந உ.

மாகாண அதிபர் இலக்கம் : Q 3907/J/AL/1030.

காணியின் விபரம்

கொழும்பு டிஸ்திரிக் சீயான கோறனை மேற்கு, மெடபத்துவா தலைமொத்த என்னும் கிராமத்திலிருக்கும் 13 போச்சல் விசாலமுள்ள கஹத்தகஹ வத்த என்னும் காணியின் ஒரு பகுதி. எல்லைகள் பின்வருமாறு :—

வடக்கு : கஹத்தகஹவத்தவும், கலிலியாவுக்குப் போகும் ரோடும் ;
கிழக்கு : பழைய நீர்பாச்சம் வாய்க்கால் ;
தெற்கு : பழைய நீர்பாச்சம் வாய்க்கால், வியாங்கொட-கலிலியா ரோடும் ;
மேற்கு : கஹத்தகஹவத்த குமபுற.

டடலி சேனனாய்க்க,
காணி, விவசாய மந்திரி.

1950 ம் ஆண்டின் 9 ம் இலக்க காணி எடுத்தற் சட்டம் 5 ம் பிரிவின்படியான பிரகடனம்.

கீழ்க்காணும் காணி ஒரு பரிசுக் தேவைக்கு வேண்டியதாயிருக்கின்றதென்றும் 1950 ம் ஆண்டின் 9 ம் இலக்க காணி எடுத்தற் சட்டத்தின் ஏற்பாடுகளின் பிரகாரம் அது எடுத்துக்கொள்ளப்படுமென்றும் அச்சட்டத்தின் 5 ம் பிரிவின (1) ம் உட்பிரிவின பிரகாரம் காணி, விவசாய மந்திரி டடலி ஷேனனாய்க்க ஆகிய நான இத்தால பிரகடனம் செய்கின்றேன்.

கொழும்பு,

1951 ம் ஆண்டு (செப்டெம்பர்) புரட்டாசிமீ 20 ந உ.

மாகாண அலலது டிஸ்திரிக் எண்ணுவின் இலக்கம் :

காணி, விவசாய மந்திரி காரியாலையத்தின் இலக்கம் : J/E/305.

காணியின் விபரம்.

புது டிஸ்திரிக்கைச் சேர்ந்த கனவரிலா நாட்டில் அமைக்கப்பட்டிருக்கும் 2 ஏக்கர் விசாலமான கீழே கூறியுள்ள எல்லைக்குட்பட்ட அம்பிடடிவேளை என்ற நிலம் எடுத்துக்கொள்ளப்படுமென்றும்

வடக்கு—கிராமச் சங்க ரோடும்,
கிழக்கு—வி. பி. 550 ல் அடங்கிய 49 ம, 102 ம துண்டுகளின் பகுதிகள்,
தெற்கு—வி. பி. 550 ல் அடங்கிய 102 ம துண்டுகளின் ஒரு பகுதி,
மேற்கு—வி. பி. 550 ல், அடங்கிய 49 ம, 102 ம துண்டுகளின் பகுதிகள்.

டடலி சேனனாய்க்க,
காணி, விவசாய மந்திரி.

1950 ம் ஆண்டின் 9 ம் இலக்க காணி எடுத்தற் சட்டம் 5 ம் பிரிவின்படியான பிரகடனம்.

கீழ்க்காணும் காணி ஒரு பரிசுக் தேவைக்கு வேண்டியதாயிருக்கின்றதென்றும் 1950 ம் ஆண்டின் 9 ம் இலக்க காணி எடுத்தற் சட்டத்தின் ஏற்பாடுகளின் பிரகாரம் அது எடுத்துக்கொள்ளப்படுமென்றும் அச்சட்டத்தின் 5 ம் பிரிவின (1) ம் உட்பிரிவின பிரகாரம் காணி, விவசாய மந்திரி டடலி ஷேனனாய்க்க ஆகிய நான இத்தால பிரகடனம் செய்கின்றேன்.

கொழும்பு,

1952 ம் ஆண்டு (ஜனவரி) தைமீ 17 ந உ.

மாகாண அதிபர் இலக்கம் : Q 3460/J/HLG/1410.

காணியின் விபரம்.

கொழும்பு டிஸ்திரிக், ஹேவகம் கோறனை ஹெக்கண்டற தெற்கு என்னும் கிராமத்திலிருக்கும் கூட்டுத்தொகை 0 ஏ. 0 ரூ. 04 4 போ. விசாலமுள்ள நிறுவெல்லுக்குமபுற-கொலன்னகுமபுற, டெலகஹவத்த என்னும் காணியிருப்பது இரு பகுதிகள் ஆரம்பபட்ட இல. A 2,989 ல் துண்டுகள் 1 ம, 3 ம என்று அளந்து காட்டப்பட்டிருக்கின்றன.

டடலி சேனனாய்க்க,
காணி, விவசாய மந்திரி.

1950 ம் ஆண்டின் 9 ம் இலக்க காணி எடுத்தற் சட்டம் 5 ம் பிரிவின்படியான பிரகடனம்.

கீழ்க்காணும் காணி ஒரு பரிசுக் தேவைக்கு வேண்டியதாயிருக்கின்றதென்றும் 1950 ம் ஆண்டின் 9 ம் இலக்க காணி எடுத்தற் சட்டத்தின் ஏற்பாடுகளின் பிரகாரம் அது எடுத்துக்கொள்ளப்படுமென்றும் அச்சட்டத்தின் 5 ம் பிரிவின (1) ம் உட்பிரிவின பிரகாரம் காணி, விவசாய மந்திரி டடலி ஷேனனாய்க்க ஆகிய நான இத்தால பிரகடனம் செய்கின்றேன்.

கொழும்பு,

1952 ம் ஆண்டு (ஜனவரி) தைமீ 17 ந உ.

டிஸ்திரிக் எண்ணுவின் இலக்கம் . LD. 7341.

காணி, விவசாய மந்திரி காரியாலையத்தின் இலக்கம் : J/AL/1262.

காணியின் விபரம்

(1) அம்பாந்தோட்டைப் பிரிவில், மாகமபத்துவில், தென்னிசா கிராமத்தில் (இறுதிக் கிராமப்பட்டு இலக்கம் 634) கசினகம் என்னும் காணியிலுள்ள 26 போச்சல் நிலம் இதன் எல்லைகளாவன :—

வடக்கு—திரு. சி. எல். எம். மூருத்தினதும், பங்காளாகரினதும் காணி,
கிழக்கு—பொதுஜன சேவை இலாகாவின் தெருவும், லாககாலகொட விவசாயத் தெருவும்,
தெற்கு—திரு. டபிள்யூ. டி. ஏ. அபெஞ்சியாவின் காணி,
மேற்கு—திரு. சி. எல். எம். மூருத்தினதும், பங்காளாகரினதும் காணி.

(2) அம்பாந்தோட்டைப் பிரிவில், மாகமபத்துவில், லாககாலகொட கிராமத்தில் (இறுதிக் கிராமப்பட்டு இலக்கம் 629), லாககாலகொடபிலா என்னும் காணியிலுள்ள 26 போச்சல் நிலம். இதன் எல்லைகளாவன :—

வடக்கு—திரு. சி. எல். எம். மூருத்தினதும், பங்காளாகரினதும் காணி,
கிழக்கு—லாககாலகொட விவசாயத் தெருவும், திரு. டி. கே. பூருவின் காணியும்,
தெற்கு, மேற்கும்—திரு. பி. அனருவின் காணி.

(3) அம்பாந்தோட்டைப் பிரிவில், மாகமபத்துவில், லாககாலகொட கிராமத்தில் (இறுதிக் கிராமப்பட்டு இலக்கம் 629) பாவலா என்னும் காணியிலுள்ள 10 போச்சல் நிலம். இதன் எல்லைகளாவன :—

வடக்கு—லாககாலகொட விவசாயத் தெரு,
கிழக்கு, தெற்கும்—திரு. டி. கே. பூருவின் காணி,
மேற்கு—திரு. பி. அனருவின் காணி.

(4) அம்பாந்தோட்டைப் பிரிவில், மாகமபத்துவில், லாககாலகொட கிராமத்தில் (இறுதிக் கிராமப்பட்டு இலக்கம் 629) பாவலா என்னும் காணியிலுள்ள 18 போச்சல் நிலம். இதன் எல்லைகளாவன :—

வடக்கு, கிழக்கு—திரு. டி. கே. பூருவின் காணி,
தெற்கும், மேற்கும்—லாககாலகொட விவசாயத் தெரு.

டடலி சேனனாய்க்க,
காணி, விவசாய மந்திரி.

1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டம் 5 ம் பிரிவின்படியான பிரகடனம்.

கீழ்க்காணும் காணி ஒரு பகிரங்க தேவைக்கு வேண்டியதாயிருக்கின்றதென்றும் 1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டத்தின் ஏற்பாடுகளின் பிரகாரம் அது எடுத்துக்கொள்ளப்படும் என்றும் அச்சட்டத்தின் 5 ம் பிரிவின (1) ம் உட்பிரிவின பிரகாரம் காணி, விவசாய மந்திரி டடலி ஷெல்லர் சேனனாயக்க ஆகிய நான இத்தால் பிரகடனம் செய்கின்றேன்.

கொழும்பு,

1951 ம் ஆண்டு (ஜனவரி) தைமீ 3 ந் உ.

மாகாண அல்லது இலத்திரிக ஏசண்ணின் இலக்கம் :

காணி, விவசாய மந்திரி காரியாலயத்தின் இலக்கம் : J/HLG/13

காணியின் விபரம்

புதின இலத்திரிக, புதின நகரசபை எல்லைக்குட்பட்ட, " லோவர் கிங்ஸ் ஸ்ரீற, எசலமண்ட இல. 519, 519A, 520, 520A, 520—AL to 4A, 520—BL B2, 520—CL to C4, 522—AL to A4, 524, 532, 532A, 523 (PT), 535, 533, 534, 536, 537, 538, 539, 540 ம் 540A ஆகிய இ. பபளியு, ஜயசிங்கம், பபளியு. ஏ. பி. ஜயதிலக, ஓ. இ. பெற்றேனின் சந்ததியாரா, ர. கெசனின் சந்ததியாரா, வி சோமசுந்தரத்தின் சந்ததியாரா, எம். ஏ. பிலோரிஸுறாமியின் சந்ததியாரா, மிலிஸ் முத்தையா, பபளியு ஏ. பி. ஜயதிலக, இ. கே. புற, இங்கிரந்த சபை இலாகனால உரிமை பாராட்டப்படும் கொட்டகுகொட்டகம், பெகெல்பொலவத்த, எல்பிடடியவத்த, இலங்குகெட்டவத்த, மெறவத்த, மெடிறியவத்த ஆகிய காணிகளிலிருந்து 0 ஏ 1 ரூ 09 ப விசாலமான பகுதிகள் எடுத்துக்கொள்ளப்படும்.

LA/7059/J/E/1473

1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டம் 5 ம் பிரிவின்படியான பிரகடனம்.

கீழ்க்காணும் காணி ஒரு பகிரங்க தேவைக்கு வேண்டியதாயிருக்கின்றதென்றும் 1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டத்தின் ஏற்பாடுகளின் பிரகாரம் அது எடுத்துக்கொள்ளப்படும் என்றும் அச்சட்டத்தின் 5 ம் பிரிவின (1) ம் உட்பிரிவின பிரகாரம் காணி, விவசாய மந்திரி டடலி ஷெல்லர் சேனனாயக்க ஆகிய நான இத்தால் பிரகடனம் செய்கின்றேன்.

கொழும்பு,

1952 ம் ஆண்டு (ஜனவரி) தைமீ 9 ந் உ.

மாகாண அல்லது இலத்திரிக ஏசண்ணின் இலக்கம் :

காணி, விவசாய மந்திரி காரியாலயத்தின் இலக்கம் : J/E/1473.

காணியின் விபரம்.

குருணாகல் இலத்திரிக, ஹிரியால அட்டே, இறலவிவித்தே கோரல் மேற்கு, நெம்பிரிசுமபுற பகுதி, பறமுள்ள கிராமத்தில், பதல்கொட எஸ்ரேற எனனும் காணியில் 3 ஏ. 01 ப. விசாலம் 1,196 ம் இலக்கப் பிரதமபட்டத்துக்கு 1 ம் இணைப்பட்டு 53 ம் துண்டாக அளந்து காட்டப்பட்டுள்ளது.

LA/7452/J/E/1638.

1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டம் 5 ம் பிரிவின்படியான பிரகடனம்.

கீழ்க்காணும் காணி ஒரு பகிரங்க தேவைக்கு வேண்டியதாயிருக்கின்றதென்றும் 1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டத்தின் ஏற்பாடுகளின் பிரகாரம் அது எடுத்துக்கொள்ளப்படும் என்றும் அச்சட்டத்தின் 5 ம் பிரிவின (1) ம் உட்பிரிவின பிரகாரம் காணி, விவசாய மந்திரி டடலி ஷெல்லர் சேனனாயக்க ஆகிய நான இத்தால் பிரகடனம் செய்கின்றேன்.

கொழும்பு,

1952 ம் ஆண்டு (ஜனவரி) தைமீ 9 ந் உ.

மாகாண அல்லது இலத்திரிக ஏசண்ணின் இலக்கம் :

காணி, விவசாய மந்திரி காரியாலயத்தின் இலக்கம் : J/E/1638

காணியின் விபரம்.

குருணாகல் இலத்திரிக, டம்பேடேனி அட்டே, வெவகம் பகுதி, வெவகம் கிராமத்தில், வெவகம் எஸ்ரேற்றில் 5 ஏக்கா விசாலமுள்ள எல்லைகள் :—

வடக்கால்—வெவகம் எஸ்ரேற்றின் மிகுதிப்பாகம்,
கிழக்கால்—பிற்பொல பி. பபளியு இ. ரேட்டே,
தெற்கால்—பாடசாலைத் தோட்டமும், அம்பலம்பிதிய எஸ்ரேற்றும்,
மேற்கால்—வெவகம் எஸ்ரேற்றின் மிகுதிப் பாகம்.

டடலி சேனனாயக்க,
காணி, விவசாய மந்திரி.

1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டம் 5 ம் பிரிவின்படியான பிரகடனம்.

LA/7344/J/HLG/940

கீழ்க்காணும் காணி ஒரு பகிரங்க தேவைக்கு வேண்டியதாயிருக்கின்றதென்றும் 1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டத்தின் ஏற்பாடுகளின் பிரகாரம் அது எடுத்துக்கொள்ளப்படும் என்றும் அச்சட்டத்தின் 5 ம் பிரிவின (1) ம் உட்பிரிவின பிரகாரம் காணி, விவசாய மந்திரி டடலி ஷெல்லர் சேனனாயக்க ஆகிய நான இத்தால் பிரகடனம் செய்கின்றேன்.

கொழும்பு,

1951 ம் ஆண்டு (செப்டெம்பர்) புரட்டாதிமீ 8 ந் உ.

மாகாண அல்லது இலத்திரிக ஏசண்ணின் இலக்கம் :

காணி, விவசாய மந்திரி காரியாலயத்தின் இலக்கம் : J/HLG/940

காணியின் விபரம்.

குருணாகல் இலத்திரிக, வேவுடலி ஹற்பத்த, வெளிக்பொல பகுதி, ரதமல்கொட கிராமத்தில் டேயசி வெலி எஸ்டேட் எனனும் காணியில் ஏறக்குறைய 2 ஏக்கா விசாலமுள்ள எல்லைகள் —

வடக்கால் : கிராமச் சங்கத்துக்கு ஒதுக்கப்பட்ட இடமும் டேயசிவெலி எஸ்டேட்டின் பாகமும்.
கிழக்கால் : நெல் வயலும் டேயசி வெலி எஸ்ரேற்றின் பாகமும்,
தெற்கால் : காலம்சென்ற எம் செயனுலாபத்தினுக்குரிய காணியும் ஹய ரேட்டேமும்;
மேற்கால் : பரகஹதெனியிலிருந்து புச்செல்லாவக்குப் போகும் உ ஆர் சீ. ரேட்டே.

டடலி சேனனாயக்க,
காணி, விவசாய மந்திரி.

1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டம் 5 ம் பிரிவின்படியான பிரகடனம்.

கீழ்க்காணும் காணி ஒரு பகிரங்க தேவைக்கு வேண்டியதாயிருக்கின்றதென்றும் 1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டத்தின் ஏற்பாடுகளின் பிரகாரம் அது எடுத்துக்கொள்ளப்படும் என்றும் அச்சட்டத்தின் 5 ம் பிரிவின (1) ம் உட்பிரிவின பிரகாரம் காணி, விவசாய மந்திரி டடலி ஷெல்லர் சேனனாயக்க ஆகிய நான இத்தால் பிரகடனம் செய்கின்றேன்.

கொழும்பு,

1952 ம் ஆண்டு (ஜனவரி) தைமீ 17 ந் உ.

மாகாண அத்திரிக இலக்கம் Q 4049/J/LSS/1491.

காணியின் விபரம்.

கொழும்பு இலத்திரிக, அலுத்தகுறு கோணை வடக்கு (A) ல வியனகேமுலல் எனனும் கிராமத்திலிருக்கும் வைடபிலேனஸ் எனனும் காணியின் அருகாமையிலிருக்கும் சுமார் 6 ஏக்கர் விசாலமுள்ள பலகுறுவத்த எனனும் காணியின் ஒரு பகுதி. எல்லைகள் பின்வருமாறு :—

வடக்கு : வைடபிலேனஸ் (முடிக்க காணி) ;
கிழக்கு : பலகுறுவத்த ;
தெற்கு : பலகுறுவத்த ;
மேற்கு : கொழும்பு-நாகொழும்பு மெயின் ரேட்டே.

டடலி சேனனாயக்க,
காணி, விவசாய மந்திரி.

1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டம் 5 ம் பிரிவின்படியான பிரகடனம் -

LA/7462/J/HLG/1715

கீழ்க்காணும் காணி ஒரு பகிரங்க தேவைக்கு வேண்டியதாயிருக்கின்றதென்றும் 1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டத்தின் ஏற்பாடுகளின் பிரகாரம் அது எடுத்தற்கொள்ளப்படுமென்றும் அச்சட்டத்தின் 5 ம் பிரிவின (1) ம் உட்பிரிவின் பிரகாரம் காணி, விவசாய மந்திரி டபிள் ஷெலரன் சேனானாயக்க ஆசிய நான் இத்தால் பிரகடனம் செய்கின்றேன்.

கொழும்பு,

டபிள் ஷெனானாயக்க,
காணி, விவசாய மந்திரி.

1952 ம் ஆண்டு (ஜனவரி) தைமீ 13 ந் உ.

காணி, விவசாய மந்திரி காரியாலையத்தின் இலக்கம்: J/HLG/1715

காணியின் விபரம்.

குருணாகல் டிஸ்திரிக், ஹிரியால் அட்பட்டு, மடஹப்பொல பகுதி, மடஹப்பொல கிராமத்தில், கதகடுவெயாகெ எனனும் காணியில் ஏறக்குறைய 3 ஏக்கர் விசாலமுள்ள எல்லைகள் :-

- வடக்கால்—1BW 2C, 5, 1BW2, துண்டுகளும் குளக்கடும் கதகடுவெயால்;
- கிழக்கால்—1 BW 2 துண்டு;
- தெற்கால்—ரோடும் T. PS 294027-294030;
- மேற்கால்—ரோடும்.

1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டம் 5 ம் பிரிவின்படியான பிரகடனம்.

LA/7292/J/E/520

கீழ்க்காணும் காணி ஒரு பகிரங்க தேவைக்கு வேண்டியதாயிருக்கின்றதென்றும் 1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டத்தின் ஏற்பாடுகளின் பிரகாரம் அது எடுத்தற்கொள்ளப்படுமென்றும் அச்சட்டத்தின் 5 ம் பிரிவின (1) ம் உட்பிரிவின் பிரகாரம் காணி, விவசாய மந்திரி டபிள் ஷெலரன் சேனானாயக்க ஆசிய நான் இத்தால் பிரகடனம் செய்கின்றேன்.

கொழும்பு,

டபிள் ஷெனானாயக்க,
காணி, விவசாய மந்திரி.

1951 ம் ஆண்டு (ஆகஸ்ட்) ஆவணிமீ 10 ம் உ.

காணி, விவசாய மந்திரி காரியாலையத்தின் இலக்கம்: J/E/520

காணியின் விபரம்.

குருணாகல் டிஸ்திரிக், மராவித பகுதி, முதுகல் கிராமத்தில், இன்னவதத அல்லது டெல்கஹழல் கேன எனனும் காணி, ஏறக்குறைய 1 ஏக்கர் விசாலமுள்ள எல்லைகள் :-

- வடக்கால்—கம்பஹாவிலிருக்கும் நொத்தாரில் விக்ரம் ஆராச்சி அவர்களுக்குரிய காணி;
- கிழக்கால்—லம்பஹாவிலிருக்கும் நொத்தாரில் விக்ரம் ஆராச்சி, அவர்களுக்குரிய காணி;
- தெற்கால்—H. M. கிரிமுடியானசெக்கு உரிய காணி;
- மேற்கால்—N. G. லொகுசிங்கோவுக்கும் N. G. புளசி பண்டாவுக்கும் உரிய காணி.

1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டம் 5 ம் பிரிவின்படியான பிரகடனம்.

LA/7438/J/E/1534

கீழ்க்காணும் காணி ஒரு பகிரங்க தேவைக்கு வேண்டியதாயிருக்கின்றதென்றும் 1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டத்தின் ஏற்பாடுகளின் பிரகாரம் அது எடுத்தற்கொள்ளப்படுமென்றும் அச்சட்டத்தின் 5 ம் பிரிவின (1) ம் உட்பிரிவின் பிரகாரம் காணி, விவசாய மந்திரி டபிள் ஷெலரன் சேனானாயக்க ஆசிய நான் இத்தால் பிரகடனம் செய்கின்றேன்.

கொழும்பு,

டபிள் ஷெனானாயக்க,
காணி, விவசாய மந்திரி.

1952 ம் ஆண்டு (ஜனவரி) தைமீ 10 ம் உ.

காணி, விவசாய மந்திரி காரியாலையத்தின் இலக்கம்: J/E/1534

காணியின் விபரம்.

குருணாகல் டிஸ்திரிக், கடுகம்பொல அட்பட்டு, மஹிபிதி பகுதி, தலஹிதிமுல் கிராமத்தில், கொல்கஹழல் வத்தயும் சும்புகஹழல்வத்தையுமெனகிற காணிகளில் 1 ஏக்கர் 1 ரூட 10 பர்சல் விசாலமுள்ள எல்லைகள் :-

- வடக்கால்—வெறலுக்கம்-வெலிபென்னகஹழல் V. C. ரோட்டு;
- கிழக்கால்—சும்புகஹழல் சும்புறயும் ரத்தநகஹழலும்புறயும்;
- தெற்கால்—சும்புகஹழல்வத்தயின் மிகுதிப் பாகம்;
- மேற்கால்—கொல்கஹழலாயவத்த (ரோட்க்குரிய காணி).

1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டம் 5 ம் பிரிவின்படியான பிரகடனம்.

LA/7452/J/E/1638

கீழ்க்காணும் காணி ஒரு பகிரங்க தேவைக்கு வேண்டியதாயிருக்கின்றதென்றும் 1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டத்தின் ஏற்பாடுகளின் பிரகாரம் அது எடுத்தற்கொள்ளப்படுமென்றும் அச்சட்டத்தின் 5 ம் பிரிவின (1) ம் உட்பிரிவின் பிரகாரம் காணி, விவசாய மந்திரி டபிள் ஷெலரன் சேனானாயக்க ஆசிய நான் இத்தால் பிரகடனம் செய்கின்றேன்.

கொழும்பு,

டபிள் ஷெனானாயக்க,
காணி, விவசாய மந்திரி.

1952 ம் ஆண்டு (ஜனவரி) தைமீ 9 ம் உ.

காணி, விவசாய மந்திரி காரியாலையத்தின் இலக்கம்: J/E/1638.

காணியின் விபரம்.

குருணாகல் டிஸ்திரிக், டம்படேனி அட்பட்டு, வெவகம் பகுதி, வெவகம் கிராமத்தில், வெவகம் எனறேட எனனும் காணியில் ஏறக்குறைய 5 ஏக்கர் விசாலமுள்ள எல்லைகள் :-

- வடக்கால்—வெவகம் எனறேறடின மிகுதிப் பாகம்;
- கிழக்கால்—பிஹப்பொல P. W. D. ரோட்டு;
- தெற்கால்—பாடசாலைத் தோட்டமும் அம்பலம்பிதிய எனறேறடினும்;
- மேற்கால்—வெவகம் எனறேறடின மிகுதிப் பாகம்.

1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டம் 5 ம் பிரிவின்படியான பிரகடனம்.

கீழ்க்காணும் காணி ஒரு பகிரங்க தேவைக்கு வேண்டியதாயிருக்கின்றதென்றும் 1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டத்தின் ஏற்பாடுகளின் பிரகாரம் அது எடுத்தற்கொள்ளப்படுமென்றும் அச்சட்டத்தின் 5 ம் பிரிவின (1) ம் உட்பிரிவின் பிரகாரம் காணி, விவசாய மந்திரி டபிள் ஷெலரன் சேனானாயக்க ஆசிய நான் இத்தால் பிரகடனம் செய்கின்றேன்.

கொழும்பு,

டபிள் ஷெனானாயக்க,
காணி, விவசாய மந்திரி.

1951 ம் ஆண்டு (மே) வைகாசிமீ 10 ந் உ.

மாக்காண அல்லது டிஸ்திரிக் எண்ணுவின இலக்கம்
காணி, விவசாய மந்திரி காரியாலையத்தின் இலக்கம்: J/HLG/17.

காணியின் விபரம்.

புதுண டிஸ்திரிக், புதுண நகரசபை எல்லைக்குட்பட்ட "பேனக் ஹலுல் காடன" என்ற காணியின் (கீழே கூறியுள்ள எல்லைகளுள் அடங்கப்பட்டிருக்கும்) 0 ஏ. 0 ரூ. 1.28 ப. விசாலமான காணி எடுத்தற்கொள்ளப்படுமென்றும்

- வடக்கு—"பேக்க ஒப் ஊவா" (பேவக் ஒப் சிலோன, புதுண),
- கிழக்கு—லோவா ஸ்ரீற,
- தெற்கு—எல்ல டெறல் ரோட்,
- மேற்கு—எல்ல டெறல் ரோட்;

1950 ம ஆண்டின் 9 ம் இலக்க காணி எடுத்தற் சட்டம் 5 ம் பிரிவின்படியான பிரகடனம்.

மீழ்க்காணும் காணி ஒரு பகிரங்க தேவைக்கு வேண்டியதாயிருக்கின்றதென்றும் 1950 ம ஆண்டின் 9 ம் இலக்க காணி எடுத்தற் சட்டத்தின் ஏற்பாடுகளின் பிரகாரம் அது எடுத்துக்கொள்ளப்படும் என்றும் அச்சட்டத்தின் 5 ம் பிரிவின (1) ம் உட்பிரிவின பிரகாரம் காணி, விவசாய மந்திரி, டடலி ஷெலரன் சேனனாயக்க ஆகிய நான இத்தால் பிரகடனம் செய்கின்றேன்.

கொழும்பு,
1951 ம் ஆண்டு (செப்டெம்பர்) புரடாதிமீ 17 ந உ.

மாகாண அல்லது இலத்திரிக ஏசனடுவின் இலக்கம் :
காணி, விவசாய மந்திரி காரியாலயத்தின் இலக்கம் : J/TW/1079.

டடலி சேனனாயக்க,
காணி, விவசாய மந்திரி.

காணியின் விபரம்.

பதுளை இலத்திரிக, உடுகிடை பகுதி, உட்பலாத்த கோரூன், புலுக்கம் நாட்டில் இருக்கும் கீழே கூறியுள்ள எல்லைக்குட்பட்ட அடங்கும் 15 பேர்ச்சல விசாலமான கல்பொக்க என்ற நிலம் எடுத்துக்கொள்ளப்படும்.

வடக்கு }
கிழக்கு } பி. டி. பி பிரிஸ் அப்புறாமி, பாலுக்கம் அவர்களுக்கு சொந்தமான நிலம்.
தெற்கு }
மேற்கு }

பதுளை இலத்திரிக, உடுகிடை பகுதி உட்பலாத்த கோரூன், புலுக்கம் நாட்டில் சேர்ந்த கீழே கூறியுள்ள எல்லைக்குட்பட்ட கல்பொக்க என்ற 18 போச்சல விசாலமான நிலம் எடுத்துக்கொள்ளப்படும்

வடக்கு }
கிழக்கு } பி. டி. பி பிரிஸ் அப்புறாமி, பாலுக்கம் அவர்களின் சொந்தப் பூமி.
தெற்கு }
மேற்கு }

1950 ம ஆண்டின் 9 ம் இலக்க காணி எடுத்தற் சட்டம் 5 ம் பிரிவின்படியான பிரகடனம்.

மீழ்க்காணும் காணி ஒரு பகிரங்க தேவைக்கு வேண்டியதாயிருக்கின்றதென்றும் 1950 ம ஆண்டின் 9 ம் இலக்க காணி எடுத்தற் சட்டத்தின் ஏற்பாடுகளின் பிரகாரம் அது எடுத்துக்கொள்ளப்படும் என்றும் அச்சட்டத்தின் 5 ம் பிரிவின (1) ம் உட்பிரிவின பிரகாரம் காணி, விவசாய மந்திரி டடலி ஷெலரன் சேனனாயக்க ஆகிய நான இத்தால் பிரகடனம் செய்கின்றேன்

கொழும்பு,
1951 ம் ஆண்டு (மே) வைகாசிமீ 29 ந உ.

மாகாண அல்லது இலத்திரிக ஏசனடுவின் இலக்கம் :
காணி, விவசாய மந்திரி காரியாலயத்தின் இலக்கம் : J/HLG/995.

டடலி சேனனாயக்க,
காணி, விவசாய மந்திரி.

காணியின் விபரம்

டவுன் பிலேன் 43, துண்டு 83 ஆகிய ஊவா மாகாணம், பதுளை நகரசபை எல்லைக்குட்பட்ட புவகொடமுல்ல வார்ட், பஹால்கெரயிலிருக்கும் 0 ஏ. 1 ரூ. 14-3 ப விசாலமான கீழே கூறியுள்ள எல்லைக்குட்பட்ட 4 ஏ. ம. நம் மெனிககா, டி. எம். கி. மெனிககா, டி. எம். உக்கு மெனிககா, பஹால்கெடற, மெட்டத்தன், பதுளையைச் சேர்ந்த அவர்களால் உரிமைப் பாராட்டப்படும் கஹாட்டக்கஹாக்கொடுவ என்ற நிலம் எடுத்துக்கொள்ளப்படும்.

வடக்கு—சொந்தப் பூமி,
கிழக்கு—சாககார நிலம்,
தெற்கு—பதுளை ஓய,
மேற்கு—நகரசபைக்குச் சொந்தமான பூமி.

1950 ம ஆண்டின் 9 ம் இலக்க காணி எடுத்தற் சட்டம் 5 ம் பிரிவின்படியான பிரகடனம்.

மீழ்க்காணும் காணி ஒரு பகிரங்க தேவைக்கு வேண்டியதாயிருக்கின்றதென்றும் 1950 ம ஆண்டின் 9 ம் இலக்க காணி எடுத்தற் சட்டத்தின் ஏற்பாடுகளின் பிரகாரம் அது எடுத்துக்கொள்ளப்படும் என்றும் அச்சட்டத்தின் 5 ம் பிரிவின (1) ம் உட்பிரிவின பிரகாரம் காணி, விவசாய மந்திரி, டடலி ஷெலரன் சேனனாயக்க ஆகிய நான இத்தால் பிரகடனம் செய்கின்றேன்

கொழும்பு,
1951 ம் ஆண்டு (ஜூலை) ஆடிமீ 10 ந உ.

மாகாண அல்லது இலத்திரிக ஏசனடுவின் இலக்கம் :
காணி, விவசாய மந்திரி காரியாலயத்தின் இலக்கம் : J/HLG/867.

டடலி சேனனாயக்க,
காணி, விவசாய மந்திரி.

காணியின் விபரம்.

ஊவா மாகாணத்தைச் சேர்ந்த பதுளை நகரசபை எல்லைக்குட்பட்ட கெயில்கொட, (டவுன் பிலேன் 43, துண்டு 60) என்ற இடத்தைச் சேர்ந்த 0 ஏ 0 ரூ 8-0 ப விசாலமான கீழே கூறியுள்ள எல்லைக்குட்பட்ட அடங்கும் நிலத்தை-அரவ என்ற நிலத்திலிருந்து ஒரு பாகம் எடுக்கப்படும்.

வடக்கு—வயல்கள்,
கிழக்கு—வயல்கள்
தெற்கு—வயல் வரம்பு,
மேற்கு—வயல்கள்.

1950 ம ஆண்டின் 9 ம் இலக்க காணி எடுத்தற் சட்டம் 5 ம் பிரிவின்படியான பிரகடனம்.

மீழ்க்காணும் காணி ஒரு பகிரங்க தேவைக்கு வேண்டியதாயிருக்கின்றதென்றும் 1950 ம ஆண்டின் 9 ம் இலக்க காணி எடுத்தற் சட்டத்தின் ஏற்பாடுகளின் பிரகாரம் அது எடுத்துக்கொள்ளப்படும் என்றும் அச்சட்டத்தின் 5 ம் பிரிவின (1) ம் உட்பிரிவின பிரகாரம் காணி, விவசாய மந்திரி டடலி ஷெலரன் சேனனாயக்க ஆகிய நான இத்தால் பிரகடனம் செய்கின்றேன்.

கொழும்பு,
1950 ம் ஆண்டு (ஒக்டோபர்) ஐப்பசிமீ 30 ந உ.

மாகாண அல்லது இலத்திரிக ஏசனடுவின் இலக்கம் :
காணி, விவசாய மந்திரி காரியாலயத்தின் இலக்கம் : J/E/63.

டடலி சேனனாயக்க,
காணி, விவசாய மந்திரி.

காணியின் விபரம்.

பதுளை இலத்திரிக, யடுகிடை இலத்திரிக, கிராமத் தலைவரின் பகுதியான கெனகெலயில் அமைக்கப்பட்டிருக்கும் கீழே கூறியுள்ள எல்லைக்குட்பட்ட "எல்டெப் குறூப்" பச்சையிலிருந்து கிட்டத்தட்ட 15 ஏக்கர் விசாலமான ஒரு பகுதி எடுத்துக்கொள்ளப்படும்.

வடக்கு—நீர் ஓடை,
கிழக்கு—மிரினாடுகே கனடு,
தெற்கு—தோட்டத்தின் எல்லை,
மேற்கு—தோட்டத்தின் எல்லையும், நீர் ஓடையும்.

L. D.—B. 49/50.

No. LD. 7353/LRO/APL/4,180/J/AL/1754.

Notice under section 7 of the Land Acquisition Act, No. 9 of 1950

I, A. B. S. N. Pullenayegum, Assistant Government Agent of the Hambantota District, do hereby give notice under section 7 of the Land Acquisition Act, No. 9 of 1950, that—

- (1) it is intended to acquire under the said Act, for the purposes of the Land Redemption Ordinance, No. 61 of 1942, the land described in the Schedule hereto;
- (2) claims for compensation for the acquisition of such land may be made to me, and
- (3) every person interested in such land shall—
- (a) appear, personally or by agent duly authorised in writing, before me at Weeraketiya V. C. Office, on the 2nd day of April, 1952, at 11.30 a.m.; and
- (b) notify to me in writing on or before the 26th day of March, 1952, the nature of his interests in the land, the particulars of his claim for compensation, the amount of compensation and the details of the computation of such amount.

The Kachcheri,
Hambantota, January 29, 1952.

A. B. S. N. PULLENAYEGUM,
Assistant Government Agent.

SCHEDULE

Supplement No 3 to Final Village plan No 248. Village—Hinbunna

Lot	Name of Land	Description	Name of Claimant	Extent A. R. P.
142	Andarahena	Coconut garden 25 years, contains one mud and wattle thatched temporary building and temporary cadjan shed	M. S. Ratnayake of Mandaduwa, Weeraketiya (The 2 temporary buildings are claimed by Nanayakkara Bamunusin Vitarana Gamage Don Davith of Hinbunna, who is the present occupier.)	3 0 16

Reference No. LD 7348/LRO/APL/4949/J/A/L1311.

Notice under Section 7 of the Land Acquisition Act, No. 9 of 1950

I, A. B. S. N. Pullenayegum, Assistant Government Agent of the Hambantota District, do hereby give notice under section 7 of the Land Acquisition Act, No. 9 of 1950, that—

- (1) it is intended to acquire under the said act, for the purposes of the Land Redemption Ordinance, No. 61 of 1942, the lands described in the Schedule hereto,
- (2) claims for compensation for the acquisition of such lands may be made to me; and
- (3) every person interested in such lands shall—
- (a) appear, personally or by agent duly authorised in writing before me at Belatta Town Council Office, on April 2, 1952, at 9 a.m.;
- (b) notify to me in writing on or before March 26, 1952, the nature of his interests in the lands, the particulars of claim for compensation, the amount of compensation, and the details of the computation of such amount.

The Kachcheri,
Hambantota, February 2, 1952.

A. B. S. N. PULLENAYEGUM,
Assistant Government Agent.

SCHEDULE

Supplement No. 7 to final village plan No. 296. Village—Getamanna

Lot	Name of Land	Description	Name of Claimant	Extent A. R. P.
770	Delgahawatta	Garden contains 1 coconut tree 45 years, 10 coconut and 7 arecanut trees 20 years	Hetti Hewage Podinona, C/o V. H. of Belatta	0 0 4
771	Delgahawatta and Kondaramagewatta	Garden contains 3 coconut, 2 breadfruit trees 20 years and 6 arecanut trees 10 years	do.	0 0 5
772	Do.	Garden contains coconut 4-40 years, citronella 15 years, jak 40 years and a tiled mud house, thatched mud house, thatched mud latrine and a part of a cadjan shed	do.	3 1 9
Total				3 1 18

L. D.—B. 49/50.

No. LD. 7351/LRO/APL/808/J/AL/1656.

Notice under section 7 of the Land Acquisition Act, No. 9 of 1950

I, A. B. S. N. Pullenayegum, Assistant Government Agent of the Hambantota District, do hereby give notice under section 7 of the Land Acquisition Act, No. 9 of 1950, that—

- (1) it is intended to acquire under the said Act, for the purposes of Land Redemption Ordinance, No. 61 of 1942, the lands described in the Schedule hereto;
- (2) claims for compensation for the acquisition of such lands may be made to me; and
- (3) every person interested in such lands shall—
- (a) appear, personally or by agent duly authorised in writing, before me at Belatta Town Council Office, on the 2nd day of April, 1952, at 10 a.m., and
- (b) notify to me in writing on or before the 26th day of March, 1952, the nature of his interests in the land, the particulars of his claim for compensation, and amount of compensation and the details of the computation of such amount.

The Kachcheri,
Hambantota, January 29, 1952.

A. B. S. N. PULLENAYEGUM,
Assistant Government Agent.

SCHEDULE

Supplement No. 11 to Final Village plan No. 290. Village—Nalagama

Lot	Name of Land	Description	Name of Claimant	Extent		
				A.	R.	P.
521	Ganithaheparanawatta, Mahaparanawatta, Mylagahakoratuwa	Garden contains coconut, jak and arecanut 40 years and a temporary thatched mud house	K. H. Simon Silva of Beliatta	7	1	30.5
522	Dadakirillagahahena	Garden contains coconut 40 years	do.	0	0	10.0
523	Mahaparanawatta	Citronella 40 years	do.	0	3	8.0
524	Ganithaheparanawatta, Mahaparanawatta Mylagahakoratuwa	Garden (no cultivation)	do.	0	0	4.0
Total				8	1	12.5

Reference No. LD 7357/LRO/APL/1319/J/AL/1730.

Notice under section 7 of the Land Acquisition Act, No. 9 of 1950

I, A. B. S. N. Pullenayegum, Assistant Government Agent of the Hambantota District, do hereby give notice under section 7 of the Land Acquisition Act, No. 9 of 1950, that—

- (1) it is intended to acquire under the said act, for the purposes of the Land Redemption Ordinance, No. 61 of 1942, the lands described in the Schedule hereto,
- (2) claims for compensation for the acquisition of such lands may be made to me; and
- (3) every person interested in such lands shall—

(a) appear, personally or by agent duly authorised in writing before me at Beliatta Town Council Office, on April 2, 1952, at 9 a.m.,

(b) notify to me in writing on or before March 26, 1952, the nature of his interests in the lands, the particulars of claim for compensation, the amount of compensation, and the details of the computation of such amount.

The Kachcheri,
Hambantota, February 2, 1952.

A. B. S. N. PULLENAYEGUM,
Assistant Government Agent.

SCHEDULE

Combined Supplement No. 1 to final village plan Nos. 262 and 263. Villages—Ihala Beligalla and Pallattara

Lot	Name of Land	Description	Name of Claimant	Extent		
				A.	R.	P.
129	Serugahahena	Coconut garden 20 years	R. A. Babusin Appuhami, Pallattara, Beliatta	2	0	6
131	Arewatta	Coconut garden 40 years	do.	4	0	18
513	Serugahahena	Coconut garden 20 years	do.	0	0	14
Total				6	0	38

Reference No. LRO/APL/3020/J/AL/1666/LM. 5406.

The Land Acquisition Act, No. 9 of 1950

Notice under Section 7

I hereby give notice, under sub-section (1) of section 7 of the Land Acquisition Act, No. 9 of 1950, that the Government intends to acquire the following land which is required for the purposes of the Land Redemption Ordinance, No. 61 of 1942.

Description of the land to be acquired:

Preliminary plan No. A 701 Village—Wettewa

Lot	Name of Land	Description	Name of Claimant	Extent		
				A.	R.	P.
1	Mahakumbura	Coconut garden contains 3 old coconut trees	H. P. Rewatha Thero of New Temple, Hingula	0	0	3
2	Do.	Paddy field	do.	0	0	16
3	Do.	do.	do.	0	3	32
4	Do.	do.	do.	0	0	25
Total				1	0	36

All persons interested in the aforesaid land are hereby required to appear personally, or by agents duly authorized in writing, before me at the Mawanella Rest House on March 25, 1952, at 10 a.m., and are hereby requested to notify to me in writing (in duplicate), on or before March 18, 1952, the nature of their interests in the land, the particulars of their claims for compensation for the acquisition of the said land, the amount of compensation and the details of the computation of such amount.

The Kachcheri,
Kegalla, January 25, 1952.

D. G. DAYARATNE,
Assistant Government Agent.

Miscellaneous Land Notices

No. LS. 2504.

Notification under Regulation 21 (2) of the Crown Lands Regulations, 1948

NOTICE is hereby given that Taldena Agricultural Products and Sales Society Ltd., has applied for about an acre from lots 69 and 72 in F. V. P. 178, situated in Nagollagama Village, Soranotota Korale, Wiyalywa Division, Badulla District, for the purpose of constructing a store thereon.

2. The land is available for the purpose. It is proposed to grant the application for lease subject to the following conditions, amongst others:—

(a) Term: 30 years.

(b) Rent: Rs. 8 per annum.

(c) The lessee shall, within one year from the commencement of the lease, erect a store on the land to the satisfaction of the Government Agent, Badulla.

(d) The lessee shall use the land as a site for a store and for no other purpose.

3. The lease will be granted unless valid reasons to the contrary are adduced in writing to me within six weeks from the date hereof.

Colombo, February 8, 1952.

E. K. R. ASERAPPA,
for Land Commissioner.

ආණ්ඩුවට ඉඩම් ලබාගැනීම සම්බන්ධ දන්වීම්

Q. 3941/J/AL/1141.

1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 5 වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයකි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම් පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය ආණ්ඩුවට ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කායිකම හා ඉඩම් පිලිබඳ ඇමතිවරයා වූ බිබිලි ෂැල්ටන් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි :

(1) කොළඹ දිසත්‍රිකයේ නැගෙනහිර සියනැකෝරළේ රඳුවානේ පිහිටි වාරිමාට් දෙපාර්තමේන්තුවේ ප්‍රදේශ භාර නිලධාරී තුමාගේ 6.4.51 දින දරණ සිතියමේ 1 වෙනි කැබැල්ලේ විස්තර කරනලද හත්පෙරුම යන ඉඩමෙන් අක්කරයකින් .06 ක පමණ ප්‍රමාණය. ඊට මායිම්:—

- උතුරට : සී. ඒ. සේනාරත්න මහත්මයාගේ හත්පෙරුම කුඹුර;
- නැගෙනහිරට : පුගොඩ මය;
- දකුණට : කේ. ජේ. අමරසේකර මහත්මයාගේ හත්පෙරුම;
- බස්නාහිරට : ඩී. දිසෝනිස් සේනාරත්නගේ ඉඩම.

(2) කොළඹ දිසත්‍රිකයේ නැගෙනහිර සියනැකෝරළේ රඳුවානේ පිහිටි වාරිමාට් දෙපාර්තමේන්තුවේ ප්‍රදේශ භාර නිලධාරී තුමාගේ 6.4.51 දින දරණ සිතියමේ 2 වෙනි කැබැල්ලේ විස්තර කරනලද හත්පෙරුම යන ඉඩමෙන් අක්කරයකින් .14 ක පමණ ප්‍රමාණය. ඊට මායිම්:—

- උතුරට සහ නැගෙනහිරට : පුගොඩ මය;
- දකුණට සහ බස්නාහිරට : කේ. ජේ. අමරසේකරට අයිති කුඹුර.

(3) කොළඹ දිසත්‍රිකයේ නැගෙනහිර සියනැකෝරළේ රඳුවානේ පිහිටි වාරිමාට් දෙපාර්තමේන්තුවේ ප්‍රදේශ භාර නිලධාරී තුමාගේ 6.4.51 දින දරණ සිතියමේ 3 වෙනි කැබැල්ලේ විස්තර කරනලද පහල හත්පෙරුම යන ඉඩමෙන් අක්කරයකින් .10 ක පමණ ප්‍රමාණය. ඊට මායිම්:—

- උතුරට සහ නැගෙනහිරට : පුගොඩ මය;
- දකුණට සහ බස්නාහිරට : කේ. ජේ. අමරසේකරට අයිති කුඹුර.

(4) කොළඹ දිසත්‍රිකයේ නැගෙනහිර සියනැකෝරළේ රඳුවානේ පිහිටි වාරිමාට් දෙපාර්තමේන්තුවේ ප්‍රදේශ භාර නිලධාරී තුමාගේ 6.4.51 දින දරණ සිතියමේ 4 වෙනි කැබැල්ලේ විස්තර කරනලද පහල හත්පෙරුම යන ඉඩමෙන් අක්කරයකින් .29 ක පමණ ප්‍රමාණය. ඊට මායිම්:—

- උතුරට : සී. ඒ. සේනාරත්න මහත්මයාට අයිති හත්පෙරුම යන ඉඩම;
- නැගෙනහිරට : කේ. ජේ. අමරසේකර මහත්මයාට අයිති පහල හත්පෙරුම යන ඉඩම;
- දකුණට : පී. ඩබ්ලිව්. ඩී. පාර;
- බස්නාහිරට : ඩී. දිසෝනිස් සේනාරත්නට අයිති ඉඩම.

(5) කොළඹ දිසත්‍රිකයේ නැගෙනහිර සියනැකෝරළේ රඳුවානේ පිහිටි වාරිමාට් දෙපාර්තමේන්තුවේ ප්‍රදේශ භාර නිලධාරී තුමාගේ 6.4.51 දින දරණ සිතියමේ 5 වෙනි කැබැල්ලේ විස්තර කරනලද ඉඹුලෝව්වෙන් යන ඉඩමෙන් අක්කරයකින් .29 ක පමණ ප්‍රමාණය. ඊට මායිම්:—

- උතුරට සහ නැගෙනහිරට : පන්සලවත්ත;
- දකුණට : පී. ඩබ්ලිව්. ඩී. පාර;
- බස්නාහිරට : සී. ජේ. සේනාරත්න මුදලිතුමාට අයිති ඉඹුලෝව්ව.

(6) කොළඹ දිසත්‍රිකයේ නැගෙනහිර සියනැකෝරළේ රඳුවානේ පිහිටි වාරිමාට් දෙපාර්තමේන්තුවේ ප්‍රදේශ භාර නිලධාරී තුමාගේ 6.4.51 දින දරණ සිතියමේ 6 වෙනි කැබැල්ලේ විස්තර කරනලද නින්දමෙල යන ඉඩමෙන් අක්කරයකින් .06 ක පමණ ප්‍රමාණය. ඊට මායිම්:—

- උතුරට : පී. ඩබ්ලිව්. ඩී. පාර;
- නැගෙනහිරට : ඇල;
- දකුණට : පුගොඩ මය;
- බස්නාහිරට : ඇස්. ඩී. ජේ. ඩබ්ලිව්. ජයසේකර බණ්ඩාර මහත්මයාම අයිති නින්දමෙල යන ඉඩම.

(7) කොළඹ දිසත්‍රිකයේ නැගෙනහිර සියනැකෝරළේ රඳුවානේ පිහිටි වාරිමාට් දෙපාර්තමේන්තුවේ ප්‍රදේශ භාර නිලධාරී තුමාගේ 6.4.51 දින දරණ සිතියමේ 7 වෙනි කැබැල්ලේ විස්තර කරනලද පන්සලපැන්කුඹුර යන ඉඩමෙන් අක්කරයකින් .15 ක පමණ ප්‍රමාණය. ඊට මායිම්:—

- උතුරට : පන්සලවත්ත යන ඉඩමෙන් කොටසක්;
- නැගෙනහිරට සහ දකුණට : පුගොඩ මය;
- බස්නාහිරට : සී. ඒ. සේනාරත්න මහත්මයාට අයිති හත්පෙරුම යන ඉඩම.

(8) කොළඹ දිසත්‍රිකයේ නැගෙනහිර සියනැකෝරළේ රඳුවානේ පිහිටි වාරිමාට් දෙපාර්තමේන්තුවේ ප්‍රදේශ භාර නිලධාරී තුමාගේ 6.4.51 දින දරණ සිතියමේ 8 වෙනි කැබැල්ලේ විස්තර කරනලද පන්සලවත්ත යන ඉඩමෙන් අක්කරයකින් .16 ක පමණ ප්‍රමාණය. ඊට මායිම්:—

- උතුරට සහ බස්නාහිරට : පුගොඩ මය;
- නැගෙනහිරට : ඉරිසේගන් ඇල;
- දකුණට : සී. ජේ. සේනාරත්න මුදලිතුමාට අයිති ඉඹුලෝව්ව යන ඉඩම.

මි 1952 ක් වූ ජනවාරි මස 7 වැනි දින කොළඹ දීය.

බිබිලි සේනානායක, කායිකම හා ඉඩම් පිලිබඳ ඇමතිතුමා.

L. P. 6321.

1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 5 වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයකි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම් පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය ආණ්ඩුවට ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කායිකම හා ඉඩම් පිලිබඳ ඇමතිවරයා වූ බිබිලි ෂැල්ටන් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි :

අත්තිලියොඩ මාලුවේ ගම්පහා පාර දිසත්‍රිකයේ සඳහා භාලු දිසත්‍රිකයේ කඩවත්සකර තුල පිහිටි අත්තිලියොඩ සහ මාලුවේ යන ගම්පි පිලිවෙලින්, බිම් ප්‍රමාණය පර්චස් 20 සහ 10 ඇති, ඉදල්ගහවත්ත සහ හිඟුරුවෙල ගලකොටුවත්ත යන ඉඩම් කැබලි දෙක

මි 1952 ක් වූ ජනවාරි මස 17 වැනි දින කොළඹ දීය.

බිබිලි සේනානායක, කායිකම හා ඉඩම් පිලිබඳ ඇමතිතුමා.

L. B. 2046.

1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 5 වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම් පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය ආණ්ඩුවට ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කායිකම හා ඉඩම් පිලිබඳ ඇමතිවරයා වූ බිහිලි ඇල්ටන් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි:

මාතර දිනුක්කයේ වැලිගම කොත්ලේ පරදුව යන ගම පිහිටි දොරගොඩගල නැමැති දූඩයේ අ. 0, රු. 0, ප. 21.3 ක පමණ බිම් ප්‍රමාණයක්, මායිම්:—

- උතුර : දොරගොඩගල;
- නැගෙනහිර } දොරගොඩගල.
- දකුණ }
- බස්නාහිර }

මි 1952 ක්වූ ජනවාරි මස 17 වැනි දින කොළඹදීය.

බිහිලි සේනානායක, කායිකම හා ඉඩම් පිලිබඳ ඇමතිතුමා.

L. B. 2036.

1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 5 වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම් පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය ආණ්ඩුවට ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කායිකම හා ඉඩම් පිලිබඳ ඇමතිවරයා වූ බිහිලි ඇල්ටන් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි:

මාතර දිනුක්කයේ වැලිලබ පත්තුවේ දික්වැල්ල උතුර සහ ගමේ පිහිටි දුගලවත්ත, දත්ගහවත්ත සහ වැටගහ කොරවුව යන ඉඩම්වලින් අක්කර 1 1/2 පමණ බිම් ප්‍රමාණයක්, මායිම්:—

(1) දුගලවත්ත සහ දත්ගහවත්ත—

- උතුර : දත්ගහවත්ත;
- නැගෙනහිර : දුගලවත්ත;
- දකුණ : ගම්පහා පාර;
- බස්නාහිර : වෙහිසවත්ත.

(2) වැටගහකොරවුව—

- උතුර : පාඨයාලාව;
- නැගෙනහිර : මුල්ලගේකොරවුව;
- දකුණ : ගලවෙහිසවත්ත;
- බස්නාහිර : අමුකොරවුව.

මි 1952 ක්වූ ජනවාරි මස 25 වැනි දින කොළඹදීය.

බිහිලි සේනානායක, කායිකම හා ඉඩම් පිලිබඳ ඇමතිතුමා.

1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 5 වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම් පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය ආණ්ඩුවට ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කායිකම හා ඉඩම් පිලිබඳ ඇමතිවරයා වූ බිහිලි ඇල්ටන් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි:

කුරුණෑගල දිනුක්කයේ වැලිබිලි හත්පත්තුවේ කුරුණෑගල නාගරික සභාව තුළ පිහිටි අක්කර 25, රු. 0, ප. 3 වස 12 1/2 විශාලතාවක් ඇති ලේක් සයිඩ් ඒස්වේලි රාමන් තත්වූ නැමැති වඩා විසාරවී 1942 කේ මැයි මස 20 වෙනි දින දරණ පුද්ගලික මැණීමේ ප්ලාන් නො. 215A දරන ප්ලාන් 11 වෙනි ඉඩම් කැබැල්ලට මායිම්:—

- උතුර : ඩී. පී. 138,370 වේ 12 වෙනි කැබැල්ල;
- නැගෙනහිර : ඊ. පී. ජේ. ජේ. සහ ඊ. ඇල්. බැනියල්ට අයිති ලේක් සයිඩ් වත්ත;
- දකුණ : වැන්නියේ “සයිසලර්” පාර සහ
- බස්නාහිර : කේ. ඇම්. පී. ඇල්. මුත්තුරාමන් වෙහිසියාර්වද, පලනිඅපපා වෙහිසියාර්වද අයිති 11A දරන බිම්කැබැල්ල වේ.

අඛණ්ඩ J/LSS/1624.

මි 1952 ක්වූ ජනවාරි මස 23 වැනි දින කොළඹදීය.

බිහිලි සේනානායක, කායිකම හා ඉඩම් පිලිබඳ ඇමතිතුමා.

Q. 3428/J/HLG/1577.

1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 5 වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම් පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය ආණ්ඩුවට ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කායිකම හා ඉඩම් පිලිබඳ ඇමතිවරයා වූ බිහිලි ඇල්ටන් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි:

කොළඹ දිනුක්කයේ නැගෙනහිර සියනැකෝරලේ නිව්වමුවේ පිහිටි දෙල්ගහවත්ත නැමැති ඉඩමෙන් අඩි 40 x 50 ක පමණ ප්‍රමාණය, ඊට මායිම්:—

- උතුර : බිහිලි. ඇම්. කේ. කරෝලිස් ප්‍රනාන්දු;
- නැගෙනහිර : ස්. ජේ. පී. බබේසේකරට අයිති ඉඩම;
- දකුණ : මිගමු-රුවන්වැල්ල පී. බිහිලි. බී. පාර;
- බස්නාහිර : කොළඹ-නුවර පාර.

මි 1952 ක්වූ ජනවාරි මස 23 වැනි දින කොළඹදීය.

බිහිලි සේනානායක, කායිකම හා ඉඩම් පිලිබඳ ඇමතිතුමා.

L. P. 6388.

1950෦෧ අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 5වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම් පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය ආණ්ඩුවට ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950෦෧ අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කෘෂිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිවරයා වූ බිඞ්ලි මැල්ටන් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි:

ආලු දිඤ්ඤිකයේ වැල්ලබඩ පත්තුවේ භික්කුබුදු භූමි භූමිකර්ම පිහිටි අක්කර 19, රූඩ් 1, පර්චස් 33 ප්‍රමාණය ඇති කොටුදුටු නමැති ඉඩම් කැබලි 20 නොහොත් නොමිමර 2,642 දරණ මුලික සිතියමේ අංක 1444-1458 දරණ (ආණ්ඩුවේ) ඉඩම් කැබලිද, නොමිමර 13,658 දරණ මුල් සිතියමේ අංක 1, 2 සහ 3 දරණ ඉඩම් කැබලි සහ නොමිමර 14,222 දරණ මුල් සිතියමේ අංක 1 සහ 2 දරණ ඉඩම් කැබලිද මේ.

Ref. No. J/E/1127.

වම් 1952ක්වූ ජනවාරි මස 15 වැනි දින කොළඹදීය.

බිඞ්ලි සේනානායක, කෘෂිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිතුමා.

L. B. 2030.

1950෦෧ අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 5වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම් පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය ආණ්ඩුවට ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950෦෧ අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කෘෂිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිවරයා වූ බිඞ්ලි මැල්ටන් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි:

මාතර දිඤ්ඤිකයේ ගඟබඩ පත්තුවේ නායිම්බල යන ගම පිහිටි බොහොවත්ත, පොඤ්ඤාවත්ත සහ පත්තියෙමත්ත යන ඉඩම්වලින් අක්කර 1½ පමණ බිම් ප්‍රමාණයක්, මායිම්:—

(1) බෝගහවත්ත—

- උතුරට : පොඤ්ඤාවත්ත ;
- නැගෙනහිරට : පී. බිඞ්ලිව. ඩී. පාර සහ කොපිමිමිබහකොරටුව ;
- දකුණට : කෝත්ගහවිතාරනගේමත්ත සහ බෝගහකොරටුව ;
- බස්නාහිරට : මාලිමිබඩගෙමත්ත.

(2) පොඤ්ඤාවත්ත සහ පත්තියෙමත්ත—

- උතුරට : පුප්පමුල්ලකුඹුර සහ පලවත්ත
- නැගෙනහිරට : පොඤ්ඤාවත්ත ;
- දකුණට : බෝගහවත්ත ;
- බස්නාහිරට : මාලිමිබඩගෙමත්ත.

වම් 1952ක්වූ ජනවාරි මස 25 වැනි දින කොළඹදීය.

බිඞ්ලි සේනානායක, කෘෂිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිතුමා.

L.B. 2055.

1950෦෧ අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 5වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම් පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය ආණ්ඩුවට ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950෦෧ අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කෘෂිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිවරයා වූ බිඞ්ලි මැල්ටන් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි:

මාතර දිඤ්ඤිකයේ වැලිගම කෝරළේ සුල්කානගොඩ යන ගම පිහිටි යද්දෙහිකුඹුර, පිටඅද්දර, එරමුදුගහඅද්දර සහ එරමුදුගහඅද්දර යන ඉඩම්වලින් අ. 0, රූ. 1, ප. 6'14 කොටස්. ජම මායිම්:—

(1) යද්දෙහිකුඹුර—

- උතුරට : සුල්කානගොඩ යන ගම්සභාපාර ;
- දකුණට : පිටඅද්දර ;
- නැගෙනහිරට සහ බස්නාහිරට } යද්දෙහිකුඹුර.

(2) පිටඅද්දර—

- උතුරට : යද්දෙහිකුඹුර ;
- දකුණ සහ නැගෙනහිරට } පිටඅද්දර ;
- බස්නාහිරට : එරමුදුගහඅද්දර.

(3) එරමුදුගහඅද්දර—

- උතුරට ; යද්දෙහිකුඹුර ;
- දකුණට සහ නැගෙනහිරට } පිටඅද්දර ;
- බස්නාහිරට : එරමුදුගහඅද්දර ;

(4) එරමුදුගහඅද්දර—

- උතුරට සහ දකුණට } එරමුදුගහඅද්දර
- නැගෙනහිරට } එරමුදුගහඅද්දර
- බස්නාහිරට : කොට්ටිලම යන ගම්සභාපාර.

වම් 1952ක්වූ ජනවාරි මස 17 වැනි දින කොළඹදීය.

බිඞ්ලි සේනානායක, කෘෂිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිතුමා.

Ref. No. L. D. 7355/J/AL/1781.

1950 අංක 9 දරන ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 5 වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම් පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය ආණ්ඩුවට ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950 අංක 9 දරන ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කායිකම් හා ඉඩම් පිළිබඳ ඇමතිවරයා වූ බිබිලි ඇල්ටන් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි:

(1) හම්බන්තොට දිස්ත්‍රික්කයේ නැගෙනහිර ශිරුවා පත්තුවේ ගොන්නඩුආර යන ගමේ පිහිටි මෙහි පහත සඳහන් මායිම් කුල දුක්වෙන පර්චස් 35ක් පමණ වූ බිම් ප්‍රමාණය—

උතුර, නැගෙනහිර, දකුණ සහ බටහිරට ආණ්ඩුවේ ඉඩමකින් සෑදුණු වැව් කන්ඩියකි.

(2) හම්බන්තොට දිස්ත්‍රික්කයේ නැගෙනහිර ශිරුවා පත්තුවේ ගොන්නඩුආර යන ගමේ පිහිටි මෙහි පහත සඳහන් මායිම් කුල දුක්වෙන ආක්කර 1 කි, පර්චස් 32ක් පමණ වූ බිම් ප්‍රමාණය—

උතුරට: පව්වියපොල පන්සලේ නායක ස්වරයන්ගේ ඉඩම්වලින්ද;

නැගෙනහිරට: එම ගම පදිංචි බිබිලි, ඒ. කේ. ජී. පියදසරේ ඉඩම්වලින්ද;

දකුණට: ආණ්ඩුවේ ඉඩමකින් සෑදුණු වැව් කන්ඩියකින්ද සහ

බටහිරට: පව්වියපොල පන්සලේ නායක ස්වරයන්ගේ ඉඩම්වලින්ද සහ ආණ්ඩුවේ ඉඩමකින් සෑදුණු වැව් කන්ඩියකි.

(3) හම්බන්තොට දිස්ත්‍රික්කයේ නැගෙනහිර ශිරුවා පත්තුවේ ගොන්නඩුආර යන ගමේ පිහිටි මෙහි පහත සඳහන් මායිම් කුල දුක්වෙන රූම් 1 කි, පර්චස් 14ක් පමණ වූ බිම් ප්‍රමාණය—

උතුරට: පව්වියපොල පන්සලේ නායක ස්වරයන්ගේ ඉඩම්වලින්ද;

නැගෙනහිරට: එම ගම පදිංචි බිබිලි, ඒ. කේ. ජී. පියදසරේ ඉඩම්වලින්ද;

දකුණට: එම ගම පදිංචි ජී. එම්. බිබිලි, පී. අර්චන්ද්‍රසිල් සිල්වාගේ ඉඩම්වලින්ද;

බටහිරට: ආණ්ඩුවේ ඉඩමකින් සෑදුණු වැව් කන්ඩියකි.

(4) හම්බන්තොට දිස්ත්‍රික්කයේ නැගෙනහිර ශිරුවා පත්තුවේ නොන්කඩුආර යන ගමේ පිහිටි මෙහි පහත සඳහන් මායිම් කුල දුක්වෙන රූම් 2 කි, පර්චස් 32ක් පමණ වූ බිම් ප්‍රමාණය—

උතුරට: පව්වියපොල පදිංචි බිබිලි, ඒ. කේ. ජී. පියදසරේ ඉඩම්වලින්ද;

නැගෙනහිරට: එම ගම පදිංචි ජී. එම්. බිබිලි, පී. අර්චන්ද්‍රසිල් සිල්වාගේ ඉඩම්වලින්ද;

දකුණට: ආණ්ඩුවේ ඉඩමකින් සහ

බටහිරට: ආණ්ඩුවේ ඉඩමකින් සෑදුණු වැව් කන්ඩියකි.

මිම් 1952ක් වූ ජනවාරි මස 25 වැනි දින කොළඹදීය.

බිබිලි සේනානායක, කායිකම් හා ඉඩම් පිළිබඳ ඇමතිතුමා.

L. B. 2056.

1950 අංක 9 දරන ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 5 වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම් පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය ආණ්ඩුවට ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950 අංක 9 දරන ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කායිකම් හා ඉඩම් පිළිබඳ ඇමතිවරයා වූ බිබිලි ඇල්ටන් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි:

මාතර දිස්ත්‍රික්කයේ වැල්ලබඩ පත්තුවේ සහ කඩවත්සනරේ වෙහෙල්ල යන ගම පිහිටි එගොඩදෙණිය, දෙහිගහදෙණිය, පිත්ලිආද්ද සහ වෙලොවවත්ත යන ඉඩම්වලින් අ. 0, රූ. 2, ප. 8 පමණ ඇති බිම් කොටස් හතරක්, මායිම්:—

(1) එගොඩදෙණිය—

උතුරට: බී. ඇල්. ජන්දෙර්ස්ට සහ නවත් අගම ආයිති ඉඩම;

දකුණට: බිබිලි, දේවමිත්ත තෙරුන්ට ආයිති ඉඩම;

නැගෙනහිරට: එම

බස්නාහිරට: ඇලේ දකුණු ඉවරේ දකුණු ඉවර.

(2) දෙහිගහදෙණිය—

උතුරට: ඒ. හිමාර සහ කමිත් අගම ඉඩම;

දකුණට සහ නැගෙනහිරට: ඇස්. බිබිලි, එසිහාමිගේ සහ නවත් අගම ඉඩම;

බස්නාහිරට: එම

(3) පිත්ලිආද්ද—

උතුරට: බී. ඇල්. ජන්දෙර්ස් සහ නවත් අගම ඉඩම;

දකුණට: දේවමිත්ත තෙරුන්ගේ ඉඩම;

නැගෙනහිරට: බිබිලි, එසිහාමිගේ සහ නවත් අගම ඉඩම;

බස්නාහිරට: ඇලේ දකුණු ඉවරේ දකුණු ඉවර.

(4) වෙලොවවත්ත—

උතුරට සහ නැගෙනහිරට: ඒ. හිමාර සහ නවත් අගම ඉඩම;

දකුණට සහ බස්නාහිරට: ඇස්. බිබිලි, එසිහාමි සහ නවත් අගම ඉඩම.

මිම් 1952ක් වූ ජනවාරි මස 25 වැනි දින කොළඹදීය.

බිබිලි සේනානායක, කායිකම් හා ඉඩම් පිළිබඳ ඇමතිතුමා.

Reference No. L. D. 7356/J/HA/1801.

1950 අංක 9 දරන ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 5 වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම් පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවත්, එය ආණ්ඩුවට ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවත්, 1950 අංක 9 දරන ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කායිකම් හා ඉඩම් පිළිබඳ ඇමතිවරයා වූ බිබිලි ඇල්ටන් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි:

හම්බන්තොට දිස්ත්‍රික්කයේ බටහිර ශිරුවා පත්තුවේ නාගල්ලේ නාගරික සීමාව කුල පිහිටි කෙටන්ගහවත්ත නමැති ඉඩමෙන් ආක්කරයක් පමණ වූ බිම් ප්‍රමාණය, මායිම්:—

උතුරට: ඒකභාසක වලම්වෙවත්ත;

නැගෙනහිරට: ඇල්. ජී. පොලිසර් මහතාගේ ඉඩම්වලින්ද;

දකුණට: කඳුරුපොකුණේ නාගරික පාරෙන්ද සහ

බස්නාහිරට: නාගරිකයේ රවුම් පාරද.

මිම් 1952ක් වූ ජනවාරි මස 25 වැනි දින කොළඹදීය.

බිබිලි සේනානායක, කායිකම් හා ඉඩම් පිළිබඳ ඇමතිතුමා.

L. B. 2018.

1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 5 වෙනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මෙහි පහත විස්තර කර තිබෙන ඉඩම් පොදු කටයුත්තකට උවමනාකර තිබෙන බවින්, එය ආඥාවට ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ විධිවිධාන යටතේ ලබාගන්නා බවින්, 1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ කාමිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිවරයා වූ බිහිලි පැල්වත් සේනානායක නමැති මම මෙයින් ප්‍රකාශ කරමි :

මාතර දිඤ්ඤිකයේ කඳුබඩ පත්තුවේ සත්තුවේ සහ ගමේ පිහිටි ගමපිටිලකුඹුර, මිනිදිවෙලකුඹුර, දිගහඟවතුරකුඹුර, යකර මුදුගෙමුලනකුඹුර සහ බෙලිගහකුඹුර යන ඉඩම්පිලිත් රූපී 1 කි, පර්චස් 30 ක් පමණ වන ඉඩම් කැබලි තුනක්, ඉඩම්වලට මායිම්:—

- (1) ගමගෙපිටිලකුඹුර—
 - උතුර: යකරමුදුගෙමුලනකුඹුර;
 - දකුණ සහ බස්නාහිර : ගමගෙපිටිලකුඹුර;
 - නැගෙනහිර : මහ පාර.
- (2) මිනිදිවෙලකුඹුර—
 - උතුර : බෙලිගහකුඹුර;
 - දකුණ සහ නැගෙනහිර : මිනිදිවෙලකුඹුර;
 - බස්නාහිර : මහ පාර.
- (3) දිගහඟවතුරකුඹුර—
 - උතුර සහ බස්නාහිර : දිගහඟවතුරකුඹුර;
 - දකුණ : යකරමුදුගෙමුලනකුඹුර;
 - නැගෙනහිර : මහ පාර.
- (4) යකරමුදුගෙමුලනකුඹුර—
 - උතුර : දිගහඟවතුරකුඹුර;
 - දකුණ : ගමගෙපිටිලකුඹුර;
 - නැගෙනහිර : මහ පාර;
 - බස්නාහිර : යකරමුදුගෙමුලනකුඹුර.
- (5) බෙලිගහකුඹුර—
 - උතුර සහ නැගෙනහිර : බෙලිගහකුඹුර;
 - දකුණ : මිනිදිවෙලකුඹුර;
 - බස්නාහිර : මහ පාර.

මි 1952 ක් වූ ජනවාරි මස 29 වැනි දින කොළඹදීය.

බිහිලි සේනානායක,
කාමිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිතුමා.

L. H. 540.

ආඥාවේ කටයුත්තකට, ඒ නමි:—ප්‍රසිඬි වැසිකිලියකට මෙහි පහත සඳහන් වන ඉඩම් ලබාගැනීමේ සඳහා ක්‍රියාකරණ පිණිස “ 203 පරිච්ඡේදයේ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ ” පස්වෙනි කාණ්ඩයේ කරනිබෙන ප.ගාර්තුචල ප්‍රකාරයට කාමිකම්හා ඇමතිතුමාගේ නියෝගය පරිදි නිසිආකාර මට අණ ලැබී තිබේ. ඒ ඉඩම නමි:—

සිතියමේ නො. A 2,405.	ගම—ඉද්දගොඩ පත්තුවේ මිතුගම, කාර්කර දිඤ්ඤිකය	ප්‍රමාණය, අ. රූ. ප.
නො. ඉඩමේ නම	විස්තර	
I	දෙල්ගහ බුරුමුත්ත අවුරුදු 30 ක ප්‍රමාණ වයස ඇති රබර් ගසක්ද, අවුරුදු දෙකකට—තුනකට අතර වියස ඇති 0 0 8 වූවක්සේ දෙකක්ද, කර්තර “ රෙබින්හුඹු ” නැමැති නිවෙසෙහි පදිංචි පර්සි සිල්වා ගිනියේ මහතා අයිතිකම්කරන ඉඩම	

එබැවින් ඉඩම අයිතිකරගැනීමේ ආඥාවේ කලානාම තිබෙන බව පොදුජනාධි දූතගැන්ම සඳහා හඟවෙනි වගන්තියේ මිනැකර තිබෙන හැටියට මෙයින් දැනුම්දෙමි.

ඉහත කී ඉඩමට අයිතිවාසිකම් ඇත්තා වූ සැමදෙනම තමුන්ම නොහොත් තමුන් වෙහෙවර ක්‍රියාකරන අය මි 1952 ක් වූ මාර්තු මස 3 වෙනි දින පෙරවරු 10 ක් කර්තර කම්බර්ගේදී මා ඉදිරිපිටට පැමිණ ඒ කොඩි අත්දමේ අයිතිවාසිකම්ද කිසි කියාසිටින්නට මිනැමා සහ මෙම ඉඩම වෙහෙවර දෙල්ලාසිටින මුදල් ගණනක් ඊට ඇත්තා වූ තමුන්ගේ අයිතිකම් කොරතුරුත් කියා සිටින්නට මිනැ බව මෙයින් දැනගත යුතුයි.

මි 1952 ක් වූ ජනවාරි මස 30 වෙනි දින කර්තර කම්බර්ගේදීය.

ආර්. ඩී. පී. පවුලස්,
ආඥාවේ උප ජ්ජන්තු මමහ.

1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 7 වැනි වගන්තිය යටතේ වූ දැන්වීමයි

පොදු කටයුත්තක් සඳහා අවශ්‍ය පහත දැක්වෙන ඉඩම්/බුක්කි විශේෂය ලබාගැනීමට ආඥාව අදහස්කරන බැවි: 1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 7 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ මෙයින් දැනුම්දී සිටිමි.

ලබාගැනීමට බලාපොරොත්තුවන ඉඩමේ නොහොත් බුක්කි විශේෂයේ විස්තර :—

මාතලේ දිඤ්ඤිකයේ රත්තොට සුඵ.ගගර සභා මායිම් තුළ නො. 2 කේ කොට්ඨාසයේ පිහිටි වර්පණම් නො. 77 දරණ නො. A 1,699 ගේ මුල් සිතියමේ නො. 1 කේ බිම් කොටසකිසි පෙත්තො තිබෙන අක්කර 1, පර්චස් 4-8 ක බිම් ප්‍රමාණය ඇති බිම් කොටස (රත්තොට සිට ලස්සලට යන මහපාරේ සිට මෙම ඉඩමට එන්නට පාරකට සහරැස් අඩි 630 ක් ඉහත කී ඉඩම් කොටසෙන් අත්හරිනු ලැබේ.

ඉඩම දුල්ලා සිටින අය : කේ. ඩී. මාර්ටින්තු මහත්මයා, හල්ගොල්ලමන්න, රත්තොට

ඉහත සඳහන් ඉඩමට/බුක්කි විශේෂයට කිමිකම් අයිතිවාසිකම් හෝ වෙනත් සම්බන්ධකම් කිසි සිටින සියලුදෙනාම තම තමන් හෝ ඔවුන්ගෙන් ලියවිලිවලින් බලය ලත් අයවලුන් හෝ මි 1952 ක් වූ මාර්තු මස 13 වෙනි දින පෙරවරු 10 වේලාවට මාතලේ කම්බර්ගේදී මා සම්මුඛව සිටිය යුතුයි

තවද මි 1952 ක් වූ මාර්තු මස 3 වෙනි දිනට මත්තෙන් ඒ ඉඩම සම්බන්ධයෙන් ඔවුන්ගේ අයිතිවාසිකම්වල ස්වභාවයත්, එකී ඉඩම හෝ බුක්කි විශේෂය ලබාගැනීමේ ගැන වත්දී ඉල්ලීමට ඇති කරුණු පිලිබඳ විස්තරත්, වත්දී මුදල හා ඒ මුදල ගණන් බැඳී හැටිත් මා වෙත (පිටපත් දෙකක් සහිතවූ) ලියවිලිවලින් දැනුම්දිය යුතුයි.

මි 1952 ක් වූ පෙබරවාරි මස 5 වෙනි දින මාතලේ කම්බර්ගේදීය.

ඒ. ආර්. රත්නවේල්,
ආඥාවේ උප ජ්ජන්තුමා.

1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 7 වැනි වගන්තිය යටතේ දැක්වීමයි

පොදු කටයුත්තක් සඳහා අවශ්‍ය පහත දැක්වෙන ඉඩම් ලබාගැනීමට ආණ්ඩුව අදහස්කරන බැවින් 1950 අංක 9 දරන ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 7 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ මෙසින් දැනුම් දී සිටීම.

ලබාගැනීමට බලාපොරොත්තුවන ඉඩම්වල විස්තර :—

නො.	ඉඩමේ නම	විස්තර	අයිතිකරුවන්ගේ නම් සහ ලියුම් ලැබෙන පිලිවෙළ	ප්‍රමාණය, අ.ර. ප.
1	නලාගස් දෙකිය බැඳ්ද නොහොත් නාකන් දෙසේන සහ සුදු වැල නොහොත් නාකන් දෙසේන	අවුරුදු 50 වයස ඇති කුරුඳු ඉඩමෙහි අවුරුදු 25-30 වයස ඇති පොල්ගස් 20ක්ද, කොස්ගස් 3ක්ද, දෙහි ගස් 1ක්ද, මූම්මෙන් බිඳිනලද උර් සෙවිලිකල ගොඩ නැගිලලක්ද, කරනපාරකින් කොටසක්ද, ගල්කණ්ඩයක් සහ අවුරුදු 55 වයස ඇති පොල්ගස් 172ක්ද, අවුරුදු 10-20 වයස ඇති පොල්ගස් 35ක්ද, අවුරුදු 30 වයස ඇති කොස්ගස් 2ක්ද, අවුරුදු 10-12 වයස ඇති අම්ගස් 4ක්ද, දෙල්ගස් 1ක්ද, සුම්බන්ගස් 2ක්ද, කැප්ගස් 1ක්ද, ගොඩපරගස් 6ක්ද, බෙලිගස් 1ක්ද, දොඹගස් 4ක්ද, උර් සෙවිලිකල මූට්ටියක් තනනලද ගෙයක් සහ බැම්මෙන් බිඳිනලද ලීදක්ද ඇති පොල් ඉඩම	හික්කඩුවේ “අල්විස් මිලා” හි පදිංචි ඇල්. බිබ්ලි වි. තෝමස් ද අල්විස් මහත්මයා	17 0 31.5
2	ඉහළ පිප්පවෙල ..	අවුරුදු 15 වයස ඇති කුරුඳු ඇති මිට්ට	.. හික්කඩුවේ “අල්විස් මිලා” හි ඇල්. බිබ්ලි වි. තෝමස් ද අල්විස් මහත්මයා	0 2 4.5
3	ඉහළ පිප්පවෙල ..	අවුරුදු 20 වයස ඇති කොළොල්පඳුරු 10ක්ද, දෙල්ගස් 2ක්ද, පොල්ගස් 3ක්ද, සුම්බන්ගස් 1ක්ද තිබෙන මිට්ට	.. හික්කඩුවේ නලාගස් දෙකියේ ඇම්. කේ. අනුරත් අප්පුහාමි මහතා සහ හික්කඩුවේ නාකන්දේ, ජී. කේ. බසුන් සිසිලා මහතා	0 0 21.1
4	ඉහළ පිප්පවෙල සහ නලාවෙවත්ත	අවුරුදු 30 වයස් වූ කුරුඳු වැවිල්ලක් ඇති මිට්ට සහ අවුරුදු 30 වයස ඇති පොල්ගස් 26 සහ මූට්ටියක් තනනලද අතුසෙවිලිකල ගෙයක්ද තිබෙන පොල් මත්ත	.. හික්කඩුවේ “අල්විස් මිලා” හි පදිංචි ඇල්. බිබ්ලි වි. තෝමස් ද අල්විස් මහත්මයා	0 3 13.5
5	හුණ්ණෙමත්ත ..	අවුරුදු 35 වයස ඇති පොල්ගස් 30 තිබෙන පොල්ඉඩම	දෙබන්දුව කුමාරමහවිහාරය, (හාරකාරනැන) වි. බණ්ඩාර සර්පි	0 0 39

ඉහත සඳහන් ඉඩම්වලට හික්කඩු අයිතිවාසිකම් හෝ වෙනත් සහකාරකම් කියාසිටින සියලුදෙනාම තම නමත් හෝ බඩුන්ගෙන් ලියවිලිවලින් බලක ලත් අයවලුන් හෝ වම් 1952 ක් වූ මාර්තු මස 17 වැනි දින පෙරවරු 9 වේලාවට හික්කඩුවේ තානායමේදී මා සම්මුඛ විභාගයකට සහභාගී විය යුතුයි.

තවද වම් 1952 ක් වූ මාර්තු මස 10 වැනි දිනට මත්තෙන් ඒ ඉඩම් සම්බන්ධයෙන් බඩුන්ගේ අයිතිවාසිකම්වල සම්භාවයන්, එක් ඉඩම් ලබාගැනීම ගැන වත්දී ඉල්ලීමට ඇති කරුණු පිලිබද විස්තරයන්, වත්දී මුදල හා ඒ මුදල ගණන් බැඳු හැටිත් මා වෙත (විටපත් දෙකක් සහිතවූ) ලියවිලිකින් දැනුම්දිය යුතුයි.

වම් 1952 ක් වූ ජනවාරි මස 26 වැනි දින ගාල්ලේ කවිචේරියේදීය.

රේන් රයිට්, ආණ්ඩුවේ උප ඒජන්තතුමා.

L. P. 6179.

ආණ්ඩුවේ කටයුත්තකට, එනම් :—හික්කඩුවේ ජලගැල්ම වැලැක්වීම සඳහා කාණුකැනීම පිණිස මෙහි පහත සඳහන්වෙන ඉඩම් ලබාගැනීම සඳහා ක්‍රියාකරණ පිණිස “203 පරිච්ඡේදයේ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ” පස්වැනි කාණ්ඩයේ කරනීමෙන පංතාර්තුවල ප්‍රකාරයට කෘෂිකම් හා ඉඩම් පිලිබද ඇමතිතුමාගෙන් නිසිආකාර මට අණ ලැබී තිබේ. ඒ ඉඩම් නම් :—

මුල් සිතියමේ නො. A 1252. ගම්—වවුලාතොඩ (කොටසක්) සහ කිරිඳිගොඩ (කොටසක්), දුවේගොඩ (කොටසක්) හික්කඩුව-දෙබන්දුව, කිරියාමුගොඩ, එගොඩගොඩ සහ ජේමහන්දිගොඩ,

නො.	ඉඩමේ නම	විස්තර	අයිතිකම්කීර්තෘ	ප්‍රමාණය, අ.ර. ප.
42	කහවගහවත්ත අද්දරකුඹුර	කුඹුර හික්කඩුවේ කුසයාවුගොඩ පදිංචි ගාල්ලේ දියෝතිස්	0 0 6
43	එම	එම හික්කඩුවේ ආරම්භිකන්ද පදිංචි කුසියහැන් දියෝමහල්පු සහ හික්කඩුව කුසයාවුගොඩ පදිංචි මනිකාවු පොඹිහාමි	0 0 21.8
44	කුත්තවුල්වත්ත අද්දරකුඹුර, කුරුමරක්කල සු. විවත්ත අද්දරකුඹුර	අවුරුදු 8ක් වයස් වූ පොල්ගස් 20ක්ද, අවුරුදු 5ක් වයස් වූ අම් ගස් 4ක්ද, අවුරුදු 5ක් වයස් වූ මුරුගාගත් සහ අවුරුද්දක් වයස් වූ කොළොල්පඳුරු හතරක් ඇති කුඹුර සහ මිට්ට	.. හික්කඩුවේ කුසයාවුගොඩ පදිංචි මානෙසිදුව මිල්සන් සිල්වා	0 1 6.2
45	වල්කිරියවත්ත අද්දර. කුඹුර	කුඹුර හික්කඩුවේ කුසයාවුගොඩ පදිංචි මෙරන් වි කන්කානන්ගේ රැන්සිහාමි	0 0 20.3
46	නදුගොඩපල	එම හික්කඩුවේ පදිංචි නැලි මිරසිංහ	0 1 21.6
47	දෙබන්දුගොඩවත්ත කුඹුර	අද්දර එම හික්කඩුවේ පදිංචි ඒබ්‍රහම් සෙනමිරත්න, ගෙවිටි ආච්චි ලෝරු ගුණවර්ධන, හික්කඩුවේ නාකතු ඉදිපලිපතිරනගේ දියෝතිස්, හික්කඩුවේ කුසයාවුගොඩ පදිංචි වෙයිසේනේ ඇපාගේ වාර්ලිස් අප්පුහාමි	0 0 31.7
48	මහවෙල නොහොත් එගොඩ ගොඩවෙල	එම හික්කඩුවේ වැල්ලවත්ත පදිංචි පවුචන විනානගේ ලැන්සිනෝනා	0 0 3.5
49	එම	එම හික්කඩුවේ වැල්ලවත්ත පදිංචි අලුත්වල තන්තිරියේ ජයසේන	0 1 6.7
49	එම	එම එම	0 1 6.7
50	මහවෙල	එම එගොඩ හික්කඩුවේ පදිංචි ලියනගේ විලියම් සිල්වා	0 0 17.2
51	එම	එම හික්කඩුවේ එගොඩ පදිංචි ලියනගේ සියසේන	0 0 13.8
52	එම	එම හික්කඩුවේ දුවගොඩ පදිංචි අලුත්තන්තිරියේ ජයසේන	0 0 29.8

නො.	ඉඩමේ නම	විස්තර	අයිතිකරුවන්ගේ නම	ප්‍රමාණය, අ. රූ. ප.
53	මහවෙල නොහොත් එගොඩ ගොඩවෙල	එම පොල්ලෙලි වලවල් සහිත..	සීක්කඩුව වැල්ලවත්ත පදිංචි අලුත්වල තත්කිරිගේ පියසේන	0 3 33.3
54	කෝරලගේවත්ත අද්දර කුඹුර සහ කෝරලගේ වත්ත, වර්පණම් අංක ෫෮෯ 15න් කොටසක්	අවුරුදු 15 ක් වයස්වූ පොල්ගස් 4ක් ඇති කුඹුරක් සහ පොල් ඉඩම	සීක්කඩුව පදිංචි හෙට්ටිආච්චි ලෝරා ගුණවර්ධන, ඇල්බට් විරසේකර, මහමල්පේකෝරලගේ මුම්පි, අලුත්වල තත්කිරිගේ ජයසේන, කර අප්පුචාමාන්, ඇද්දේ එලියස් ද සිල්වා, ඊවර්ඩ් ද සිල්වා අමරසිංහ ගුණවර්ධන, සුමි විරක්කොඩි වික්‍රමසිංහ සහ නොමිකඩ පල්ලිය ගුරුගේ කොරනේලියා	0 0 12.6
55	එම	අවුරුදු 60ක් වයස්වූ පොල්ගස් 4ක්ද, අවුරුදු 30ක් වයස්වූ පොල්ගස් 3ක්ද, අවුරුදු 2ක් වයස්වූ ගොඩපරගසක්ද, අවුරුදු 2ක් වයස්වූ අම්බසක් සහ කුණු බැම්මෙන් තනනලද කුඹුර සහ පොල් ඉඩම	එම	0 0 18.7
56	මහවෙල නොහොත් එගොඩ ගොඩවෙල	පොල්ලෙලි වලවල් සහිත කුඹුර	සීක්කඩුව වැල්ලවත්ත පදිංචි පවුඩන විනානගේ ලැක්සිනෝනා	0 0 10.2
57	එම	එම	සීක්කඩුව එගොඩගොඩ පදිංචි ලියනගේ පියසේන	0 0 12
58	එම	එම	සීක්කඩුව එගොඩගොඩ පදිංචි ලියනගේ විලියම් සිල්වා	0 0 11.7
59	එම	එම	සීක්කඩුව දුම්භෙගොඩ පදිංචි අලුත්වල තත්කිරිගේ ජයසේන	0 0 28.9
60	එම	එම	සීක්කඩුව එගොඩගොඩ පදිංචි අලුත්ගම ගුරුගේ ආරණ්ඩියෙකු සහ අලුත්ගම ගුරුගේ සුඛබාණී	0 0 6.1
61	මහවෙල අද්දර මීට	අවුරුදු 12ක් වයස්වූ පොල්ගස් 8ක් ඇති පොල් ඉඩම	එම	0 0 4

එබැවින් ඉඩම් අයිතිකරුවන්ගේ මට ආණ්ඩුමේ කලාප වාසි කිරීමට පොදුජනතාව දැනගැනීම සඳහා හඬවෙහි වගන්තියේ මනාකර නිවේන හැරීමට මෙයින් දැනුම් දෙමි.

ඉහත සඳහන් ඉඩම්වලට අයිතිවාසිකම් ඇත්තාවූ සෑමදෙනම තමන්ම නොහොත් තමන් වෙනුවට ක්‍රියාකරන අය වම් 1952ක්වූ මාර්තු මස 21 වෙනි දින පෙරවරු 9.30 ගේ කාණ්ඩයට සීක්කඩුව නානාගමේදී මා ඉදිරිපිටට පැමිණ ඒ කොසි අයුළුම අයිතිවාසිකම්ද කීතු කියා සිටින්නට මනා බව මෙයින් දැනගත යුතුයි.

එම් 1952ක්වූ ජනවාරි මස 26 වෙනි දින
 ගාල්ලේ කවිචේරියේදීය.

රේන් රයිඩ්,
 ආණ්ඩුමේ උප ජ්‍යෙෂ්ඨ වමන.
 අ. කය LRO/APL/693/J/AL/1124/LP 6405.

1950න් අංක 9 දරන ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 7 වැනි වගන්තිය යටතේවූ දැන්වීමයි

පොදු කටයුත්තක් සඳහා අවශ්‍ය පහත දැක්වෙන ඉඩම් ලබාගැනීමට ආණ්ඩුව අදහස්කරන බැව් 1950න් අංක 9 දරන ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 7 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ මෙයින් දැනුම් දී සිටිමි.

නො.	ඉඩමේ නම	විස්තර	අයිතිකරුවන්ගේ නම සහ ලියුම් ලැබෙන පිලිවෙල	ප්‍රමාණය, අ. රූ. ප.
954	මල්ලගහමුලාන්දුම්	කොස්, පොල්, රබර් ආදී ගස් සහ මැටියෙන් තනා අතු සෙවිලිකළ කුඩා ගෙයක්ද නිවේන ඉඩම	ඉහල කිබ්ලේ බෝදියවත්තෙහි පදිංචි එච්. ජයවර්ධන	0 3 2
955	මල්ලගහමුලානෙදුව නොහොත් ගුලන්කන්ද අද්දරවත්ත	කොස් සහ පොල්ගස් ආදිය ඇති ඉඩම	එම	0 0 4

ඉහත සඳහන් ඉඩම්වලට හිමිකම් අයිතිවාසිකම් හෝ වෙනත් සම්බන්ධතා කීයා සිටින සියලුදෙනාම තම තමන් හෝ ඔවුන්ගෙන් ලියවිලිවලින් බලාපොරොත්තු වූ අය වලින් හෝ වම් 1952ක්වූ මාර්තු මස 24 වෙනි දින පෙරවරු 9.30 වේලාවට ගාල්ලේ කවිචේරියේදී මා සම්මුඛ විචාරයකට.

තවද වම් 1952ක්වූ මාර්තු මස 16 වෙනි දිනට මත්තෙන් ඒ ඉඩම් සම්බන්ධයෙන් ඔවුන්ගේ අයිතිවාසිකම්වල සහතිකයක්, එකී ඉඩම් ලබාගැනීම ගැන වන්දි ඉල්ලීමට ඇති කරුණු පිළිබඳ විස්තරයක්, වන්දි මුදල හා ඒ මුදල ගණන් බැලූ හැටිත් මා වෙත (පිටපත් දෙකක් සහිතවූ) ලියවිලි ලිඛිත දැනුම්දීම යුතුයි.

එම් 1952ක්වූ ජනවාරි මස 26 වෙනි දින
 ගාල්ලේ කවිචේරියේදීය.

රේන් රයිඩ්,
 ආණ්ඩුමේ උප ජ්‍යෙෂ්ඨ වමන.
 අ. කය J/E/780/L. P. 6234.

1950න් අංක 9 දරන ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 7 වැනි වගන්තිය යටතේවූ දැන්වීමයි

පොදු කටයුත්තක් සඳහා අවශ්‍ය පහත දැක්වෙන ඉඩම් ලබාගැනීමට ආණ්ඩුව අදහස්කරන බැව් 1950න් අංක 9 දරන ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 7 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ මෙයින් දැනුම් දී සිටිමි.

නො.	ඉඩමේ නම	විස්තර	අයිතිකරුවන්ගේ නම සහ ලියුම් ලැබෙන පිලිවෙල	ප්‍රමාණය, අ. රූ. ප.
1	බටපොළකන්දෙදුව	අවුරුදු 15-20 වයස් ඇති හෝ සහ රබර් නිවේන අවුරුදු 15 වයස් ඇති පොල්ගස් 16ක්ද, අවුරුදු 30 වයස් ඇති කොස් ගස් 1ක්ද, අභිපාරක්ද නිවේන අර්ධෙන් පාලි සිටිමනලද කුරුඳු ඉඩම	නාගොඩ කැපැල් කන්කෝරු වෙහි වික්ටර් ඒ. ජයසිංහ සහ නාගොඩ සිරිල් ඒ. ජයසිංහ	9 1 5

ඉහත සඳහන් ඉඩමට හිමිකම් අයිතිවාසිකම් හෝ වෙනත් සම්බන්ධතා කීයා සිටින සියලුදෙනාම තම තමන් හෝ ඔවුන්ගෙන් ලියවිලිවලින් බලාපොරොත්තු වූ අය වලින් හෝ වම් 1952ක්වූ මාර්තු මස 29 වෙනි දින පෙරවරු 10.30ට නාගොඩ ආණ්ඩුමේ කණිහි පාසාලාමේදී මා සම්මුඛ විචාරයකට.

තවද වම් 1952ක්වූ මාර්තු මස 21 වෙනි දිනට මත්තෙන් ඒ ඉඩම් සම්බන්ධයෙන් ඔවුන්ගේ අයිතිවාසිකම්වල සහතිකයක්, එකී ඉඩම් ලබාගැනීම ගැන වන්දි ඉල්ලීමට ඇති කරුණු පිළිබඳ විස්තරයක්, වන්දි මුදල හා ඒ මුදල ගණන් බැලූ හැටිත් මා වෙත (පිටපත් දෙකක් සහිතවූ) ලියවිලි ලිඛිත දැනුම්දීම යුතුයි.

එම් 1952ක්වූ පෙබරවාරි මස 2 වෙනි දින
 ගාල්ලේ කවිචේරියේදීය.

රේන් රයිඩ්,
 ආණ්ඩුමේ උප ජ්‍යෙෂ්ඨ වමන.

L. D. 7332/J/PT/422.

1950න් අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 7 වැනි වගන්තිය යටතේ වූ දැන්වීමයි

පොදු කටයුත්තක් සඳහා ඉඩතා පහත දැක්වෙන ඉඩම් ලබාගැනීමට ආණ්ඩුව අදහස් කරන බැව් 1950න් අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 7 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ මෙයින් දැනුම් දී සිටිමි.

ලබාගැනීමට බලාපොරොත්තුවන ඉඩමේ විස්තර :—

නො.	ඉඩමේ නම	විස්තර	අයිතිකම්කරුන්ගේ නම	ප්‍රමාණය, අ. ර. ප.
1	විලිවත්ත, කන්සේරු නො. 21/6, 21/10, 21/14 සහ 21, නො. 2 කොඩ්ස්	අවුරුදු 25කට ඉහළ වූ පොල් වැවිල්ල, සීර ගොඩනැගිලි 2කින්ද, නාවකාලික ගොඩනැගිල්ලකින්ද, සීර වැසිකිලියකින් සහ නාවකාලික වැසිකිලියකින් යුක්ත වේ	ජ. ආ. ම. ජයරත්න මහාපාල (නාවකාලික ගොඩනැගිල්ලටද, නාවකාලික වැසිකිලියටද සහ බන්දු ආරච්චිගේ පුස්තකාලය, නාවල, අයිතිකම්කරු ලෙස)	2 1 38.1

ඉහත සඳහන් ඉඩමට භූමිකම් අයිතිවාසිකම් හෝ වෙනත් සම්බන්ධතා කිසිවක් සිදුදෙනාම කම කමත් හෝ ඔවුන්ගෙන් ලියවිලිවලින් බලපලත් අයවලුන් මේ 1952 මාර්තු මස 10 දින පෙරවර 9.30 ට උප දිනපතිතුමාගේ සංචාරක නිවාසස්ථානයේදී නොහොත් ඉස්සර පාලිකාර බංගලාවේදී මා සම්මුඛ වී සිටිය යුතුයි.

තවද මේ 1952 මාර්තු මස 30 වැනි දිනට මත්තෙන් ඒ ඉඩම සම්බන්ධයෙන් ඔවුන්ගේ අයිතිවාසිකම්වල ස්වභාවයත්, එක් ඉඩම් ලබාගැනීම ගැන වන්දි ලේඛණ ඇති කරුණු පිළිබඳ විස්තරත්, වන්දි මුදල හා ඒ මුදල ගණන් බැඳු හැරින් මා වෙත (පිටපත් දෙකක් සහිතවූ) ලියවිලිවලින් දැනුම් දිය යුතුයි.

මේ 1952ක් වූ ජනවාරි මස 30 වැනි දින හමිබන්තොට කවිචේරියේදීය. ඒ. ඩී. ආර්. ආර්. පුල්ලෙනායකම්, ආණ්ඩුවේ උප ඒජන්තතුමා. No. L. D. 3198/J/E/262.

1950න් අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 7 වැනි වගන්තිය යටතේ වූ දැන්වීමයි

පොදු කටයුත්තක් සඳහා ඉඩතා පහත දැක්වෙන ඉඩම් ලබාගැනීමට ආණ්ඩුව අදහස් කරන බැව් 1950න් අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 7 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ මෙයින් දැනුම් දී සිටිමි.

ලබාගැනීමට බලාපොරොත්තුවන ඉඩමේ විස්තර :—

නො.	ඉඩමේ නම	විස්තර	අයිතිකම් කිරුණ	ප්‍රමාණය, අ. ර. ප.
1	මාවිච්චිලම්	ඉඩම් සහකාරු, අවුරුදු 40 වසය ඇති අඹගහකින්ද සහ පාඨසාලාවකින්ද අඩංගු ඉඩම	සම්මන්තුරේ මල්ලිකානිති පදිංචි නායකම් පිල්ලේ කම්බිනාද පිල්ලේ	1 2 2.2
2	එම	කුඹුර	එම	0 0 0.3
එකතුව				1 2 2.5

ඉහත සඳහන් ඉඩම්වලට භූමිකම්, අයිතිවාසිකම් හෝ වෙනත් සම්බන්ධතා කිසිවක් සිදුදෙනාම කම කමත් හෝ ඔවුන්ගෙන් ලියවිලිවලින් බලපලත් අයවලුන් මේ 1952ක් වූ මාර්තු මස 25 වැනි දින පුච්චාග 10.30න් වේලාවට සම්මන්තුරේ ඩී. ආර්. ම. කන්තෝරුවේදී මා සම්මුඛ වී සිටිය යුතුයි.

තවද මේ 1952ක් වූ මාර්තු මස 17 වැනි දිනට මත්තෙන් ඒ ඉඩම සම්බන්ධයෙන් ඔවුන්ගේ අයිතිවාසිකම්වල ස්වභාවයත්, එක් ඉඩම් ලබාගැනීම ගැන වන්දි ලේඛණ ඇති කරුණු පිළිබඳ විස්තරත්, වන්දි මුදල හා ඒ මුදල ගණන් බැඳු හැරින් මා වෙත (පිටපත් දෙකක් සහිතවූ) ලියවිලිවලින් දැනුම් දිය යුතුයි.

මේ 1952ක් වූ පෙබරවාරි මස 1 වැනි දින මඩකලපු කවිචේරියේදීය. ටී. රජපුරෙයි, ආණ්ඩුවේ උප ඒජන්තතුමා. No. L. D. 3251/J/AL/1094.

1950න් අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 7 වැනි වගන්තිය යටතේ වූ දැන්වීමයි

පොදු කටයුත්තක් සඳහා ඉඩතා පහත දැක්වෙන ඉඩම් ලබාගැනීමට ආණ්ඩුව අදහස් කරන බැව් 1950න් අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 7 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ මෙයින් දැනුම් දී සිටිමි.

ලබාගැනීමට බලාපොරොත්තුවන ඉඩමේ විස්තර :—

මඩකලපු දිස්ත්‍රික්කයේ ඒරලූරේ කෝරළේ පත්තුවේ ඒරලූරේ නමේ පිහිටි අඩක 488 දරණ මුල් පලාපොත් පෙන්නුම්කරන අක්කර 241, රු.ඩි 0, පර්චස් 21 තරම ප්‍රමාණ වපසරිය ඇති සමුලත්තුවා නැමති ඉඩමට මායිම් :—

(1) වෙන්කල්ලාභියේ ඒරලූරේ නමේ පදිංචි යු. පී. මිරලෙඩිගේපොත්, යු. ඩී. මොහමඩ් අර්ප් සහ ඒ. ආසියා උමමා යන අයට අයිති ලොට් D 160 සහ E 160න් පෙන්නුම්කරන ප්‍රමාණයෙන් අක්කර 43, රු.ඩි 3, පර්චස් 27 පමණ ඇති ඉඩමට මායිම්—

- උතුරට : නො. 4648 ඉඩම් කැබැල්ලද;
- දකුණට : නො. 4658 ඉඩම් කැබැල්ලද;
- නැගෙනහිරට : ආණ්ඩුවේ ඉඩමද;
- බස්නාහිරට : නො. 4650 සහ 4653 යන ඉඩම් කැබැල්ලද.

(2) කානාන්කුඹියේ නාවලිකුඹාවේ පදිංචි ටී. කේ. ආර්. රචනසියාට අයිති කොටසක් වූ ලොට් 4646 සිට 4656 සහ 4659 සිට 4661න් පෙන්නුම්කරන ප්‍රමාණයෙන් අක්කර 91 පමණ ඇති ඉඩම් කැබැල්ලට මායිම්—

- උතුරට : නො. 4642 ඉඩම් කැබැල්ලද;
- දකුණට : උලත්තනේ ආරු;
- නැගෙනහිරට : නො. 4662 සහ D 160 යන ඉඩම් කැබැල්ලද;
- බස්නාහිරට : රචනසියාට අයිති ඉහරු ඉ. මී. කැබැල්ලද.

(3) ඉහළ සඳහන් (1) න් පෙන්නුම්කරන අයවලට අයිති කොටසක් වූ ලොට් 4657න් පෙන්නුම්කරන ප්‍රමාණයෙන් අක්කර 2, රු.ඩි 0, පර්චස් 30 පමණ ඇති ඉඩම් කැබැල්ලට මායිම්—

- උතුරට : නො. D 160 ඉඩම් කැබැල්ලද;
- දකුණට සහ නැගෙනහිරට : උලත්තනේ ආරු;
- බස්නාහිරට : නො. 4656 ඉඩම් කැබැල්ලද.

(4) ඉහළ සඳහන් (1)න් පෙන්වුම්කරන අයවලට අයිති කොටසක් වූ ලොච් 4662න් පෙන්වුම්කරන ප්‍රමාණයෙන් අක්කර 7, රූඩ් 1, පර්චස් 8 පමණ ආදානම් කැබැල්ලට මායිම්—

- රතුරට : හො. 4657 ඉඩම් කැබැල්ලද ;
- දකුණට : උලන්තනේ ආරු ;
- නැගෙනහිරට : හො. 4663 ඉඩම් කැබැල්ලද ;
- බස්නාහිරට : හො. 4661 ඉඩම් කැබැල්ලද.

(5) මඩකලපුවේ ආඥා ආර්ථිකයේ වෙනත් සඳහා වූ ඉඩම් අයිතිවාසිකම් හෝ වෙනත් සබඳකම් කියා සිටින සියලුදෙනාම තම නමත් හෝ බඩුන්ගෙන් ලියවිලිවලින් බලය ලත් අයවලුන් හෝ වම් 1952ක් වූ අප්‍රේල් මස 4 වැනි දින පෙරවරු 10ට මඩකලපු කමිටියේදී මා සම්මුඛව පෙනී සිටිය යුතුය.

- රතුරට : හො. 4642 ඉඩම් කැබැල්ලද ;
- දකුණට : උලන්තනේ ආරු ;
- නැගෙනහිරට : හො. 4642 සහ D 160 යන ඉඩම් කැබැල්ලද ;
- බස්නාහිරට : හො. 3718, 3712 සහ 3724 යන ඉඩම් කැබැල්ලද.

ඉහත සඳහන් ඉඩම්වලට හිමිකම් අයිතිවාසිකම් හෝ වෙනත් සබඳකම් කියා සිටින සියලුදෙනාම තම නමත් හෝ බඩුන්ගෙන් ලියවිලිවලින් බලය ලත් අයවලුන් හෝ වම් 1952ක් වූ අප්‍රේල් මස 4 වැනි දින පෙරවරු 10ට මඩකලපු කමිටියේදී මා සම්මුඛව පෙනී සිටිය යුතුය.

තවද වම් 1952ක් වූ මාර්තු මස 27 වැනි දිනට මත්තෙන් ඒ ඉඩම් සම්බන්ධයෙන් බඩුන්ගේ අයිතිවාසිකම්වල සම්බන්ධයෙන් එකී ඉඩම් ලබාගැනීම සඳහා වන්දි ඉල්ලීමට ආදානම් පිළිබඳ විස්තරත්, වන්දි මුදල හා ඒ මුදල ගණන් බැඳු හැටිත් මා වෙත (පිටපත් දෙකක් සහිතව) ලියවිලිවලින් දැනුම්දිය යුතුය.

වම් 1952ක් වූ ජනවාරි මස 31 වැනි දින මඩකලපු කමිටියේදීය.

එ. රජපුරෙයි,
ආණ්ඩුවේ උප ඒජන්තතුමා.

අභිභාග L. A. 7059/J/E/1473.

1950හේ අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 7 වැනි වගන්තිය යටතේ වූ දැන්වීමයි

පොදු කටයුත්තක් සඳහා අවශ්‍ය පහත දැක්වෙන ඉඩම් ලබාගැනීමට ආණ්ඩුව අදහස්කරන බැව් 1950හේ අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 7 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ මේ මෙයින් දැනුම්දී සිටිමි.

ලබාගැනීමට බලාපොරොත්තුවන ඉඩමේ විස්තර :—

කුරුණෑගල දිස්ත්‍රික්කයේ හීරියාල හත්පත්තුවේ ඉහල විසිදෙන කෝරළේ නෙමිසිරිකුඹුර පළාතේ පරමුල්ලේ පිහිටි ඉඩබාගනුමේ බහාලේගොඩ හී. ඒ. ජ. සෙනෙවිරත්න මහතාට උරුමයිකියන බහාලේගොඩවත්තෙන් අ. 3, රූ. 0, ප. 1.3ක විශාලතියක් ආදානම් අවසාන ගම් මැනීමේ ජලයේ හො. 1,196 දරණ පසුබුට්ටි අභිවේදයේ හො. 53 දරණ බිම්කැබැල්ල වේ.

ඉහත සඳහන් ඉඩමට හිමිකම් අයිතිවාසිකම් හෝ වෙනත් සබඳකම් කියා සිටින සියලුදෙනාම තම නමත් හෝ බඩුන්ගෙන් ලියවිලිවලින් බලය ලත් අයවලුන් හෝ වම් 1952ක් වූ මාර්තු මස 18වෙනි දින පෙරවරු 9ට කුරුණෑගල කමිටියේදී මා සම්මුඛව පෙනී සිටිය යුතුය.

තවද වම් 1952ක් වූ මාර්තු මස 11වෙනි දිනට මත්තෙන් ඒ ඉඩම් සම්බන්ධයෙන් බඩුන්ගේ අයිතිවාසිකම්වල සම්බන්ධයෙන් එකී ඉඩම් ලබාගැනීම සඳහා වන්දි ඉල්ලීමට ආදානම් පිළිබඳ විස්තරත්, වන්දි මුදල හා ඒ මුදල ගණන් බැඳු හැටිත් මා වෙත (පිටපත් දෙකක් සහිතව) ලියවිලිවලින් දැනුම්දිය යුතුය.

වම් 1952ක් වූ ජනවාරි මස 28වෙනි දින කුරුණෑගල කමිටියේදීය.

බිලිලි. එ. ජයසිංහ,
විසම් පළාතේ ආණ්ඩුවේ ඒජන්තතුමා වෙනුවෙන්.

අංක LRO/APL/3020/J/AL/1666/LM 5406.

1950හේ අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනත. 7 වැනි වගන්තිය යටතේ වූ දැන්වීමයි

1942හේ අංක 61 දරණ ඉඩම් නිදහස්කරදීමේ ආඥාපනත සඳහා අවශ්‍ය පහත දැක්වෙන ඉඩම් ලබාගැනීමට ආණ්ඩුව අදහස්කරන බැව් 1950හේ අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 7 වැනි වගන්තියේ (1) වැනි උප වගන්තිය යටතේ මෙයින් දැනුම්දී සිටිමි.

ලබාගැනීමට බලාපොරොත්තුවන ඉඩම්වල විස්තර :—

හො. අංකය	ඉඩමේ නම	අංක A 701 දරණ මුල් සැලැස්ම. ගම—වෑන්තුව		ප්‍රමාණය, අ. රූ. ප.
		විස්තරය	අයිතිකම්කරුන්ගේ	
1	මහකුඹුර	පැරණි පොල්ගස් 3ක් ආදානම් කිරීමේ අලුත් පිහාරයේ පදිංචි එම්. පී. ජේවන සමරසේන	පොල් ඉඩම වහන්සේ	0 0 3
2	එම	කුඹුර	එම	0 0 16
3	එම	එම	එම	0 3 32
4	එම	එම	එම	0 0 25
එකතුව				1 0 36

ඉහත සඳහන් ඉඩම්වලට හිමිකම් අයිතිවාසිකම් හෝ වෙනත් සබඳකම් කියා සිටින සියලුදෙනාම තම නමත් හෝ බඩුන්ගෙන් ලියවිලිවලින් බලය ලත් අයවලුන් හෝ වම් 1952ක් වූ මාර්තු මස 25වෙනි දින පු. හා. 10ට මාමහලේලා කානාගම්පලේදී මා සම්මුඛව පෙනී සිටිය යුතුය.

තවද වම් 1952ක් වූ මාර්තු මස 18වෙනි දිනට මත්තෙන් ඒ ඉඩම් සම්බන්ධයෙන් බඩුන්ගේ අයිතිවාසිකම්වල සම්බන්ධයෙන් එකී ඉඩම් ලබාගැනීම සඳහා වන්දි ඉල්ලීමට ආදානම් පිළිබඳ විස්තරත්, වන්දි මුදල හා ඒ මුදල ගණන් බැඳු හැටිත් මා වෙත (පිටපත් දෙකක් සහිතව) ලියවිලිවලින් දැනුම්දිය යුතුය.

වම් 1952ක් වූ ජනවාරි මස 25වෙනි දින කුරුණෑගල කමිටියේදීය.

හී. ජී. දයාරත්න,
ආණ්ඩුවේ උප ඒජන්තතුමා.

1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මීට යාකොට ඇති උප ලේඛනයේ විස්තර කර තිබෙන ඉඩම්, 1942 අංක 61 දරණ ඉඩම් නිදහස් කිරීමේ ආඥාපනතේ කටයුතු සඳහා ලබාගත යුතුයයි ඉඩම් කොමසාරිස්තුමා විසින් නිකුත්කර තිබෙන බැවින් (ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 62 වැනි වගන්තියෙන් සංශෝධනය වූ ඉඩම් නිදහස් කිරීමේ ආඥාපනතේ 3 (5) වැනි වගන්තිය 25 සමග කියවා තේරුම් ගත යුතු වූ) 1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 (1) යටතේ එකී ඉඩම් පොදු කටයුත්තක් වශයෙන් සැලකෙන කටයුත්තක් සඳහා අවශ්‍යව තිබෙන බවත්, එකී ආඥාපනත යටතේ අත්පත් කරගනු ලබන බවත්, කාමිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිවරයා වූ බිහිලි ශ්‍රේෂ්ඨ ජනාධිපති මම මෙයින් ප්‍රකාශ කරමි.

විමි 1952 ක්වූ ජනවාරි මස 28 වැනි දින කොළඹදීය.

බිහිලි සේනානායක, කාමිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිතුමා.

ඉඩම් කොමසාරිස්වරයාගේ කාර්යාල රීපරන්ස් නො. LRO/APL 3416. කාමිකම් හා ඉඩම් ඇමතියගේ රීපරන්ස් නො. J/AL 1963. මඩකලපු කවිචේරියේ රීපරන්ස් නො. L. D. 3325.

උප ලේඛනය

නො.	ඉඩමේ නම	විස්තර	පමුදු පලාතේ නොමිමරය A 993.	ගම්—මුල්කම්පිටි අයිතිකම්කියත්තා	ප්‍රමාණය, අ. රූ. ප.
1	මුනිසර්කාඩු නාවල් ආචාර්ය ආචාර්ය	කිත්දමුර් හිවිසන් 2 කේ පදිංචි මග සබ්බලොඩිබේ උමරුලොඩිබේ සහ මිග්ගෙඩු ලොඩිබේ අහමිදු ලොඩිබේ			0 0 8
2	එම	එම	එම	එම	3 0 26
3	එම	එම	එම	එම	0 0 38
4	එම	එම	එම	එම	8 1 7
5	එම	එම	එම	එම	0 0 13
එකතුව					3 3 12

L. A. 3259/J/AL/736.

1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 වැනි වගන්තිය යටතේ වූ ප්‍රකාශයයි

මීට යාකොට ඇති උප ලේඛනයේ විස්තර කර තිබෙන ඉඩම්, 1942 අංක 61 දරණ ඉඩම් නිදහස් කිරීමේ ආඥාපනතේ කටයුතු සඳහා ලබාගත යුතුයයි ඉඩම් කොමසාරිස්තුමා විසින් නිකුත්කර තිබෙන බැවින් (ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 62 වැනි වගන්තියෙන් සංශෝධනය වූ ඉඩම් නිදහස් කිරීමේ ආඥාපනතේ 3 (5) වැනි වගන්තිය සමග කියවා තේරුම් ගත යුතු වූ) 1950 අංක 9 දරණ ඉඩම් ලබාගැනීමේ ආඥාපනතේ 5 (1) යටතේ එකී ඉඩම් පොදු කටයුත්තක් වශයෙන් සැලකෙන කටයුත්තක් සඳහා අවශ්‍යව තිබෙන බවත්, එකී ආඥාපනත යටතේ අත්පත්කරගනු ලබන බවත්, කාමිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිවරයා වූ බිහිලි ශ්‍රේෂ්ඨ ජනාධිපති මම මෙයින් ප්‍රකාශ කරමි.

විමි 1951 ක්වූ නොවැම්බර් මස 16 වැනි දින කොළඹදීය.

බිහිලි සේනානායක, කාමිකම් හා ඉඩම් පිලිබඳ ඇමතිතුමා.

ඉඩම් කොමසාරිස්වරයාගේ කාර්යාල රීපරන්ස් නො. LRO/APL 3416. කාමිකම් හා ඉඩම් ඇමතියගේ රීපරන්ස් නො. J/AL 1963. මඩකලපු කවිචේරියේ රීපරන්ස් නො. L. D. 3325.

උප ලේඛනය

නො.	ඉඩමේ නම	විස්තර	මුල් පලාතේ නොමිමරය A 1,074.	ගම්—මුදුගොඩ අයිතිකම්කියත්තා	ප්‍රමාණය, අ. රූ. ප.
1	කැවකැලසෙවත්ත	අවුරුදු 30 කට වැඩි පොල් වත්ත	හේරත්මුදියාන්සේලාගේ අප්පුහාමි, මුදුගොඩ, කවිච්චන		0 1 20

Ref. No. L. D. 7357/LRO/APL/1319/J/AL 1730.

1950 අංක 9 දරණ ආණ්ඩුවේ ඉඩම් ගැනීමේ පනතේ 7 වැනි වගන්තිය යටතේ දැන්වීමයි

හම්බන්තොට දිසත්‍රිකයේ ආණ්ඩුවේ උප ඒජන්තා නැත්පත් ඒ. ඩී. ඇස්. ඇන්. පුල්ලොනාගම වන මම, 1950 අංක 9 දරණ ඉඩම් ආණ්ඩුව ගැනීමේ පනතේ 7 වැනි වගන්තිය යටතේ පහත සඳහන් කරුණු ගැන මෙයින් කල්දෙමි.

- (1) මෙහි සඳහන් උප ලේඛනයේ විස්තර කර තිබෙන ඉඩම්, ඉහතකී පනත යටතේ 1942 අංක 61 දරණ ඉඩම් නිදහස් කිරීමේ ආඥාපනතේ අවශ්‍යතාවයන් සඳහා ආණ්ඩුවට ගැනීමට අදහස්කරනු ලැබේ.
- (2) එසේ ගැනීමට අදහස්කරන ඉඩම් වෙනුවෙන් වත්දි ලබාගැනීම සඳහා මා වෙත අයිතිවාසිකම් ඉදිරිපත් කළ යුතුය.
- (3) එසේ ගත්ව ගත ඉඩම් ගැන අයිතිවාසිකම් ඇති සෑම කෙනෙක්ම—
- (අ) විමි 1952 ක්වූ අප්‍රේල් මස 2 වැනි දින පෙරවරු 9 ව ට බෙලිආත්ත නගර සභාවට පැමිණ මා ඉදිරියේ පුද්ගලිකව පෙනී සිටිය යුතුයි. නැතහොත් ලියවිල්ලකින් බලය දෙනලද නමුත් ඒජන්තා කෙනෙක් එසේ මා ඉදිරියට එවිය යුතුයි;
- (ආ) කවද, එසේ පෙනී සිටින ආනැත්තා විසින් විමි 1952 ක්වූ මාර්තු මස 26 වැනි දින හෝ ඊට ප්‍රථම හෝ ඉඩම් පිලිබඳ නව්‍යයේ අයිතිවාසිකම්වල සම්බන්ධ, වත්දි ඉල්ලා සිටීම පිලිබඳ විස්තර, ඉල්ලන වත්දියේ ප්‍රමාණය සහ එම ප්‍රමාණය ගණන් බැලූ පිලිවෙලෙහි විස්තර ගත මේවා මා වෙත ලියවිල්ලකින් දැනුම්දී සිටිය යුතුයි.

විමි 1952 ක්වූ පෙබරවාරි මස 2 වැනි දින හම්බන්තොට කවිචේරියේදීය.

ඒ. ඩී. ඇස්. ඇන්. පුල්ලොනාගම, හම්බන්තොට දිසත්‍රිකයේ ආණ්ඩුවේ උප ඒජන්තාතුමා.

උප ලේඛනය

නො.	ඉඩමේ නම	විස්තර	අභිලේඛන නො. 1 කේ සමබනි මුල් පලාතේ නොමිමර 262 හහ 263.	ගම්—ඉහල බෙලිගල්ල සහ පල්ලන්තර අයිතිකම්කියත්තා	ප්‍රමාණය, අ. රූ. ප.
129	සේරුගහගේන	අවුරුදු 20 ක්වූ පොල් වැවිල්ල	අර්. ඒ. බඩුසින් අප්පුහාමි, පල්ලන්තර, බෙලිආත්ත		2 0 6
131	ආරෙවත්ත	අවුරුදු 40 ක්වූ පොල් වැවිල්ල	එම		4 0 18
513	සේරුගහගේන	අවුරුදු 20 ක්වූ පොල් වැවිල්ල	එම		0 0 14
එකතුව					6 0 38

Reference No. L. D. 7348/LRO/APL/4949/J/AL 1311.

1950 අංක 9 දරණ ආණ්ඩුවේ ඉඩම් ගැනීමේ පනතේ 7 වැනි වගන්තිය යටතේ දැන්වීමයි

හම්බන්තොට දිසත්‍රිකයේ ආණ්ඩුවේ උප ඒජන්තා නැත්පත් ඒ. ඩී. ඇස්. ඇන්. පුල්ලොනාගම වන මම, 1950 අංක 9 දරණ ඉඩම් ආණ්ඩුව ගැනීමේ පනතේ 7 වැනි වගන්තිය යටතේ පහත සඳහන් කරුණු ගැන මෙයින් කල්දෙමි.

- (1) මෙහි සඳහන් උප ලේඛනයේ විස්තර කර තිබෙන ඉඩම්, ඉහතකී පනත යටතේ, 1942 අංක 61 දරණ ඉඩම් නිදහස් කිරීමේ ආඥාපනතේ අවශ්‍යතාවයන් සඳහා ආණ්ඩුවට ගැනීමට අදහස්කරනු ලැබේ.
- (2) එසේ ගැනීමට අදහස්කරන ඉඩම් වෙනුවෙන් වත්දි ලබාගැනීම සඳහා මා වෙත අයිතිවාසිකම් ඉදිරිපත් කළ යුතුය.
- (3) එසේ ගත්ව ගත ඉඩම් ගැන අයිතිවාසිකම් ඇති සෑම කෙනෙක්ම—
- (අ) විමි 1952 ක්වූ අප්‍රේල් මස 2 වැනි දින පෙරවරු 9 ව ට බෙලිආත්ත නගර සභා සභාවට පැමිණ මා ඉදිරියේ පුද්ගලිකව පෙනී සිටිය යුතුයි. නැතහොත් ලියවිල්ලකින් බලය දෙනලද නමුත් ඒජන්තා කෙනෙක් එසේ මා ඉදිරියට එවිය යුතුයි;

(ආ) කවද එසේ පෙනීසිටින තැනැත්තා විසින් වම් 1952ක්වූ මාර්තු මස 26වෙනි දින හෝ ඊට ප්‍රථම හෝ ඉඩම් පිළිබඳ කමාගේ අයිතිවාසිකම්වල ස්වභාව, වන්දි ඉල්ලා සිටීම පිළිබඳ විස්තර, ඉල්ලන වන්දියේ ප්‍රමාණය සහ එම ප්‍රමාණය ගණන් බැඳු පිළිවෙලෙහි විස්තර යන මේවා මා වෙත ලියවිල්ලකින් දැනුම්දී සිටිය යුතුයි.

වම් 1952ක්වූ ජනවාරි මස 2වෙනි දින හමිබත්තොට කවිචේරියේදීය.

ඒ. බී. ඇස්. ඇන්. පුල්ලොනායගම, හමිබත්තොට දිස්ත්‍රික්කයේ අණුවිලි උප ඒජන්තතුමා.

උපලේඛනය

නො.	ඉඩමේ නම	විස්තර	අයිතිකම්කරුන්ගේ නම	ප්‍රමාණය, අ. රූ. ප.
770	දෙල්ගහවත්ත	අවුරුදු 45ක්වූ පොල්ගහකින්ද, අවුරුදු 20ක්වූ පොල් ගස් 10කින්ද සහ පුවත්ත 7කින්ද යුක්තවේ	බෙලිඅත්ත සම මූලාදායියා බාණේ හෙවිච්චේවාගේ පොම් නෝනා, බෙලිඅත්ත එම	0 0 4
771	දෙල්ගහවත්ත සහ කෝන්දරම්ගෙවත	අවුරුදු 20ක්වූ පොල් ගස් 3කින්ද (දෙල්ගස් 2කින්ද සහ අවුරුදු 10ක්වූ පුවත්ත 6කින්ද යුක්තවේ)	එම	0 0 5
772	එම	අවුරුදු 40ක්වූ පොල්ගස් 4කින්ද, අවුරුදු 15ක්වූ පැහිරකින්ද, අවුරුදු 40ක්වූ කොස්ගහකින්ද සහ මැටියෙන් සාදනලද උච්ච ගෙයකින්ද, වඳවීගිය කින්ද, වඳවීගියෙන් සාදනලද මැසිනිලියකින්ද සහ පොල්අතු මඩුවකින්ද යුක්තවේ	එම	3 1 9
එකතුව				3 1 18

LD.—B 49/50

L D. 7351/LRO/APL/808/J/AL/1656.

1950හේ අංක 9 දරණ අණුවිලි ඉඩම් ගැනීමේ පනතේ 7වෙනි වගන්තිය යටතේ දැන්වීමයි

දකුණු පළාතේ හමිබත්තොට දිස්ත්‍රික්කයේ අණුවිලි උප ඒජන්ත තැන්පත් ඇලන් බෙයිල් සැමුවෙල් හේසරුප් පුල්ලොනායගම වන මම, 1950 අංක 9 දරණ ඉඩම් අණුවිලි ගැනීමේ පනතේ 7වෙනි වගන්තිය යටතේ පහත සඳහන් කරුණු ගැන මෙයින් කල්දෙමි.

- (1) මෙහි සඳහන් උප ලේඛනයේ විස්තර කර තිබෙන ඉඩම් ඉහත සඳහන් පනත යටතේ, 1942 අංක 61 දරණ ඉඩම් නිදහස් කිරීමේ ආඥාපනතේ අවශ්‍යතාවන් සඳහා අණුවිලි ගැනීමට අදහස්කරනු ලැබේ.
- (2) එසේ ගැනීමට අදහස්කරන ඉඩම් වෙනුවෙන් වන්දි ලබාගැනීම සඳහා මා වෙත අයිතිවාසිකම් ඉදිරිපත් කළ යුතුය.
- (3) එසේ ගත්ව යන ඉඩම් ගැන අයිතිවාසිකම් ඇති සෑම කෙනෙක්ම—
- (අ) වම් 1952ක්වූ අප්‍රේල් මස 2 වෙනි දින ප්‍රථමයෙන් 10ට බෙලිඅත්ත නගර සභා ශාලාවට පැමිණ මා ඉදිරියේ පුද්ගලිකව පෙනී සිටිය යුතුයි. නැතහොත් ලියවිල්ලකින් බලය දෙනලද කමන්ගේ ඒජන්ත කෙනෙක් එසේ මා ඉදිරියට එවිය යුතුයි.
- (ආ) කවද එසේ පෙනීසිටින තැනැත්තා විසින් 1952ක්වූ මාර්තු මස 26වෙනි දින හෝ ඊට ප්‍රථම හෝ ඉඩම් පිළිබඳ කමාගේ අයිතිවාසිකම්වල ස්වභාව, වන්දි ඉල්ලා සිටීම පිළිබඳ විස්තර, ඉල්ලන වන්දියේ ප්‍රමාණය සහ එම ප්‍රමාණය ගණන් බැඳු පිළිවෙලෙහි විස්තර යන මේවා මා වෙත ලියවිල්ලකින් දැනුම්දී සිටිය යුතුයි.

වම් 1952ක්වූ ජනවාරි මස 29වෙනි දින හමිබත්තොට කවිචේරියේදීය.

ඒ. බී. ඇස්. ඇන්. පුල්ලොනායගම, හමිබත්තොට දිස්ත්‍රික්කයේ අණුවිලි උප ඒජන්තතුමා.

උපලේඛනය

අතිරේක නො. 11 දරන අවසාන ගම්බද සිතියමේ නො. 290. ගම—නලගම

නො.	ඉඩමේ නම	විස්තර	අයිතිකම්කරුන්ගේ නම	ප්‍රමාණය, අ. රූ. ප.
521	කනිනාහෙපරනවත්ත, මහපරන වත්ත, මයිලගහකොරවුම්	අවුරුදු 40ක්වූ පොල්, කොස් සහ පුවත් වැවිල්ල සහ වර්ච්චි ගෙයකින් යුක්තවේ	කේ. එච්. සයිමන් සිල්වා	7 1 30.5
522	දඩකිරිල්ලගහගේන	අවුරුදු 40ක්වූ පොල් වැවිල්ලකින් යුක්තවේ	එම	0 0 10
523	මහපරනවත්ත	අවුරුදු 40ක්වූ පැහිරි වැවිල්ලකින් යුක්තවේ	එම	0 3 8
524	කනිනාහෙපරනවත්ත, මහපරන වත්ත, මයිලගහකොරවුම්	වහාගොනාලු ඉඩමකි	එම	0 0 4
එකතුව				8 1 12.5

L. D.—B 49/50.

L. D. 7353/LRO/APL/4180/J/AL 1754.

1950හේ අංක 9 දරණ අණුවිලි ඉඩම් ගැනීමේ පනතේ 7වෙනි වගන්තිය යටතේ දැන්වීමයි

දකුණු පළාතේ හමිබත්තොට දිස්ත්‍රික්කයේ අණුවිලි උප ඒජන්ත තැන්පත් ඇලන් බෙයිල් සැමුවෙල් හේසරුප් පුල්ලොනායගම වන මම, 1950 අංක 9 දරණ ඉඩම් අණුවිලි ගැනීමේ පනතේ 7වෙනි වගන්තිය යටතේ පහත සඳහන් කරුණු ගැන මෙයින් කල්දෙමි.

- (1) මෙහි සඳහන් උප ලේඛනයේ විස්තර කර තිබෙන ඉඩම්, ඉහත සඳහන් පනත යටතේ, 1942 අංක 61 දරණ ඉඩම් නිදහස් කිරීමේ ආඥාපනතේ අවශ්‍යතාවන් සඳහා අණුවිලි ගැනීමට අදහස්කරනු ලැබේ.
- (2) එසේ ගැනීමට අදහස්කරන ඉඩම් වෙනුවෙන් වන්දි ලබාගැනීම සඳහා මා වෙත අයිතිවාසිකම් ඉදිරිපත් කළ යුතුය.
- (3) එසේ ගත්ව යන ඉඩම් ගැන අයිතිවාසිකම් ඇති සෑම කෙනෙක්ම—
- (අ) 1952ක්වූ අප්‍රේල් මස 2වෙනි දින ප්‍රථමයෙන් 11.30ට විරකැටිය ගම්පහා ශාලාවට පැමිණ මා ඉදිරියේ පුද්ගලිකව පෙනී සිටිය යුතුයි. නැතහොත් ලියවිල්ලකින් බලය දෙනලද කමන්ගේ ඒජන්ත කෙනෙක් එසේ මා ඉදිරියට එවිය යුතුයි;
- (ආ) කවද එසේ පෙනී සිටින තැනැත්තා විසින් 1952ක්වූ මාර්තු මස 26වෙනි දින හෝ ඊට ප්‍රථම හෝ ඉඩම් පිළිබඳ කමාගේ අයිතිවාසිකම්වල ස්වභාව, වන්දි ඉල්ලා සිටීම පිළිබඳ විස්තර, ඉල්ලන වන්දියේ ප්‍රමාණය සහ එම ප්‍රමාණය ගණන් බැඳු පිළිවෙලෙහි විස්තර යන මේවා මා වෙත ලියවිල්ලකින් දැනුම්දී සිටිය යුතුයි.

වම් 1952ක්වූ ජනවාරි මස 29වෙනි දින හමිබත්තොට කවිචේරියේදීය.

ඒ. බී. ඇස්. ඇන්. පුල්ලොනායගම, හමිබත්තොට දිස්ත්‍රික්කයේ අණුවිලි උප ඒජන්තතුමා.

උපලේඛනය

අතිරේක නො. 3, අවසාන ගම්බද සිතියමේ නො. 248. ගම—පින්වුන්න

නො.	ඉඩමේ නම	විස්තර	අයිතිකම්කරුන්ගේ නම	ප්‍රමාණය, අ. රූ. ප.
142	අන්දරගේන	අවුරුදු 25ක්වූ පොල් මැවිල්ල, කවුමැටියෙන් සාදනලද කාවකාලික ගෙයකින් සහ කාම් කාලික පොල්අතු මඩුවකින්ද යුක්තවේ	ඇම්. ඇස්. රත්නායක, මත්ඛාඩුව, විරකැටිය, (නානායකන්කාර බඩුණුසින් විනානගමගේ දෙයන් දමින් කාවකාලික හෙවල් දෙකට අයිතිකම් කියනු ලැබේ)	3 0 16

அரசாட்சியாரின் தேள்வைக்காயி காணி விளம்பரங்கள்

1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டம் 5 ம் பிரிவின்படியான பிரகடனம்.

கீழ்க்காணும் காணி ஒரு பகிரங்க தேள்வைக்கு வேண்டியதாயிருக்கின்றதென்றும், 1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டத்தின் ஏற்பாடுகளின் பிரகாரம் அது எடுத்துக்கொள்ளப்படும் என்றும் அச்சட்டத்தின் 5 ம் பிரிவின் (1) ம் உட்பிரிவின் பிரகாரம் காணி, விவசாய மந்திரி டடலி ஷெலரன் சேனனாயக்க ஆகிய நான் இத்தால் பிரகடனம் செய்கின்றேன்.

கொழும்பு,
1952 ம் 19 (ஜனவரி) தைமீ 7 ந வ.

டடலி சேனனாயக்க,
காணி, விவசாய மந்திரி.

மாதாண் அதிபர் இலக்கம் : Q. 3941/J/AL/1141.

காணியின் விபரம்.

(1) கொழும்பு டிஸ்திரிக் சியான் கோற்றை கிழக்கு, நடவான் என்னும் கிராமத்திலிருக்கும் 06 ஏக்கர் விசாலமுள்ள ஹத்பெருமா என்னும் காணியின் ஒரு பகுதி டிவிஷனல் நீர்ப்பாய்ச்சல் அதிகாரியின் பட்டத்தில் (6 4.51) துண்டு 1 என்று விரிவாக விவரிக்கப்பட்டிருக்கிறது. எல்லைகள் :—

வடக்கு : திரு. டி. ஏ. செனறட்டினவுக்கு சொந்தமான ஹத்பெருமா என்னும் நெல்வயல,
கிழக்கு : பூகொடலூயா,
தெற்கு : திரு. கே. ஜே. அமரசேகராவுக்கு சொந்தமான ஹத்பெருமா என்னும் நெல்வயல.

(2) கொழும்பு டிஸ்திரிக் சியான் கோற்றை கிழக்கு நடவான் என்னும் கிராமத்திலிருக்கும் 14 ஏக்கர் விசாலமுள்ள ஹத்பெருமா என்னும் காணியின் ஒரு பகுதி டிவிஷனல் நீர்ப்பாய்ச்சல் அதிகாரியின் பட்டத்தில் (6.4.51) துண்டு 2 என்று விரிவாக விவரிக்கப்பட்டிருக்கிறது. எல்லைகள் பின்வருமாறு :—

வடக்கு : பூகொடலூயா,
கிழக்கு : பூகொடலூயா,
தெற்கு : கே. ஜே. அமரசேகராவுக்கு சொந்தமான நெல்வயல,
மேற்கு : கே. ஜே. அமரசேகராவுக்கு சொந்தமான நெல்வயல.

(3) கொழும்பு டிஸ்திரிக் சியான் கோற்றை கிழக்கு, நடவான் என்னும் கிராமத்திலிருக்கும் 10 ஏக்கர் விசாலமுள்ள பஹலஹத்பெருமா என்னும் காணியின் ஒரு பகுதி டிவிஷனல் நீர்ப்பாய்ச்சல் அதிகாரியின் பட்டத்தில் (6.4.51) துண்டு 3 என்று விரிவாக விவரிக்கப்பட்டிருக்கிறது. எல்லைகள் பின்வருமாறு :—

வடக்கு : பூகொடலூயா,
கிழக்கு : பூகொடலூயா,
தெற்கு : கே. ஜே. அமரசேகராவுக்கு சொந்தமான நெல்வயல,
மேற்கு : கே. ஜே. அமரசேகராவுக்கு சொந்தமான நெல்வயல.

(4) கொழும்பு டிஸ்திரிக் சியான் கோற்றை கிழக்கு, நடவான் என்னும் கிராமத்திலிருக்கும் 29 ஏக்கர் விசாலமுள்ள பஹலஹத்பெருமா என்னும் காணியின் ஒரு பகுதி டிவிஷனல் நீர்ப்பாய்ச்சல் அதிகாரியின் பட்டத்தில் (6.4.51) துண்டு 4 என்று விரிவாக விவரிக்கப்பட்டிருக்கிறது. எல்லைகள் பின்வருமாறு :—

வடக்கு : திரு. டி. ஏ. செனறட்டினவுக்கு சொந்தமான ஹத்பெருமா என்னும் காணி,
கிழக்கு : கே. ஜே. அமரசேகராவுக்கு சொந்தமான பஹலஹத்பெருமா என்னும் காணி,
மேற்கு : டி. டி. யோனிலி செனறட்டினவுக்கு சொந்தமான காணி.

(5) கொழும்பு டிஸ்திரிக் சியான் கோற்றை கிழக்கு, நடவாதன் என்னும் கிராமத்திலிருக்கும் 29 ஏக்கர் விசாலமுள்ள இம்புலோவித்த என்னும் காணியின் ஒரு பகுதி டிவிஷனல் நீர்ப்பாய்ச்சல் அதிகாரியின் பட்டத்தில் (6.4.51) துண்டு 5 என்று விரிவாக விவரிக்கப்பட்டிருக்கிறது. எல்லைகள் பின்வருமாறு :—

வடக்கு : பாணசாலவத்த என்னும் காணி,
கிழக்கு : பாணசாலவத்த என்னும் காணி,
தெற்கு : பி. டி. யூ. டி. ரேட்டே,
மேற்கு : முதலியாரா, டி. ஜே. செனறட்டினவுக்கு சொந்தமான இம்புலோவிட்ட.

(6) கொழும்பு டிஸ்திரிக் சியான் கோற்றை கிழக்கு, நடவாதன் என்னும் கிராமத்திலிருக்கும் 06 ஏக்கர் விசாலமுள்ள நிண்டாவல் என்னும் காணியின் ஒரு பகுதி டிவிஷனல் நீர்ப்பாய்ச்சல் அதிகாரியின் பட்டத்தில் (6.4.51) துண்டு 6 என்று விரிவாக விவரிக்கப்பட்டிருக்கிறது. எல்லைகள் பின்வருமாறு :—

வடக்கு : பி. டி. யூ. டி. ரேட்டே,
கிழக்கு : காணலாயக்கால்,
தெற்கு : பூகொடலூயா,
மேற்கு : திரு. எஸ். டி. ஜே. டி. யூ. ஜெயசேகரா பண்டாராவுக்கு சொந்தமான நிண்டாவல் என்னும் காணி.

(7) கொழும்பு டிஸ்திரிக் சியான் கோற்றை கிழக்கு, நடவாதன் என்னும் கிராமத்திலிருக்கும் 15 ஏக்கர் விசாலமுள்ள பாணசாலபெருமபுற என்னும் காணியின் ஒரு பகுதி டிவிஷனல் நீர்ப்பாய்ச்சல் அதிகாரியின் பட்டத்தில் (6.4.51) துண்டு 7 என்று விரிவாக விவரிக்கப்பட்டிருக்கிறது. எல்லைகள் பின்வருமாறு :—

வடக்கு : பாணசாலவத்த என்னும் காணியின் பகுதி,
கிழக்கு : பூகொடலூயா,
தெற்கு : பூகொடலூயா,
மேற்கு : திரு. டி. ஏ. செனறட்டினவுக்கு சொந்தமான ஹத்பெருமா.

(8) கொழும்பு டிஸ்திரிக் சியான் கோற்றை கிழக்கு, நடவாதன் என்னும் கிராமத்திலிருக்கும் 16 ஏக்கர் விசாலமுள்ள பாணசாலவத்த என்னும் காணியின் ஒரு பகுதி டிவிஷனல் நீர்ப்பாய்ச்சல் அதிகாரியின் பட்டத்தில் (6.4.51) துண்டு 8 என்று விரிவாக விவரிக்கப்பட்டிருக்கிறது. எல்லைகள் பின்வருமாறு :—

வடக்கு : பூகொடலூயா,
மேற்கு : பூகொடலூயா,
கிழக்கு : நீர்ப்பாய்ச்சல் வாயக்கால்,
தெற்கு : முதலியாரா டி. ஜே. செனறட்டினவுக்கு சொந்தமான இம்புலோவித்தா.

1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டம் 5 ம் பிரிவின்படியான பிரகடனம்.

L. P. 6388

கீழ்க்காணும் காணி ஒரு பகிரங்க தேள்வைக்கு வேண்டியதாயிருக்கின்றதென்றும் 1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டத்தின் ஏற்பாடுகளின் பிரகாரம் அது எடுத்துக்கொள்ளப்படும் என்றும் அச்சட்டத்தின் 5 ம் பிரிவின் (1) ம் உட்பிரிவின் பிரகாரம் காணி, விவசாய மந்திரி டடலி ஷெலரன் சேனனாயக்க ஆகிய நான் இத்தால் பிரகடனம் செய்கின்றேன்.

கொழும்பு,
1952 ம் 19 (ஜனவரி) தைமீ 15 ந வ.

டடலி சேனனாயக்க,
காணி, விவசாய மந்திரி.

மாகாண் அல்லது டிஸ்திரிக் எஞ்சனரின் இலக்கம் : L. P. 6388.

காணி, விவசாய மந்திரி காரியாலையத்தின் இலக்கம் : J/E/1127.

காணியின் விபரம்

காலி-டிஸ்திரிக்ஸில் வெல்லப்பொட பதவில ஹிக்கடுவ கிழக்கிலுள்ள குறிச்சியில் 19 ஏக்கர் 1 ரூட 33 போச்சல் விசாலமுள்ள கொடுவல் என்னும் இருபது துண்டுகள். இன்னும் ஆரம்பப்பட இல. 2,642 ல் (அரசாங்க) துண்டுகள் 1444—1458, ஆரம்பப்பட இல. 13,658 ல் துண்டுகள் 1, 2, 3, ஆரம்பப்பட இல. 14,222 ல் துண்டுகள் 1, 2 ல் விபரமாய் காட்டியுள்ளன.

1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டம் 5 ம் பிரிவின்படியான பிரகடனம்.

LP 6321

கீழ்க்காணும் காணி ஒரு பகிரங்க தேவைக்கு வேண்டியதாயிருக்கின்றதென்றும் 1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டத்தின் ஏற்பாடுகளின் பிரகாரம் அது எடுத்துக்கொள்ளப்படும் என்றும் அச்சட்டத்தின் 5 ம் பிரிவின (1) ம் உட்பிரிவின பிரகாரம் காணி, விவசாய மந்திரி டடலி ஷெல்லரன் சேனனாயக்க ஆகிய நான இத்தால் பிரகடனம் செய்கின்றேன்.

கொழும்பு,

1952 ம் (ஔ) (ஜனவரி) தைமீ 17 ந ட.

மாகாண அல்லது டிஸ்திரிக் ஏசனடுவின் இலக்கம் : LP 6321,
காணி, விவசாய மந்திரி காரியாலயத்தின் இலக்கம் : J/HLG/331

காணியின் விபரம்

எட்டிலிகொட, மாயிடிபே வீ. சீ. பாதையை திருப்தி செய்வதென்பொருட்டு, காலி-டிஸ்திரிக்கில் போகிறவட்டில் எட்டிலிகொட-மாயிடிபே எனலும் இடத்தில் 20 போச்சல 10 போச்சல விசாலமுள்ள தெல்கஹவடாவின்னும் ஹிங்குறுகொடவடாவிலிருந்து இரண்டு துண்டுகள்.

டடலி சேனனாயக்க,
காணி, விவசாய மந்திரி.

1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டம், 5 ம் பிரிவின்படியான பிரகடனம்

LA 7439/J/LSS/1624

கீழ்க்காணும் காணி ஒரு பகிரங்க தேவைக்கு வேண்டியதாயிருக்கின்றதென்றும், 1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டத்தின் ஏற்பாடுகளின் பிரகாரம் அது எடுத்துக்கொள்ளப்படும் என்றும் அச்சட்டத்தின் 5 ம் பிரிவின (1) ம் உட்பிரிவின பிரகாரம் காணி, விவசாய மந்திரி டடலி ஷெல்லரன் சேனனாயக்க ஆகிய நான இத்தால் பிரகடனம் செய்கின்றேன்.

கொழும்பு,

1952 ம் (ஔ) (ஜனவரி) தைமீ 23 ந ட.

மாகாண அல்லது டிஸ்திரிக் ஏசனடுவின் இலக்கம் :
காணி, விவசாய மந்திரி காரியாலயத்தின் இலக்கம் : J/LSS 1624.

காணியின் விபரம்.

குருணாகல் டிஸ்திரிக், வேவுடவில்லி அட்பத்த, குருணாகல் முனிசிபல் எல்லைக்குள் லேக ஸைட எஸ்டேட் இராமன் துண்டு எனலும் காணி ஏறக்குறைய 25 ஏக்கர் 12½ பொச்சல விசாலமுள்ள எல்லைகள் 215A ம் சொந்த நில அளவு பட்டத்தில் (20 5.42) 11 ம் துண்டாக அழந்து காட்டப்பட்டுள்ளது. எல்லைகள்—

வடக்கு : 12 ம் துண்டு, T. P 138,370 ல பாகம்.

கிழக்கு : லேக ஸைட எஸ்டேட் E. C. ஜொபகைக்கும், ஈ. எப். டனியலைக்கும் உரிமை.

தெற்கு : குளத்து சேக்குலா ரோட்டு.

மேற்கு : 11A ம் துண்டு, கே. எம். பி. எல். முதலாமன் செட்டியாக்கும், பலனியப்ப செட்டியாக்கும் உரிமை.

டடலி சேனனாயக்க,
காணி, விவசாய மந்திரி.

1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டம், 5 ம் பிரிவின்படியான பிரகடனம்

கீழ்க்காணும் காணி ஒரு பகிரங்க தேவைக்கு வேண்டியதாயிருக்கின்றதென்றும் 1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டத்தின் ஏற்பாடுகளின் பிரகாரம் அது எடுத்துக்கொள்ளப்படும் என்றும் அச்சட்டத்தின் 5 ம் பிரிவின (1) ம் உட்பிரிவின பிரகாரம் காணி, விவசாய மந்திரி டடலி ஷெல்லரன் சேனனாயக்க ஆகிய நான இத்தால் பிரகடனம் செய்கின்றேன்.

கொழும்பு,

1952 ம் (ஔ) (ஜனவரி) தைமீ 23 ந ட.

மாகாண அறிபா இலக்கம் : Q 3428/J/HLG/1577.

காணியின் விபரம்

கொழும்பு டிஸ்திரிக், சியான் கோறனை கிழக்கு நித்தம்புவா எனலும் கிராமத்திலிருக்கும் 2,000 சதுர அடி நீளமுள்ள தெல்கஹவத்த என்னும் காணியின் ஒரு பகுதி எல்லைகள் பின்வருமாறு :—

வடக்கு . டபிளயு. எம். கே. கரோலில் பொண்ணோவுக்குரிய காணி.

கிழக்கு . சோ. ஜே. பீ. ஓபயசேகராவுக்கு சொந்தமான காணி.

தெற்கு : நீர்கொழும்பு-றாவாவல் பீ. டபிளயு. டி. ரோட்டு.

மேற்கு : கொழும்பு-கண்டி. பீ. டபிளயு. டி. ரோட்டு.

டடலி சேனனாயக்க,
காணி, விவசாய மந்திரி.

1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டம் 5 ம் பிரிவின்படியான பிரகடனம்.

கீழ்க்காணும் காணியின் பகுதிகள் ஒரு பகிரங்க தேவைக்கு வேண்டியதாயிருக்கின்றதென்றும் 1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டத்தின் ஏற்பாடுகளின் பிரகாரம் அது எடுத்துக்கொள்ளப்படும் என்றும் அச்சட்டத்தின் 5 ம் பிரிவின (1) ம் உட்பிரிவின பிரகாரம் காணி, விவசாய மந்திரி டடலி ஷெல்லரன் சேனனாயக்க ஆகிய நான இத்தால் பிரகடனம் செய்கின்றேன்.

கொழும்பு,

1952 ம் (ஔ) (ஜனவரி) தைமீ 25 ந ட.

டிஸ்திரிக் ஏசனடுவின் இலக்கம் : L B 2030.
காணி, விவசாய மந்திரி காரியாலயத்தின் இலக்கம் : J/E/1500

காணியின் விபரம்.

மாததறைப் பிரிவு, கங்கப்பொடத்து, நைம்பல் என்ற கிராமத்தில் போகிறவத்த, பொருளேவத்த, பட்டினிகேவத்த என்ற காணிகளிலிருந்து 1½ ஏக்கர் நிலம். கீழ்வரும் எல்லைக்குட்பட்டன :—

(1) போகிறவத்த :—

வடக்கு . பொருளேவத்த ;

கிழக்கு : பீ. டபிளயு. டி. தெரு, கொட்டம்பஹர்க்கொற்றட்டுவ ;

தெற்கு : கோனகஹவிதறனகே வத்த, போகிறவத்த ;

மேற்கு : மலிம்படகேவத்த.

(2) பொருளேவத்த, பட்டினிகேவத்த :—

வடக்கு : புப்பமுலகுமபுற, பலவத்த ;

கிழக்கு : பொருளேவத்த ;

தெற்கு : போகிறவத்த ;

மேற்கு : மலிம்படகேவத்த, அலுவத்த.

டடலி ஷெல்லரன் சேனனாயக்க,
காணி, விவசாய மந்திரி.

1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டம் 5 ம் பிரிவின்படியான பிரகடனம்.

கீழ்க்காணும் காணி ஒரு பகிரங்க தேவைக்கு வேண்டியதாயிருக்கின்றதென்றும் 1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டத்தின் ஏற்பாடுகளின் பிரகாரம் அது எடுத்துக்கொள்ளப்படும் என்றும் அச்சட்டத்தின் 5 ம் பிரிவின (1) ம் உட்பிரிவின பிரகாரம் காணி, விவசாய மந்திரி டடலி ஷெல்லரன் சேனனாயக்க ஆகிய நான இத்தால் பிரகடனம் செய்கின்றேன்

கொழும்பு,

1952 ம் (ஔ) (ஜனவரி) தைமீ 25 ந ட.

டிஸ்திரிக் ஏசனடுவின் இலக்கம் : L D 7356.
காணி, விவசாய மந்திரி காரியாலயத்தின் இலக்கம் : J/HA/1801.

டடலி ஷெல்லரன் சேனனாயக்க,
காணி, விவசாய மந்திரி.

காணியின் விபரம்.

அம்பாந்தோட்டைப் பிரிவு, மேற்கிறுவாப்பத்தில, தங்காலை நகர சபை எல்லைக்குள் இருக்கும் 1 ஏக்கர் விசாலமுள்ள கீடனகஹுவத்தை எனும் காணி இதன் எல்லைகளாவன :—

வடக்கு : எக்கநாயக்கவல்லவத்தை ;
கிழக்கு : திரு. எல். லீ. போலியரின் காணி ;
தெற்கு : நகர சபையின் கடுறுபொகளுவீதி ;
மேற்கு : நகர சபையின் சுற்றுத் தெரு.

1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டம் 5 ம் பிரிவின்படியான பிரகடனம்,

கீழ்க்காணும் காணித் துறைகளுள் ஒரு பகிரங்க தேவைக்கு வேண்டியதாயிருக்கின்றதென்றும் 1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டத்தின் ஏற்பாடுகளின் பிரகாரம் அவைகள் எடுத்துக்கொள்ளப்படும் என்றும் அச்சட்டத்தின் 5 ம் பிரிவின் (1) ம் உட்பிரிவின் பிரகாரம், காணி, விவசாய மந்திரி டீ. லி. ஷெல்லர்ன் சேனனாயக்க ஆகிய நான இத்தால் பிரகடனம் செய்கின்றேன்.

கொழும்பு,
1952 ம் ஆண்டு (ஜனவரி) தைமீ 25 ந் உ.

டீ. லி. ஷெல்லர்ன் சேனனாயக்க,
காணி, விவசாய மந்திரி.

டிஸ்திரிக் ஏசன்கேரின் இலக்கம் : L D 7355.

காணி, விவசாய மந்திரி காரியாலையத்தின் இலக்கம் : J/AL/1781.

காணிகளின் விபரங்கள்.

(1) அம்பாந்தோட்டைப் பிரிவின், கீழ்கிறுவாப்பத்தில கொள்கதது அரு கிராமத்திலுள்ள 35 போச்சல் விசாலமுள்ள காணி. இதன் எல்லைகளாவன :—

வடக்கு, கிழக்கு, தெற்கு, மேற்கு : குளப்படுக்கையான முடிக்குரிய காணி.

(2) அம்பாந்தோட்டைப் பிரிவின் கீழ்கிறுவாப்பத்தில, கொள்கதது அரு கிராமத்திலுள்ள 1 ஏக்கர், 32 போச்சல் விசாலமுள்ள காணி. இதன் எல்லைகளாவன :—

வடக்கு : பத்தியபோலா ஆலயத்தின் பெரிய குருவின் காணி ;
கிழக்கு : டபிளபு. ஏ. கே. லீ. பியதாசாவின் காணி, பத்தியபோலா ;
தெற்கு : குளப்படுக்கையான முடிக்குரிய காணி ;
மேற்கு : பத்தியபோலா ஆலயத்தின் பெரிய குருவின் துறை, குளத்தின் படுக்கையான முடிக்குரியதுமான காணி.

(3) அம்பாந்தோட்டைப் பிரிவின் கீழ்கிறுவாப்பத்தில, கொள்கதது அரு கிராமத்திலுள்ள 1 றூட 14 போச்சல் விசாலமுள்ள காணி. இதன் எல்லைகளாவன :—

வடக்கு : பத்தியபோலா ஆலயத்தின் பெரிய குருவின் காணி ;
கிழக்கு : டபிளபு. ஏ. கே. லீ. பியதாசாவின் காணி, பத்தியபோலா ;
தெற்கு : லீ. எச். டபிளபு. பீ. அரனோலில் சிலவாவின் காணி, பத்தியபோலா ;
மேற்கு : குளப்படுக்கையான முடிக்குரிய காணி.

(4) அம்பாந்தோட்டைப் பிரிவின் கீழ்கிறுவாப்பத்தில கொள்கதது அரு கிராமத்திலுள்ள 2 றூட 30 போச்சல் விசாலமுள்ள காணி, இதன் எல்லைகளாவன :—

வடக்கு : டபிளபு. ஏ. கே. லீ. பியதாசாவின் காணி, பத்தியபோலா ;
கிழக்கு : லீ. எச். டபிளபு. பீ. அரனோலில் சிலவாவின் காணி, பத்தியபோலா ;
தெற்கு : முடிக்குரிய நிலம்,
மேற்கு : குளப்படுக்கையான முடிக்குரிய காணி.

1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டம் 5 ம் பிரிவின்படியான பிரகடனம்

கீழ்க்காணும் காணிப் பகுதிகளில் ஒரு பகிரங்க தேவைக்கு வேண்டியதாயிருக்கின்றதென்றும் 1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டத்தின் ஏற்பாடுகளின் பிரகாரம் அது எடுத்துக்கொள்ளப்படும் என்றும் அச்சட்டத்தின் 5 ம் பிரிவின் (1) ம் உட்பிரிவின் பிரகாரம் காணி, விவசாய மந்திரி டீ. லி. ஷெல்லர்ன் சேனனாயக்க ஆகிய நான இத்தால் பிரகடனம் செய்கின்றேன்.

கொழும்பு,
1952 ம் ஆண்டு (ஜனவரி) தைமீ 29 ந் உ.

டீ. லி. ஷெல்லர்ன் சேனனாயக்க,
காணி, விவசாய மந்திரி.

டிஸ்திரிக் ஏசன்கேரின் இலக்கம் : LB 2018.

காணி, விவசாய மந்திரி காரியாலையத்தின் இலக்கம் : J/TW/1323.

காணியின் விபரம்.

மாத்தறைப் பிரிவு, கண்டப்பொடத்த, ஹகமனவில் கமகேஜீவலகுமபுற, மினிதிவெலகுமபுற, டியகஹாவலகுமபுற, யகறமுடுகேமுலகுமபுற, பெலிகஹாகுமபுற என்ற காணிகளிலிருந்து எடுக்கப்பட்ட துண்டின் விசாலம் 1 றூட 30 போ. எல்லைகள் பின்வருமாறு :—

(1) கமகேஜீவலகுமபுற :—

வடக்கு : யகறமுடுகேமுலகுமபுற ;
தெற்கும் மேற்கும் : கமகேஜீவலகுமபுற ;
கிழக்கு : பெரிய தெரு.

(2) மினிதிவெலகுமபுற :—

வடக்கு : பெலிகஹாகுமபுற ;
தெற்கு, கிழக்கு : மினிதிவெலகுமபுற ;
மேற்கு : பெரிய தெரு.

(3) டியகஹாவலகுமபுற :—

வடக்கு, மேற்கு : டியகஹாவலகுமபுற ;
தெற்கு : யகறமுடுகேமுலகுமபுற ;
கிழக்கு : பெரிய தெரு.

(4) யகறமுடுகேமுலகுமபுற :—

வடக்கு : டியகஹாவலகுமபுற ;
தெற்கு : கமகேஜீவலகுமபுற ;
கிழக்கு : பெரிய தெரு ;
மேற்கு : யகறமுடுகேமுலகுமபுற.

(5) பெலிகஹாகுமபுற :—

வடக்கு, கிழக்கு : பெலிகஹாகுமபுற ;
தெற்கு : மினிதிவெலகுமபுற ;
மேற்கு : பெரிய தெரு.

1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டம் 5 ம் பிரிவின்படியான பிரகடனம்

கீழ்க்காணும் காணி ஒரு பகிரங்க தேவைக்கு வேண்டியதாயிருக்கின்றதென்றும், 1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டத்தின் ஏற்பாடுகளின் பிரகாரம் அது எடுத்துக்கொள்ளப்படும் என்றும் அச்சட்டத்தின் 5 ம் பிரிவின (1) ம் உட்பிரிவின் பிரகாரம் காணி, விவசாய மந்திரி டடலி ஷெலரன் சேனனாயக்க ஆகிய நான இத்தால் பிரகடனம் செய்கின்றேன்:—

கொழும்பு,

1952 ம் (நடு) (ஜனவரி) தைமீ 17 ந வ.

டிஸ்திரிக் ஏசனடுவின் இலக்கம் : L B 2055.

காணி, விவசாய மந்திரி காரியாலயத்தின் இலக்கம் : J/AL/1727.

டடலி சேனனாயக்க,
காணி, விவசாய மந்திரி.

காணியின் விபரம்.

தெனமாகாணம், மாத்தறைப் பிரிவு, வெலிகம கோறளை, சுல்தானகொட என்ற கிராமத்திலுள்ள யட்டிகிழும்புறபிட்டற, இறமுக்கேஹட்டற, இறமுக்கேஹட்டற என்ற நாலு காணிகளிலிருந்து நாலு துண்டு நிலம் மொத்தம் 0 ஏ 1 ரூ. 6 14 போச்சல விசாலமானவை. எல்லைகள்:—

(1) யட்டிகிழும்புற—

வடக்கு : கிராமச் சங்கத் தெரு-சுல்தானகொட,
தெற்கு : பிட்டதற,
மேற்கு-கிழக்கு : யட்டிகிழும்புற,

(2) பிட்டதற—

வடக்கு : யட்டிகிழும்புற,
தெற்கு-கிழக்கு : பிட்டதற,
மேற்கு : இறமுக்கேஹட்டற,

(3) இறமுக்கேஹட்டற—

வடக்கு : யட்டிகிழும்புற,
தெற்கு-கிழக்கு : பிட்டதற,
மேற்கு : இறமுக்கேஹட்டற.

(4) இறமுக்கேஹட்டற—

வடக்கு-தெற்கு-கிழக்கு : இறமுக்கேஹட்டற ;
மேற்கு : கிராமச் சங்கத்தெரு, கொடவில்ல.

1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டம், 5 ம் பிரிவின்படியான பிரகடனம்

கீழ்க்காணும் காணிப்பகுதிகள் ஒரு பகிரங்க தேவைக்கு வேண்டியதாயிருக்கின்றதென்றும் 1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டத்தின் ஏற்பாடுகளின் பிரகாரம் அது எடுத்துக்கொள்ளப்படும் என்றும் அச்சட்டத்தின் 5 ம் பிரிவின (1) ம் உட்பிரிவின் பிரகாரம் காணி, விவசாய மந்திரி டடலி ஷெலரன் சேனனாயக்க ஆகிய நான இத்தால் பிரகடனம் செய்கின்றேன்.

கொழும்பு,

1952 ம் (நடு) (ஜனவரி) தைமீ 25 ந வ.

டிஸ்திரிக் ஏசனடுவின் இலக்கம் : L B 2056.

காணி, விவசாய மந்திரி காரியாலயத்தின் இலக்கம் : J/AL/1737.

டடலி சேனனாயக்க,
காணி, விவசாய மந்திரி.

காணியின் விபரம்.

மாத்தறைப் பிரிவு, வெல்லைப்பொடபத்து, நாலு கிறவெட்டில் வெஹெறல் என்ற கிராமத்தில் எகொடதெனிய, தெஹிக்ஹதெனிய, பிளலியட்ட, வெல்காவவத்த என்ற நாலு காணிகளிலிருந்து நாலு துண்டுகளின் மொத்தம் விசால்ம் 0 ஏ. 2 ரூ. 8 போச்சல. கீழ்வரும் எல்லைகளுட்பட்டன.—

(1) எகொடதெனிய—

வடக்கு : பி. எல். ஜனடோனிஸ் முதலியோர் காணி ;
கிழக்கு-தெற்கு : சவாமி டபிளயு. தேவாமித்திர தேரே ;
மேற்கு : வாய்க்காலின் வலதுபக்கம்.

(2) தெஹிக்ஹதெனிய—

வடக்கு : கே. கிமற முதலியோர் காணி ;
கிழக்கு-தெற்கு-மேற்கு : எல். டபிளயு. லுசிஹாமியின் காணி ;

(3) பிளலியட்ட—

வடக்கு : பீ ஏல் ஜனடேறில் முதலியோர் காணி ;
தெற்கு : சவாமி தேவாமித்திர தேரே ;
கிழக்கு : டபிளயு லுசிஹாமி ;
மேற்கு : வலதுபக்கம்-வாய்க்காலின் காணி.

(4) வெல்காவவத்த—

வடக்கு-கிழக்கு : ஏ. கிமாராவின் காணி ;
தெற்கு-மேற்கு : எல். டபிளயு. லுசிஹாமி முதலியோர்.

1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டம் 5 ம் பிரிவின்படியான பிரகடனம்

கீழ்க்காணும் காணிப் பகுதிகள் ஒரு பகிரங்க தேவைக்கு வேண்டியதாயிருக்கின்றதென்றும் 1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டத்தின் ஏற்பாடுகளின் பிரகாரம் அது எடுத்துக்கொள்ளப்படும் என்றும் அச்சட்டத்தின் 5 ம் பிரிவின (1) ம் உட்பிரிவின் பிரகாரம் காணி, விவசாய மந்திரி டடலி ஷெலரன் சேனனாயக்க ஆகிய நான இத்தால் பிரகடனம் செய்கின்றேன்.

கொழும்பு,

1952 ம் (நடு) (ஜனவரி) தைமீ 25 ந வ.

டிஸ்திரிக் ஏசனடுவின் இலக்கம் : L B 2036.

காணி, விவசாய மந்திரி காரியாலயத்தின் இலக்கம் : J/E/1529.

டடலி ஷெலரன் சேனனாயக்க,
காணி, விவசாய மந்திரி.

காணியின் விபரம்

மாத்தறைப் பிரிவு, வெள்ளப்பொடபத்து, டிக்கவெல் வடக்கு, இஹலவத்த, டங்கஹவத்த, வடக்கேஹகொறட்டுவ என்ற காணிகளிலிருந்து 1 1/2 ஏக்கர் நிலம் எல்லைகள்:—

(1) இஹலவத்த-டங்கஹவத்த:—

வடக்கு : டங்கஹவத்த ;
கிழக்கு : இஹலவத்த ;
தெற்கு : கிராமச் சங்கத் தெரு ;
மேற்கு : வெட்டியேவத்த.

(2) வெடக்கேஹகொறட்டுவ —

வடக்கு : பாடசாலை ;
கிழக்கு : முலல்கேகொறட்டுவ ;
தெற்கு : கல்வரேகஹவத்த ;
மேற்கு : அழகொறட்டுவ.

1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டம், 5 ம் பிரிவின்படியான பிரகடனம்

கீழ்க்காணும் காணி ஒரு பகிரங்க தேவைக்கு வேண்டியதாயிருக்கின்றதென்றும் 1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டத்தின் ஏற்பாடுகளின் பிரகாரம் அது எடுத்துக்கொள்ளப்படும் என்றும் அச்சட்டத்தின் 5 ம் பிரிவின (1) ம் உட்பிரிவின பிரகாரம் காணி, விவசாய மந்திரி டீ.லி ஷெல்லர் சேனனாய்க்க ஆகிய நான இத்தால் பிரகடனம் செய்கின்றேன்

கொழும்பு,
1952 ம் ஆண்டு (ஜனவரி) தைமீ 17 ந் உ.

டீ.லி சேனனாய்க்க,
காணி விவசாய மந்திரி.

டிஸ்திரிக் ஏசனடுவின இலக்கம் : L B 2046.

காணி, விவசாய மந்திரி காரியாலயத்தின் இலக்கம் : J/AL/1615.

காணியின் விபரம்

மாததறைப் பிரிவு, வெலிகம கோற்றை-பறவே என்ற கிராமத்தில் டிகற மாஹகும்புற என்ற காணியில் 09 0 று 21.3 போச்சல நிலம். எல்லைகள்— வடக்கு, தெற்கு, மேற்கு, கிழக்கு டிகறமஹாகும்புற.

பொதுஜன கக்கூசுக்கு என்னும் பகிரங்க தேவைக்கு வேண்டியதான பின்னாச சொல்லப்படும் காணியை, அஃதாவது —

பிரதமபட்டத்து இல A 2405. குறிச்சி—மதுகாமம் இத்தக்கொபத்துவா, கருத்தறை டிஸ்திரிக்.

விசாலம்.

துண்டு. காணியினது பெயர்.

விபரம்

உரித்தாளியின் பெயர்

ஏ. று. ப.

1 தெலகாக்குறுந்துவத்தை 1 றப்பா மரம், 30 வருடம், 2 பாகு 2-3 போதி சிலவா கினிகே “ரெபினகூட்” கருத்தறை 0 0 8 வருடமுள்ள

எடுத்துக்கொள்வதற்கான எத்தனகு செய்யும்படி காணி எடுத்துக்கொள்வதைப்பற்றிய சட்டத்தினது (203 ம் அதிகாரம்) 5 ம் பிரிவின ஏற்பாடுகளின் பிரகாரம் நில, விவசாய மந்திரியவாகள எனக்குக் கற்பனைசெய்திருப்பதனால் அக்காணியை ஆட்சி ஒப்புக்கொள்ள அரசாட்சியார் எண்ணியிருக்கிறார் என்பதை 6 ம் பிரிவினப்படி வேண்டிய பிரகாரம் நான இத்தனைக்கொண்டு பிரசுத்தலாய விளம்பரஞ்செய்கின்றேன்.

மேற்குறித்த காணிக்கு உரித்துப்பேசுகின்ற சகலரும் தாமாக அல்லது அவரவருடைய காரியகாராமூலமாய 1952 ம் ஆண்டு (மாச) பங்குனி மாதம் 10 ந் தேதியிலன்று காலை 10 மணிகு கருத்தறை கச்சேரியில் என்முன்பாக வெளிப்படுத்த தத்தமக்கு அக்காணியினுள்ள உடநதைகளின் தன்மையையும் அவ்வடநதைகளுக்காய்த தாம தாதிக்கும் உரித்துகளின் தொகையையும் விபரங்களையும் சொல்லும்படி இத்தலை அவர்களிடத்திற் கேட்டுக்கொள்ளப் படுகின்றது.

கருத்தறை கச்சேரி,

1952 ம் ஆண்டு (ஜனவரி) தைமீ 30 ந் உ.

ஆர். டீ. பெளலல்,
உதவி அரசாட்சி ஏசனடு.

1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டம் 7 ம் பிரிவின்படியான அறிவித்தல்.

L 3049

ஒரு பகிரங்க தேவைக்கு வேண்டியதான கீழ்க்காணும் காணியை எடுத்துக்கொள்ள அரசாட்சியார் எண்ணியிருக்கிறார் என்பதை 1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டத்தின் 7 ம் பிரிவின (1) ம் உட்பிரிவின பிரகாரம் நான இத்தால் அறிவிக்கின்றேன்.

எடுத்துக்கொள்ளவிருக்கும் காணியின் விபரம் —

மாததறை டிஸ்திரிக்கின, ரத்தொட்ட பட்டணை சங்கத்திக்குட்பட்ட 2 ம் குறிச்சியில் வரி நம்பா 77 ம் காணியில் ஒரு பகுதியாகவும் ஆரம்பப்படும் A 1,699 தில் முதலாம் துண்டாக அளந்து விவரிக்கப்பட்டுள்ள 1 ஏக்கர், 0 றுட, 4 8 பாச்சல விலாங்கொண்ட காணித்துண்டில் ரத்தொட்டலக்கல் டீ. டிபியு. டி. ரேட்டுக்காக விடப்பட்ட 630 சதுர அடி நீக்கி, மிஞ்சின காணித்துண்டு இத்த உரித்தாளிகே வீ மாரிமுத்து, ஹல்கொள்ளவத, ரத்தொட்ட

மேற்குறித்த காணிக்கு உரித்துப்பேசுகின்ற சகலரும் தாமாக அல்லது முறைப்படி எழுத்தில் அதிகார அளிக்கப்பட்ட காரியகாராமூலமாக 1952 ம் ஆண்டு (மாச) பங்குனி மாதம் 13 ந் தேதி காலை 10 மணிகு மாததறை கச்சேரியில் என்முன்பாக வெளிப்படுத்தும்படியும் அக்காணியில் அவர்களுக்குள்ள உடநதைகளின் தன்மையையும் குறித்த காணியை எடுத்தற்கான நஷ்ட ஈடுபற்றிய அவர்களின் கோரிக்கைகளின் விபரங்களையும், நஷ்ட ஈடு தொகையையும், அத்தொகை கணிக்கப்பட்ட விபரங்களையும் 1952 ம் ஆண்டு (மாச) பங்குனி மாதம் 3 ந் தேதிக்கு முன்னா எழுத்தில் முப்பிரதிகளாக எனக்கு அறிவிக்கும்படியும் இத்தால் கேட்டுக்கொள்ளப்படுகின்றன

மாததறை கச்சேரி,

1952 ம் ஆண்டு (பெப்ரவரி) மார்ச்சி 5 ந் உ

ஏ. ஆர். இரத்தினவேல்,
டிஸ்திரிக் உதவி அரசாட்சி ஏசனடு.

1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டம் 7 ம் பிரிவின்படியான அறிவித்தல்.

L. P 6203

ஒரு பகிரங்க தேவைக்கு வேண்டியதான கீழ்க்காணும் காணிகளை எடுத்துக்கொள்ள அரசாட்சியார் எண்ணியிருக்கிறார்கள் என்பதை 1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டத்தின் 7 ம் பிரிவின (1) ம் உட்பிரிவின பிரகாரம் நான இத்தால் அறிவிக்கின்றேன்.

எடுத்துக்கொள்ளவிருக்கும் காணியின் விபரம் —

துண்டு. காணியின் பெயர்.	விபரம்.	உரித்தாளியின் பெயர்.	விசாலம்
1 நலகலதெனிய்பெத்த அல வது நாகண்டேஹூல வும், கடுவலை அல்லது நாகண்டேஹூல	50 வருஷ கருவா, 20 வருஷ தெனனை, 3 பலா மரங்கள், 30-25 வருஷ 1 தேசிக்காமரமும், ஓட்டால் வேயந்த மேசனறி கட்டுமாணம் வண்டிப் பாதையில் கொஞ்சம்-கல்லு களும், 55 வருஷ 172 தெனனமரங்களும், 20-10 வருஷ 35 தெனனமரங்களும், 30 வருஷ 2 பலாமரமும், 4 மாமரங் களும், 1 ஈரப்பலாமரம், 2 பாகுமரங்கள், 1 கஜலமரம், 6 கொடப்பொர மரங்கள், 10-12 வருஷ 1 பெலிமரம், 4 தொம்ப மரங்கள், ஓட்டால் வேயந்த மணலீடு சேனறிக் கின்றும் உள்ளன	எல். டிபியு. தோமஸ் டி. அலவில் 17 0 31 5 “அலவில் வில்லா”, ஹிக்கடுவ	
2 இஹல் பீபாவல்	ஓவிடாவில் 15 வருஷங்கொண்ட கறுவா	எல். டிபியு தோமஸ் டி. அலவில்.. 0 2 4 5	
3 ஷெ	20 வருஷ 10 வாழைமரங்கள், 2 ஈரப்பலாமரங்கள், 3 தெனன மரங்கள், 1 பாகுமரமுங்கொண்ட ஓவிடா மரங்கள் ஒரு பாகுமரமுங்கொண்ட ஓவிடா	எம். கே. அந்தரயஸ் அப்பஹாமி, நல 0 0 21.1 கலதெனியா, ஹிக்கடுவ, ஜீ. கே. புபுனிகுஞோ, நாக்கநத, ஹிக்கடுவ	
4 இஹல் பீபாவலவும், டலவேவத்த	ஓவிடாவில், 30 வருஷ கறுவா, 26 தெனனைமரங்கள், 30 வருஷம், ஓலையால் வேயந்த மணலீடுமுள்ளன	எல். டிபியு. தோமஸ் டி. அலவில், 0 3 13.5 “அலவில் வில்லா”, ஹிக்கடுவ	
5 ஹூனுகேவத்த	35 வருஷ 30 தெனனைமரங்களடங்கிய தெனனந தோட்டம்	குமாரமஹவிஹார, தொடனதுவ, 0 0 39 டிஹலடி டி. தாமரமுதேரே	

மேற்குறித்த காணிக்கு உரித்துப்பேசுகின்ற சகலரும் தாமாக அல்லது முறைப்படி எழுத்தில் அதிகாரம் அளிக்கப்பட்ட காரியகாராமூலமாக 1952 ம் ஆண்டு (மாச) பங்குனி மாதம் 17 ந் திகதி 9 மணிகு ஹிக்கடுவ ஓயவுசாலையில் என்முன்பாக வெளிப்படுத்தும்படியும் அக்காணியில் அவர்களுக்குள்ள உடநதைகளின் தன்மையையும் குறித்த காணியை எடுத்தற்கான நஷ்ட ஈடுபற்றிய அவர்களின் கோரிக்கைகளின் விபரங்களையும், நஷ்ட ஈடு தொகையையும், அத்தொகை கணிக்கப்பட்ட விபரங்களையும், 1952 ம் ஆண்டு (மாச) பங்குனி மாதம் 10 ந் திகதிக்கு முன்னா எழுத்தில் முப்பிரதிகளாக எனக்கு அறிவிக்கும்படியும் இத்தால் கேட்டுக்கொள்ளப்படுகின்றன.

காலிக் கச்சேரி,

1952 ம் ஆண்டு (ஜனவரி) தைமீ 28 ந் உ.

ரெயின றயிட்,
டிஸ்திரிக் உதவி அரசாட்சி ஏசனடு.

1950 ම ජූනි 9 ම ඉලික්ක කාණි எடுத்தற சட்டம் 7 ம பிரிவின்படியான அறிவித்தல். J/E/780/LP/6234

ஒரு பகிரங்க தேவைக்கு வேண்டியதான கீழ்க்காணும் காணியை எடுத்துக்கொள்ள அரசாட்சியா எண்ணியிருக்கிறார்கள் என்பதை 1950 ம ஆண்டின் 9 ம இலக்கக் காணி எடுத்தற சட்டத்தின் 7 ம பிரிவின (1) ம உட்பிரிவின பிரகாரம் நான இதால் அறிவிக்கிறேன்

எடுத்துக்கொள்ளவிருக்கும் காணியின் விபரம் —

துணடு. காணியின் பெயர்.	விபரம்	உரித்தாளியின் பெயர்	விசாலம் எ. ரூ. ப
1	படப்பொல்கந்தேதுவ . 20-15 வருஷங்கொண்ட தேயிலையும், நப்பாமரங்களும், 15 வருஷ விகடா ஏ ஐயசிங்ஹ, தபால் கந்தோர், 9 1 5 16 தென்னைமரங்களும், 30 வருஷ 1 பலாமரமும், அடிப் பாதையும் நாகொட, சிறில எ. ஐயசிங்ஹ, நா கொட	உரித்தாளியின் பெயர்	9 1 5

மேற்குறித்த காணிக் கு உரித்துப்பேசுகின்ற சகலரும் தாமாக அல்லது முறைப்படி எழுத்தில் அதிகாரம் அளிக்கப்பட்ட காரியக்காராமூலமாக 1952 ம ஓஸ் (மாாச) பங்குனி மாதம் 29 ந திகதி காலை 10.30 மணிக் கு நாகொட ஜூனியா பாட்சாலயில் எனமுன்பாக வெளிப்படுத்தும்படியும் அக்காணியில் அவர்களுக்குள்ள உடநதைகளின் தன்மையையும் குறித்த காணியை எடுத்தறகான நஷ்ட ஈடுபற்றிய அவர்களின் கோரிக்கைகளின் விபரங்களையும், நஷ்ட ஈட்டுத் தொகையையும், அத்தொகை கணிக்கப்பட்ட விபரங்களையும் 1952 ம ஓஸ் (மாாச) பங்குனி மாதம் 21 ந திகதிக்கு முன்னா எழுத்தில் முப்பிரதிகளாக எனக்கு அறிவிக்கும்படியும் இதால் கேட்டுக்கொள்ளப்படுகின்றனா.

காலிக் கச்சேரி,

1952 ம ஓஸ் (பெருவரி) மார்ச் 2 ந உ.

றெயினற றயிற, டிலத்திக உதவி அரசாட்சி எண்ணடு

LP 6179

ஹிக்கடுவை வாக்கால் நீாதடுக்கும் சூத்திரம் கட்டுப்படி எனனும் பகிரங்க தேவைக்கு வேண்டியதான பின்னாச சொல்லப்படும் காணியை, அஃதாவது — பிரதமபடத்து இல A. 1252 குறிச்சி—வலலகொட, கிராஹணடிக்கொட, ருவேக்கொட, ஹிக்கடுவ—டொடனடுவ, கிரயவடுக்கொட, எக்கொடகொட, ஜோமஹணடிக்கொட.

துணடு. காணியின் பெயர்.	விபரம்.	உரித்தாளியின் பெயர்.	விசாலம் எ. ரூ. ப
42	கஹ்டகஹவட்ட அட்டற நெலவயல குமபுற ஷே	கல்லகே டியோனிஸ் சிலவா, ருசாயவடு கொட, ஹிக்கடுவ	0 0 6
43	ஷே	துயய ஹெனனடிக்கே இசன அப்பு ஆராசசிக்கண்ட, ஹிக்கடுவ ; மானிக்கவடு பொடிஹாமி, ருசாயவடுகொட, ஹிக்கடுவ	0 0 21.8
44	ருஹுவல் வட்ட அட்டற குமபுற கலும்றக்கல் புஞ்சிவட்ட அட்டற குமபுற	8 வருஷம் கொண்ட 20 தென்னை மரங்கள, 5 வருஷம் கொண்ட 4 மாமரங்கள, 5 வருஷம் கொண்ட 1 முருங்காமரம், 1 வருஷம் கொண்ட 4 வாழை பந்துறைகள் அடங்கிய ஒவிடாவும் நெல்வயலும்	0 1 6.2
45	வெலஹீரியவட்ட அட்டற குமபுற	நெல்வயல	0 0 20 3
46	நடுக்கொய்யொல	ஷே	0 1 21 6
47	டொடனகொடவட்ட அட்டற குமபுற	ஷே	0 0 31.7
48	மஹவல் அல்லது ஏக்கொடவல்	ஷே	0 0 3.5
49	மஹவல் அல்லது ஏக்கொடவல்	ஷே	0 1 6.7
50	மஹவெல்	ஷே	0 0 17 2
51	ஷே	ஷே	0 0 13 8
52	ஷே	ஷே	0 0 29 8
53	மஹவெல் அல்லது ஏக்கொடகொடவெல்	தென்னை மட்டைகள் போடும் சூழிக் கண்டங்கிய நெல்வயல்	0 3 33 3
54	கோருலகேவட்ட அட்டற குமபுற கோருலகே வட்ட, எச்செலமண்ட நொ 15	15 வருஷம் கொண்ட 4 தென்னைமரங்கள கொண்ட தென்னை தோட்டமும் நெல்வயலும்	0 0 12.6
55	கோருலகேவட்ட அட்டற குமபுறவும் கோருலகேவட்ட, எச்செலமண்ட நொ. 15	60 வருஷம் கொண்ட 4 தென்னை மரங்கள, 30 வருஷம் கொண்ட 3 தென்னை மரங்கள, 2 வருஷம் கொண்ட 1 கொடப்பொற மரம், 2 வருஷம் கொண்ட 1 மா மரம், இன்னும் மேசனறி கிணறு மடங்கிய ஒரு தெவைந தோட்டமும் நெல்வயலும்	0 0 18.7
56	மஹவெல் அல்லது ஏக்கொடகொடவெல்	மட்டக்குழி கொண்ட ஒரு நெல்வயல்	0 0 10.2
57	ஷே	ஷே	0 0 12
58	ஷே	ஷே	0 0 11.7
59	ஷே	ஷே	0 0 28.9
60	மஹவல் அல்லது ஏக்கொடவெல்	ஷே	0 0 6.1
61	மஹவெல் அட்டற ஒவிட	12 வருஷம் கொண்ட 8 தென்னை மரங்கள அடங்கிய ஒரு தென்னை தோட்டம்	0 0 4

எடுத்துக்கொள்வதற்கான எத்தனஞ்செய்யும்படி காணி எடுத்துக்கொள்வதைப்பற்றிய சட்டத்தினது (203 ம அதிகாரம்) 5 ம பிரிவின ஏற்பாடுகளின் பிரகாரம் காணி, விவசாய மந்திரி எனக்கு கற்பனை செய்திருப்பதனால் அக்காணியை ஆட்சி ஒப்புக்கொள்ள அரசாட்சியா எண்ணியிருக்கிறார்கள் என்பதை 6 ம பிரிவின்படி வேண்டிய பிரகாரம் நான இதனைக்கொண்டு பிரசிட்தமாய் விளம்பரஞ்செய்கிறேன்.

மேற்குறித்த காணிக் கு உரித்துப்பேசுகின்ற சகலரும் தாமாக அல்லது அவரவருடைய காரியக்காராமூலமாக 1952 ம ஓஸ் மாாச மாதம் 21 ந தேதியிலையு காலை 9 மணிக் கு ஹிக்கடுவ ஓயவு சாலையில் எனமுன்பாக வெளிப்படுத்த தத்தமக்கு அக்காணியிலுள்ள உடநதைகளினது தன்மையையும் அவரவுடநதைகளுக்காய்த தாம சாதிக்கும் உரித்துகளின் தொகையையும் விபரங்களையும் சொல்லும்படி இத்தனால் அவர்களிடத்திற கேட்டுக்கொள்ளப்படுகின்றது.

காலி கச்சேரி,

1952 ம ஓஸ் (ஜனவரி) தைஸ் 26 ந உ.

றெயின றெயிட், உதவி அரசாட்சி எண்ணடு.

1950 ம் ஆண்டின் 9 ம் இலக்க காணி எடுத்தற் சட்டம் 7 ம் பிரிவின்படியான அறிவித்தல்.

LP 6405

ஒரு பரிசுடக தேவைக்கு வேண்டியதான கீழ்க்காணும் காணியை எடுத்துக்கொள்ள அரசாட்சியா எண்ணியிருக்கிறார்கள எனபதை 1950 ம் ஆண்டின் 9 ம் இலக்க காணி எடுத்தற் சட்டத்தின் 7 ம் பிரிவின (1) ம் உட்பிரிவின பிரகாரம் நான் இததால் அறிவிக்கிறேன்.

எடுத்துக்கொள்ளவிருக்கும் காணியின் விபரம் :—

காணியின் பெயர்	விபரம்	உரித்தாளியின் பெயர்	விசாலம் ஏ. ரூ. ப.
954 மிலைகஹமுலானேவே	பலாமரம், தென்னமரம், நப்பாமரம், மண சூலைநீடுமடங்கிய ஒரு தோட்டம்	எச. ஜயவாதன, போடியவத்த, இறைமேயிய, ஆர். ஜ.	0 3 2
955 மிலைகஹமுலானேவே	அல்லது பலா மரம், தென்னேழமரமடங்கிய குலங்கந்த அட்டறவத்த தோட்டம்	ஒரு ஷே	0 0 4

மேற்கூறிய காணிகளுக்கு உரித்தர்ப்பேசுகின்ற சகலரும் தாமாக அல்லது முறைப்படி எழுத்தில் அதிகாரம் அளிக்கப்பட்ட காரியக்காரராமுலமாக 1952 ம் ஆண்டு (மாச) பங்குனி மாதம் 24 ந் திகதி 9.30 மணிக்கு காலிக கச்சேரியில் எனமுன்பாக வெளிப்படுத்தும்படியும் அக்காணியில் அவர்களுக்குள்ள உடந்தைகளின் தன்மையையும் குறித்த காணியை எடுத்தற்கான நஷ்ட ஈடுபற்றிய அவர்களின் கோரிக்கைகளின் விபரங்களையும், நஷ்ட ஈட்டுத் தொகையையும், அத்தொகை கணிக்கப்பட்ட விபரங்களையும் 1952 ம் ஆண்டு (மாச) பங்குனி மாதம் 16 ந் திகதிக்கு முன்னா எழுத்தில் முப்பிரதிகளாக எனக்கு அறிவிக்கும் படியும் இததால் கேட்டுக்கொள்ளப்படுகின்றன.

காலிக கச்சேரி,

றெயின் றயிட்,

1952 ம் ஆண்டு (ஜனவரி) தைமீ 28 ந் உ.

டிஸ்திரிக் உதவி அரசாட்சி எசண்டு.

1950 ம் ஆண்டின் 9 ம் இலக்க காணி எடுத்தற் சட்டம் 7 ம் பிரிவின்படியான அறிவித்தல்.

LD 7332/J/PT/422

ஒரு பரிசுடக தேவைக்கு வேண்டியதான கீழ்க்காணும் காணியை எடுத்துக்கொள்ள அரசாட்சியா எண்ணியிருக்கிறார்கள எனபதை 1950 ம் ஆண்டின் 9 ம் இலக்க காணி எடுத்தற் சட்டத்தின் 7 ம் பிரிவின (1) ம் உட்பிரிவின பிரகாரம் நான் இததால் அறிவிக்கிறேன்.

எடுத்துக்கொள்ளவிருக்கும் காணியின் விபரம் :—

காணியின் பெயர்	விபரம்	உரித்தாளியின் பெயர்	விசாலம் ஏ. ரூ. ப.
1 வன்வத்தை குடி இல. 21/6, 21/10, 21/14	ஆரம்பப்பட இல : A 1,335. கிராமம்—கொடுவேகொட விபரம்	விசாலம். ஏ. ரூ. ப.	
2 21, 2 ம் வட்டாரம்	2 நிரந்தர வீடுகள், 1 நிரந்தரமற்ற வீடு, 1 ஸ்ரீமதி. சீ. எம். எதிரிசிவஹு, தங்காலை, (நிரந்தரமற்ற வீடும 2 1 38-1 கல மலக்கூடம், 1 நிரந்தரமற்ற மலக்கூட நிரந்தரமற்ற மலக்கூடமும், தங்காலை வாசியான சகபனது முங்கொண்ட 25 வருஷத்திற்கு மேற்பட்ட ஆராசிக்கே யலரினொழி உரிமைகோருகிறார்) தென்னந் தோட்டம்.		

மேற்கூறிய காணிகளுக்கு உரித்தர்ப்பேசுகின்ற சகலரும் தாமாக அல்லது முறைப்படி எழுத்தில் அதிகாரம் அளிக்கப்பட்ட காரியக்காரராமுலமாக 1952 ம் ஆண்டு (மாச) பங்குனி மாதம் 10 ந் திகதி காலை 9.30 மணிக்கு உதவி மார்காண்ட அதிகாரி "சேக்கியூட் பங்களாவில்" (பழைய நியாயாதிபதியின் பங்களா) எனமுன்பாக வெளிப்படுத்தும்படியும் அக்காணியில் அவர்களுக்குள்ள உடந்தைகளின் தன்மையையும் குறித்த காணியை எடுத்தற்கான நஷ்ட ஈடுபற்றிய அவர்களின் கோரிக்கைகளின் விபரங்களையும், நஷ்ட ஈட்டுத் தொகையையும், அத்தொகை கணிக்கப்பட்ட விபரங்களையும் 1952 ம் ஆண்டு (மாச) பங்குனி மாதம் 3 ந் திகதிக்கு முன்னா எழுத்தில் முப்பிரதிகளாக எனக்கு அறிவிக்கும்படியும் இததால் கேட்டுக்கொள்ளப்படுகின்றன.

அடிப்பாத்தோட்டக் கச்சேரி,

ஏ. பி. எஸ். என புளேநாயகம்,

1952 ம் ஆண்டு (ஜனவரி) தைமீ 30 ந் உ.

டிஸ்திரிக் உதவி அரசாட்சி எசண்டு.

1950 ம் ஆண்டின் 9 ம் இலக்க காணி எடுத்தற் சட்டம் 7 ம் பிரிவின்படியான அறிவித்தல்.

LD 3198/J/B/262

மலலிகைத்தீவு அரசினா தமிழ் கலவன பாடசாலை எனலும் ஒரு பரிசுடக தேவைக்கு வேண்டியதான கீழ்க்காணும் காணிகளை எடுத்துக்கொள்ள அரசாட்சியா எண்ணியிருக்கிறார்கள எனபதை 1950 ம் ஆண்டின் 9 ம் இலக்க காணி எடுத்தற் சட்டத்தின் 7 ம் பிரிவின (1) ம் உட்பிரிவின பிரகாரம் நான் இததால் அறிவிக்கிறேன்

எடுத்துக்கொள்ளவிருக்கும் காணியின் விபரம் :—

காணியின் பெயர்	விபரம்	உரிமை கேட்பவரின் பெயர்	விசாலம் ஏ. ரூ. ப.
1 மாடிவடிவளவு	பட இலக்கம் : A 983 ம் ஆரம்பப்படம். கிராமம்—மலலிகைத்தீவு. தோட்டமும், நெல்வயலும், தோட்டத்தில் 40 வருஷ 1 மாமரமும், நாகமணிப்பிளளை தம்பிநாதபிளளை, 1 2-2-2 1 நிரந்தர பாடசாலைக் கட்டிடமும் உள்ளன மலலிகைத்தீவு, சமமரத்தறை		
2 ஷே	நெல்வயல	ஷே	0 0 0-3

மொத்தம் . . . 1 2 2-5

மேற்கூறிய காணிகளுக்கு உரித்தர்ப்பேசுகின்ற சகலரும் தாமாக அல்லது முறைப்படி எழுத்தில் அதிகாரம் அளிக்கப்பட்ட காரியக்காரராமுலமாக 1952 ம் ஆண்டு (மாச) பங்குனி மாதம் 25 ந் திகதி காலை 10.30 மணிக்கு சமமரத்தறை காரியாதிகாரியின் கந்தோரில் எனமுன்பாக வெளிப்படுத்தும்படியும் அக்காணியில் அவர்களுக்குள்ள உடந்தைகளின் தன்மையையும் குறித்த காணியை எடுத்தற்கான நஷ்ட ஈடுபற்றிய அவர்களின் கோரிக்கைகளின் விபரங்களையும், நஷ்ட ஈட்டுத் தொகையையும், அத்தொகை கணிக்கப்பட்ட விபரங்களையும், 1952 ம் ஆண்டு (மாச) பங்குனி மாதம் 17 ந் திகதிக்கு முன்னா எழுத்தில் இரண்டு பிரதிகளாக எனக்கு அறிவிக்கும்படியும் இததால் கேட்டுக்கொள்ளப்படுகின்றன.

மட்டக்களப்புக் கச்சேரி,

தி. ராஜகுரை,

1952 ம் ஆண்டு (பெருவரி) மாசிமீ 1 ந் உ.

டிஸ்திரிக் உதவி அரசாட்சி எசண்டு.

1950 ம் ஆண்டின் 9 ம் இலக்க காணி எடுத்தற் சட்டம் 7 ம் பிரிவின்படியான அறிவித்தல்.

LD 3251—J/AL 1094

ஒரு பரிசுடக தேவைக்கு வேண்டியதான கீழ்க்காணும் காணியை எடுத்துக்கொள்ள அரசாட்சியா எண்ணியிருக்கிறார்கள எனபதை 1950 ம் ஆண்டின் 9 ம் இலக்க காணி எடுத்தற் சட்டத்தின் 7 ம் பிரிவின (1) ம் உட்பிரிவின பிரகாரம் நான் இததால் அறிவிக்கிறேன்.

எடுத்துக்கொள்ளவிருக்கும் காணியின் விபரம் :—

மட்டக்களப்பு டிஸ்திரிக், ஏறலூர் கோற்றைப் பற்று, ஏறலூர் கிராமத்திலுள்ள 488 ம் ஆரம்பப்படத்தில் அடங்கிய சமரா 241 ஏக்கர் 21 பரப்புக்கொண்ட சமுலங்குடா என்று அழைக்கப்படும் கீழ்க்காணும் காணித்தளைகளும், எல்லைகளும் :—

(1) D. 160 ம், E. 160 ம் கண்டங்கள்—43 ஏ. 3 ரூ. 27 ப., விசாலம்; உரித்தர்ப்பேசுவர்கள் : ஏறலூர் யூ. வீ. மீராலைவ்வை போடியும், யூ. வீ. மொத்தமழது ஷேரிடும், ஏ. ஆசியா உமமாவும். எல்லைகள் :—

வடக்கு : 4,648 ம் கண்டம்.

தெற்கு : 4,658 ம் கண்டம்,

கிழக்கு : முடிக்குரிய காணி,

மேற்கு : 4,650 ம், 4,653 ம் கண்டங்கள்.

(2) 4,646 ம் கண்டத்தின் பகுதியிலிருந்து 4,656 ம் வரைக்கும், 4,659 லிருந்து 4,661 வரைக்கும். 91 ஏக்கர் விசாலம். உரித்தர்ப்பேசுபவர் : கீ. கே. எஸ். இரத்தையா, நாவுருடா, காத்தான்குடி. எல்லைகள் :—

வடக்கு : 4,642 ம் கண்டம்,

தெற்கு : உலந்தனை ஆறு,

கிழக்கு : 4,662 ம், D 160 ம் கண்டங்கள்,

மேற்கு : திரு. இரத்தையாவின் பிச்சக்காணி.

(3) 4,657 ம கண்டத்தின் பகுதி—2 ஏ. 30 பெ. விசாலம்—உரித்துப்பேசுவா மேலே குறிப்பிட்ட D. 160 ம, E. 160 ம கண்டங்களுக்கு சொல்லிய படி. எல்லைகள் :—

வடக்கு : D 160 ம கண்டம்,
தெற்கும், கிழக்கும்—உலந்தனை ஆறு,
மேற்கு : 4,656 ம கண்டம்.

(4) 4,662 ம கண்டத்தின் பகுதி—விசாலம் 7 ஏ. 1 று 8 ப' உரித்துப்பேசுவா—மேலே குறிப்பிட்ட D. 160 ம, E. 160 ம கண்டங்களுக்கு சொல்லியபடி. எல்லைகள் —

வடக்கு : 4,657 ம கண்டம்,
தெற்கு : உலந்தனை ஆறு.
கிழக்கு : 4,663 ம கண்டம்
மேற்கு : 4,661 ம கண்டம்.

(5) 46, 46 ம கண்டத்தின் பகுதியிலிருந்து 4,656 வரைக்கும். விசாலம்—96 ஏ. 2 று. 36 ப. உரித்துப்பேசுவா—எஸ் என. வேலுப்பிள்ளை, அப்புககாத்து, மட்டக்களப்பு எல்லைகள் —

வடக்கு : 4,642 ம கண்டம்.
தெற்கு : உலந்தனை ஆறு.
கிழக்கு : 4,642 ம, D. 160 ம கண்டங்கள்.
மேற்கு : 3,718 ம, 3,712 ம, 3,724 ம கண்டங்கள்.

மேற்குறித்த காணிகளுக்கு உரித்துப்பேசுகின்ற சகலரும் தாமாக அல்லது முறைப்படி எழுத்தில் அதிகாரம் அளிக்கப்பட்ட காரியக்காராமூலமாக 1952 ம (ஸ்) (எப்பிறல்) சித்திரை மாதம் 4 ந் திகதி காலை 10 மணிக்கு மட்டக்களப்புக் கச்சேரியில் எனமுன்பாக வெளிப்படுத்தும்படியும் அக்காணியில் அவர்களுக்கான உடந்தைகளின் தன்மையையும் குறித்த காணியை எடுத்தற்கான நஷ்ட ஈடுபற்றிய அவர்களின் கோரிக்கைகளின் விபரங்களையும், நஷ்ட ஈட்டுத் தொகையையும் அத்தொகை, கணிக்கப்பட்ட விபரங்களையும், 1952 ம (ஸ்) (மாச) பங்குனி மாதம் 27 ந் திகதிக்கு முன்னா எழுத்தில் இரண்டு பிரதிகளாக எனக்கு அறிவிக்கும்படியும் இத்தால் கேட்டுக்கொள்ளப்படுகின்றனா.

மட்டக்களப்புக் கச்சேரி,
1952 ம (ஸ்) (ஜனவரி) தைமீ 31 ந வ.

தி ராஜதுரை,
டிஸ்திரிக் உதவி அரசாட்சி ஏசண்டு.

1950 ம் ஆண்டின் 9 ம் இலக்க காணி எடுத்தற் சட்டம் 7 ம் பிரிவின்படியான அறிவித்தல். இலக்கம் LA/7059/J/E/1473

ஒரு பிரதிக தேவைக்கு வேண்டியதான கீழ்க்காணும் காணியை எடுத்துக்கொள்ள அரசாட்சியா எண்ணியிருக்கிறாக்கள் எனப்பதை 1950 ம ஆண்டின் 9 ம் இலக்க காணி எடுத்தற் சட்டத்தின் 7 ம் பிரிவின (1) ம உட்பிரிவின பிரகாரம் நான இத்தால் அறிவிக்கின்றேன்.

எடுத்துக்கொள்ளவிருக்கும் காணியின் விபரம் :—

குருணாகல் டிஸ்திரிக், ஹிரியால் அட்டபட்டு, இஹலிவித்தேகே கோறல் மேற்கு, நெம்பிரிக்கும்புற பகுதி, பறமுள்ள கிராமத்தில் பதல்கொட எஸ்டேட் எனும் காணியில் 3 ஏக்கர் 01.3 பாசல் விசாலம் உள்ள எல்லை. 1916 ம இலக்கப் பிரதமபட்டத்துக்கு 1 ம இணைப்படத்தில் 53 ம துண்டாக அழந்து காட்டப்பட்டுள்ளது.

இக்காணியின் உரிமைக்காரா இப்பக்குவ, பஹல்கொட எஸ்டேற்றில் இருக்கும் டி. ஜீ. ஏ செனாவிதன் என்று சொல்லப்படுகிறது.

மேற்குறித்த காணிகளுக்கு உரித்துப்பேசுகின்ற சகலரும் தாமாக அல்லது முறைப்படி எழுத்தில் அதிகாரம் அளிக்கப்பட்ட காரியக்காராமூலமாக 1952 (ஸ்) (மாச) பங்குனி மாதம் 18 ந் தேதி 9 மணிக்கு குருணாகல் கச்சேரியில் எனமுன்பாக வெளிப்படுத்தும்படியும் அக்காணியில் அவர்களுக்கான உடந்தைகளின் தன்மைகளையும் குறித்த காணியை எடுத்தற்கான நஷ்ட ஈடுபற்றிய அவர்களின் கோரிக்கைகளின் விபரங்களையும், நஷ்ட ஈட்டுத் தொகையையும், அத்தொகை கணிக்கப்பட்ட விபரங்களையும் 1952 ம (ஸ்) (மாச) பங்குனி மாதம் 11 ந் தேதிக்கு முன்னா எழுத்தில் முப்பிரதிகளாக எனக்கு அறிவிக்கும்படியும் இத்தால் கேட்டுக்கொள்ளப்படுகின்றனா.

குருணாகல் கச்சேரி,
1952 ம (ஸ்) (ஜனவரி) தைமீ 28 ந வ.

டபியூ, ரீ. ஜயசிங்ஹ,
வடமேற்கு மாணா அரசாட்சி ஏசண்டுக்காக.

இலக்கம் LRO/APL/3020 J/AL/1666/LM 5406.

1950 ம் ஆண்டின் 9 ம் இலக்க காணி எடுத்தற் சட்டம் 7 ம் பிரிவின்படியான அறிவித்தல்.

1942 ம ஆண்டின் 61 ம் இலக்க காணி மீட்கும் சட்டத் தேவைக்கு வேண்டியதான கீழ்க்காணும் காணியை எடுத்துக்கொள்ள அரசாட்சியா எண்ணியிருக்கிறாக்கள் எனப்பதை 1950 ம ஆண்டின் 9 ம் இலக்க காணி எடுத்தற் சட்டத்தின் 7 ம் பிரிவின (1) ம உட்பிரிவின பிரகாரம் நான இத்தால் அறிவிக்கின்றேன்.

எடுத்துக்கொள்ளவிருக்கும் காணியின் விபரம் :—

பிரதமபட்ட இலக்கம் A 701. கிராமம்—வெத்தேவ.		கிராமம்—வெத்தேவ.	விசாலம்.	
துண்டு.	காணியின் பெயர்.	உரித்தாளியின் பெயர்	ஏ. று. ப.	
1	மஹாகுமபுற	3 முதிய தென்னமரங்களையுடைய தென்னந தோட்டம்	எச். பீ. தேவதத தேரே, புதுக்கோவில், ஹிங்குலை	0 0 3
2	ஷே	நெலவயல்	ஷே	0 0 16
3	ஷே	ஷே	ஷே	0 3 32
4	ஷே	ஷே	ஷே	0 0 25

மொத்தம் . . . 1 0 36

மேற்குறித்த காணிகளுக்கு உரித்துப்பேசுகின்ற சகலரும் தாமாக அல்லது முறைப்படி எழுத்தில் அதிகாரம் அளிக்கப்பட்ட காரியக்காராமூலமாக 1952 ம (ஸ்) (மாச) பங்குனி மாதம் 25 ந் திகதி காலை 10 மணிக்கு மாவல்ல விடுதி வீட்டில் எனமுன்பாக வெளிப்படுத்தும்படியும் அக்காணியில் அவர்களுக்கான உடந்தைகளின் தன்மையையும் குறித்த காணியை எடுத்தற்கான நஷ்ட ஈடுபற்றிய அவர்களின் கோரிக்கைகளின் விபரங்களையும், நஷ்ட ஈட்டுத் தொகையையும், அத்தொகை கணிக்கப்பட்ட விபரங்களையும் 1952 ம (ஸ்) (மாச) பங்குனி மாதம் 18 ந் திகதிக்கு முன்னா எழுத்தில் முப்பிரதிகளாக எனக்கு அறிவிக்கும்படியும் இத்தால் கேட்டுக்கொள்ளப்படுகின்றனா.

கேகலைக் கச்சேரி,
1952 ம (ஸ்) (ஜனவரி) தைமீ 25 ந வ.

டீ. ஜீ. தயாரத்தின,
டிஸ்திரிக் உதவி அரசாட்சி ஏசண்டு.

காணி மீட்டற் சட்டம்.

1950 ம் ஆண்டின் 9 ம் இலக்க காணி எடுத்தற் சட்டம் 5 ம் பிரிவின்படியான பிரகடனம். LA 3259/J/AL/736

1942 ம ஆண்டின் 61 ம் இலக்க காணி மீட்கும் சட்டத்தின் நோக்கங்களுக்காக இதன் அடவலையிற் விபரிகப்படும கரணி எடுத்துக்கொள்ளப்பட்டு வேண்டும் என்று காணிக்கொமிஷனா தீர்மானித்திருப்பதால்,

காணி, விவசாய மந்திரி, டட்டி ஷெலர்ன் சேனாயுக்க ஆகிய நான 1950 ம ஆண்டின் 9 ம் இலக்க காணி எடுத்தற் சட்டத்தின் 5 (1) ம பிரிவின கீழ் (இதை குறித்த சட்டத்தின் 3 (5) ம பிரிவைத்திருந்தும் அச்சட்டத்தின் 62 ம் பிரிவுடன் சோதனை வாசித்து) குறித்த காணி ஒரு பிரதிக தேவையென்று கருதப்படும் ஓர் தேவைக்கு வேண்டும் என்றும் அக்காணி அச்சட்டத்தின்கீழ் எடுத்துக்கொள்ளப்படும் என்றும் இத்தால் பிரகடனம் செய்கின்றேன்.

கொழும்பு,
1952 ம் (ஸ்) காத்திகைமீ 16 ந வ.

டட்டி சேனாயுக்க,
காணி, விவசாய மந்திரி.

அட்டவணை.

ஆரம்பப்பட்ட இலக்கம் A. 1074. கிராமம்—மெத்கொட. விசாலம்.
துண்டு. காணியின் பெயர். காணி விபரம். உரிமைகேட்பவர் பெயர். ஏ. று. ப.

1	கெடகெலேஹுவத்த	30 வயதுக்கு மேல்பட்ட தென்னந தோட்டம்	ஹேரத்தமுடியானசெலாகே அப்பஹாமி	0 1 20
---	---------------	-------------------------------------	------------------------------	--------

மெத்கொட, கட்டிமஹேன்

1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டத்தின் 5 ம் பிரிவின்படியான பிரகடனம்

1942 ம் ஆண்டின் 61 ம் இலக்கக் காணி மீட்டற் சட்டத்தின் நோக்கங்களுக்காக இதன் அட்டவணியில் விபரிக்கப்படும் காணி எடுத்துக்கொள்ளப்பட்டு வேண்டு எனறு காணிக் கொமிஷனா தீர்மானித்திருப்பதால்,

காணி, விவசாய மந்திரி, டடலி ஷெலரன் சேனனாயகா ஆகிய நான 1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணி எடுத்தற் சட்டத்தின் 5 (1) ம் பிரிவின கீழ் (இதை குறித்த சட்டத்தின் 3 (5) ம் பிரிவைத் திருத்தும் அச்சட்டத்தின் 62 ம் பிரிவுடன் சேர்த்து வாசித்து) குறித்த காணி ஒரு பகிரங்க தேவையென்று கருதப்படும் ஓர் தேவைக்கு வேண்டும் என்றும் அக்காணி அச்சட்டத்தின்கீழ் எடுத்துக்கொள்ளப்படும என்றும் இத்தால் பிரகடனம் செய்கின்றேன்.

கொழும்பு,
1952 ம் ஆண்டு (ஜனவரி) தைமீ 27 ந் உ.

டடலி ஷெலரன் சேனனாயககா,
காணி, விவசாய மந்திரி.

காணி, விவசாய மந்திரி கந்தோர் இலக்கம் : J/AL/1963.

காணிக் கொமிஷனா கந்தோர் இலக்கம் : LRO/APL/3416

மட்டக்களப்புக் கச்சேரி இலக்கம் : LD 3325.

அட்டவணை.

ஆரம்பப்பட இலக்கம் : A 993. கிராமம்—மல்கம்பிட்டி.

துணடு	காணியின் பெயர்.	விபரம்	உரித்துப்பேசுவர்.	விசாலம். ஏ. ரூ. ப.
1	முனியாகாடு, நாவலடிவயல	நெல் வயல	மீராசாயபு லெவவை உமாறு லெவவையும், மீராசாயபு லெவ்வை அகமித்து லெவவையும், நிற்காலூர், 2 ன் குறிச்சி	0 0 8
2	ஷெ	ஷெ	ஷெ	3 0 26
3	ஷெ	ஷெ	ஷெ	0 0 38
4	ஷெ	ஷெ	ஷெ	0 1 7
5	ஷெ	ஷெ	ஷெ	0 0 13
			மொத்தம்	3 3 12

குறிப்பிலக்கம் : LD/7357/LRO/APL/1319/J/AL/1730

1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணியைப் பெற்றுக்கொள்ளும் சட்டத்தின் 7 ம் பிரிவின்படியான அறிவித்தல்

(1) 1942 ம் ஆண்டின் 61 ம் இலக்கக் காணி மீட்டற் சட்டத்தின் பொருட்டு இதனகத்துள்ள அட்டவணியில் விபரிக்கப்பட்ட காணிகளை 1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணியைப் பெற்றுக் கொள்ளும் சட்டத்தின்படி பெற்றுக்கொள்ளும் எண்ணம் உண்டென்றும்,

(2) அதற்கைய காணிகளைப் பெற்றுக் கொள்வதால் ஏற்படும் நஷ்டாட்டுக் கோரிக்கைகள் எமக்கு அனுப்பப்படவேண்டுமென்றும்,

(3) அதற்கைய காணிகளில் உரித்துக் கோரும் ஒவ்வொருவரும்—

(அ) நோமுகமாக அல்லது எழுத்துமூலம் அதிகாரம் கொடுக்கப்பட்ட இன்னொருவர் மூலமாக 1952 ம் ஆண்டு (ஏப்ரல்) சித்திரை மாதம் 2 ந் திகதி காலை 9 மணிக் கு பெலியத்தை நகர சபைக் கந்தோரில் எனமுன் சமூகமளித்தும்,

(ஆ) அக்காணிகளில் தமக்குள்ள உரித்தின் தன்மையையும், தாம் நஷ்டாட்டு கோரும் விபரத்தையும் நஷ்டாட்டுத் தொகையையும், அத தொகை கணக்கெடுத்த விபரத்தையும் 1952 ம் ஆண்டு (மார்ச்) பங்குனி மாதம் 26 ந் திகதியன்று அல்லது அதற்குமுன் எழுத்துமூலம் எமக்கு அறிவிக்க வேண்டுமென்றும்,

அம்பாந்தோட்டைப் பிரிவு உதவி அரசாட்சி அதிபர் ஏ. பீ. எஸ். என புள்ளிநாயகம் ஆகிய நான மேற்சொல்லிய 1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் சட்டத்தின் 7 ம் பிரிவின்படி இத்தால் அறிவித்தல் கொடுக்கிறேன்

அம்பாந்தோட்டைக் கச்சேரி,

1952 ம் ஆண்டு (பெப்ரவரி) மார்ச்சி 2 ந் உ.

ஏ. பீ. எஸ். என. புள்ளிநாயகம்,
பிரிவு உதவி அரசாட்சி அதிபர்.

அட்டவணை

இணை உப்பட இல 1, இறுதிக் கிராமப்பட இலக்கங்கள் 262, 263. கிராமங்கள்—இஹலபெலிகல், பலத்தற்.

துணடு.	காணியின் பெயர்.	விபரம்	உரிமை கோருபவர்.	விசாலம். ஏ. ரூ. ப.
129	கிறுகஹேறேன்	20 வருடத் தெனனந் தோட்டம்	ஆர் ஏ பவுசினி அப்புஹாமி, பலத்தற், பெலியத்தை	2 0 6
131	அறிவத்தை	40 வருடத் தெனனந் தோட்டம்	ஷெ	4 0 18
513	கிறுகஹேறேன்	20 வருடத் தெனனந் தோட்டம்	ஷெ	0 0 14
			மொத்தம்	6 0 38

LD—B. 49/50.

இல. LD 7353/LRO/APL/4180/J/AL 1754

1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணியைப் பெற்றுக்கொள்ளும் சட்டத்தின் 7 ம் பிரிவின்படியான அறிவித்தல்

1. 1942 ம் ஆண்டின் 61 ம் இலக்கக் காணி மீட்டற் சட்டத்தின் பொருட்டு இதனகத்துள்ள அட்டவணியில் விபரிக்கப்பட்ட காணிகளை 1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணியைப் பெற்றுக்கொள்ளும் சட்டத்தின்படி பெற்றுக்கொள்ளும் எண்ணம் உண்டென்றும்,

2. அந்தக் காணியைப் பெற்றுக்கொள்வதால் ஏற்படும் நஷ்டாட்டுக் கோரிக்கைகள் எமக்கு அனுப்பப்பட வேண்டுமென்றும்,

3. அதற்கைய காணியில் உரித்துக்கோரும் ஒவ்வொருவரும்—

(அ) நோமுகமாக அல்லது எழுத்துமூலம் அதிகாரம் கொடுக்கப்பட்ட இன்னொருவர் மூலமாக 1952 ம் ஆண்டு (ஏப்ரல்) சித்திரை மாதம் 2 ந் திகதி காலை 11 30 மணிக் கு வீரகெத்தியா கிராமச் சங்கக் கந்தோரில் எனமுன் வந்து தெரியப்படும்,

(ஆ) அக்காணியில் தமக்குள்ள உரித்தின் தன்மையையும், தாம் நஷ்டாட்டுக்கோரும் விபரத்தையும், நஷ்டாட்டுத் தொகையையும், அத்தொகை கணிக்கப்பட்ட விபரத்தையும், 1952 ம் ஆண்டு (மார்ச்) பங்குனி மாதம் 26 ந் திகதியன்று அல்லது அதற்குமுன் எழுத்துமூலம் எமக்கு அறிவிக்கவும் வேண்டுமென்றும்,

அம்பாந்தோட்டைப் பிரிவு உதவி அரசாட்சி அதிபர், அலன் பாசில் சாமுவேல் நேச்சராஜா புள்ளிநாயகம் ஆகிய நான மேற்சொல்லிய 1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் சட்டத்தின் 7 ம் பிரிவின்படி இத்தால் அறிவித்தல் கொடுக்கிறேன்.

அம்பாந்தோட்டைக் கச்சேரி,

1952 ம் ஆண்டு (ஜனவரி) தைமீ 29 ந் உ.

ஏ. பீ. எஸ். என. புள்ளிநாயகம்,
உதவி மாணாண் அரசாட்சி அதிபர்.

அட்டவணை

துணடு.	காணியின் பெயர்	விபரம்	உரிமை கோருபவரின் பெயர்	விசாலம். ஏ. ரூ. ப.
142	அன்றடஹீன	தடிகளால் பின்னப்படும் மண்ணைக் கட்டப்பட ஒரு நிரந்தரமற்ற வீடும், ஒரு நிரந்தரமற்ற ஒலைக் குடிசையும் கொண்ட 25 வருஷத் தெனனந் தோட்டம்	எம் எஸ். ரதனாயக்க மண்டலுவா, வீரகெத்தியா, (நானாயக் காரா பமணுசின விறற்றுகமக்கே டொன டாவிட நிரந்தர மற்ற வீடுகளை உரிம்கோரும் தற்காலிகக் குடியிருப்பாளர் ஹீனபுனன)	3 0 16

இல. LD 7351/LRO/APL/808/J/AL/1656.

1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணியைப் பெற்றுக்கொள்ளும் சட்டத்தின் 7 ம் பிரிவின்படியான அறிவித்தல்

1. 1942 ம் ஆண்டின் 61 ம் இலக்கக் காணி மீட்டற சட்டத்தின் பொருட்டு இதனகத்துள்ள அட்டவணையில் விபரிக்கப்பட்ட காணிகளை 1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணியைப் பெற்றுக்கொள்ளும் எண்ணம் உண்டென்றும்,
 2. அந்தக் காணிகளை பெற்றுக்கொள்வதால் ஏற்படும் நஷ்ட ஈட்டுக் கோரிக்கைகள் எமக்கு அனுப்பப்பட வேண்டுமென்றும்
 3. அதற்கைய காணிகளில் உரித்துக்கேட்கும் ஒவ்வொருவரும்—
 (அ) நோமுகமாக அல்லது எழுத்துமூலம் அதிகாரம் கொடுக்கப்பட்ட இன்னொருவா மூலமாக 1952 ம் ஆண்டு (ஏப்பிரல்) சித்திரை மாதம் 2 ந் திகதி காலை 10 மணிக்கு பெலியத்தை நகர சபை கந்தோரில் எனமுனவந்து தெரியப்படும்,
 (ஆ) அக்காணியில் தமக்குள்ள உரித்தின் தன்மையையும், தாம் நஷ்ட ஈடு கோரும் விபரத்தையும், நஷ்ட ஈட்டுத் தொகையையும் அத்தொகையைக் கணக்கெடுத்த விபரத்தையும் 1952 ம் ஆண்டு (மார்ச்) பங்குனி மாதம் 26 ந் திகதியின்று அல்லது அதற்குமுன் எழுத்துமூலம் எமக்கு அறிவிக்கவும் வேண்டுமென்றும்,
- அமபாந்தோட்டைப் பிரிவு உதவி மாகாண அரசாட்சி அதிபா, அலன் பாகில் சாமுவேல் நேசராஜா புள்ளிநாயகம் ஆகிய நான மேற்சொல்லிய 1950 ம் ஆண்டின் 9 ம் இலக்கச் சட்டத்தின் 7 ம் பிரிவின்படி இத்தால் அறிவித்தல் கொடுக்கிறேன்.

அமபாந்தோட்டைக் கச்சேரி, 1952 ம் ஆண்டு (ஜனவரி) தைமீ 29 ந் உ. ஏ. பீ. எஸ். என. புள்ளிநாயகம்,
உதவி மாகாண அரசாட்சி அதிபா.

துணடு.	காணியின் பெயர்	இணை இலக்கம் 11 இறுதிக் கிராமப்பட இல. 290. கிராமம்—நலகம்	அட்டவணை விபரம்	உரிமை கேட்பவரின் பெயர்	விசாலம்
521	கனித்தக்கீபுருனவத்த, கஹுகொற்றறுவா	40 வருஷ தெனணையும், பலாவும், கமுகும், ஒரு நிரந்தரமற்ற ஒலை மணவீடு மடங்கியதோட்டம்	விபரம்	உரிமை கேட்பவரின் பெயர்	ஏ. ரூ. ப.
522	தடகிறிலலகஹேன	40 வருஷ தெனணையுள்ள தோட்டம்		கே. எச். சைமன் சிலவா,	7 1 30 5
523	மஹாபுருனவத்தை	40 வருஷ "சிறேனிலா" வுள்ள தோட்டம்		பெலியத்தை	0 0 10
524	கனித்தக்கீபுருனவத்த, கஹுகொற்றறுவா	செய்கையற்ற தோட்டம்		ஷே	0 3 8
				ஷே	0 0 4
மொத்தம்					8 1 12 5

குறிப்பிலக்கம் : LD 7348/LRO/APL/4949/J/AL/1311

1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணியைப் பெற்றுக்கொள்ளும் சட்டத்தின் 7 ம் பிரிவின்படியான அறிவித்தல்.

- (1) 1942 ம் ஆண்டின் 61 ம் இலக்கக் காணி மீட்டற சட்டத்தின் பொருட்டு இதனகத்துள்ள அட்டவணையில் விபரிக்கப்பட்ட காணிகளை 1950 ம் ஆண்டின் 9 ம் இலக்கக் காணியைப் பெற்றுக்கொள்ளும் சட்டத்தின்படி பெற்றுக்கொள்ளும் எண்ணம் உண்டென்றும்,
 - (2) அதற்கைய காணிகளைப் பெற்றுக்கொள்வதால் ஏற்படும் நஷ்ட ஈட்டுக் கோரிக்கைகள் எமக்கு அனுப்பப்பட வேண்டுமென்றும்,
 - (3) அதற்கைய காணிகளில் உரித்துக்கொளும் ஒவ்வொருவரும்—
 (அ) நோமுகமாக அல்லது எழுத்துமூலம் அதிகாரம் கொடுக்கப்பட்ட இன்னொருவா மூலமாக 1952 ம் ஆண்டு (ஏப்பிரல்) சித்திரை மாதம் 2 ந் திகதி, காலை 9 00 மணிக்கு பெலியத்தை நகர சபை கந்தோரில் எனமுன் சமூகமளித்தும்,
 (ஆ) அக்காணியில் தமக்குள்ள உரித்தின் தன்மையையும் தாம் நஷ்ட ஈடு கோரும் விபரத்தையும், நஷ்ட ஈட்டுத் தொகையையும் அத்தொகை கணக்கெடுத்த விபரத்தையும் 1952 ம் ஆண்டு (மார்ச்) பங்குனி மாதம் 26 ந் திகதி, அல்லது அதற்குமுன் எழுத்துமூலம் எமக்கு அறிவிக்க வேண்டுமென்றும்,
- அமபாந்தோட்டைப் பிரிவு உதவி அரசாட்சி அதிபா, ஏ. பி. எஸ். என. புள்ளிநாயகம் ஆகிய நான மேற்சொல்லிய 1950 ம் ஆண்டின் 9 ம் இலக்கச் சட்டத்தின் 7 ம் பிரிவின்படி இத்தால் அறிவித்தல் கொடுக்கிறேன்

அமபாந்தோட்டைக் கச்சேரி, 1952 ம் ஆண்டு (பெப்ரவரி) மார்ச்சி 2 ந் உ. ஏ. பீ. எஸ். என. புள்ளிநாயகம்,
உதவி அரசாட்சி அதிபா.

துணடு.	காணியின் பெயர்	இணை இல. 7. இறுதிக் கிராமப்பட இல. 296. கிராமம்—கெட்டமன	அட்டவணை விபரம்	உரிமை கேட்பவரின் பெயர்	விசாலம்
770	டெலக்கவத்தை	40 வருட 1 தெனணை, 20 வருட 10 தெனணைகள், 7 கமுகுகள் கொண்ட தோட்டம்	காணி விபரம்	உரிமை கேட்பவரின் பெயர்	ஏ. ரூ. ப.
771	டெலக்கவத்தையும் கொள டறமக்கேவத்தை வத்தையும்	20 வருட 3 தெனணைகள், 2 ராப்பலாக்கள், 10 வருட, 6 கமுகுகள் கொண்ட தோட்டம்		கெட்டி கேவகே பொடிநோனூ 0/0 பெலி யத்த கிராம விதானை	0 0 4
772	ஷே	4-40 வருட தெனணை, 15 வருட சிறேனிலா, 40 வருட பலா மரம், 1 ஓடு போட்ட மணவீடு, 1 ஒலை மணவீடு, 1 ஒலை மணமலக்கூட்டம், ஒரு பகுதியில் ஒலைக் கொட்டில் கொண்ட தோட்டம்		ஷே	0 0 5
				ஷே	3 1 9
மொத்தம்					3 1 18